

વार्षिक लयाजम 35. १५०/-

वर्ष : ४५मुं  
અંગ્રસ્ત - ૨૦૨૦  
અંક - ૫૦૭

મંગલ મંદિર • કુઠુંબાણ-૨૦૨૦ • ૧  
(કુલ પાત્રા : ૮૨)



# મંગલ મંદિર

શ્રી કથુંબાણ જીન સેવા સમાજ - અમદાવાદનું માસિક મુખ્યપત્ર

15<sup>TH</sup>  
**AUGUST**  
INDEPENDENCE DAY



મુખ્ય કાર્યાલય :-

શ્રી કથુંબાણ જીન સેવા સમાજ - અમદાવાદ

માતુશ્રી સાકરનાને રવજી મોરારજી લાલન (લોડાંગ-કૃતીમવાળા)

શ્રી કથુંબાણ ભવન

તંગી મંડળ :

પ્રતાપ નારાયણ દંડ - મુખ્ય તંગી

દિનેશ આર. મહેતા - સહંતંગી

૪૩-૪૪, કુઠુંબાણ નિગમનદી સોસાયટી, પાલડી, એરિસ્કુલીય, અમદાવાદ-૩૮૦ ૦૦૫,

ફોન : (૦૭૯) ૨૬૫૭ ૮૮૯૨, ૨૬૫૮ ૧૫૦૧, ૨૬૫૭ ૯૪૬૯ ફેસ્ટ : (૦૭૯) ૨૬૫૮ ૨૦૬૦

Email : kjssmangalmandir@gmail.com • Web site : www.kuthchijainahd.org



## BOPAL'S NEW BUSINESS DESTINATION

Premium commercial space  
near Basant Bahar Gymkhana



Artist's impression

RETAIL AND OFFICE SPACES | EASY ACCESS TO BRTS | BANK LOAN AVAILABLE



Site address: Gala HUB, Next to Basant Bahar Gymkhana, Gala Gymkhana Road, Bopal, Ahmedabad 380058.

**CALL: 8141680000**

Email: perfection@galainfra.com | www.galainfra.com



PR/GJ/AHMEDABAD/DASKROI/AUDA/CAA07162/190620 | gujraa.gujarat.gov.in



DEEP  
Industries  
Limited

Oil & Gas Exploration  
Production & Services



- EXPLORATION AND PRODUCTION OF OIL AND GAS BLOCKS
- EXPLORATION AND PRODUCTION OF COAL BED METHANE
- NATURAL GAS COMPRESSION SERVICES
- OIL & GAS PROCESSING EQUIPMENT
- WORK OVER AND DRILLING RIGS
- HIGH PRESSURE MOBILE AIR COMPRESSION
- NATURAL GAS BASED POWER GENERATION
- GAS DEHYDRATION UNIT

● CONTACT DETAILS ●

**Deep Industries Limited**

Address : 12A & 14, Abhi Shree Corporate Park,

Ambli Bopal Road, Ambli, Ahmedabad-380 058, Gujarat, INDIA.


Phone # : +91-2717-298510 Fax # : +91-2717-298520

Website : [www.deepindustries.com](http://www.deepindustries.com) E-mail : [info@deepindustries.com](mailto:info@deepindustries.com)



૧૫મી ઓગસ્ટ, ૨૦૨૦ : સ્વાતંત્ર્ય દિવસ

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રહામના સ્થૂભઘારો....



મહાત્મા ગાંધીજી



સરદાર વલલભભાઈ પટેલ



નેતાજી સુભાષચંદ્ર બોઙ



રાજગુરુ

શહીદ ભગતસિંહ

સુખદેવ

છેલવા જ્ઞ વર્ષથી દર મહિનાની ૫ તારીખે  
નિયમિતપણે પોસ્ટ કરવામાં આવતું  
“શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદ”નું  
મુખ્યપત્ર

### “મંગલ મંદિર”

#### મુખ્ય કાર્યાલય

શ્રી કચ્છી જૈન ભવન,  
૪૩-૪૪, શ્રી બ્રાહ્મણ મિત્રમંડળ સોસાયટી,  
પાલડી, એલિસાબિઝ,  
અમદાવાદ-૩૮૦ ૦૦૬.  
ફોન : (૦૯૮) ૨૬૪૭૮૮૨૨, ૨૬૪૮૧૫૦૧  
ફેક્સ : (૦૯૮) ૨૬૪૮૨૦૬૦  
ઈ-મેઇલ : kutchijainam@gmail.com  
વેબ-સાઇટ : www.kutchijainahd.org

#### તંત્રી

પ્રતાપ નારાણાજુ દંડ

#### સહ તંત્રી

દિનેશ આર. મહેતા

અંકમાં પ્રાણિધ્ય થયેલ લેખો તથા અન્ય વિભાગની  
માહિતીઓ સાથે તંત્રીમંડળ સહમત છે તેમ માની લેખું  
જરૂરી નથી. રજૂ થયેલ વિચારો જે તે વ્યક્તિના હોય  
છે, તેની નોંધ લેવા વિનંતી.

#### લેખકોને નામ વિનંતી

‘મંગલ મંદિર’માં પ્રગટ કરવા  
માટે વિપુલ પ્રમાણમાં લેખ સામગ્રી  
અમને મળતી રહે છે અને એટલે  
સ્વીકૃત કૃતિઓને પ્રગટ કરવાનું પણ  
સ્વાભાવિક રીતે વિતંબાય. મંગલ  
મંદિરના ધોરણાને ધ્યાનમાં લઈ,  
પોતાની રચના મોકલતી વખતે લેખક  
સ્વવિવેક દાખવે તેવી વિનંતી છે.  
એક સાથે એકથી વધુ કૃતિઓ  
ન મોકલવા વિનંતી.

ભાષાદોષ અને લાંબા લેખો  
અસ્વીકાર્ય બનશે તેની નોંધ લેવા  
વિનંતી. લેખમાં એકની એક વાતમાં  
પુનરાવર્તન (રિપિટેશન) ટાળ્યું  
જરૂરી છે. કૃતિની છસ્તપ્રત સ્વચ્છ  
અને સુવાચ્ય હોવી જોઈએ. આશા  
છે કે, આ બાબતમાં લેખક મિત્રોનો  
સહકાર અમને મળી રહેશે.

- મુખ્યતંત્રી

## આનુક્રમણિકા

### તંત્રી લેખ :

- આપણે આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારવી પડશે ..... ૭
- અગત્યના દિન : રાષ્ટ્રીય અને વિશ્વ ..... ૮

### લેખ :

#### ભક્તિ

- પર્વાનિરાજ પર્યુષણ : તપ, ત્યાગ અને તિતિક્ષાનો વ્યવહાર ..... દિનેશ આર. મહેતા ..... ૮

#### કલ્યાણ

- સામાયિક તો સુલસાબાઈનો ..... પુષ્પાલેન શાહ ..... ૧૧

#### વ્યક્તિ વિશેષ

- આધુનિક ભારતના એક શિલ્પી : ડૉ. રાજેન્દ્રપ્રસાદ ..... ૧૩

#### ઇતિહાસ

- જલિયાંવાલા બાગ – નરસંહાર ..... ડૉ. મહિંર અમ. વોરા ..... ૧૫

#### કચ્છ

- કચ્છના સંનિષ્ઠ કેળવણીકાર : વસંતરાય પણ્ણી ..... ભરત ‘કુમાર’ પ્રા. ટાકર ..... ૧૭

#### વિચારમંચ

- બ્રહ્માંડની ઉત્પત્તિ કેવી રીતે થઈ? ..... ડૉ. યાસીન દલાલ ..... ૧૮
- ઘડપણમાં વસિયતનામું – જીવાનીમાં હેસિયતનામું! ..... દિનેશ પાંચાલ, જનાલિસ્ટ ..... ૨૧

#### કોરોના સંક્રમણ

- મહામારી – ગંભીર બીમારી અને તેનાં ઉપાયો ..... ડૉ. શ્રેતા પરીઅ, અમ.ડી. .... ૨૩  
(કન્સલ્ટન્ટ સાઇકાટ્રિસ્ટ)

#### શિક્ષણ જગત

- માનવ સંસાધન વિકાસમાં શિક્ષણ ..... ડૉ. પલ્લવી શાહ ..... ૨૪

#### કારક્ઝી

- જીપીએસીની પરીક્ષા પાસ કર્યા બાદ ડેપ્યુટી ક્લેક્ટરે  
કેવી કામગીરી નિભાવવાની હોય છે? ..... હીરેન દવે ..... ૨૭
- કારક્ઝી ઘડતર માટેની ૭ ટીપ્સ ..... શાલીર અહેમદ ખરી ..... ૨૮

#### રહસ્ય

- મૃત્યુની પરિવર્તનશીલતા ..... પ્રા. સૂર્યકાંત ભણ.... ૨૯

#### વાસ્તવિકતા

- ‘બી પ્રેક્ટિકલ’ એપ્રોય એ કોઈ પાપ નથી! ..... પાર્થ દવે, જનાલિસ્ટ.... ૩૦

#### આરાધના

- મદદ ..... સુનિતા અ. શાહ.... ૩૧

#### વાત્ર

- મરક મરક કથા : કોરોનાના ફળ મીઠા – જરૂર ..... ભલવીરસિંહ જાડેજા.... ૩૪

<p><b>શ્રી કરછી જૈન સેવા સમાજ - અમદાવાદના “પદાધિકારીશ્રીઓ”</b></p> <p><b>મેળેજિંગ ટ્રસ્ટી</b> શ્રી પ્રતાપ નારાણાજી દંડ ઘર : ૦૯૮- ૨૬૪૦૫૦૪૭ મો. ૯૮૨૬૭ ૨૫૬૧૮</p> <p><b>ઉપમુખ-૧</b> શ્રી મનુભાઈ ગોવિંદલાલ શાહ ઘર : ૨૬૪૪ ફ્રેન્ડ્સ ૪૫૩, ઓ. ૨૬૪૦ ૧૧૫૦ મો. ૯૮૨૫૦ ૩૧૫૨૮</p> <p><b>ઉપમુખ-૨</b> શ્રી શાંતિલાલ મુળજી સાવલા ઘર : (૦૨૭૧૭) ૨૩૪૪૫૫ મો. ૯૮૨૫૦ ૪૮૬૪૫</p> <p><b>માનદ મંગી</b> શ્રી પ્રેરીપ સૂરજલાલ મહેતા ઘર : ૨૬૬૧૨૦૮૮ મો. ૯૮૨૫૦ ૬૧૧૬૦</p> <p><b>સહમંગી</b> શ્રી રોહિત સંધવી</p> <p><b>ખજાનચી</b> શ્રી ચંદ્રકાંત દામજી શાહ ઘર : ૨૬૬૦૫૨૪૫</p> <p><b>સહ ખજાનચી</b> શ્રી ૨૭નીકાંત ધરમશી પારેખ મો. ૯૮૮૮૦ ૫૩૫૨૯</p> <p><b>શ્રી કરછી વિશ્વામ ગૃહનં સરનામું :</b> શ્રી કરછી જૈન સેવા સમાજ - અમદાવાદ સંચાલિત શ્રી કરછી વિશ્વામ ગૃહ અરિંગતનગર દેરાસરની સામે, ગાંધી વિદ્યાલયની ગલીમાં, દરના સ્કૂલની પાછળ, રાજ્યસ્થાન હોસ્પિટલ પાસે, શાહીબાગ, અમદાવાદ-૩૮૦ ૦૦૪. ફોન : ૦૯૮-૨૨૮૮૪૫૪૭</p> <p><b>સેવા ભવનનં સરનામું :</b> શ્રી કરછી જૈન સેવા સમાજ - અમદાવાદ સંચાલિત માતુશ્રી કંકુલેન કાળજીએદ રવજી (નાની ખાખરવાલા) સેવા ભવન, એસ. ટી સ્ટેન પાસે, સાટકર ગેસ્ટ હાઉસની તામે, રંગનાથપુરા, અમદાવાદ-૩૮૦ ૦૨૨. ફોન : ૦૯૮-૨૫૪૬૧૨૭૦</p> <p><b>‘મંગલ મંદિર’ના અંકો સમાજની વેબસાઈટ</b> <a href="http://www.kutchijainahd.org">www.kutchijainahd.org</a> <b>ઉપર... ઉપરાઠા...</b> <a href="http://www.hellokutchis.com">www.hellokutchis.com</a> <b>ઉપર વાંચી શકાય છે.</b></p>	<p><b>સેલ્ફ્યુટ</b></p> <ul style="list-style-type: none"> <li>● વાખુ.....ડૉ. સુધીર ચી. મોદી.....૩૭</li> </ul> <p><b>વિવિધ માહિતી</b></p> <p style="text-align: right;">સંકલન : દિનેશચંદ્ર જગજીવન શાહ</p> <ul style="list-style-type: none"> <li>● ભારતનો રાખ્રેધજ શ્રી આપણું રાખ્રીય પ્રતીક – અશોકચક ..... ૩૮</li> <li>● ભારતની ખ્યાતિપ્રાપ વ્યક્તિનાનો નામો અને તેમના કાર્યો ..... ૩૯</li> <li>● રેડકોસ શું છે? ..... ૪૦</li> <li>● ગુજરાતના પ્રસિદ્ધ સામયિકો ● ગુજરાતના નામાંકિત સમાચાર પત્રો ..... ૪૧</li> </ul> <p><b>YOUTH CLUB</b></p> <ul style="list-style-type: none"> <li>● Some Golden Rays ..... ૪૨</li> </ul> <p><b>વૈવિદ્ય</b></p> <ul style="list-style-type: none"> <li>● આંજો કાગર ..... ૪૩</li> <li>● અન્ય સંસ્થાઓના સમાચાર ..... ૪૪</li> <li>● દેલવાડા મંદિર – એક નજર ..... ચંદ્રકાંત દામજી શાહ (કે.ડી. શાહ) .... ૫૦</li> <li>● રંગસૂત્ર અને જનીન : રહસ્યમય માહિતીનો ખજાનો ..... ૫૦</li> <li>● સંબંધ : દીકરી એટલે શું? ..... સંકલન : દિનેશચંદ્ર જગજીવન શાહ.... ૫૧</li> <li>● ધર્મ અને અધ્યાત્મનું પ્રતીક : હિન્દીસિંહના દેરાસર .. રજૂઆત : રમણિકલાલ કે. ગોસર.... ૫૨</li> </ul> <p><b>ગોમસ જોતેરી</b></p> <ul style="list-style-type: none"> <li>● આઈ લવ માય ઈન્ડિયા ..... ભાવના એ. ઝવેરી.... ૫૩</li> <li>● પણલ્સ ..... શ્રીમતી કિરણ કુકર.... ૫૪</li> </ul> <p><b>મનોરમ્ય</b></p> <ul style="list-style-type: none"> <li>● ખુમારી : ખગી હુસેન ઇસ્માઇલ (કમર કરછી) ..... ૫૬</li> <li>● જોવા આવ્યો છું : દિલીપ આચાર્ય ‘દિલકશ’ ..... ૫૬</li> <li>● પિતાની વાત – બાળકની સંગાથ : રોશની ગૌતમ શાહ ..... ૫૬</li> <li>● હવે શક્યતા નથી : રમેશચંદ્ર જ. ધેધ ..... ૫૬</li> </ul> <p><b>નિયમિત વિભાગો</b></p> <ul style="list-style-type: none"> <li>● Nano Nine શબ્દ રમત-૧૬૩ ..... સંકલન : ૨૭નીકાંત પારેખ ..... ૫૭</li> <li>● Nano Nine Sudoku (ક્રમાંક : ૧૧૨૧) ..... સંકલન : ૨૭નીકાંત પારેખ ..... ૫૮</li> <li>● બાલું જ્યું ગાલિયું ..... સંકલન : ગુલાબચંદ ધારશી રંભિયા..... ૬૦</li> </ul> <p><b>શ્રી કરછી જૈન સેવા સમાજ - અમદાવાદ</b></p> <ul style="list-style-type: none"> <li>● સમાજ દર્પણ ..... ૬૧</li> <li>● સંસ્થા સમાચાર ..... ૬૨</li> </ul>
--	--

તંત્રી લેખ

## આપણે આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારવી પડશે...

છેલ્લા લગભગ આઈ માસ દરમિયાન, સૌથી વધુ વખત બોલાયો હોય, લખાયો હોય, વંચાયો હોય, ચર્ચામાં આવ્યો હોય, મીઠિયામાં ઉપયોગ થયો હોય તેવો એક જ શર્જ છે અને તે છે કોરોના... કોરોના...

એક અહેવાલ મુજબ કોરોના વાયરસની શરૂઆત વિશ્વ સ્તરે ૨૭મી ડિસેમ્બર, ૨૦૧૮થી થઈ હતી. ત્યારબાદ દિન પ્રતિદિન વાયરસથી અસરગ્રસ્ત લોકોની સંખ્યામાં વૃદ્ધિ થતી રહી. પ્રારંભમાં ચીન બાદ ધીરે ધીરે વિશ્વના અનેક દેશોમાં કોવિડ-૧૯ પ્રસરી ગયો.

કોરોનાના મુખ્ય ત્રણ સ્તર કહી શકાય. વિદેશમાંથી એક અથવા વધુ સંપર્કો ધરાવતા વ્યક્તિનું દેશમાં આગમન, એ પ્રથમ તબક્કો. બીજા તબક્કામાં કોરોનાગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવવાથી સ્થાનિકે કોરોનાનો ફેલાવો થાય છે. જ્યારે ત્રીજો તબક્કો કોમ્યુનિટી ટ્રાન્સમિશનનો છે. કોરોનાનો પ્રસાર ધરાવતા દેશનો પ્રવાસ કર્યો ન હોય અથવા કોરોના ધરાવતી વ્યક્તિના સંપર્કમાં ન આવી હોય તેવી વ્યક્તિને કોરોનાનું નિદાન થાય તો તેને કોમ્યુનિટી ટ્રાન્સમિશનની વ્યાખ્યામાં લઈને, તેને ત્રીજો તબક્કો કહે છે.

વિશ્વના અનેક દેશોની સાથે ભારતમાં પણ કોરોના વાયરસનો પ્રકોપ જ્યારે સતત વધી રહ્યો હતો ત્યારે તા. ૨૪-૦૩-૨૦૨૦ની રાતથી જ સમગ્ર દેશમાં ૨૧ દિવસ સુધી લોકડાઉનની જાહેરાત થઈ હતી. ત્યારબાદ તેને લંબાવવામાં આવ્યું. આ રીતે લોકડાઉન-૧ થી ૪નો ઉદ્દેશ્ય એવો હતો કે આ સમય દરમિયાન લોકો પરસ્પર સંપર્કમાં આવે નહીં અને દેશમાં કોરોના વાયરસનો પ્રસાર ન થાય. તે સાથે કોરોના વાયરસના સંદર્ભમાં સમગ્ર દેશમાં તબીબી સવલતો

**- માળપું વ્યવસ્થિત થઈ શકે.** કોવિડ-૧૯ની બીમારીના દર્દીઓની યોગ્ય સારવાર માટે મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફને જરૂરી તાલીમ અપાય, અંગત રીતે રક્ષણ થાય, તેમજ કોરોના વાયરસ સંબંધી તેના સાધન અને સામગ્રી દરેક સ્થળોએ ઉપલબ્ધ કરાય. પરંતુ આ પ્રકારનું સમગ્ર આયોજન તાત્કાલિક ન થતાં કોરોના વાયરસના કેસોનું પ્રમાણ દેશમાં વધતું ગયું. અનેક લોકો કોવિડ-૧૯ની બીમારીના કારણે મૃત્યુ પામ્યા. પરિસ્થિતિ મુજબ સરકારે લોકડાઉનના સ્થાને અનલોક જાહેર કરીને ઘણી છૂટછાટ જાહેર કરી. હકીકતમાં આ તબક્કો વધારે ખતરનાક સાબિત થતો ગયો કારણકે તે સમય દરમિયાન લોકો રસ્તાઓ અને ઓફિસોમાં અવરજવર કરવા બહાર નીકળી ગયા. કોરોના વાયરસ હજુ ગયો નથી ત્યાં લોકોની બેદરકારીના પગલે શારીરિક રીતે સુરક્ષિત રહી શકાય નહીં, તેવી સ્થિતિનું નિર્માણ થયું.

લોકડાઉનમાં લોકો કંટાળીને કાંઈક અંશે હતાશા અનુભવતા હતા. એટલે અનલોકના તબક્કામાં લોકો ઘરની બહાર ફરતા થયા. હકીકતમાં કોરોના વાયરસનો અંત આવ્યો જ નથી. સામાજિક રીતે એટલે રોગ સંબંધી સામાન્ય ભયનો અંત આવી જાય છે. પરંતુ તબીબી રીતે? મેડિકલ રીતે અંત આવ્યો જ નથી. આ સ્થિતિમાં લોકોએ સાવયેત રહેવાનું, શિસ્ત પામવાનું, પોતાની જવાબદારીઓનું પાલન કરવાનું વધારે જરૂરી અને અગત્યનું છે.

કોરોનાનો પ્રસાર અટકાવવા માટે સમગ્ર દેશમાં લાગુ લોકડાઉનનો ચોથો તબક્કો તા. ૩૧-૦૫-૨૦૨૦ના પૂરો થતાં ગૃહ મંત્રાલયે લોકડાઉનના પાંચમા તબક્કા અંગેની માર્ગદર્શિકા જાહેર કરી હતી. આ સાથે ગૃહ મંત્રાલયે દેશમાં અર્થતંત્રની ગાડી પાટા પર લાવવા માટે ગ્રાણે તબક્કામાં લોકડાઉનને અનલોક કરવાની એટલે કે ઉઠાવી લેવાની પ્રક્રિયા શરૂ કરી હતી અને કેટલીક છૂટછાટ જાહેર કરી હતી. આમ જોઈએ તો દેશના અર્થતંત્રની સ્થિતિ સુધારવા હવે કાર્યવાહી થઈ રહી છે. પરંતુ તેનો મતલબ એવો કરી શકાય નહીં કે કોરોના વાયરસનો અંત આવી ગયો છે. જ્યારે રોગથી થતા મૃત્યુદરમાં સતત ઘટાડો થાય અને છેવટે કોઈ નવો કેસ નોંધાય નહીં ત્યારે કહી શકાય કે કોરોના વાયરસનો અંત નજીક છે અથવા તો નાખૂં થઈ રહ્યો છે.

કોરોના જેવી વैશ્વિક મહામારીના ઈતિહાસની તરફ નજર કરતાં જ્ઞાશે કે આવા વैશ્વિક ગંભીર રોગચાળાનો અંત એકદમ રીતે આસાન હોતો નથી. અત્યારે સાયન્સ અને ટેકનોલોજી ખૂબ જ વિકાસ પામ્યા છે તો પણ વિશ્વભરમાં લાખો લોકો કોરોનાગ્રસ્ત - કોરોના સંકમિત થઈ રહ્યા છે. આ પરિસ્થિતિમાં તેના અંતની રાહ જોવાને બદલે સંકમણ ન થાય તેની તકેદારી રાખવી વધુ હિતાવહ છે. તે ઉપરાંત, હવે લોકોએ પોતાની લાઈફ સ્ટાઇલમાં ફેરફાર કરીને સ્થિતિને અનુકૂળ થવા પ્રયાસ કરવો પડશે. બાકી લોકો પોતે શિસ્ત પાળશે, સાવચેત રહેશે, નિયમોનું યોગ્ય રીતે પાલન કરશે ત્યારે જ કોરોના વાયરસનો અંત નજીદીક આવશે. ટૂંકમાં લોકો કોરોના વાયરસ સામે જેટલા જગૃત થશે તેટલા પ્રમાણમાં સુરક્ષિત રહી શકશે.

આ નવીન કોરોના માટે હજુ સુધી કોઈ દવા નથી. વેક્સિન આવતા સમય લાગશે. આપણે આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારવી પડશે અને કોરોના ફેલાતો અટકાવવા તેની કિંને તોડવી પડશે. ડરની બિલકુલ જરૂર નથી. મન મજબૂત રાખીને આત્મવિશ્વાસ કેળવવાની જરૂર છે. ભીડથી દૂર રહેવું, બે વ્યક્તિઓએ પોતાની વચ્ચે અંતર રાખવું, વારંવાર હાથ ધોવા, માસ્કનો હંમેશાં ઉપયોગ કરવો અને વિશ્વ આરોગ્ય સંસ્થાના સૂચનોનું સખત પાલન કરવું.

**ભારત : અગાત્યના રાષ્ટ્રીય દિન**

**વિશ્વ : અગાત્યના દિન**

**માસ : ઓગસ્ટ**

- ૦૧ લોકમાન્ય ટિળકની પુષ્યતિથિ
- ૦૭ રવીન્દ્રનાથ ટાગોરની પુષ્યતિથિ
- ૦૮ શહીદ દિન (મહાગુજરાત આંદોલન)
- ૦૮ 'હિંદ છોડો' આંદોલન દિન
- ૧૫ સ્વાતંત્ર્ય દિન
- ૨૮ રાષ્ટ્રીય રમત દિન (મેજર ધ્યાનયંદનો જન્મ દિવસ)

- ૦૧ માસનો પ્રથમ રવિવાર
- વિશ્વ મૈત્રી દિન (ફેન્ડશિપ ૩)
- ૦૯ વિશ્વ આદિવાસી દિન
- ૧૫ ભારતનો સ્વાતંત્ર દિન

### KRIDA – મુંબઈ અને શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદનો સમન્વય (Tie-Up)

કચ્છમાં રહેતા ખેડૂતોને તન-મન-ધન અને ટેકનોલોજીથી સહકાર આપી, તેમનો ઉધ્યાર કરવાની નેમ સાથે મુંબઈમાં શ્રી કચ્છી વીસા ઓસવાળ અને શ્રી કચ્છી ભાનુશાળી સમાજોએ ભેગા થઈ એક સેવા સંસ્થા – KRIDA (કૃષિ રીસર્ચ ઇનોવેશન એન્ડ ટેચલપમેન્ટ એસોસિએશન)ની સ્થાપના કરી. ([www.krida.org](http://www.krida.org))

**ઉદ્દેશ્ય :** ★ મુંબઈથી કચ્છ જવા માંગતા લોકોને ખેતી તરફ વાળીને તેમને મુંબઈ કે તેના જેટલી જ અથવા વધુ આવક ઊભી કરવી. ★ મુંબઈગરાઓની કચ્છની વેરાન જમીનમાં બને તેટલું વધુ ઓર્ગેનિક ખેતીનું ઉત્પાદન કરવું અને જેરી કેમિકલ / પેસ્ટીસાઇડ્સથી નવી પેઢીને બચાવવી. ★ ખેડૂતોને આધુનિક ખેતીની તાલીમ, સાધનો, એક્સપર્ટ્સ પૂરા પાડવા. ★ ખેતીને વર્દ લેવલ સુધી લઈ જઈને – કચ્છી ખેડૂતોને એક્ષપોર્ટ કરવા સુધીની મહદ્દ કરવી. ★ કચ્છના ગામોમાં સગવડ મુજબ રેટિંગ કરવા (STAR Rating) અને ઓવરાઓલ સ્તર ઉપર લાવવું – જેવા અત્યંત જરૂરી અને Visionary કાર્યો કરતી આ સંસ્થાના ફાઉન્ડર ટ્રસ્ટી શ્રી ગોવિંદભાઈ માંગે અને અન્ય ટ્રસ્ટી અને હોદેદારો શ્રી અમૃતભાઈ શાહ અને શ્રી પ્રદીપભાઈ છેડા મુંબઈથી અતે પથારેલ હતા અને સમાજના મહેમાન તરીકે શ્રી કચ્છી જૈન ભવન - પાલડી ખાતે એક રાત રોકાયેલ હતા.

મુંબઈથી કચ્છ જતી વખતે ઉપર મુજબના મહેમાનોએ શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદના હોદેદારો સાથે મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને તે મુજબ તા. ૨૭-૭-૨૦૨૦ના રોજ એક મીટિંગનું આયોજન શ્રી કચ્છી જૈન ભવન ઉપર રાખેલ હતું. સાથે આપણા સમાજના શ્રી પ્રતાપભાઈ દંડ, શ્રી પ્રદીપ મહેતા, શ્રી રોહિત સંઘવી અને શ્રી હીરેન શાહ હાજર રહ્યા હતા.

KRIDA – મુંબઈએ કચ્છના ખેડૂતો વતી એવી પ્રારંભિક ઓફર આપેલ છે, કે ૩૦૦ એકરના ખેતરમાં માત્ર આપણે જે નક્કી કરી ઓર્ડર આપીશું, તે જ અનાજ - શાકભાજ અને ફળો પકવશે – જે આપણે જ વેચીશું.

આગળના આયોજન માટેની વિગતો ‘મંગલ મંદિર’ના આવતા અંકમાં પ્રસારીત કરવામાં આવશે.

– દીરેન કે. શાણ (એચ. કે. શાણ)

ભક્તિ

## પવાર્ધિરાજ પર્યુષણ :

### તપ, ત્યાગ અને તિતિક્ષાનો તહેવાર




દિનેશ આર. પટેલા

પર્યુષણ પર્વમાં જૈનો પ્રભુ ભક્તિમાં પરોવાય છે. આત્માના કલ્યાણ માટે અધ્યાત્મના આશરે જીવનો આ ઉત્સવ છે. પર્યુષણ એ લૌકિક નહીં, લોકોત્તર પર્વ છે, આધ્યાત્મિક પર્વ છે. ઈદ્રિયો અને મનને શાંત કરવા જ્ય, તપ, ભક્તિ અને ધ્યાનનો માર્ગ અપનાવાય છે અને એટલે જ અન્ય પર્વો કરતાં પર્યુષણ પર્વ નોખું છે, અનોખું છે.

આપણે ત્યાં કહેવામાં આવે છે કે, “જો જાગતા હૈ સો પાવત હૈ, જો સોવત હૈ વો ખોવત હૈ.” પર્યુષણ એ જાગૃતિનું પર્વ છે. આખું વર્ષ રોજબરોજની ઘટમાળમાં રહ્યા બાદ પોતાના માટે આત્મશુદ્ધિ માટે કંઈક કરવાની આવેણા છે. પર્યુષણ એ જૈનો માટે પવાર્ધિરાજ ગણાય છે.

પર્યુષણ એટલે શું? પર્યુષણનો શાબ્દિક અર્થ સમજાવતા પૂ. ગિરીશચંદ્રજી મહારાજ કહે છે, પરિ + ઉસ + સન એટલે પર્યુષણ. જે દિવસોમાં અહનિશ આપણા પોતાના આત્માના સમીપે વર્સી, તેની આજુબાજુ જામેલા ભવોભવના અને મુખ્યત્વે આ ભવનાં વિષય - કખાયના જાળાને દૂર કરવાની તક મળે છે તે દિવસોને પર્યુષણ કહેવાય છે. એટલે કે પર્યુષણ તપ, ત્યાગ અને તિતિક્ષા (સહનશીલતા)નો તહેવાર છે.

આ પર્વમાં જૈનધર્મ, આચાર-વિચાર, સિદ્ધાંતની સમજ અપાય છે, અનુમોદના થાય છે. જૈન ધર્મ પ્રાચીનતમ ધર્મ હોવાનું માનવામાં આવે છે. પણ આ અંગે આપણે ત્યાં તલસ્પર્શી સંશોધન થયું નથી એ કમનસીબી છે. ગુણવંત શાહ લખે છે, મહાવીરનો અહિંસાનો સંદેશ બીજુ ભાષાઓમાં જોઈએ તેટલો પહોંચ્યો નથી. એક નવું જૈન દેરાસર બાંધવા માટે કરોડ રૂપિયા હોંશેહંશે



પર્યુષણ એ લૌકિક નહીં, લોકોત્તર પર્વ છે, આધ્યાત્મિક પર્વ છે. ઈદ્રિયો અને મનને શાંત કરવા જ્ય, તપ, ભક્તિ અને ધ્યાનનો માર્ગ અપનાવાય છે અને એટલે જ અન્ય પર્વ કરતાં પર્યુષણ પર્વ નોખું છે, અનોખું છે.

પર્યુષણ એ જાગૃતિનું પર્વ છે. આખું વર્ષ રોજબરોજની ઘટમાળમાં રહ્યા બાદ પોતાના માટે આત્મશુદ્ધિ માટે કંઈક કરવાની આવેણા છે. પર્યુષણ એ જૈનો માટે પવાર્ધિરાજ ગણાય છે.

ખર્ચનારો જૈન સમાજ મહાવીરના વિચારોને બધી ભાષાઓમાં પ્રચાર થાય તે માટે ખર્ચ કરવામાં એટલી હોંશ બતાવતો નથી એ હુંખદ છે.

ડૉ. એસ.સી. વિદ્યાભૂષણ માને છે કે, જૈન ધર્મ સર્વશ્રોષ પ્રાચીન ધર્મમાંનો એક છે.

જૈન ધર્મ વિશે વિદેશીઓએ ટીક ટીક સંશોધન કર્યું છે. એમાં જર્મનીમાં ડૉ. હર્મન પાકોલી અને પ્રિસ્તી પાદરી ડૉ. રાઈસ ડેવિડના નામ લેવા પડે છે. ડૉ. પાકોલીએ એવું પ્રતિપાદિત કર્યું કે, જૈન ધર્મ તો મહાવીર પહેલાં સ્થપાયેલો. મહાવીરે તો એમાં સુધારા કર્યા, શ્રમણ સંધને નવેસરથી વ્યવસ્થિત કર્યા.

તો ડૉ. ડેવિસે કહ્યું, જૈનો બૌદ્ધ ધર્મના ઉત્થાન પહેલાના ભારતીય ઇતિહાસમાંથી માંઠીને વર્તમાન સમય સુધી સુચાયિત વ્યવસ્થિત કોમ તરીકે વિદ્યમાન રહી છે.

ડૉ. રાધાકૃષ્ણને કહેલું : ‘જૈન ધર્મ વર્ધમાન અથવા પાર્શ્વનાથ પહેલાં પ્રવર્તમાન હશે. એ વિશે શંકા નથી. હા, જૈન ધર્મને ધૂણ વિઘ્નોનો સામનો કરવો પડ્યો છે. સિંહ નાદીની ખીણમાં ખોદકામ કરતા મળી આવેલી મોહન-જો-ડેરો અને હડપા સંસ્કૃતિના અવશેષો જૈન ધર્મની પ્રાચીનતા પુરવાર કરે છે. ડૉ. કાલીદાસ નાગે સરસ વાત કરી છે. જૈન ધર્મ એ કોઈ અમુક ચોક્કસ જાતિ કે સંપ્રદાયનો ધર્મ નથી, એ જીવનમાગ્રાનો ધર્મ છે, એ આંતરરાષ્ટ્રીય અને સમગ્ર વિશ્વનો ધર્મ છે.

જૈન ધર્મ, મહાવીર સંદેશને પેણાનિક આધાર પણ છે. આચારો જોઈએ તો રાત્રિ ભોજન ન કરવું, કંદમૂળ ન ખાવા વગેરેને વૈજ્ઞાનિક આધાર છે. સાંજે જભા પદ્ધી આપણે શ્રમ કરતા નથી. એટલે મોઢું ખાઈએ તો પાચન ન થાય. કંદમૂળમાં બહુ

જીવો હોવા ઉપરાંત, એ તામસી છે. ‘આહાર એવો ઓડકાર’ એમ આપણે ત્યાં કહેવાયું છે.

જૈન આગમોનો અભ્યાસ થાય તો ખ્યાલ આવે કે એમાં કેવી અઠળક આગાહી છે. જૈન ધર્મનું પદાર્થવિજ્ઞાન સચોટ છે. સજ્જવ અને અજ્જવનું લોજિક ગળે ઉત્તરી જાય એવું છે. અણુસંબંધી અદ્ભુત વાસ્તવિકતા જૈન આગમોમાં હજારો વર્ષ પહેલાં અપાઈ હતી. જૈનોએ જ નહીં, જૈનેતરોએ આ બાબતે મુનિ દિવ્ય ક્રીત્વિજ્યજ્ઞનું ‘તત્ત્વાર્થ સૂત્ર’ પુસ્તક વાંચ્યાં જોઈએ. એમાં એમણે વિશ્વ વિખ્યાત પ્રાચીન અને નવીન બંનેની સરખામણી કરી છે અને એ વાત શીરાની જેમ ગળે ઉત્તરી જાય એવી છે.

ચોવીસમાં તીર્થકર મહાવીરે તો વિશ્વને એક નવી જ જીવનશૈલી બધી છે. અહિસાની વાત ભગવાન મહાવીરે સામાન્ય ગૃહસ્થ સુધી પહોંચાડી છે. ‘જીવો અને જીવવા દો’ – ક્ષમાપનાનો સંદેશ મહાવીર સ્વામીએ આપ્યો છે. અહિસાની અસરકારકતા આપણે જોઈ છે. આજના સાયબર યુગમાં તો અહિસા અને ક્ષમાપનાની વધુ જરૂર છે.

વાતવાતમાં આપણે ગુસ્સે થઈએ છીએ. અણુશક્તો વિકસી રહ્યા છે. ખૂનખરાબા, હિંસા યુદ્ધો વગેરે ચાલતા રહે છે. એ રોજબરોજની ઘટના છે અને આપણે સંવેદના ગુમાવતા જઈએ છીએ. આપણી સંવેદનશીલતાની ધાર જાણે બુઝી થઈ ગઈ છે. આવી સ્થિતિમાં મહાવીર સંદેશને જીવનમાં ઉતારવાની જરૂર છે. રાજકોટના જૈન તત્ત્વચિંતક શરીકાંતભાઈ મહેતા કહે છે, ‘લડતી અઘડતી દુનિયાએ મહાવીરે ચિંદેલા માર્ગ ચાલવું પડશે. મહાવીર આપણાને એક નવી જીવનશૈલી આપી છે. વિશ્વમાં માંસાહારીઓ શાકાહારી બની રહ્યા છે. અહિસાની વાત બધાને ગળે ઉત્તરી રહી છે.’

વાત સાવ સાચી છે. હિંસાથી ભરેલાં વિશ્વમાં બધા શાંતિ જંખે છે અને શાંતિ યુદ્ધથી નહીં અહિસાથી જ સ્થપાય તેમ છે. નહીં તો વિશ્વમાં આટલા યુદ્ધ થયા છતાં શાંતિ કેમ સ્થપાતી નથી. ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયા છે છતાં આજેય સીમાઓ સળગે છે. દુનિયામાં ગમે ત્યાં જુઓ શાંતિ મંગણાથી જ ઉકેલ આવ્યો છે.

ગાંધીજીએ કહેલું : ‘અહિસા એ કાયરતા ઢાંકવાનો બુરખો નથી, પણ વીરનો શ્રેષ્ઠ ગુણ છે. અહિસાના પ્રયોગમાં શસ્ત્રપ્રયોગ કરતાં પણ વધારે બહાદુરી જોઈએ. જગતનો ઈતિહાસ એ

અવિરત સંગ્રામોની કથા છે. અહિસાના અખાની ધાર જેવા દુર્ગમ માર્ગ સિવાય આજની વધિત દુનિયા માટે ઉગારવાની બીજી કોઈ આજ્ઞા નથી.’

માઈકલ કોરડાની એક નવલકથામાં લખાયું છે : ‘વેરની વાનગી તો ઠંડી પડે પછી જ આરોગવી સારી. સુંદર રીતે જીવવું એ વેર લેવાનો ઉત્તમ માર્ગ છે.’ એટલે જ જ્ઞાનીઓ કહે છે, બીજાના જીતવા કરતાં જીતને જીતવી જરૂરી છે અને પર્યુષાશ પર્વનો આજ તો મૂળ મંત્ર છે. મન ઉપર વિજય મેળવવો સૌથી મુશ્કેલ છે. એકલતામાં માનવી સૌથી સંઘર્ષમય હોય છે. **જતને જીતવી અધરી વાત છે.** જ્પ, તપ કે ધ્યાન કે અભ્યાસથી એ માટે પ્રયાસ કરી શકાય છે.

મહાવીરે અહિસા ઉપરાંત વિશ્વને જે અદ્ભુત સિદ્ધાંત આપ્યો તે સ્યાદ્વાદ છે, **અનેકાંત છે.** અહીં પોતાના વિચારનું જ નહીં પડા બીજાના વિચારનું પડા સ્થાન છે, સન્માન છે. **જૈન દર્શન આ સિદ્ધાંતથી જીજા દર્શનોને પાછળ મૂકી દે છે.** એક જ વસ્તુને સારી રીતે સમજી શકાય. સાત વિકલ્પો હોઈ શકે છે : (૧) હોય પણ ખરું, (૨) ન પણ હોય, (૩) હોય અને ન પણ હોય, (૪) વર્ષાવી ન શકાય તેવું હોય, (૫) હોય અને વર્ષાવી ન શકાય તેવું હોય, (૬) ન પણ હોય અને વર્ષાવી ન શકાય તેવું હોય, (૭) હોય કે ન હોય અને વળી વર્ષાવી ન શકાય તેવું હોય.

**ખામેમિ સત્ત્વ જીવે સત્ત્વે જીવા ખમંતુ મે, મિતિ મે સત્ત્વભુયેસુ, વરેં મજ્જા ન કેણાઈ.**

એટલે કે આજથી હવે આ જગતના સર્વ જીવો સાથે મારે મિત્રતા છે. કોઈની પણ સાથે દુશ્મનાવટ નથી. સહુ મારા મિત્ર છું. મારાથી થઈ ગયેલા અપરાધોની સહુ મને માફી આપો. હું પણ સહુને મારા તરફથી માફી આપું છું. એકબીજાને ખમાવવાની પ્રથા જૈન ધર્મમાં છે. એટલે જ પર્યુષણાને મૈત્રીનું પર્વ પણ ગણવામાં આવે છે.

ખામેમિ સત્ત્વ જીવે સત્ત્વે જીવા ખમંતુ મે, મિતિ મે સત્ત્વભુયેસુ, વરેં મજ્જા ન કેણાઈ.

ખુલ્ખું મન અને ઉદારતા હોય તો વિગ્રહ ન થાય, ઉપદ્રવ ન સર્જાય, યુદ્ધ તો દૂરની વાત છે. **જૈન ધર્મ ઉદારતાનો ધર્મ છે.** મહાવીર ભગવાને અનેક સુધારાઓ કર્યા. અપરિશ્રહનો સિદ્ધાંત આપ્યો અને ક્ષમાપના દિવસે જૈનો સંવત્સરી મત્રિકમણ કર્યા પછી સર્વ જીવોને ખમાવે છે ‘**મિચામિ દુક્કડમ્**’ કહે છે.

**ખામેમિ સત્ત્વ જીવે સત્ત્વે જીવા ખમંતુ મે, મિતિ મે સત્ત્વભુયેસુ, વરેં મજ્જા ન કેણાઈ.**

એટલે કે આજથી હવે આ જગતના સર્વ જીવો સાથે મારે મિત્રતા છે. કોઈની પણ સાથે દુશ્મનાવટ નથી. સહુ મારા મિત્ર છું. સહુનો મિત્ર છું. મારાથી થઈ ગયેલા અપરાધોની સહુ મને માફી આપો. હું પણ સહુને મારા તરફથી માફી આપું છું. એકબીજાને ખમાવવાની પ્રથા જૈન ધર્મમાં છે. એટલે જ પર્યુષણાને મૈત્રીનું પર્વ પણ ગણવામાં આવે છે.

(અનુસંધાન : જુઓ પાના નં. - ૧૨ ઉપર)

કલ્યાણ

## સામાયિક તો સુલસાબાઈનો



પુષ્પાબેન કનકસેન શાહ

સામાયિક શ્રદ્ધાથી કરો, પૂર્ણત: ધ્યાને કરી,  
શુદ્ધ ભાવ, શુદ્ધ આચારથી કરી કાપવી જે કર્મની,  
સુલસા અને ચોંસઠ વધુ, ઝૂલી કારમી જે વાતને,  
જોડી ગૃહ નીકળી પડ્યા, તજ આત્મ કુર ધ્યાનને,  
મુખે મુહૂરતિ નજર નીચી, દંડ ભાવના હેઠે લઈ,  
સામાયિક લીધું જીવનભરનું વીરના શરણે જઈ.

‘પુષ્પયમથી સતીઓ થકી ઉજ્જવળ છે ઈતિહાસ.’ ભારતીય સંસ્કૃતિનો ઈતિહાસ સતી સ્ત્રીઓ અને સશારીઓથી ઝગ્ણણે છે. ભારત દેશમાં એવા કેટલાય સ્ત્રીનો થયા છે, જેમણે આવનારી પેઢી માટે મ્રકાશપુંજ વેરી રસ્તો સ્પષ્ટ કર્યો છે. જૈન ધર્મમાં પણ આવી અનેક સ્ત્રીઓનાં નામ અને કામ, સૂત્રને પાને ચડ્યા છે. કેટલાય ચરિત્રો કથારૂપે જીવંત રહી જીવનનું બળ આપે છે. એમાં કેટલાક બહુ પ્રચલિત છે, કેટલાક અલ્ય જાણીતા છે.

આવું એક ચાચિત્ર છે સુલસાબાઈનું, નાગ ગાથાપતિના એ અર્ધાંગિની. પૂર્વના પુષ્પોદયે કોઈ કમી નથી. આઠ આઠ પુત્રો વડે માતાની ગોદ ભરી ભરી છે. નાગ ગાથાપતિ ઉપર રાજની મહેર છે. રહેવાના આવાસ હીરારતન જરૂરિત છે. સમાજમાં સંન્માન છે. એક એક પુત્રને આઠ આઠ પત્ની છે. બહોળા પરિવારમાં, સુખની છાયામાં રહેતા સુલસાબાઈ ધર્મમય જીવન ગુજારે છે.

**સુલસાબાઈ જૈન શાચિકા છે. જૈન શાચક-શાચિકાને સામાયિકની કિયા પ્રિય હોય.** એના અંદરના સંસ્કાર બોલતા હોય. ‘સામાયિક વિના સમભાવ નથી, સમભાવ વિના સમાધિ નથી, સમાધિ નથી તો મોક્ષમાર્ગ દૂર છે, દૂર છે.’ આવો ટંકારવ એના મનમાં સતત થતો હોય એટલે એને તો સમય મળે સામાયિક કરવાની જ ઈચ્છા હોય અને ન મળે તો સામાયિક માટે સમય ગમે ત્યાંથી ચોરી લેવાનો હોય.

એક દિવસ સુલસાબાઈ સામાયિકમાં બેઠા છે. સાથે એમની ચોંસઠ પુત્રવધૂઓ પણ છે. પ્રત્યેક વ્યક્તિ આત્મભાવમાં ખોવાઈ જવા પ્રયત્નશીલ છે. એમને એમના સુખ વૈભવ યાદ નથી આવતા. કર્ષણીય ગાન્તાનમાં એમનું મન નથી. સુંવાળી શાયા કે આસનનું સ્મરણ નથી. પતિ સાથેના રંગરાગ વિસરાઈ ગયા છે. એકમાત્ર ધ્યાન છે ભગવાન મહાવીરનાં વચ્ચનોમાં, એમનું

મન બહાવરું બની દોડે છે મુક્તિના માર્ગની શોધમાં.

અચાનક બહાર કોલાહલ થવા લાગ્યો. સુલસાબાઈના કાને શબ્દો પડ્યા! રાજા શ્રેષ્ઠિકની રક્ષા કરતાં નાગ ગાથાપતિ અને આઠ પુત્રો રાજ સામે લડતાં ખપી ગયા. અરરર... બહુ ખોટું થયું. આ મહેલમાં હવે કોઈ પાછો નહીં આવે. હદ્ય ઉપર કારમો ઘા કરે એવા આ શબ્દો હતા. કાળજુ કંપી ઉઠે, હૈયું ચીરાઈ જાય એવા આ સમાચાર હતા. આથી વિશેષ ખરાબ બીજી કઈ ઘટના હોઈ શકે? એક સાથે સીના જીવનનું સૌભાગ્ય એવો પતિ અને જીવનજોધ એવા આઠ-આઠ પુત્રો સુલસાબાઈએ ગુમાવ્યા હતા.

સુલસાબાઈ સામાયિકમાં હતા. એ સામાયિકનો મર્મ જાણતા હતા. સમભાવની પ્રાસિ કરાવે તે સામાયિક. સમભાવે રહેતા શીખવે તે સામાયિક. સુખ અને દુઃખના પ્રસંગોમાં, રાગ અને દ્રેષ્ણી પળોમાં તટસ્ય રહેતાં શીખવે તે સામાયિક. સુલસાબાઈએ સામાયિક જાણ્યો. એમણે પુત્રવધૂઓને પ્રશ્ન કર્યો, ‘એક કલાકનો (બે ઘડીનો) સમય તમને કેવો લાગ્યો?’ સામાયિક તમને કેવો લાગ્યો?’ ગુણીયલ, સરળ સ્વભાવી, હળુકમી પુત્રવધૂઓએ કહ્યું, ‘માતાજી, અમને બહુ આનંદ આવ્યો. હમેશા આવો સમય હોય તો કેવું સારું!’ ‘તમને હંમેશા એવો આનંદ જોઈએ છે તો ચાલો, આપણે જઈએ પ્રભુ મહાવીરના શરણો’ સુલસાબાઈએ કહ્યું.

પુત્રવધૂઓને બનેલા બનાવની કશી ખબર નથી. એ બધી તો સાસુજીની સાથે મહેલો જેવા આવાસ છોડી ચાલી નીકળે છે. છેલ્લી પુત્રવધૂ દરવાજો બંધ કરવા થંબે છે. સુલસા કહે છે, ‘કોના માટે દરવાજો બંધ કરવાનો છે? હવે અહીં કોઈ આવવાનું નથી.’ અને ઘર ખૂલ્લાં મૂકી ચોંસઠ વધુ અને પાંસઠમાં સુલસાબાઈ જીવનભરનો સામાયિક લેવા પ્રભુ પાસે જઈ પહોંચે છે.

**કેવું હશે એ દશ્ય!** રસ્તા ઉપરથી એક સાથે સુખી પરિવારની પાંસઠ સ્ત્રીઓ મોટે મુહૂરતિ ભાંધીને જતી હશે! કેવા હશે એ સુલસાબાઈ જેમણે એક આખી દુર્ઘટનાને સદ્ગટનામાં ફેરવી નાખી! સંસારીની આંખે જોઈએ તો આખો પ્રસંગ અત્યંત શોકનો પ્રસંગ છે. આ પ્રસંગે ભયંકર વલોપાત હોય, કારમું રૂદ્ધન હોય, જોઈ ન શકાય એવી પાંસઠ સ્ત્રીઓની સ્થિતિ હોય!

ફૂલેફૂલો પોરસાતી વસંત પાનખરમાં ફેરવાઈ ગઈ હતી. પરંતુ ધન્ય છે એ સુલસાને જેણે સામાયિક શબ્દને ચરિતાર્થ કર્યો. સામાયિકની કિયા માત્ર કિયા ન રહી, એ આચરણમાં આવી અને છેલ્લું પગથિયું આસાનીથી ચડાઈ ગયું. આ તફાવત હોય સામાન્ય ખીઓમાં અને એક વિશેષ વ્યક્તિત્વમાં. આ તફાવત એમનું નામ સૂત્રપાઠ આવ્યું.

આ ઘટનાને વિશેષ વિચારીએ તો સુલસાબાઈએ એક બીજું મોટું કામ કર્યું છે. સામાન્ય રીતે સાસુ માટે એમ કહેવાય કે, સાસુ એટલે સામાન્ય નામ અને ભયંકર જાતિ. સાસુ અને વહુનો સુમેળ હોય એવું ઓછું જોવા મળે. છોકરીને બાળપણમાં શિરામણની સાથે સાસુની બીક પીરસવામાં આવે છે. સમાજમાં વગોવાયેલા સાસુના પાત્ર માટે કહેવાય કે જે જુથે ત્રાંસુ, પડાવે આંખમાંથી આંસુ, તેનું નામ સાસુ. સુલસાબાઈએ સાસુ માથે લાગેલું આ કલંક ઉજાવળ કર્મથી, ધીરજથી હોયું છે. એમણે કરી બતાવ્યું કે સંસારમાં સાચા સુખનો મારગ બતાવે તે સાસુ.

સુલસાબાઈએ ક્ષણને સાચવી જાણી. જે ક્ષણે આર્તદ્યાન કરી કર્મોના પોટલા બંધાય એ ક્ષણે એમણે કર્મો તોડ્યા. સમભાવનું સાધન લઈ મોહનીય કર્મને છેદ્યા. પુત્રવધૂઓને આર્ત કે રૂદ્ર ધ્યાનની ખાઈમાં પડતી બચાવી, ધર્મધ્યાનને રસ્તે ચડાવી. જે બનવાનું હતું તે બની ગયું હતું. નાગ ગાથાપતિ કે એમના આઠ પુત્રો જે મૃત્યુને વર્યા તે હવે પાછા આવે એમ નહોતા. એમની પાછળ જુર્યા કરવાથી કોઈ અર્થ સરે એમ નહોતો. સુલસા આ મર્મને પૂરો જીણતા હતા. મોહકર્મનો પ્રવેશ ન થાય એ માટે એમણે સમભાવની દીવાલ ખરી કરી દીધી.

વાટે જતાં રસ્તે આવતો પથર ધ્યાન ન રહે તો એ ઠોકર વાગવાનું કારણ બને છે અને એ જ પથર દાણી હોય તો વિસામો બને છે. અગ્નિનો ઉપ્યોગ આવકે તો એ અને પકવી આપે છે, ન આવકે તો દાઢું છે. જીવનમાં દરેક ઘટના કોઈને કોઈ સંદેશ લઈને આવે છે. દુઃખકારી વિપરીત અસરની પાછળ જ સુખદ, સોનેરી તક રાહ જોઈને જ ઊભી હોય છે. માણસ મોટેભાગે પહેલી તકનું સ્વાગત કરવામાં વસ્ત હોય છે. એની પાછળ ઊભી રહેલી બીજી તક રાહ જોઈ જોઈને થાકીને જતી રહે છે. સુલસાબાઈએ બીજાનું સ્વાગત કર્યું. જીવનને સાચા માર્ગ લઈ ગયા. એમને માટે પથર વિસામો બન્યો.

સુલસાનું આ વલણ એક બીજો સંદેશ આપે છે. “વાસાંસિ શુણાનિ ચથા વિહાય, નવાનિ ગૃહણાતિ નરોપરાણિ.” માણસ જૂનું વખ્ય બદલી નવું પહેરે છે. મનુષ્ય સંબંધો એવા છે. કપું જૂનું થાય પછી શરીરથી અણગું થાય. એમ સાંસારિક સંબંધ હતા તે હતા. પૂરા થયા પછી એનો હર્ષશોક કેવો! એમણે સંબંધોના વાધા તજી દીધા. પુત્રવધૂઓ એમના પગલે ચાલી અને

પાંસઠ જીવન જે કારમા દુઃખમાં રીબાઈ રીબાઈને લાચારી ભોગવી પૂરા થાત, તે ઉત્તે મસ્તકે ભવકટી કરતાં, ત્યાગનો સંદેશ દેતાં, જૈન શાસનનો જ્યાનાદ ગજવતાં પૂરા થયા. ધન્ય છે એ સામાયિકને જીણનારી સુલસાબાઈને!

આમ, સામાયિક એટલે ‘સમાનિ-જ્ઞાન, દર્શન, ચારિત્રાણિ તેષુ અયનં, ગમનં સમાયઃ, સ એવ સામાયિકમ્ભ.’ માત્ર મોક્ષમાર્ગના સાધન જ્ઞાન, દર્શન અને ચારિત્ર સમ કહેવાય છે. તેમાં અચન કહેતાં ગમન કરવું એટલે કે પ્રવૃત્તિ કરવી તે ‘સામાયિક’ છે.

સામાયિક આપી શકાય નહીં, ખરીદી કે લઈ શકાય નહીં. એ તો આત્માની વસ્તુ છે. સૂત્રકાર તો કહે છે, આત્મા એ જ સામાયિક છે. એ તો રાગ-દ્રેષ્ટી પર છે. બંધનમાં છે ત્યાં સુધી જ તકલીફ. ચાર કખાયોની ચોકડી ભેદો, રાગનું બંધન, દ્રેષ્ટનું બંધન તોડી ઉખેડી ફેંકી દી પછી તો મર્સ્તી જ મર્સ્તી. મુક્તિની મર્સ્તી થોર છે અને એ મર્સ્તી માણવા સામાયિક જરૂરી. દ્રવ્ય સામાયિકની નેટ પ્રેક્ટિસ દ્વારા ભાવ સામાયિકમાં પ્રવેશી સતત સમની સાધના કરવી એ જ માનવ જીવનું ધ્યેય છે. એમાં જ જીવનનું શ્રેય છે.

ઘનવંતરી વિકિત્સાલય,  
શ્રીજી નગર, મુંદ્રા, કચ્છ.

#### પર્વાદિરાજ પર્યુષણ : તપ, ત્યાગ અને તિતિક્ષાનો તહેવાર

(અનુસંધાન : પાના નં. – ૧૦ ઉપરથી ચાલુ)

જૈન ચિંતક શશીકંતભાઈ મહેતાએ નવકાર બેંક બનાવી છે. નવકાર મંત્રના સમૂહ જાપ કરાવાય છે. તેઓ માને છે કે, શુભ ભાવનાથી કોઈ કામ થાય તો તેની અસર ઉપજે છે. પર્યાવરણ શુદ્ધ બને છે અને આ કાર્યક્રમ દ્વારા શુભ સંદેશો ફેલાવવા માંગીએ છીએ.

જૈન આચારો કરક છે એવી પણ ટીકા થાય છે. તપ, જપનો મહિમા છે. પણ આ બદ્ધું પરાણે કર્માવાતું નથી. આ તો સહજ હોવું જોઈએ. ત્યાગ સહજ હોવો જોઈએ. સહજતાથી ન હોડવું હોય તો એ માત્ર દંબ છે.

પણ, સમર્યાદા એ છે કે, આપણે કોઈ પણ ધર્મ કે દર્શનની મૂળ ભાવનાનો મહિમા ગાતા નથી. કિયાકંડને મહત્વ આપી દઈએ છીએ. જૈન સમાજમાં પણ અલગ અલગ ફિરકાઓ છે. આ બદ્ધું છૂટવું જોઈએ. જરૂર છે, જૈન ધર્મના સાચા પ્રચારની. એનો મૂળ મંત્ર સમાજમાં ફેલાય તો શાંતિ હાથવગી બને તેમ છે.

૩૦૨, મર્લિન અર્ટ્સ, ૧૧, વિશ્વકુર્જ સોસાયટી,  
નારાયણનગર રોડ, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭.  
મો. ૯૯૨૪૩ ૪૪૬૨૮

## વ્યક્તિ વિશેષ

## આધુનિક ભારતના એક શિલ્પી :

### ડૉ. રાજેન્ડ્ર પ્રસાદ



આધુનિક ભારતને જે શિલ્પીઓ મળ્યા છે તે એકથી એક ચેડે એવા અને દંતકથા સમાન છે. આજનું ભારત જોનારાને કલ્પના નથી કે કઈ સ્થિતિમાંથી ઊઠીને આપણે અહીં સુધી આવ્યા છીએ. તેમાં જે મહામાનવોની ભૂમિકા છે એમાંથી એક અણમોલ નામ છે, ડૉક્ટર રાજેન્ડ્ર પ્રસાદ. ૧૮૮૪ની ઉજી ડિસેમ્બરે બિહારના સિવાન શહેરમાં તેમનો જન્મ અને મૃત્યુ ૧૯૬૫ની ૨૮મી જાન્યુઆરીના રોજ.

તેઓ મહાત્મા ગાંધીના અનુયાયી હતા અને સાદગીપૂર્ણ જીવન માટે સુઝ્યાત હતા. દેશના પ્રથમ રાખ્રૂપતિ તરીકે તેમને જે પગાર મળતો હતો તેમાંથી ૫૦ ટકા રકમનો જ સ્વીકાર કરતા હતા. ત્યારે રાખ્રૂપતિનો પગાર રૂ. ૧૦,૦૦૦ હતો. કાર્યકાળના છેલ્લા તબક્કામાં તો એથીય કમ યાને માત્ર ૨૫ ટકા પગાર જ સ્વીકારતા. પોતાની બયચ્યાનાંથી તેમણે કાર ખરીદ્દી. આ વિશે ચર્ચા શરૂ થઈ જતાં કાર પાછી આપી દીધી. આ સમાજ એવો છે કે ૧૦૦ કામ બીજા માટે કરશો તો લોકો વાહ-વાહ કરશો, પણ એક કામ જો પોતાના માટે કરશો તો તેઓ તમે કરેલા ૧૦૦ લોકલક્ષી કાર્યોને ભૂલાવી દેશે.

ભાષાવામાં ખૂબ તેજસ્વી હતા. ૧૯૧૫માં કલકત્તા યુનિવર્સિટીની પ્રવેશ પરીક્ષામાં પ્રથમ કમે પાસ થયા હતા. આથી તેમને પ્રતિવર્ષ રૂ. ૩૦ની શિષ્યવૃત્તિ ચૂકવવામાં આવતી હતી. એક પરીક્ષામાં ટીચરે તેની પૂર્વવિભાગાનું લખ્યું હતું,

**Examinee is better than Examiner.**

તેમણે અર્થશાસ્ત્રમાં અનુસ્નાતકની પદવી હાંસલ કરી હતી. બાદમાં મુગ્ગફરપુરમાં અંગ્રેજ વિષયના પ્રોફેસર તરીકે જોડાયા હતા. ત્યાર પછી કલકત્તાની સિટી કોલેજમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર તરીકે કામ કર્યું. અલહાબાદ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં ડૉક્ટરેટની ડિગ્રી પ્રાપ્ત કરી. એ પછી બિહાર અને ઓડિશામાં વકીલાતની પ્રેક્ટિસ કરી.

સન ૧૯૧૦માં તેઓ કલકત્તામાં વકીલાત ભાગી રહ્યા હતા ત્યારની આ વાત છે. એ જમાનાના જ્યાત બેરિસ્ટર પરમેશ્વર લાલને મળવા ગોપાલકૃષ્ણ ગોખલે પહોંચ્યા. તેમણે કલકત્તાના ગ્રાન્ચ-ચાર હોનહાર વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરાવી આપવા કર્યું. પરમેશ્વરજીએ નવયુવાન રાજેન્ડ્રને બોલાવ્યા.

હજુ થોડા દિવસ પહેલા જ ગોખલેજાએ શ્રીકૃષ્ણ પ્રસાદ સાથે મળીને સર્વનંદસ ઓફ ઇન્ડિયા સોસાયટીની સ્થાપના કરી હતી. તેમને દરેક શહેરમાં કેટલાક પ્રતિભાવંત યુવાનોની આવશ્યકતા હતી. આથી તેમણે રાજેન્ડ્રબાબુને કહ્યું, સંભવ છે કે તારી વકીલાત ખૂબ ચાલી નીકળે. તું ખૂબ પૈસા કમાઈ શકીશ. બહુ જ આરામથી જીવી શકીશ. કોઈ, ઘોડાગાડી બધું હશે તારી પાસે. તું ભાષાવામાં હોંશિયાર છો એટલે આ વિશેની શક્યતા ઓર વધી જાય છે.

આટલું કચ્ચા પછી તેઓ થોડીવાર ચૂપ થઈ ગયા. ઓરડામાં સનાટો છવાઈ ગયો. રાજેન્ડ્રબાબુના મનમાં તૂફાન ચાલી રહ્યું હતું. ગોખલેજે આગળ બોલવાનું શરૂ કર્યું. મારી સામે પણ આ જ સવાલો ઉભા થયા હતા.

આ જ ઉમરમાં, હું પણ સાધારણ ગરીબ પરિવારનો છોકરો હતો. ઘરના સત્યોને બહુ જ અપેક્ષા હતી. તેમને હતું કે હું ભાડીને તૈયાર થઈ જઈશ, પૈસા કમાઈશ અને બધાને સુખી કરીશ. પણ મેં તેમની આશા ઉપર પાણી ફેરવી, દેશસેવાનું ક્રત લઈ લીધું.

મારા ભાઈ એટલા દુઃખી હતા કે થોડા દહ્યા તો મારી સાથે વાત સુદ્ધાં ન કરી. સંભવ છે કે આવું તારી સાથે પણ બને. પરંતુ વિશ્વાસ રાખજે, અંતમાં એ જ લોકો તારી પૂજા કરવા લાગશે.

છેવટે તેમણે કહ્યું, અત્યારે જ ઉત્તરી પડવાની જરૂર નથી. સવાલ ઉંડો છે. શાંતિથી વિચારજે. ફરી પાછા મળીશું ત્યારે તારી રાય જણાવજો.

પછીના દિવસો રાજેન્ડ્રબાબુ માટે કપરા બની ગયા. દેશસેવા કરવાની તીવ્ર ભૂખ લાગી હતી, પણ મોટા ભાઈને જણાવતા ડર લાગતો હતો. મોઢામોઢ કહેવાની જરાય હિંમત નહોતી. આથી લાંબો પત્ર લખ્યો. ભાઈ બહાર ગયા હતા ત્યારે તે તેમના બિસ્તર પર મૂકી દીધો અને બહાર ચાલવા જતા રહ્યા. ભાઈ આવ્યા ત્યારે તેમણે પત્ર વાંચ્યો. તરત જ નાના ભાઈને શોધવા નીકળી પડ્યા. જેવા મળ્યા કે રસ્તામાં તેમને ભેટીને રડવા લાગ્યા.

૧૯૦૬માં તેમણે બિહારી સ્ટુડન્ટ્સ કોન્ફરન્સનું આયોજન

કર્યું હતું. ૧૯૧૩માં બિહાર ધાત્ર સંમેલનના અધ્યક્ષ તરીકે ચૂંટાયા. ૧૯૭૦માં મહાત્મા ગાંધી નમક સત્યાગ્રહના મુખ્ય નેતા બચ્ચા. ૧૯૭૪માં ભૂકુપ અને પૂરમાં પાયમાલ થઈ ગયેલા લોકોને ઉભા કરવા રિલીફ ફડ એકત્રિત કરવાની કામગીરી હાથ ધરી. રૂ. ૩૮ લાખ ભેગા કર્યા. એ સમયમાં આ રકમ આજના ૫૦-૧૦૦ કરોડ જેવી કહેવાય. આંદોલન માટે પૈસા એકત્રિત કરવા દેશના અનેક વિસ્તારો ઘૂમી વળેલા.

તેમણે આત્મકથામાં લખ્યું છે, દરો જેટલો જોરથી પછાડે એટલો વધારે તીવ્રતાથી ઉછળે છે. અંગ્રેજોના દમનને કારણે લોકો વધુ જોશમાં આવી ગયા હતા. સભામાં રૂપિયાનો વરસાદ થાય છે. પ્રવાસ ખૂબ આકરો હતો. તબિયત સુધરી હતી, પણ હજુ કમજોરી ગઈ નહોતી. લોકોનો ઉત્સાહ વધારવા હું ભાષણ આપતો. આગામી ચૂંટણી માટે હું કંઈક કહેતો અને પછી રૂપિયા માટે અપીલ કરતો. દરેક જિલ્લામાં ટાર્ગેટ કરતા વધુ પૈસા મળ્યા.

**ગાંધી અને સુભાષ વર્ચેના મતલેદ દૂર કરવામાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી.** ત્રિપુરી અધિવેશનમાં સુભાષયંક બોડ કોંગ્રેસ અધ્યક્ષ તરીકે ચૂંટાયા. તેમના વિરોધી હૃદ્યતા હતા કે રાજેન્દ્ર પ્રસાદ ચૂંટાય. રાજેન્દ્ર બાબુએ કહ્યું, જે સુભાષ બાબુના પક્ષમાં બહુમત હોય તો તેમણે કોંગ્રેસની કમાન સંભાળવી જોઈએ. ત્રિપુરી કોંગ્રેસના અધિવેશન બાદ ગાંધી સમર્થક અને સુભાષ સમર્થક વચ્ચે ગરમા-ગરમી થઈ ગઈ હતી.

રાજેન્દ્ર પ્રસાદ પર આક્રેપ હતો કે સુભાષયંક બોડના અધ્યક્ષ બનવાથી તેઓ જરા પણ ખુશ નથી. અખબારોમાં આ વિશે ચમકેલા સમાચારને તેમણે રહિયો આપેલો. તેમણે કહ્યું, સુભાષની ઘણી વાતો સાથે હું સહમત નથી એ વાત સાચી, પણ મારા મનમાં તેમના માટે જરાય કડવાશ નથી. આ વિશે અખબારોનો દાવો ખોટો છે.

તેઓ પોતે પક્ષના અધ્યક્ષપદથી દૂર ભાગી રહ્યા હતા. ગ્રાઉન્ડ પર કામ કરવા માગતા હતા. તેમણે ગાંધીજીને આ વિશે વાત કરી. બાપુ ન માન્યા. તેમણે રાજેન્દ્ર બાબુને અધ્યક્ષ બનવાવા માટે હઠ પકડી. રાજેન્દ્રબાબુ અધ્યક્ષ તરીકે ચૂંટાયા. ઓલ ઇન્ઝિનિયા કોંગ્રેસ કમિટીની બેઠક પૂરી થયા બાદ આ મુદ્દે પંડાલમાં હંગામો મચી ગયો. **ગોવિંદ વલ્લભ પંત અને આચાર્ય કૃપલાની** સાથે ગેરવર્તન કરવામાં આવ્યું. મારપીટની નોભત આવી ગઈ.

રાજેન્દ્ર બાબુને કારણે સુભાષ બાબુ બીજે દિવસે અધિવેશનમાં ન આવ્યા. તેમણે રાજીનામું મોકલી દીધું. રાજેન્દ્ર બાબુ બોલવા ઉભા થયા કે સુભાષ બાબુના સમર્થકોએ હોબાળો મચાવવાનું શરૂ કરી દીધું.

તેઓ ચુપચાપ ઉભા રહ્યા. કોલાહલ શાંત પઢ્યા બાદ

તેમણે સભા બરખાસ્ત કરી. તેઓ ત્યાંથી જવા લાગ્યા તો સુભાષ બાબુના સમર્થકોએ તેમને પકડી લીધા. તેમને બેંચવા લાગ્યા. બીજું જૂથ તેમને બચાવવા આવી ગયું. તેમને કોઈ પ્રકારની ઈજા તો નહોતી થઈ, કિન્તુ જબ્બાના બટન તૂટી ગયાં. ખૂબ વિરોધ પછી અધ્યક્ષ બનાવાયા હોવાથી રાજેન્દ્ર બાબુ દુઃખી હતા. ગાંધીજીના અનુયાયી હોવાથી તેમને ઈન્કાર ન કરી શક્યા.

ડૉ. રાજેન્દ્ર પ્રસાદ અને પંડિત જવાહરલાલ નહેરુ વચ્ચે તીવ્ર રાજકીય મતભેદ હતા. ખાસ કરીને ધાર્મિક બાબતોમાં. નહેરુ આધુનિક સમાજવાદના પક્ષધર હતા. તેઓ માનતા કે ભારતની એ સમયની સ્થિતિનું કારણ ભીરુ, ધાર્મિક વલણ પણ હતું. આ દેશ પરંપરાના નામે સરેલી - ગળેલી માન્યતા સાથે જકડાયેલો હતો. આજાદી બાદ ભારતને વૈજ્ઞાનિક ચેતના સાથે આગળ વધવાનું હતું. ભારતને મંદિરોની જરૂર હતી. એ મંદિરમાં ઈશ્વરની મૂર્તિ અને ઉપાસનાને સ્થાન નહીં. એ મંદિર એટલે ઉદ્ઘોગ, નિયોજિત શહેર, બંધ, હોસ્પિટલ, સ્કૂલ અને પ્રયોગશાળા.

રાજેન્દ્ર પ્રસાદ ઔદ્ઘોગિક પ્રગતિના પક્ષધર હતા, પરંતુ ભારતની માનસિકતા પરિવર્તિત કરીને નહીં. તેઓ ખૂબ ધાર્મિક હતા અને માન્યતા સંબંધિત બાબતોનું પ્રદર્શન કરવામાં તેમને જરાય છોછ નહોતો. સરદાર, નહેરુ અને પ્રસાદની વચ્ચે ક્યાંક હતા.

ઓક્ટોબર ૧૯૪૭માં બંધારણ સભામાં હિંદુ કોડ બીલ રજૂ થયું. **આંબેડકરે** તેનો મુસદ્દો તૈયાર કર્યો હતો. આ ખરડા અંતગત હિંદુઓ માટે નિયમો ઘડવામાં આવ્યા હતા.

વિવાહ, વારસો અને બીજી ગણી બધી બાબતોનો તેમાં સમાવેશ થતો હતો.

રાજેન્દ્ર પ્રસાદ કહ્યું, આ પ્રકારનું બીલ પસાર કરતા પહેલાં તેના માટે દેશમાં જનમત તૈયાર કરવો જોઈએ. તમામ વર્ગોને સાથે લીધા વિના નિયમોનું પાલન કરાવી શકાશે નહીં.

નહેરુ હિંદુ કોડ બીલ પસાર કરાવવાની હઠ કરી રહ્યા હતા જ્યારે ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ઉગ્ર વિરોધ કરી રહ્યા હતા. સંતો તથા હિંદુવાદી સમાજસેવકો પણ જાહેર પ્રદર્શન યોજને હિંદુ કોડ બીલનો વિરોધ કરી રહ્યા હતા.

તેમણે એક જલદ ચિંહી લખી. જેમાં તેમને અન્યાયપૂર્ણ અને બિનલોકતાંત્રિક ગણાવ્યા. આ ચિંહી સરદાર પટેલને વંચાવી. પટેલે તે બિસ્સામાં મૂકી દીધી અને રાજેન્દ્રબાબુને કહ્યું કે આ મામલો પાર્ટી ફોરમમાં ઉઠાવજો. આમાં વ્યક્તિગત મતભેદની કોઈ વાત નથી.

૨૬મી નવેમ્બરે બંધારણ લખાઈ ચૂક્યું હતું. પરંતુ ગણતંત્ર

(અનુસંધાન : જુઓ પાના નં. - ૧૮ ઉપર)

## ધિતિહાસ

## જલિયાંવાલા ભાગ - નરસંહાર



ડૉ. ભિહિર એમ. વોરા

ભુજથી લગભગ ૧૫ કિ.મી. દૂર વંદે માતરમ મેમોરિયલ આવેલું છે, જેમાં ૧૮૫૭થી ૧૮૪૭ સુધીના બધા ઐતિહાસિક પ્રસંગોનું બારીકાઈથી એક ભૂક્લિયમ બનાવ્યું છે. જેમાં સૌ પ્રસંગોમાં એમ જ લાગે છે જ્ઞાણે આપણે તેમાં સામેલ છીએ. આવા જ એક પ્રસંગને જોતા મને આ લેખ લખવાનું મન થયું છે અને જે ભારતની આજાદીમાં એક કાળો ઘણ્ણો છે બ્રિટીશ સરકાર ઉપર, જેની માફી આજ સુધી કોઈએ માંગી નથી, જે એક ચિંતાનો વિષય છે. અને તે પ્રસંગ છે જલિયાંવાલા બાગનો નરસંહાર. જે એપ્રિલની ૧૩ તારીખે થયો હતો. આમ તો આ વાતનો ઈતિહાસ આપણે સૌ જાણીએ છીએ પણ ફરી પાછો એકવાર તેનું પુનરાવર્તન કરી લઈએ અને જે નિર્દોષ લોકો શહીદ થયા હતા, તેમને આ લેખથી શબ્દાંજલિ આપીએ. **આ વાતને ૧૦૦ વર્ષો પૂરા થયા છે** ત્યારે હાહાકારરૂપી બનાવને એકવાર યાદ કરી લઈએ. **અમૃતસરના સુવર્ણ મંદિર નજુકનો નાનકડો ભગીયો જલિયાંવાલા ભાગ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રહમના ધિતિહાસમાં એક અનોખું સ્થાન ઘરાયે છે.** ૧૩ એપ્રિલ, ૧૮૧૮ના દિવસે બ્રિગેડિયર જનરલ રેજનોલ ડાયરેના નેતૃત્વમાં અંગ્રેજ હક્કમતના સૈનિકોએ ગોળીઓ ચલાવીને નિશાની, શાંત એવા અભાલ-વૃદ્ધ અને બાળકો સહિત સેંકડો લોકો પર ગોળીઓ ચલાવી હતી. આ ગોળીબારમાં ઘણા લોકો માર્યા ગયા હતા અને હજારો લોકો ઘાયલ પણ થયા હતા. જો કોઈ એક ઘટનાએ ભારતીય સ્વતંત્રતા સંગ્રહમાં સૌથી વધારે પ્રભાવ પાડ્યો હતો, તો તે ઘટના આ જધન્ય અને નિર્મભ હત્યાકંડ છે. આજે પણ કોઈ સત્તાના દમનકારી વલશની ઘટના કે હત્યાકંડ થાય છે, તો તેને જલિયાંવાલા હત્યાકંડ સાથે સરખાવી દેવામાં આવે છે.

૧૩ એપ્રિલ, ૧૮૧૮નો દિવસ બેશાખીનો દિવસ હતો. બેશાખીના દિવસે આખા પંજાબ અને આસપાસના પ્રદેશોમાં ખેડૂતો રવિ પાક કાપીને નવા વર્ષની ખુશીઓ મનાવતા હોય છે. ૧૩ એપ્રિલ, ૧૮૧૮ના દિવસે શીખોના દસમા ગુરુ ગોવિંદસિંહે ખાલસા પંથની સ્થાપના કરીને લોકોને અન્યાય અને અત્યાચાર સામે માથું ન ઝુકાવવાની હાકલ કરી હતી. તેના કારણે પંજાબ અને આસપાસના પ્રદેશોમાં બેશાખી સૌથી મોટો તહેવાર છે અને શીખો તેને સામુહિક જન્મ દિવસના રૂપમાં

ઉજવે છે. અમૃતસરમાં તે દિવસે એક મેળો સેંકડો વર્ષોથી યોજાતો હતો, તેમાં તે દિવસે પણ હજારો લોકો દૂર-દૂરના સ્થાનો પરથી ખુશીઓ વહેંચવા આવ્યા હતા. અંગ્રેજ હક્કમતનું દમનકારી વલશ ૧૮૫૭ના પ્રથમ સ્વતંત્રતા સંગ્રહમાં બાદ શરૂ થઈ ચૂક્યું હતું. તેમ છતાં ભારતે પ્રથમ વિશ્વયુદ્ધમાં બ્રિટીશ હક્કમતનો ખૂલીને સાથ આપ્યો હતો. પ્રથમ વિશ્વ યુદ્ધની સમાનિએ આશા હતી કે બ્રિટીશ શાસન હવે ભારત સાથે નરમાશથી વર્તશે. પરંતુ લોકોની ભાવનાથી વિપરીત બ્રિટીશ સરકારે મોન્ટેગુ-ચેસ્કર્ફ સુધારા લાગુ કરી દીધા. પ્રથમ વિશ્વ યુદ્ધ વખતે પંજાબના ક્ષેત્રોમાં બ્રિટીશરો સામે વિરોધ કંઈક વધારે પ્રમાણમાં સપાઈ પર આવ્યો હતો. તેને દબાવવા માટે **ભારત પ્રતિરક્ષા કાયદો (૧૯૧૫)** લાગુ કરીને વિરોધને કચડી નાખ્યું હતું. ત્યારબાદ ૧૯૧૮માં એક બ્રિટીશ ૪૪ સિડની રોલેટની અધ્યક્ષતામાં એક સમિતિની નિમણૂક કરવામાં આવી હતી. આ સમિતિની જવાબદારી ભારતમાં ખાસ કરીને પંજાબ અને બંગાળમાં બ્રિટીશરોનો વિરોધ કરી વિદેશી શક્તિઓની સહાયતાથી થઈ રહ્યો હતો, તેનું અધ્યયન કરવાની હતી. આ સમિતિના સૂચનો પ્રમાણે, ભારત પ્રતિરક્ષા કાયદાનો વિસ્તાર કરીને રોલેટ એકટ લાગુ કરી દેવામાં આવ્યો હતો. રોલેટ એકટનો હેતુ આજાદી માટે ચાલી રહેલા આંદોલન પર રોક લગાવવાનો હતો. તેમાં તેઓ પ્રેસ પર સેન્સરશિપ લગાવી શકે, નેતાઓને કોઈ કેસ વગર જેલમાં રાખી શકે, લોકોને વોરન્ટ વગર પકડી શકે, તેમના પર વિરોધ ટ્રિભ્યુનલોમાં જવાબદારી વગર ચુકાદા ચલાવી શકતા હતા.

રોલેટ એકટ તે સમયે બ્રિટીશ હક્કમતની દમનકારી નીતિઓનું વાહક બની ગયો હોવાથી તેની સામે વિરોધનું વાતાવરણ બની ગયું હતું. તેને કાળા કાયદા તરીકે ઓળખવામાં આવતો હતો અને લોકો તેના વિરોધમાં ધરપકડ વહેંચી રહ્યા હતા. ગાંધીજી ત્યારે દક્ષિણ આફ્રિકાથી ભારત આવી ચૂક્યા હતા અને ધીમેધીમે તેમની લોકપ્રિયતા વધી રહી હતી. તેમણે રોલેટ એકટના વિરોધનું આહવાન કર્યું હતું. તેને કચડવા માટે બ્રિટીશ સરકારે વધુ નેતાઓ અને લોકોની ધરપકડો કરી હતી. જેનાથી જનતાનો આકોશ વધ્યો હતો અને લોકોએ રેલવે તથા તાર-ટપાલ સેવાઓને બાવિત કરી હતી. આંદોલન એપ્રિલના પ્રથમ સમાહિમાં તેની ચરમ સીમા પર પહોંચ્યું હતું. લાહોર અને અમૃતસરની સરકારો પર માનવ

મહેરામણ ઉમટેલો રહેતો હતો. લગભગ ૫ હજાર લોકો જલિયાંવાલા બાગમાં ભેગા થયા હતા. બ્રિટીશ સરકારના ઘણા અધિકારીઓ તેને ૧૮૫૭ની કાંતિ અને તેમની દાખિએ વિખ્યવના પુનરાવર્તન જેવી પરિસ્થિતિ લાગી રહી હતી. તેમ ન થવા દેવા અને તેને કચડવા માટે તેઓ કંઈપણ કરવા માટે તૈયાર હતા. આંદોલનના બે નેતાઓ સત્યપાલ અને સૈફુદીન કિયલુની ધરપકડ કરીને કાળા પાણીની સજા આપવામાં આવી હતી. ૧૦ એપ્રિલ, ૧૮૧૮ના રોજ અમૃતસરના ઉપ કમિશનરના ઘર પર આ બંને નેતાઓને મુક્ત કરવાની માંગણી રજૂ કરવામાં આવી હતી. તે વખતના ઉકળાટભર્યા વાતાવરણમાં ૫ યુરોપીય નાગરિકોની હત્યા થઈ હતી. તેના વિરોધમાં બ્રિટીશ સિપાહીઓએ ભારતીય જનતા પર અંધાધૂંધ ગોળીબાર કરીને ૮૩ થી ૨૦ ભારતીયોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આગામી બે દિવસ દરમિયાન અમૃતસર તો શાંત રહ્યું હતું પરંતુ પંજાબના અન્ય ક્ષેત્રોમાં હિસા ફેલાઈ ગઈ હતી અને અન્ય ઉયરોપીય નાગરિકોની હત્યા થઈ હતી. આ પ્રકારની પરિસ્થિતિને કચડવા માટે પંજાબના મોટાભાગના વિસ્તારમાં માર્શલ લો લાગુ કરી દીધો હતો.

બૈશાખી દિવસના રોજ અમૃતસરના જલિયાંવાલા બાગમાં એક સભા રાખવામાં આવી હતી. તેમાં કેટલાક નેતાઓ ભાષણ આપવાના હતા. શહેરમાં કફર્યું લાગેલો હતો. તેમ છતાં સેંકડો લોકો એવા પણ હતા કે જે બૈશાખી જેવા માટે પરિવાર સાથે મેળો જોવા આવ્યા હતા અને શહેર જોવા આવ્યા હતા. તેઓ પણ સભાની ખબર સાંભળીને સભા સ્થળ તરફ જઈ રહ્યા હતા. જ્યારે નેતા, બાગમાં પડેલા ઉંચાણવાળા સ્થળની ભાષણ આપી રહ્યા હતા, ત્યારે બ્રિટીશ જનરલ રેઝનોલ ડાયર ૮૦ બ્રિટીશ સૈનિકો સાથે લઈને ત્યાં પહોંચી ગયા હતા. તેમના બધાના હાથમાં ગોળીઓ ભરેલી રાઈફલ હતી. નેતોએ સૈનિકોને જોયા, તો તેમણે ત્યાં ઉપસ્થિત લોકોને શાંતિથી બેસી રહેવા કર્યું હતું. સૈનિકોએ બાગને ઘેરી લઈને કોઈપણ ચેતવણી આપ્યા વગર નિશ્ચન્દ્ર લોકો પર ગોળીબાર કરવાના શરૂ કરી દીધા હતા. ૧૦ મિનિટમાં કુલ ૧૬૫૦ રાઉન્ડ ગોળીઓ ફાયર થઈ હતી. જલિયાંવાલા બાગ તે સમયે મકાનો પાછળ ખાલી પડેલું એક મેદાન હતું. ત્યાં સુધી જવા અને આવવા માટે એકમાત્ર સાંકડો રસ્તો હતો અને ચારે તરફ મકાનો હતા. ભાગવા માટે કોઈ રસ્તો ન હતો. કેટલાક લોકો જીવ બચાવવા માટે મેદાનમાં રહેલા એકમાત્ર કૂવામાં કૂદી ગયા. પરંતુ જોતજોતામાં તે કૂવામાં લાશોનો ઢગલો થયો હતો. જલિયાંવાલા બાગના હત્યાકંડ બાદ ત્યાં રહેલા કૂવામાંથી ૧૨૦ લાશો કાઢવામાં આવી હતી. શહેરમાં કફર્યું લગાવવામાં આવ્યો હતો. જેના કારણે ઘણ્યલોને સારવાર માટે પણ ક્યાંય લઈ જઈ શક્યા ન હતા. લોકો સારવારના અભાવમાં તડપીને જીવ આપી રહ્યા હતા. અમૃતસરના તેઘુટી કમિશનરના કાર્યાલયમાં ૪૮૪ શહીદોની યાદી છે. જ્યારે જલિયાંવાલા

બાગમાં કુલ ૩૩૮ શહીદોની યાદી છે. બ્રિટીશ સરકારનો અભિલેખ આ ઘટનામાં ૩૭૮ લોકોના મોત અને ૨૦૦ લોકોના ઘણ્યલ થવાની વાતનો સ્વીકાર કરે છે. તેમના જણાવ્યા પ્રમાણે માર્યા ગમેલાઓમાં ૩૭૭ પુરુષો, ૪૧ કિશોરો અને ૧ ૪ માસના બાળકનો સમાવેશ થતો હતો. અનાધિકારીક આંકડા પ્રાણે ૧૦૦૦થી વધારે લોકો માર્યા ગયા હતા અને ૨૦૦૦થી વધારે લોકો ઘણ્યલ થયા હતા. મુખ્યમથકે પાછા ફરીને બ્રિગેડિયર જનરલ રેઝનોલ ડાયરે પોતાના વરિષ્ઠ અધિકારીઓને ટેલિગ્રામ કરીને કહ્યું હતું કે તેમના પર ભારતીયોને એક ફૌજે હુમલો કર્યો હતો. તેમાંથી બચવા માટે તેમને ગોળીબાર કરવા પડ્યા હતા. બ્રિટીશ લેફ્ટનાન્ટ ગવર્નર માઈકલ ઓ. ડાયરે તેના જવાબમાં બ્રિગેડિયર જનરલ રેઝનોલ ડાયરને ટેલિગ્રામ કરીને કહ્યું હતું કે તેણે યોગ્ય પગલું લીધું છે. તેઓ તેના નિર્ણયને અનુમોદન આપે છે. ત્યારે વાઈસરોય ચેમ્સફર્ડની સ્વિકૃતિ બાદ અમૃતસર અને અન્ય ક્ષેત્રોમાં માર્શલ લો લગાવી દેવામાં આવ્યો હતો. આ હત્યાકંડની દુનિયાભરમાં આકરી ટીકા થઈ હતી. તેના દબાણમાં ભારતના સેકેટરી ઓફ સ્ટેટ એડવિન મોન્ટેગ્રૂએ ૧૮૧૮ના અંતમાં મામલાની તપાસ માટે હંટર કમિશનની નિમણુંક કરી હતી. કમિશન સામે બ્રિગેડિયર જનરલ ડાયરે સ્વીકાર્યું હતું કે જલિયાંવાલા બાગમાં ગોળીબાર કરીને લોકોને મારી નાખવાનો નિર્ણય તેણે ત્યાં જતા પહેલા જ કર્યો હતો. તે ત્યાં લોકોને મારી નાખવા માટે બે તોપો પણ લઈ ગયો હતો. પરંતુ રસ્તો સાંકડો હોવાથી તેને બહાર જ રાખવી પડી હતી. હંટર કમિશનના રિપોર્ટ બાદ જનરલ ડાયરને બ્રિગેડિયર જનરલમાંથી કર્નલ બનાવી દેવામાં આવ્યો હતો. તેને અક્રિય (નિષ્ક્રિય) અધિકારીઓની યાદીમાં રાખવામાં આવ્યો હતો. તેને ભારતમાં પોસ્ટ ન આપવાનો નિર્ણય કરાયો હતો અને તે સ્વાસ્થ્યના કારણોથી બ્રિટન પાછો ફર્યો હતો. બ્રિટના હાઉસ ઓફ કોમન્સે જલિયાંવાલા બાગ હત્યાકંડની નિદા કરીને પ્રસ્તાવ પસાર કર્યો હતો, પરંતુ હાઉસ ઓફ લોર્ડ્સ તેના વખાણ કરતો પ્રસ્તાવ પસાર કર્યો હતો. વિશ્વવ્યાપી નિદાના દબાણમાં બ્રિટીશ સરકારે તેનો નિદા પ્રસ્તાવ પારીત કર્યો અને ૧૮૨૦માં જનરલ ડાયરે રાજીનામું આપવું પડ્યું હતું. ૧૮૨૭માં જનરલ ડાયરનું કુદરતી મૃત્યુ થયું હતું. ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરે આ હત્યાકંડના વિરોધમાં નાઇટહુડનો ભિતાલ પાછો આપી દીધો હતો.

આજાદી માટે લોકોના જોશમાં આવી ઘટનાથી પણ કોઈ ઓટ આવી ન હતી. જલિયાંવાલા બાગ હત્યાકંડ બાદ લોકોમાં આજાદીની આકાંક્ષા વધવા લાગી હતી. આ હત્યાકંડની ખબર તે વખતના અપૂરતા સંચાર સાધનો છતાં જંગલમાં આગની જેમ દેશભરમાં ફેલાઈ ગઈ હતી. જલિયાંવાલા હત્યાકંડ બાદ પણ લોકોની આજાદી માટેની ચાહત જોઈને ગાંધીજીએ ૧૮૨૦માં

(અનુસંધાન : જુઓ પાના નં. - ૨૬ ઉપર)

કચ્છ

રાજ પરિવારના પ્રશિક્ષક અને 'કારા કુંગર કચ્છના'ના અનુવાદકર્તા

## કચ્છના સંનિષ્ઠ કેળવણીકાર : વસંતરાય પણેણી

૨૪૬ શતાબ્દી અવસર (૧૮૮૫-૨૦૨૦)



ભરત 'કુમાર' પ્રા. ઠાકર

૧૫મી ઓગસ્ટનો દિવસ આપણાને મોંધેરા આજાઈ પવ્ય (૧૮૮૭)ની પ્રાતિ અને મહિને અરવિંદ ઘોષ (૧૮૯૨-૧૯૫૦)ની જન્મ જયંતીનું સ્મરણ કરાવે છે. આમાં એક વધુ નામ કચ્છના વ્યક્તિ વિશેપ તરીકે રાજશાહી વખતના આજીવન કેળવણીકાર વસંતરાય નિર્ભયશંકર પણેણી (૧૮૮૫-૧૯૫૫)નું પણ ઉમેરી શકાય. પ્રસિદ્ધિથી કંઈક અંશે ઓઝલ રહેલા પણેણીજાના ઓગસ્ટ મહિનામાં આવતી ૧૨૫મી જન્મ જયંતી (૧૫-૦૮) અને ૧૫મી પુષ્યતિથી (૧૮-૦૮)ના બેવડા અવસરે એમનો પરિયય તજ્જી લેખકશીની કલમે અત્રે પ્રસ્તુત છે.

— મંત્રી મંજુલ

### ● અત્યારે વ્યક્તિત્વ :

કચ્છના આદર્શ વિદ્યાધિકારી વસંતરાયભાઈ પણેણીનું વ્યક્તિત્વ આમ ભલે અલ્યાખ્યાત રહ્યું હોય, પણ કચ્છના ઈતિહાસ પ્રેમીઓમાં એમનું નામ અને કામ 'કારા કુંગર કચ્છના'ના અનુવાદક તરીકે વિશેપ જાણીનું છે. એમનો આ અનુવાદ એટલો સરળ અને સુંદર છે કે તે જાણે અનુવાદ નહીં, પણ મૂળ ગુજરાતીમાં લખાયું હોય એવું લાગે!

વસંતરાય પણેણીનો જન્મ ૧૫મી ઓગસ્ટ, ૧૮૮૮ના ભુજ ખાતે થયો હતો. એમના પિતા નિર્ભયશંકર અંબાશંકર પણેણી (૧૮૬૮ - ૧૯૪૫) જાહેર બાંધકામ ખાતામાંથી સબ ઓવરસિયર પદેથી નિવૃત્ત થયેલા તથા જંડુ ભણુ (૧૮૭૧-૧૯૮૮)ના ઔષધાશ્રમ (ઉંઝા)માંથી આયુર્વેદ અને અરવિંદ આશ્રમ (પોંડિયેરી)માંથી યોગની તાલીમ મેળવી હતી.

સ્વાતંત્ર્ય પૂર્વે કચ્છની રાજશાહી અને સ્વાતંત્ર્યોત્તર 'ક' વર્ગના રાજ્યના સંકાંતિકાળ દરમિયાન એક સંનિષ્ઠ શિક્ષક અને શિક્ષણાધિકારી તરીકે વસંતરાયભાઈની ઉચ્ચ વર્ષ લાંબી કારકિર્દી રહી હતી. પોતાના કાર્યક્ષેત્ર અને સમાજમાં તેઓ 'પણેણી માસ્તર' તરીકે વધુ ઓળખાયા અને આદર પામ્યા હતા. તેઓ એક સાહિત્યપ્રેમી વિદ્વાન, આગેવાન નાગરિક, પ્રખર વક્તા અને કુશળ વહીવટકર્તા હતા.

### ● ટીચર અને ટ્યુટર :

જૂનાગઢ - અમદાવાદમાં ઉચ્ચ અભ્યાસ બાદ ૧૮૯૪માં તેઓ બી.એ. (સાયન્સ) થયા. પ્રથમ માંડવીની જી.ટી. હાઈસ્કૂલ (૧૮૯૪ - ૧૯૧૬) અને પછી ભુજની ઓલ્ડેડ હાઈસ્કૂલ (૧૯૧૬ - ૧૯૩૬)માં શિક્ષક તરીકે કામ કર્યું. તે પછી અંજારની ડી.વી. હાઈસ્કૂલ (૧૯૩૬ - ૧૯૪૧) અને ભુજની ઓલ્ડેડ (૧૯૪૧ - ૧૯૪૬)માં હેડ માસ્ટર તરીકે ફરજ બજાવી.

રાજશાહી સમય દરમિયાન ફિલેડસિલજી, મદનસિલજી વગેરે રાજકુંવરોના ટ્યુટર તરીકે કાર્ય કર્યું. રાજ પરિવારોના સંતાનોના લગ્ન પ્રસંગે સરભરા અને લગ્ન અધિકારી તરીકે પણ કામગીરી સંભાળી. તો, વિજયરાજજી (૧૮૮૫ - ૧૯૪૮)ના રાજ્યારોહણ (૧૯૪૨) તથા વાર્ષિક રાજદરબાર જેવા પ્રસંગોએ પ્રવચન તૈયાર કરી રાજ વતી તે સંબોધવાનું માન મેળવ્યું હતું.

અધ્યાપનની કામગીરી બાદ બઢ્યી મળતાં ૧૯૪૬માં કેળવણી નિરીક્ષક, ૧૯૪૮માં નાની બચત કમિશનર અને ૧૯૪૯માં શિક્ષણ નિયામક બન્યા બાદ ૧૯૫૨માં તેઓ નિવૃત્ત થયા. નિવૃત્તિ બાદ કચ્છના રેકર્ડ ઓફિસર (૧૯૫૪ - ૧૯૫૪) અને લાલન કોલેજમાં પર્શિયન ટ્યુટર (૧૯૫૪ - ૧૯૫૬) તરીકે સેવાઓ આપી. કચ્છની ઐતિહાસિક વિગતો તપાસવામાં શ્યામજી કૃષ્ણવર્મા (૧૮૫૭ - ૧૯૩૦)ને પણ તેઓ મદદરૂપ થયેલા.

એમની કાર્યનિષ્ઠા થકી કચ્છમાં કોઈ નવી યોજનાના મંડાણ થાય તો તે પણેણી સાહેબને સૌંપાતી. તે મુજબ કચ્છના પ્રથમ સ્કાઉટ કમિશનર, નેશનલ વોર ફિનાન્સ લીડર, સ્મોલ સેવિંગ્સ કમિશનર તરીકે જે તે પ્રવૃત્તિઓ કચ્છમાં વિસ્તારી. નાની બચતમાં કચ્છ આજે મોખરે રહ્યું છે તેમાં એમનું પ્રારંભિક પ્રદાન નોંધનીય છે. બહાર વસતા સમૃદ્ધ કચ્છાઓનો સંપર્ક કરી 'કમાઓ ગમે ત્યાં, બચત કરો કચ્છમાં'નો મંત્ર આપી કચ્છમાં મબલખ મૂડીરોકાણ કરાયું.

### ● નિવૃત્તિમાં પુનઃ પ્રવૃત્તિ

નિવૃત્તિ બાદ હોમિયોપથી અને આયુર્વેદનું પ્રશિક્ષણ - પદવી મેળવી સારવાર આપતા. ટેનિસના અચ્છા ખેલાડી હતા

અને છેક ૧૯૫૫ લગી ટેનિસ રમતા. બિહારીલાલ અંતાણી (૧૯૮૨ - ૧૯૭૧), ગુલાબશંકર ધોળકિયા (૧૯૮૩ - ૧૯૭૨) વગેરે સાથે રહીને રાજ્યના નિવૃત્ત મહાનુભાવોનું 'જવાહર કલબ' નામે મંડળ સ્થાપેલું. કષ્ણમાં પહેલી રોટરી કલબના હોદેદાર રહી સામાજિક પ્રવૃત્તિઓ કરી. માસ્ટર ચત્રભુજરાય શિવજી અંજારિયા (૧૯૪૪ - ૧૯૧૨) ચેરિટીઝના પંદર વર્ષ પ્રમુખ રહી જ્ઞાતિમાં સામાજિક, આર્થિક, શૈક્ષણિક સહાય માટેની પ્રવૃત્તિઓ કરેલી.

ઉદાત્ત ભાવનાથી પ્રેરાઈ ભુજમાં લક્ષ્મીનારાયણ મંદિરનો પાછળનો ભાગ રાજ્ય સરકાર પાસેથી ભાડાપહેલું 'ભારતીય સંસ્કૃતિ સેવામંડળ' (૧લી જુલાઈ, ૧૯૪૭)ના સ્થાપક પ્રમુખ તરીકે અહીં અનેક આધ્યાત્મિક પ્રવૃત્તિઓ વિકસાવી. રામકૃષ્ણ કાર્યાલય માટે પણ કાર્યવાહી કરી. દાર્સિકાપીઠના જગદ્ગુરુએ એમને 'સ્વધર્મભૂષણ' પદવી (૧૯૫૦)થી સન્માનયા હતા. કષ્ણના આવા સંનિષ્ઠ કેળવાણીકાર અને સામાજિક કાર્યકર પણું સાહેબનું ૧૮મી ઓગસ્ટ, ૧૯૬૫ના અવસાન થયું.

થોડો સાંસારિક પરિયય પણ કરીએ તો વસંતરાયભાઈ પણું અનીના લગ્ન ભુજના દેવશંકર જગજીવન ધોળકિયાના પુત્રી મુક્તાબહેન સાથે થયેલા, જેઓ કષ્ણના પત્રકાર ફૂલશંકર હિમતરામ પણું (૧૯૦૫ - ૧૯૮૨)ના માસિયાઈ બહેન થાય. આવકવેરા કમિશનર કનેયાલાલ ડી. ધોળકિયા (૧૯૧૦ - ૨૦૦૧) એમના સાળા થાય. તો, રાપર બેઠકના વિધાનસભ્ય (૧૯૫૭ - ૧૯૬૨) તરીકે ચૂંટાઈને 'કષ્ણના પ્રથમ મહિલા ધારાસભ્ય' બનવાનું માન મેળવનાર ત્રિલોચનાબહેન ઉધાકાંત ધોળકિયા (૧૯૨૩ - ૧૯૮૩) એમના પુત્રી થાય.

### ● 'કારા કુંગર કષ્ણજા' :

આ અંથનું પૂરું ગુજરાતી - અંગ્રેજ શિર્ફક આ પ્રમાણે છે : કારા કુંગર કષ્ણજા અથવા ઈતિહાસ અને લોકકથામાં કષ્ણ (હિંદી રાજભક્તિનું એક અધ્યયન). ધ જ્યેષ્ઠ હિલ્સ : કષ્ણ ઈન હિસ્ટરી એન્ડ લિજેન્ડ (અ સ્ટરી ઈન ઈન્ડિયન લોકલ લોયલ્ટીઝ). તેના મૂળ લેખક એલ. એફ. રશબ્દુક વિલિયમ્સ (૧૯૬૦ - ૧૯૭૮), અનુવાદક વસંતરાય પણું અને સંપાદક દુલેરાય કારાણી (૧૯૮૬ - ૧૯૮૮) હતા. કષ્ણની આમપ્રજા અને અંગ્રેજ ન જાણનાર વર્ગને આ પુસ્તકનો લાભ મળે તેમજ 'કષ્ણનું ઐતિહાસિક વ્યક્તિત્વ' બહોળી રીતે જાણવા મળે તે હેતુથી મહારાવ મદનસિંહજ સાહેબે (૧૯૦૮ - ૧૯૮૧) તેનું ગુજરાતી ભાષાંતર અને પ્રકાશન કરાવ્યું હતું.

વસંતભાઈએ તેનો પહેલો અનુવાદ ૧૯૫૪ - ૧૯૫૯ દરમિયાન કરેલો, જેની પહેલી ગુજરાતી આવૃત્તિ ૧૯૬૫માં અને બીજી ૧૯૮૮માં બહાર પડી. ૨૮૦ + ૧૮ તસવીરો સહિત કુલ

૩૦૮ પૃષ્ઠો ધરાવતા અને બે ભાગોમાં વિભાજિત આ ગ્રંથમાં કુલ ૧૩ પ્રકરણો આલેખાયા છે.

પણું અને કરેલા અનુવાદ વિશે રશબ્દુક નોંધે છે : "આ શબ્દશઃ ભાષાંતર નથી. જ્ઞાને કે હું ગુજરાતી ભાષા જ્ઞાનો હોઉં અને મેં જ ગુજરાતીમાં લખીને તે પ્રગટ કર્યું હોય એવી જાતનું આ લખાણ છે! અંગ્રેજ કરતાં તેની રચના નિરાળી છે. ગુજરાતી વાચકો ગુંઘવાડામાં પડી ન જાય એટલા માટે કેટલીક બાબતોની રજૂઆતમાં અને વર્ણનરીતિમાં થોડો ફેરફાર કરવામાં આવેલ છે."

**'શિવમ'**, ૪૦, વૃદ્ધાવન નગર-૧, અડિયા તળાવ સામે,  
વૈશાલી સ્થિનેમા રોડ, અંજાર, કચ્છ-૩૭૦ ૧૧૦.  
ફોન : (૦૨૮૩૬) ૨૪૦૭૩૬, મો. ૯૪૨૭૨ ૨૩૧૫૦

**જિંદગીના અનુભવે શીખવાડયું** છે કે સંબંધના બે છેડા થોડા ટૂંકા રાખવા, જેથી ગાંઠ પડવાની શક્યતા થોડી ઓછી રહે.

**આધુનિક ભારતના એક શિલ્પી :** ડૉ. રાજેન્દ્રપ્રસાદ

(અનુસંધાન : પાના નં. - ૧૪ ઉપરથી ચાલુ)

દિન ૨૬ જાન્યુઆરીના રોજ મનાવવામાં આવ્યો. આ દિવસ ખાસ હતો. કેમકે ૨૬ જાન્યુઆરી, ૧૯૮૨માં લાહોર અધિવેશનથી કોંગ્રેસે પૂર્ણ સ્વરાજની માંગણી ઉદાવી હતી. રાજેન્દ્ર પ્રસાદ ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ના દિવસને ગજાતત્ત્ર દિવસ રાખવા માંગતા નહોતા. કેમકે જ્યોતિષ પ્રમાણે તે દિવસ શુભ નહોતો. નહેરુ જ્યોતિષને ખાસ મહત્ત્વ નહોતા આપતા એટલે તેમણે રાજેન્દ્ર બાબુની વાત ગ્રાધ્ય ન રાખી.

બે વર્ષ સુધી તો રાજેન્દ્ર બાબુની રાષ્ટ્રપતિ તરીકે માત્ર વરણી થઈ હતી. ૧૯૫૦માં સુંટણી આવી. નહેરુ બિનસાંપ્રદાયિક વિચારધારા રાખતા સી. રાજગોપાલાચારીને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ઘોષિત કરવા માંગતા હતા. પરંતુ પટેલે અને કોંગ્રેસના અન્ય નેતાઓએ હિંદુવાદ તરફ ઝુકવ રાખતા ડૉ. રાજેન્દ્ર પ્રસાદનું નામ સૂચયું. આ બાબતમાં નહેરુનું કશું ચાલ્યું નહોતું.

૧૯૬૨માં નિવૃત્ત થયા પછી બિહારના સદાકત આશ્રમમાં રહેવા જતા રહ્યા હતા. પૂર્વ રાષ્ટ્રપતિ તરીકે તેમને મહિને રૂ. ૧૧૦૦/-નું પેન્શન મળતું હતું.

પટનાના એક્ઝિબિશન રોડ પર પંજાબ નેશનલ બેંકની એક શાખા છે. આ બેંકના ખાતા નં. ૦૩૮૦૦૦૧૦૦૦૩૦૬૮૭માં માત્ર રૂ. ૨૦૦૦ની સિલક હતી. ૫૭ વર્ષ જૂનું આ ખાતું પી.એન.બી.નું પ્રથમ એકાઉન્ટ ગણાય છે.

આ ખાતું ડૉ. રાજેન્દ્ર પ્રસાદનું હતું. વર્તમાન નેતાઓની અભજોની કાળી કમાણી વિદેશી બેંકોમાં છુપાવાયેલી છે ત્યારે દેશના પ્રથમ રાષ્ટ્રપતિની પ્રામાણિકતાથી અર્જિત થયેલી પૂછું પર ગર્વ થાય છે. ■

વિચાર મંચ

## બ્રહ્માંડની ઉત્પત્તિ કેવી રીતે થઈ?



ડૉ. યાસીન દલાલ

બ્રહ્માંડની ઉત્પત્તિ કેવી રીતે થઈ એ વિશે હજુ જીતજીતના તર્કવિતર્ક ચાલ્યા જ કરે છે. ઈસ્લામ અને પ્રિસ્તી ધર્મ એક તર્ક આપે છે અને કયામતની કલ્પના રજૂ કરે છે તો વૈજ્ઞાનિકો અને સ્વીકારતા નથી અને પ્રાચીન સંસ્કૃતિઓની વાત આગળ કરે છે. હજારો વરસો પહેલા મેસોપોટેમિયા અને ઈજિમ તથા ગ્રીસમાં સંસ્કૃતિ હતી અને માણસ પહેલા વાનર હતો એવું પ્રતિપાદિત થાય છે. સ્ટીફન હોકિન્સ જેવા નિષ્ણાતો બીગબેંગ થીયરીને આગળ કરે છે. તે કહે છે કે બ્રહ્માંડ કે પૃથ્વી એ કોઈ ઇશ્વરની દૈવી રૂચના નથી તેમ કોઈ ઇશ્વરી વ્યવસ્થા પણ નથી. પદાર્થના મૂળભૂત ગુણધર્મના જડ પરિબળોના સંચાલનનું આપોઆપ નિપજેલું પરિણામ છે. એની પાછળ કોઈ સભાન યોજના હતી જ નહીં.

અફસોસ એ વાતનો છે કે આઈન્સ્ટાઇન કહે છે કે બ્રહ્માંડ આપણને મળેલી સૌથી મૂલ્યવાન પ્રાપ્તિ છે, પણ એ હજુ પ્રાથમિક અને બાલ્યવસ્થાની છે. અફસોસ એ છે કે આઈન્સ્ટાઇન જેવા મહાત્માએ જેને અતિશય મૂલ્યવાન ગણાવી, એને આપણા માણસો સમજ શકતા નથી.

હુંમેશાં બને છે તેમ સ્ટીફન હોકિન્સનો આજના વૈજ્ઞાનિકોએ વિરોધ કર્યો અને એમ કહ્યું કે બ્રહ્માંડનું અસ્તિત્વ અક્સમાતે થઈ ગયું. વૈજ્ઞાનિકો એમ કહે છે કે આ સૃષ્ટિ ઇશ્વરની કુશળતાપૂર્વકની અને બુધ્ધિપૂર્વકની ડિઝાઇન છે. ધર્મશાસ્કીઓ અને સામાન્ય માણસ એમ કહે છે કે, દુનિયા ઇશ્વરે બનાવી છે. શું ઇશ્વર આવી દુનિયા બનાવે જ્યાં ચારેબાજુ પરપીડન જોવા મળે? એક પ્રાણીની મહામોઘી જિંદગી તે અન્ય પ્રાણીનો બે ટંકનો ખોરાક હોય? આવી પરપીડનનો આનંદ માણસી વ્યવસ્થા કદી ઇશ્વરની હોય જ નહીં, શેતાનની હોય. ઇશ્વર તો પરમદ્યાનું છે અને સર્વ શક્તિમાન છે અને બીજુ બાજુ ઉપર કહ્યું તેમ એક પ્રાણી બીજા પ્રાણીને ખાઈ જાય એ ઇશ્વરની રૂચના કેવી રીતે હોય? અહીં સંસારમાં કોઈના ચલાવ્યા વિના કશું ચાલતું જ નથી તો એવી માન્યતા સાચી હોય તો એમાં ઇશ્વરની કલ્પના ક્યાં ફીટ બેસે?

ઇશ્વર છે કે નહીં એ વિશે માણસે હજારો વરસ ચિંતન કર્યું છે. આપણા એક ઋષિ ચાવકી કહ્યું છે કે, ‘ऋણમ કૃતવા

પિબેત ધૂતમ્.’ મતલબ કે કરજ કરીને પણ ધી પીવું અને બીજ કોઈ ચિંતા કરો નહીં. આ વાક્ય આપણા જ એક ઋષિમુનિનું છે અને હજારો વર્ષ પહેલાનું છે. આપણો ત્યાં વરસો જૂની ઋષિમુનિ પરંપરા છે અને ચાર્વાકને એક અતિ ધાર્મિક દેશમાં પેદા થવા છતાં હેરાન કરવામાં આવ્યા નહોતા કે પરપીડિત પણ કરવામાં નહોતા આવ્યા. તો પ્રશ્ન એ છે કે અત્યારે આપણા દેશમાં ઇશ્વરને આટલો બધો પૂજવામાં શા માટે આવે છે અને નાસ્તિકોને કેમ સ્વીકારવામાં આવતા નથી? એમ કહેવાય છે કે, બૌધ્ય અને જૈન ધર્મમાં ઇશ્વરની વિભાવના છે જ નહીં. એમની ફિલોસોફી પણ થોડી જુદી છે. ભગવાન બુધ્ય મધ્યમ માર્ગ ઉપર ભાર મૂકે છે અને કહે છે કે કોઈ ઋષિમુનિ કહેતા હોય અથવા કોઈ ગ્રંથ કહેતું હોય તો એને માનવાને બદલે તમારો અંતરાત્મા કહેતો હોય એમ કરો. આ વાક્ય કેટલાક બિલીવરને ન ગમે, પણ વાસ્તવિકતા આ છે કે જે આપણા અંતરાત્મા કહે એમાં માનવાનું.

એક બીજ ફિલોસોફી પ્રારબ્ધવાદની છે. એ કહે છે કે તમારા નસીબમાં જે લખેલું છે તે થઈને જ રહેશે. જો હું પડી જવાનો હોઉં તો પડી જ જઈશ. કર્મોના પરિણામ મળવાના જ છે. બીજુબાજુ વિજ્ઞાન કહે છે કે કોઈ વસ્તુ પૂર્વ નિર્ભિત નથી. જે બનવાની સંભાવના હોય છે તે માગ સંભાવના જ છે. તે જો નુકસાનકારક હોય તો દરમિયાનગીરી કરીને ઓછી નુકસાનકારક બનાવી શકાય છે. અગાસી ઉપર જો કોઈ બાળક પડી જાય એવી સંભાવના હોય તો ઊંચી ગ્રીલ કરીને એને નિવારી શકાય છે. ઘણા પ્રારબ્ધવાદીઓ ઘણીવાર દુર્ઘટના બનવાની શરૂઆત થાય તો તેને આગળ વધતી અટકાવવા દરમિયાનગીરી કરતા નથી અને નાહકના દુર્ઘટનાનો ભોગ બને છે. કોઈ રોગચાળો થતો અટકાવવો હોય તો ચોક્કસ પગલા લઈને એને અટકાવી શકાય છે પણ આપણી પ્રજા સમયસર પગલા લેતી નથી અને હાથે કરીને દુઃખી થાય છે. એલોપેથિક પદ્ધતિ રોગને આગળ વધતો અટકાવે છે. જુવનમાં દુર્ઘટનાઓ તો બનવાની જ છે પરંતુ એને પ્રારબ્ધ ઉપર છોડી દઈને દુઃખી થવાને બદલે પુરુષાર્થી અને વૈજ્ઞાનિક પદ્ધતિથી એને અટકાવવી જ જોઈએ.

આપણી વચ્ચે ઈશ્વરનો ખ્યાલ ધૂસી ગયો છે એના કારણમાં જીવનની અનિશ્ચિતતા છે. જે માણસ માંડ ભાડ્યો હોય અને એને માંડ નોકરી મળે એ પણ અનિશ્ચિત હોય એ પ્રારબ્ધમાં માન્યા સિવાય કરે પણ શું? આંકિકા અને એશિયામાં ગરીબ દેશમાં કશું નિશ્ચિત નથી. પરિણામે લોકો ઈશ્વરમાં વધારે માને છે. ઈંગ્લેન્ડના હ૫% લોકો નાસ્તિક છે એટલે કે ઈશ્વરમાં માનતા નથી. બીજા અનેક લોકો એવા છે, જે માને છે. દુનિયાના અનેક મહાપુરુષો આવા જ હતા અને છે. જવાહરલાલ નહેરુ પણ આવા જ હતા. એ કહેતા કે હું જ્યારે યુ.પી.માં ગ્રામ્ય વિસ્તારમાં ફું છું અને લોકોના હુંબદદર જોઉ છું ત્યારે મને માન્યામાં જ નથી આવતું કે આવી દુનિયા ઈશ્વરે બનાવી છે. હા, બીજા કોઈએ બનાવી હોય એ શક્ય છે. બટ્રન્ડ રસેલ પણ આમ જ કહેતા. જે સમાજમાં અનિશ્ચિતતાઓ ઓછી થાય તો ઈશ્વરને ચાદ કરવાની જરૂર જ ન રહે. કોરોનાની મહામારી અટકાવવી હોય તો એના ઉપાયો કરવા જોઈએ. મોઢા ઉપર માસ્ક પહેરવું જોઈએ, બે વ્યક્તિ વચ્ચે નૃણાથી ચાર ફૂટનું અંતર રાખવું જોઈએ અને વારંવાર હાથ ધોવા જોઈએ. આ ઉપાયો ન કરીએ અને કોરોનાથી માણસ મરી જાય તો કોઈને દોષ દેવાનો અર્થ નથી. આમાં ઈશ્વર શું કરે? ખરેખર તો આમાં ઈશ્વર ક્યાંય વચ્ચે આવતો જ નથી.

એક જમાનામાં શીતળાનો રોગ જીવલોશ મનાતો. એ રોગ થાય એટલે માણસ મરી જ જાય. આપણા દેશમાં આ રીતે શીતળાના રોગનો ભોગ બનેલ છેલ્લા દર્દી જાણીતી અભિનેત્રી ગીતા બાલી હતી. એ પછી આ રોગ કોઈને થયો નથી કારણકે એની રસી શોધાઈ ગઈ છે. હવે તો જેવું કોઈ બાળક અવતરે એટલે તરત એને જાતજાતની રસીઓ અપાય છે. એમાં શીતળાની રસીનો પણ સમાવેશ થાય છે. આટલી બધી વૈજ્ઞાનિક શોધખોળો થઈ એટલે જ માણસ આટલો સુખ સગવડવાળો બન્યો છે. ન્યૂટને ગુરુત્વાકર્ષણની શોધ કરી, સ્ટીવન્સને આગામીની શોધ કરી. અત્યારે શેરીમાં ફરો તો ઝડપવાળા કે શાકભાજીવાળાના હાથમાં પણ મોબાઈલ ફોન હોય છે. એ જ રીતે મોબાઈલ ફોનની અંદર જાતજાતની સુવિધાઓ હોય છે. સેમેસેલના ઉપયોગથી અસ્તાધ્ય રોગોનું પણ નિદાન થઈ શકે છે. માણસ ચંદ્ર ઉપર જઈ આવ્યો. હવે મંગળ ઉપર પણ જઈ આવશે. અત્યારે આપણા નાગરિકમાં સરેરાશ આયુષ્ય હજ વરસ છે. આજાદી સમયે એ માત્ર ૪૦ હતું. હજ આપણે ત્યાં જેમ જેમ પીવાનું પાણી શુદ્ધ મળશે અને લોકોને સારો ખોરાક મળશે એમ આયુષ્ય વધતું જવાનું. આંકિકામાં સરેરાશ આયુષ્ય ૪૦થી ૪૫ છે.

રેશનાલિઝમ એ કોઈ વાદ નથી. તે ભૌતિકવાદ છે. ધર્મનો વિરોધ પણ નથી. બુધ્ય અને તર્ક સમાનાથી નથી. એક દાખિલિદું છે, વૈચારિક ચળવળ છે. કોઈપણ સમસ્યા વિશે વાસ્તવિક પુરાવાથોના સંદર્ભમાં તટસ્થ અને વસ્તુલક્ષી દસ્તિએ

**વિચારવાની પદ્ધતિ એટલે રેશનાલિઝમ.** એ બુદ્ધિને અને વિવેકને પ્રાધાન્ય આપે છે. એમાં કોઈ નૈતિક ધોરણો નથી કે ગમા-અણગમા નથી. જે વિચારમાં આવો વિવેક ન હોય, તે ઈરેશનલ કહેવાય. આમ સાચા અર્થમાં આ વિચારધારા વહેમ, અંધશધા, કંઈતા કે અધ્યાત્મવાદી વિચારધારાનો વિરોધી છે. આ વિચારધારા અનુભવ, સત્ય તથા તથ્ય ઉપર ભાર મૂકે છે. **વિજ્ઞાન અને વૈજ્ઞાનિક અભિગમનો એ રાજમાર્ગ છે.** સત્ય શોધનનો એ વિધાયક રસ્તો છે. ભૂતપ્રેતમાં એ માનતો નથી, યોગીઓને થતો દિવ્ય આનંદ અહીં થતો નથી. ચમત્કારો તથા અલૌકિક અનુભવ અહિયા નથી. આત્મા મોક્ષ કે પુનઃજન્મ આહિયા નથી. સાચો રેશનાલિસ્ટ સાંપ્રદાયિક કે બંધિયાર ન હોય. એ ખુલ્લા મનવાળો અને માનવતાવાદી હોય.

અત્યારે આપણા દેશમાં વૈચારિક કટોકટી ચાલે છે. લોકો આધુનિક બનવાને બદલે પદ્ધતિ બને છે. શાળામાં પ્રવેશ પણ જતિના આધારે અપાય છે. મહારાષ્ટ્રમાં જ્યોતિબા ફૂલે અને બીજા સુધારવાદીઓની મહેનત એળે ગઈ છે. **લોકો ઈશ્વરમાં માને એનો વાંધો નહીં પણ અંધશ્રદ્ધમાં માનવું એ ખોટું છે.** ખેડૂતો ચોમાસામાં આધુનિક ટેકનિક અપનાવવાને બદલે આકાશ તરરું જોતા રહે અને ભડી વાક્યોની રાહ જુઓ એ ખરાબ છે. હવે જો કે સજ્જવ ખેતીનું ચલણ વધવા માંડ્યું છે. પણ આપણે ત્યાં ખેતીનો વિકાસદર હજુ ખૂબ જ નીચો છે. **બ્રહ્માંડની રચના કોણે કરી એ અંગે વહેમ અને અંધશ્રદ્ધાથી નહીં ચાલે.** એના માટે નક્કર ફિલોસોફી જોઈએ. થોડા સમય પહેલા પેરિસમાં વિશ્વના જાણીતા વૈજ્ઞાનિકોએ એક પ્રચંડ ઘડાકો કરેલો. આ ઘડાકો સંશોધન માટેનો હતો. આવા ઘડાક ચાલુ જ રહેવા જોઈએ તો જ બ્રહ્માંડની ઉત્પત્તિનું રહસ્ય જાણવા મળશે.

સૌજન્ય પણ્ણિકેશનના  
૫, સૌરાષ્ટ્ર કલાકેન્ઝ સોસાયટી, રાજકોટ - ૩૬૦ ૦૦૭.  
કોન : (૦૨૮૧) ૨૫૭૫૩૭૭

## ॥ ક્રમા વીરસ્ય ભૂષણમ् ॥

પવાદિરાજ પર્યુષણ પર્વના સંવત્સરી પ્રસંગે  
(૦૮/૨૦૨૦) દાતાશ્રીઓ, સમાજના સર્વે  
પરિવારજનાઓ, કાર્યકર્તાઓ, સ્ટાફવર્ગ તથા  
સમાજના મુખ્યત્વમાં સાહિત્ય ક્ષેત્રે લેખન  
સામચ્રીઓનું પ્રદાન કરનાર લેખકશ્રીઓ -  
કવિશ્રીઓ, વાચકવર્ગ, વિજ્ઞાપનકારો, પ્રીન્ટસ  
વગેરે સૌને અંત:કરણપૂર્વક...

**“મિચામિ દુક્કડમ”**

## વિચાર મંચ

## ઘડપણમાં વસિયતનામું... જુવાનીમાં હેસિયતનામું!



દિલેપ પાંચાલ, જનરિપરિટર

ઘડપણ જીવનનું પેવેલિયન ગણાય. એમાં કોઈ ઝીરો રનીને આવી જાય અને કોઈ સેન્ચ્યુરી મારીને હરખભેર પ્રવેશે. થાક બંનેને લાગે, પરંતુ જે ૫૦૦ રન કરીને આવ્યો હોય, એ થાક્યો હોય તો પણ પ્રહૃદિલિત હોય અને ઝીરો રને આઉટ થઈ ગયો હોય તે લજીજિત હોય. જે ઉબલ કે ટ્રિપલ સેન્ચ્યુરી મારીને આવ્યો હોય એનો પરસેવો પણ પારિજતની સુગંધની જેમ મધમધી ઉઠે. એવા માણસોને સંતૂમિનો કેવો ઓડકાર આવે છે તેનો એક જ દાખલો બસ થશે.

થોડા સમય પૂર્વે સ્વરસામ્રાઝી લતા મંગેશકરજીએ કોઈ એવોઈ ફંકશનમાં જાહેરાત કરી હતી. એમના શબ્દોની સુગંધ માણીએ : “એસા નહીં કી એવોઈ મિલનેસે મુજે બુશી નહીં હોતી. જો લોગ સન્માન દેતે હોય, ઉનકે હમ બહેત શુક્રગુણર હોય. લેટેન મુજે ઈશ્વરને બહેત કુછ દિયા હોય. અથ મુજે કોઈ એવોઈ નહીં ચાહિયે. મૈં ચાહતી હું કિ મુજે સન્માનિત કરને કે બજાય આપ ઉન લોગોનો કો એનકરેજ કીજિયે, જો ઈન્ડસ્ટ્રીમાં નયે હોય. ઉન નયે કલાકારોંકા હૌસલા બઢેગા તો મુજસે બહેતર દૂસરી લતા મિલેગી. હમારી ઈન્ડસ્ટ્રી કો સિઝ્ફ એક લતા મંગેશકર પર રૂક આના નહીં હોય, આનેવાલે દિનોમેં લતા સે ભી બઢ્યા ગાયિકા મિલની ચાહિયે. ઈસલિયે નયી પેઢીકો જ્યાદા સે જ્યાદા સન્માનિત કરે... ઉનકા હૌસલા બઢાઈયે...” મહિન માણસોની નમૃતામાં સંતુષ્ટિ ભળો ત્યારે કેવી ઉમદા ભાવના પેદા થાય છે તેનું આ ઉદાહરણ છે. લતાજીના શબ્દો એમના કંઈ કરતા ઓછા મધુર નથી.

આપણી મૂળ વાત લતાની નહીં વ્યથાની છે. આથમતી અવસ્થાની વ્યથા...! જીવનમાં પ્રત્યેક વ્યક્તિ લતાજી જેવી પ્રતિજ્ઞા પ્રાપ્ત કરી શકતી નથી. ઘણાનું ઘડપણ એવોઈસને બદલે આંસુઓથી ભરેલું હોય છે. જીવનની પીડાનો ઉપાય કરતા પહેલાં તેને પારખવી પડે, તેના મૂળ શોધવા પડે. આ લખનારને ૧૯૬૪થી ૧૯૬૭ દરમિયાન જનતા હાઈસ્કૂલ - ઉનાઈમાં ભણવાનું મળેલું. અમારા સમયમાં પરીક્ષાના રિઝલ્ટ વખતે વિદ્યાર્થીઓને તેમની સાખિમેન્ટરી આપવામાં આવતી. પોતે કેવો દેખાવ કર્યો હતો તે વિદ્યાર્થીઓ નજરે જોઈ શકતા. એનો ફાયદો એ થતો કે વિદ્યાર્થીને આગામી પરીક્ષામાં વધુ સાવધ રહેવાનો

અવકાશ પ્રાપ્ત થતો. દોસ્તો, જીવન પરીક્ષાથી કોઈ રીતે ઉત્તરતું નથી. સંસારના એકજામ હોલમાં બેઢેલા માણસે ગ્રામ સેમેસ્ટરની પરીક્ષા આપવી પડે છે. બાળપણા... ચુવાની.... અને ઘડપણ. ત્રણેના ઈન્ટરનલ માર્ક્સથી એનું ફાઈનલ રિઝલ્ટ તૈયાર થાય છે. ઘડપણ એ જીવનની સાખિમેન્ટરી પર નજર કરવાનો ઓડિટ પિરિયદ છે. આપણે ક્યાં કાચું કાચ્યું હતું... ક્યાં દાટ વાળ્યો હતો... તે સંઘળા છબરડાઓનું ફલેશબેક ઘડપણમાં જોઈ શકાય છે. દુઃખ એ વાતનું છે કે ઘડપણ જીવનનું આખરી સ્ટેશન હોય છે. ત્યાં તમને ભૂલોનું ભાન થાય તોય પસ્તાવા સિવાય કશું કરી શકતું નથી. (પરીક્ષાનું રિઝલ્ટ આવવાનું હોય તે દિવસે તેનું ફૂટેલું પેપર હાથમાં આવે તો તેનો ફાયદો રહેતો નથી.)

ઘણાંના ઘડપણ ઠોક નિશાળિયાની કોરી સાખિમેન્ટરી જેવા હોય છે. તેમણે આખું જીવન પતંગ ચગાવવાને બદલે લુંટવાનો જ ઉઘમ વધુ કર્યો હોય છે. કોઈએ આપેલી પીડા ભૂલી જવાનું કામ અધરું છે. કોકને માફ કરી દેવાનું કામ પણ આસાન નથી. હાથમાં તલવાર હોય અને સામે નિહથો દુશ્મન ઊભો હોય ત્યારે વાર ન કરવાની મર્દનીગી ભાગ્યે જ પરવડતી હોય છે. મિત્રો કે સ્વજનો જ્યારે અંધારામાં છુપાઈને વાર કરે ત્યારે લોહીલુહાશ થવાય છે પણ તેમના હાથ કે તલવાર દેખાતા નથી. શાયર આદિલ મન્સુરીને કંઈક એવો જ અનુભવ થયો હશે ત્યારે આ પંક્તિ જન્મી હશે : “જીવનની સમી સાંજે મારે જખોની ચાદી જોવી હતી... ઘણા ઓછા પાના જોઈ શક્યો બહુ અંગત અંગત નામ હતા...!” જીવનના એકજામ હોલમાં માણસે કેવી સ્વસ્થતા રાખવી જોઈએ તે અંગે થોડી વાત કરીએ.

માણસે પોતાની જાતને સુખના અમુક ટાર્નીટ નક્કી કરી આપવા જોઈએ અને પોતાની હેસિયત વડે તે પૂર્ણ કરવા જગ્યામનું જોઈએ. ચોખા, ગુજરાતીઓનો મુખ્ય ખોરાક છે. ચોખામાં માણસની મધમધતી મહેશ્યા ભજે ત્યારે તે પુલાવ બને. યુવાનોના મસલ્સ પાવરમાં તેનો માઈન્ડ પાવર ભજે પછી જે વાનગી તૈયાર થાય તે પુલાવથી ઓછી સ્વાદિષ્ટ હોતી નથી. દરેક મહત્વાકાંક્ષી માણસ નક્કી કરે છે કે આપણે ચોખા ખાઈને આયખું પૂરું કરવું નથી, મજેદાર પુલાવ આરોગ્યો છે. એવા

**પાવરક્કુલ લક્ષ્યાંકને હેસિયતનામું કહેવાય.** બેંકોના સુપ્રીમો તેમના મેનેજરોને ડિપોઝિટના લક્ષ્યાંકો નક્કી કરી આપે છે. દરેક માણસ પોતાની જીવનની બેંકનો સ્વનિયુક્ત સુપ્રીમો છે. તેણે પોતાના જીવનમાં સુખ સમૃદ્ધિની કેટલી ડિપોઝિટ વધારવી છે, તે પોતે નક્કી કરવાનું હોય છે.

પિતાજી હંમેશાં કહેતા – ‘તમારા આંબાના પાંદડા જે આખું વર્ષ ચૂપચાપ વાળે છે, તે પાડોશીને તમારા આંબાની થોડી કેરી આપજો. વર્ષભર પાંદડા વાળવાની મણબંધી પીડા દસભાર કેરીથી ધોવાઈ જશે!’ વાત સાચી છે. મોરારિબાપુની મદદ વિના પણ એક વાત સમજુ લેવા જેવી છે. આપણા સુખમાંથી થોડુંક સુખ બીજાને આપવા જેવું સુખ બીજું એકે નથી અને ઇશ્વરનો ફોટો લૂછવા કરતાં કોકના આંસુ લૂછવા જેવું પુણ્ય બીજું એકેચ નથી.

છેક નાનપણથી આપણે જાણીએ છીએ કે ચકલાને ચોખાનો દાણો મળેલો અને ચકલીને દાળનો દાણો મળેલો. તેમાંથી બંનેને ખીચડી બનાવેલી. જો આપણું પ્લાન્ટિંગ પુલાવનું હોય તો એટલું યાદ રાખવું પડશે કે ચકલા ચકલી જેટલા આપણે નસીબદાર નથી કે રસ્તામાંથી દાળચોખા મળી જાય. શમણા પુલાવના જોઈશું અને મહેનત ખીચડી જેટલીય નહીં કરીએ તો જીવનની પરીક્ષામાં ડિસ્ટિક્શન સાથે નાપાસ થવાશે. બાર - સાયન્સની પરીક્ષા આપનારને સમજાય છે કે સૌથી અધરો કોઈ બાર - સાયન્સનો છે. પણ તે છોકરો જીવનની પરીક્ષામાં પ્રવેશે છે ત્યારે તેને સમજાય છે કે ‘સાયન્સ પ્રવાહ’ કરતાં ‘સંસાર પ્રવાહ’ વધુ કપરો છે. વિદ્યાર્થીની પડખે તેના વાલીઓ અને ટીચરો હોય છે. પણ સંસારનો સંગ્રહમ તો માણસે એકલે હાથે લડવો પડે છે. માણસની અરધી શક્તિ તો ઘરની ચાર દીવાલો વચ્ચે ઉદ્ભવતી સમસ્યાઓને સુલજાવવામાં જ પૂરી થઈ જાય છે. સરહંડ પર બેઠેલા દુશ્મનો કરતાં છાતી પર બેઠેલા સ્વજનો વધુ પીડા આપે છે. માણસ દુનિયા જીતી શકે છે પણ ઘરના ઊંબરે ફિસાઈ પડે છે. દક્ષિણ ગુજરાતમાં એક કહેવત છે : “જેને કોઈ ન પહોંચે તેને તેનું પેટ પહોંચે.” મતલબ, શક્તિશાળી માણસ પણ લાગણીના યુદ્ધમાં મહાત થઈ જાય છે. કારણ એટલું જ કે દાંત વચ્ચે જીભને કરડી શકાતી નથી. હાથ વડે પોતાની આંખ ઝોડી શકાતી નથી. પુત્ર ગરદન મારે તોય તેની ગરદન દબાવી શકાતી નથી. હાથમાં ભરેલી બંદૂક હોય પણ સામે સ્વજનો ઊભેલા હોય તો શું થઈ શકે...? (નરગીસે ફિલ્મ ‘મધર ઈન્દ્રિયા’માં પોતાના ગુંડા જેવા પુત્ર સુનિલ દાત પર ગોળી ચલાવેલી. પણ વાસ્તવિક જીવનમાં એ પોતાના પુત્ર સંજય દાતની ભૂલ્લો માટે એવો ન્યાય કરી શકતી ન હતી.) સંસારની પ્રત્યેક વ્યક્તિ ક્યારેક ને ક્યારેક વિખાદ્યોગ અનુભવે છે. દરેક સંસારીએ પોતાનું ચુદ્ધ પોતે જ લડવું પડે છે. તલવાર ખરીદી શકાય પણ હિંમત બજારમાં વેચાતી મળતી નથી. આરેના મદનમાં સંભાર શર દરી શકાય પણ એ

**મકાનને ‘ઘર’ બનાતાં અને સંસારને ‘સ્વીટલોમ’ બનાતાં  
વર્ષો લાગે છે. યાં રહે, જુવાની ઝમકદાર હશે તો ઘડપણ  
માયકાંગલું નહીં રહે. હેસિયતનામું પાવરફ્ક્લ હશે તો વસિયતનામું  
કંગાળ નહીં હોય... બેસ્ટ ઓફ લક...!**

સ્ત્રી-૧૨, મજૂર મહાયન સોસાયટી,  
ગણેદી રોડ, જમાલપુર,  
નવસારી-૩૬૫ ૪૨૭ (ગુજરાત). મો. ૧૮૮૮૧ ૬૦૪૦૮

**મહામારી – ગંભીર બીમારી અને તેના ઉપાયો**

(અનુસંધાન : પાના નં. - ૨૩ ઉપરથી ચાલુ)


પુસ્તકો વાંચવા, સંગીત સાંભળવું કે વગાડવું, નવી પ્રવૃત્તિ શીખવી – આ બધું કરવાથી મન આનંદિત રહે છે અને નકારાત્મક વિચારો ઓછા આવે છે.

- દરકામમાં બધા સભ્યોનો સહકાર લેવો - જેનાથી કામ સરળતાથી પતે પણ છે અને બધાને એકબીજા સાથે રહેવાનો સમય પણ વધુ મળે છે.
  - ખૂબ અગત્યની વાત એ છે કે ટી.વી. કે ફોન (સોશિયલ મીડિયા) પરના સમાચાર, મેસેજ જોવાનું ઓછું કરવું જોઈએ કારણકે એમાંનું ઘણુંખરું ખોટું પણ હોય છે અને ચિંતા વધારે એવું હોય છે.

આ બધા ઉપયોગ કરવા છતાં જો માનસિક ચિંતા, ઉદાસી કે ડર ખૂબ જ રહેતો હોય તો મનોચિકિત્સકની સલાહ લેવાનું ટાળવું નહીં. દવાઓ, કાઉન્સેલિંગ, સાઈકોથેરાપી જેવા ઉપયારોથી ખૂબ અસરકારક ઈલાજ થઈ શકે છે.

સ્વરૂપિત સ્પાઇન એન્ડ માઇન્ડ કેર  
૫૦૩, ગોડન આઈકોન, મેડિલિંક હોસ્પિટલની સામે,  
૧૩૨ ફૂટ રીંગ રોડ, ચ્યામ્પન ચાર સ્ટેટા પાસે,  
સેલેલાઇટ, અમદાવાદ-૧૫. ફોન : (૦૭૯) ૪૦૪૬૩૬૦૦


‘ગોમસ ગેલેરી’માં આપેલ પછું વિ.ના જવાબો



፳፻፭፻፲፮ (፩) ‘፳፻፭፻፲፮’ (፪) ‘፳፻፭፻፲፮’ (፫) : ደ-፻፭፻፲፮

፳፻፲፭ : ከ-ፍርድ

• ፭ (፻) ‘የብቃ’ (፻) ‘ጋብና’ (፻) ‘የሚሸጥ’ (፻) ‘የሚሸጥ’ (፻) ‘የሚሸጥ’ (፻) ‘የሚሸጥ’ (፻) :



## કોરોના સંક્રમણ

## મહિમારી – ગંભીર બીમારી અને તેના ઉપાયો



ડૉ. શેત્રા પરીખ, M.D.  
(કન્સલ્ટન્ટ સાઇકાન્ટ્રિસ્ટ)

કોરોના, કહેવાય છે કે આવી ખરાબ બીમારી જીવનમાં જોઈ નથી. પરંતુ હકીકત એ છે કે આવી વૈશ્વિક મહિમારી દર ૧૦૦ વર્ષે એકવાર અચ્યુક આવે છે અને માણસ તેમાંથી – એ રોગ પર જત મેળવીને બહાર આવે છે. આ રોગમાં મૃત્યુ દર ઘણો જ ઓછો છે છતાં ડર એટલો બધો છે કે માણસ નાસીપાસ થઈ જાય છે. લોકોમાં આ ડર તો ખાસ કરીને બે કારણોથી છે : (૧) ભયાનક, બીવડાવે એવા દુનિયાભરના Videos અને Social media પરના messages. (૨) સરકાર તરફથી રોગને કાબૂમાં લાવવા માટેના પગલા – જેમ કે લોકડાઉન, કોરોના વિશે માહિતી આપતી જાહેરાતો.

આ કારણે લોકોમાં જુદી જુદી માનસિક અસરો જોવા મળે છે.

## (A) ચિંતા :

- ★ ખૂબ ચિંતિત રહેવું – લાંબા સમય માટે. ગલ્બરામણ, બેચેની થવી, રઘવાટ થવો.
- ★ ચિંતા થાય એવા વિચારો આવવા જેમ કે કોઈને મળવાથી કોવિડ ઇન્ફેક્શન ફેલાશે, ધરના સભ્યોને ઇન્ફેક્શન લાગશે કે મૃત્યુ પામશે.
- ★ લોકડાઉનના કારણે કામ બંધ થઈ જવું / ઓછું થઈ જવાથી આર્થિક ચિંતા થવી.

## (B) ડિપ્રેશન

સતત ઉદાસ રહેવું, નાની નાની બાબતો પર ચીડાઈ જવું, ઊંઘ ના આવવી, કંઈ કરવાની ઈચ્છા ના થવી, ખૂબ ઓછી / વધારે લાગવી, નકારાત્મક વિચારો આવવા – આવા લક્ષણો ડિપ્રેશનમાં જોવા મળે છે.

ડિપ્રેશનના કારણો ધ્રુવ બધા હોઈ શકે. જેમ કે,

- ★ વર્ક ફોમ હોમને કારણે ધરમાં સીમિત થઈ જવું પડે. બહારના લોકો સાથે ભેગા થઈ જે આનંદ મળતો હતો તે બંધ થઈ જાય.
- ★ સામાજિક પ્રસંગો પણ બંધ થઈ જાય.
- ★ કોરોનાને કારણે થતી ચિંતા - આર્થિક સમસ્યાઓ, સામાજિક તકલીફોને કારણે પણ ડિપ્રેશન થઈ શકે છે.

## (C) Phobia – Illness Anxiety :

ખૂબ જ ડર લાગવો કે કોરોનાની બીમારી થઈ જશે. એવા વિચારો આવવા કે, “મને ઇન્ફેક્શન થઈ જ ગયું હશે – કોઈ મોટી બીમારી થઈ જશે / મૃત્યુ પામીશ.”

## (D) Suicide / આત્મહત્યા - ચિંતા - ડિપ્રેશન - Phobia

ના કારણે થોડા લોકોને આત્મહત્યાના પણ વિચારો આવે છે. ઘણા લોકોએ જીવ ખોયો પણ છે આ કારણે. લોકોમાં આવી માનસિકતા પણ તોભી થઈ છે કે જો કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવશે તો ક્વોરન્ટાઇન થવું પડશે. લોકો તમને અધ્યતની જેમ રાખશે. આ ડરના કારણે કોરોનાના લક્ષણો હોવા છતાં વ્યક્તિ તપાસ કરાવતા ડરે છે, જેના કારણે બીજા લોકો પણ સંકષિત થાય છે.

આવી માનસિક અસરોને રોકવા / નિરાકરણ લાવવા માટેના ઉપાયો :

1. કોઈ પણ વ્યક્તિ સામે તમારા વિચારો / લાગણીઓને રજૂ કરો, તેની ચર્ચા કરો.
  2. ધરના, સગાઓ કે મિત્રો પાસેથી સાથ-સહકાર લેવો અને તેમને સહકાર આપવો.
  3. શારીરિક સ્વર્થતા માટે અને ઇમ્યુનિટી વધે એ માટે ઉકાળા, દવાઓ - દેશી તેમજ એલોપેથીક લેવી જોઈએ. નિયમિત ઊંઘ અને ખોરાક લેવા. પૂરતા પોષણયુક્ત ખોરાક લેવા.
  4. દરેક પરિસ્થિતિનો સામનો કરવો જોઈએ. જે પણ તકલીફો આવી છે તેને સ્વિકારી, તેના રસ્તા કાઢવાની કોણિશા કરવી. આર્થિક ઉપાર્જન ઉપર અસર થઈ હોય તો કઈ રીતે બહાર નીકળવું - બીજા વ્યવસાય માટે શું કરવું - એ સ્વસ્થતાથી વિચારવું જોઈએ.
  5. પ્રાણાયામ - ધ્યાન આવા સંજોગોમાં પણ ઉપયોગી થશે.
  6. ધરમાં સભ્યોએ સાથે મળીને રમતો રમવી. જેનાથી મન હળવું રહેશે. પોતાને ગમતી પ્રવૃત્તિ કરવી - પેઇન્ટિંગ,
- (અનુસંધાન : જુઓ પાના નં. - ૨૨ ઉપર)



## શિક્ષણ જગત

### માનવ સંસાધન વિકાસમાં શિક્ષણ



ડૉ. પલ્લવી શાહ,  
પ્રિન્સિપલ, મા આશાપુરા કોલેજ  
ઓફ એજ્યુકેશન, ભુજ

માણસમાં જોજનવા જે અલોપ  
અથવા માણસને કાઢવાને બાર,  
હોય કોઈ માઈનો પૂણી, પુરાવિદ  
થાય તત્પર તૈયાર!

- ધ્રુવ ભટ્ટ

કવિશ્રી ધ્રુવ ભટ્ટને કેમ એમ લાગ્યું કે માણસ અલોપ થયો? અને તે ય જોજનો દૂર? ક્યાં અલોપ થયો માણસ? શું અલોપ થયું એમાંથી? હા, માણસ અલોપ થયો છે. **માણસમાંથી માણસાધ અલોપ થઈ છે.** નેતિકતા, મૂલ્યો, સંવેદના ખોવાઈ છે. જાણો કે જોજનો દૂર ચાલી ગઈ છે, જાણો કે હિતિહાસ બની ગઈ છે. એને પાછી શોધી લાવવા કોઈ માણસનો પુરાવિદ જોઈએ. કોણ છે આ પુરાવિદ? એ પુરાવિદ છે, માનવ સંસાધન. શું માનવ સંસાધન એટલે?

Noun, Human Resources ની વ્યાખ્યા કાંઈક આ મુજબ છે :

*"The personnel of business or organization, regarded as a significant asset in terms of skills and abilities."*

અન્ય એક વ્યાખ્યા મુજબ :

*"The development or support systems responsible for personnel sourcing and hiring, applicant tracking, skills development and tracking, benefits administration and compliance with associated government regulations."*

બધી જ વ્યાખ્યાઓનો સાર લેતા એટલું સમજાય કે, સંસાધન એટલે સંસ્કરણ પામેલું. **માનવ સંસાધન એટલે માનવનું સંસ્કરણ કરવું.** કૌશલ્યપૂર્ણ વ્યક્તિત્વ તૈયાર કરવું. એવા કૌશલ્યોનો વિકાસ કે જેના દ્વારા સ્વયંમાં રહેલી બધી જ શક્તિનો તે યોગ્ય ઉપયોગ કરી શકે. અને આવું **વ્યક્તિત્વ તૈયાર કરવા જતાં કોઈ પણ સાધનોનો વ્યાય ન થાય.** એવું **વ્યક્તિત્વ તૈયાર કરવું એટલે માનવ સંસાધન.** આવું વ્યક્તિત્વ તૈયાર કરવા માટે એટલે કે માનવ સંસાધનના વિકાસ

માટે શિક્ષણની ભૂમિકા ખૂબ મહત્વની છે, અનિવાર્ય છે. આ ભૂમિકા સમજતા પહેલા શિક્ષણનો અર્થ સમજવો જરૂરી છે.

#### ● શિક્ષણ એટલે શું?

કવિવર રવિન્દ્રનાથ ટાગોર કહે છે : "કેળવણી એટલે સત્યની સનાતન ખોજ, સત્યની અભિવ્યક્તિ અને સત્યની સ્વીકૃતિ."

"માણસની સંપૂર્ણ વ્યક્તિમતાનું પ્રકટીકરણ કરે તે કેળવણી" – વિવેકાનંદ.

વાપક વ્યાખ્યા મુજબ : "કેળવણી, એ પરિવર્તનની પ્રક્રિયા છે. માનવીની વિચાર શક્તિ, કલ્યાણ શક્તિ, નિર્ણય શક્તિ વિકસાવી, ચીલાચાલુ પરિસ્થિતિમાંથી પરિવર્તન લાવવાની પ્રક્રિયા છે."

ગાંધીજી કહે છે : "કેળવણી એટલે બાળક અને માણસના મન, શરીર અને આત્માના ઉત્તમ અંશોનું આવિષ્કરણ."

**દૂકમાં, શિક્ષણ અથવા કેળવણી એટલે કે –**

- ★ સત્યની શોધ, અભિવ્યક્તિ અને સ્વીકૃતિની દિશામાં જવું.
- ★ સંપૂર્ણ વ્યક્તિત્વને પ્રગટ કરવું.
- ★ પરિવર્તન લાવવું.
- ★ શક્તિઓનો વિકાસ કરવો.
- ★ વ્યક્તિમાં રહેલી ઉત્તમ બાબતોને શોધી કાઢવી.

કેળવણીની વ્યાખ્યાઓ ઉપરથી જ્યાલ આવે કે, માનવ સંસાધન વિકાસમાં શિક્ષણ કેન્દ્રવર્તી ભૂમિકા ભજવે છે.

#### ● માનવ સંસાધન વિકાસમાં કેળવણી :

શિક્ષણ પૂર્વ આયોજિત નાના નાના અનુભવોની શુંખલાથી વ્યક્તિને તૈયાર કરે છે. આ અનુભવોની હારમાળા રચાય છે. જેના દ્વારા વ્યક્તિમાં જે રહેલું છે, તે બદાર આવે છે. તેની અભિયોગતા, તેની શક્તિઓ વગેરે. અને આ ઉપરાંત તેનો દાખિકોણ, બુદ્ધિ, કાર્યક્ષમતા વગેરેનું યોગ્ય ઘડતર થાય છે. માણસ અનંત શક્તિનો ભંડાર છે અને એટલે જ એને સંસાધન તરીકે સ્થાપિત કરવામાં આવ્યો છે. આ બાબત ધ્યાનમાં રાખીને શિક્ષણ તેને અનુભવો દ્વારા ઘડે છે. આ અનુભવોની હારમાળા

એવી રીતે રચાય છે જેથી તેનામાં રહેલું સર્વોત્તમ તત્ત્વ રાખ્ણા વિકાસ માટે ઉપયોગી બને. રાખ્ણે આવા સંસાધિત વ્યક્તિની જ જરૂર પડે છે. એના માટે શિક્ષણ ગ્રાણ પ્રકારના અનુભવો આપે છે : બૌદ્ધિક, શારીરિક અને માનસિક. બૌદ્ધિક અને માનસિક અનુભવો અલગ એટલા માટે કે, માનસિક બાબતો સાથે સંવેગો જોડાયેલા છે. રાખ્ણા વિકાસ માટે જે ભૂલ વિના, સક્ષમતાથી અને સમાજને ધ્યાનમાં રાખીને કાર્ય કરી શકે તેવી માનવ સંપત્તિની જરૂર રહે છે. ગાંધીજીએ આપેલા સર્વોદ્યના સિદ્ધાંતો આ માટે જાણવા જેવા છે :

૧. સહુના ભલામાં આપણું ભલું રહેલું છે.
  ૨. વકીલ અને વાળંદના કામનું મૂલ્ય એકસરખું હોવું જોઈએ.
  ૩. સાંદું, મજૂરીનું, ખેડૂતનું જીવન એ જ સાચું જીવન છે.
- સર્વેના ઉદ્ય માટે આપેલા આ સિદ્ધાંતોમાં રાખ્ણી કે વિશ્વની કોઈ વ્યક્તિ બાકાત રહેતી નથી અને આ સિદ્ધાંતોનો સાર જોઈએ તો શિક્ષણ, એ એવી વ્યક્તિ તૈયાર કરવાની પ્રક્રિયા છે જે સ્વકેન્દ્રી ન હોય, સર્વેનો વિચાર કરીને પોતાનું જીવનયાપન કરનાર હોય, માત્ર બુદ્ધિગમ્યતાનો અભિગમ ધરાવનાર ન હોય, બૌદ્ધિક કાર્ય કરનારને જ મહત્વ આપનાર ન હોય પણ સાથે સાથે સમાજના દરેક વ્યક્તિના કાર્યને મહત્વ આપનાર હોય. અને છેલ્લે, માત્ર બૌદ્ધિક કાર્ય જ નહીં, પણ શારીરિક શ્રમ કરનાર, સાદગીપૂર્ણ જીવન જીવનાર, તેને પસંદ કરનાર તેમજ ખેડૂતની જેમ મહેનત કરનાર હોય. એટલે કે સમાજમાં રહેલ દરેક કક્ષાની, દરેક કાર્ય કરતી વ્યક્તિનો સમાજ સ્વીકાર હોય તેમજ દિનયર્થમાં શ્રમનો અનિવાર્યપણે સમાવેશ હોય.

**ટૂંકમાં કહીએ તો શિક્ષણ, રાખ્ણના વિકાસ માટે માનવ સંસાધનનો વિકાસ કરે છે.** આ વિકાસ કરવા માટે તે ગ્રાણ પ્રકારના અનુભવો પૂરા પાડે છે :

૧. વિકેન્દ્રીકરણના
૨. સમાજની દરેક વ્યક્તિના કાર્યને પ્રાધાન્ય આપવાના.
૩. સાંદું અને શ્રમપ્રધાન જીવન જીવવાના.

વિકેન્દ્રીકરણના કોશલ્ય વિકાસની સાથે સાથે વ્યક્તિમાં ભાઈચારો, સર્વધર્મ સમાનતા, સમાજના અંતિમ વ્યક્તિનો પણ વિચાર, દયા, કરુણા જેવા ગુણોનો વિકાસ થાય છે. દરેક વ્યક્તિના કાર્યને પ્રાધાન્ય આપવાની સાથે સાથે દરેક વ્યક્તિ પ્રત્યેનો આદર, તેમજ કોઈ કાર્ય ઊંચું કે હલકું નહીં પણ દરેક કાર્યને પોતાનું મહત્વ છે એવા ગુણો સંસ્કારિત થાય છે તેમજ સાદગી અને શ્રમ પ્રધાનતાની સાથે સાથે અપરિગ્રહ તેમજ સમાજને ઉપયોગી એવા ઉત્પાદક કાર્ય સાથે તે જોડાય છે.

શિક્ષણ દ્વારા આવા અનુભવો જ્યારે પૂરા પડાય ત્યારે માનવ સંસ્કરણ થયું કહેવાય. જેમાં માણસ સર્વપ્રથમ સમાજ માટે અને સમાજ દ્વારા રાખ્ણ માટે કાર્ય કરે છે. પરંતુ શું શિક્ષણ આ

ભૂમિકા સફળ રીતે નિભાવી શક્યું છે?

#### ● શિક્ષણની નબળી ભૂમિકાનાં કારણો :

શિક્ષણની ચિંતા સેવનાર કોઈ પણ શિક્ષણપ્રેમી હકારની દિશામાં માથું ધૂણાવશે નહીં. નતમસ્તક એ જ સ્વીકારવું રહ્યું કે, માનવ સંસાધનના વિકાસમાં શિક્ષણની ભૂમિકા સધ્યર કહી શકાય નહીં. એક સમય હતો જ્યારે શિક્ષણના કારણો જ રાખ્ણ એવી માનવસંપદા પ્રાક્ત કરતું હતું કે જેવી ભારતવર્ષ અજેય બન્યું. આજે પરિસ્થિતિ સંપૂર્ણ વિરુદ્ધ છે. શું કારણો છે આની પાછળ?

★ **મૂલ્યોનો અભાવ :** જેના આધારે વ્યક્તિનું, વ્યક્તિના આધારે સમાજનું અને સમાજ થકી રાખ્ણનું ઘડતર થાય છે, તેવા શાશ્વત મૂલ્યો, સામાજિક અને નૈતિક તેમજ ધાર્મિક મૂલ્યોનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળે છે. જે શિક્ષણની વ્યાખ્યા છે તેના કરતાં ઊંધા જ પ્રયોગો શિક્ષણના નામે થઈ રહ્યા છે. એટલે જ મૂલ્ય શિક્ષણ અલગથી આપવું પડે છે. મૂલ્યોના હ્રાસથી વ્યક્તિ સ્વકેન્દ્રી બન્યો છે. ‘હું ને મારી વહુ, એમાં આવી ગયા સહુ’ એ જીવનમંત્ર બન્યો છે. એવી વ્યક્તિ રાખ્ણોત્થાનમાં શું ઉપયોગ બનવાની?

★ **વ્યવહારિક અભિગમનો અભાવ :** જે શિક્ષણ મેળવ્યા પછી વ્યક્તિ સુચારું જીવન જીવવો જોઈએ, સામાજિક, પારિવારિક અને આર્થિક રીતે સુખી થવો જોઈએ, તેના બદલે પરેશાનીઓમાં વધારો ને વધારો જ જોવા મળે છે. કારણકે દરેકની માનસિકતા બાઈટ કોલર જોબની છે, જે બધા માટે શક્ય નથી. જેમાં વ્યક્તિનો સર્વાંગી વિકાસ થતો નથી. વળી, જે શીખે છે તે પચાવવાને બદલે માત્ર ગોખે છે.

★ **પરીક્ષા પદ્ધતિ :** પરીક્ષાલક્ષી શિક્ષણ હોવાને કારણે ગોખેલું ઉલટી કરવાનું તેના ફાળે આવે છે. તેમાં મૂલ્યોનું ઘડતર થાય એવી વાતનો તો છે જ ઊંડી ઉત્પાદન કે વિકાસની વાતથી જોજનો દૂર થઈ જાય છે. એવું થાય એ સ્વાભાવિક પરસ્નાઈલ રેન્ક પરથી જ મળે છે. તો શું ચિત્ર આવું જ ધૂંધળું જ રહેશે? એનો કોઈ ઉપાય નહીં? ના, એવું તો બને જ નહીં. હમેશાં એક બારી તો ખુલ્લી જ હોય.

#### ● માનવ સંસાધન વિકાસમાં શિક્ષણની ભૂમિકા મજબૂત બને તેવા સૂચનો :

ભારતને તો રન્નોનો દેશ કહ્યો છે, તેવી જ એની સંસ્કૃતિ છે. આપણી સંસ્કૃતિમાં કોઈ સમસ્યાનો હલ ન મળે એવું ન હોય. વળી, કોઈએ યોગ્ય જ કદું છે કે, “શિક્ષા સૂચનો કી મોહતાજ નહીં હૈ, શિક્ષા સાર્થકતા કી મોહતાજ હૈ.”

★ **ભારતીય સંસ્કૃતિનું જતન :** આપણા ધર્મશ્રંધરો એ માત્ર આધ્યાત્મિક બાબતો જ નથી શીખવતા પરંતુ એક સ્વસ્થ અને સમતોલ જીવન જીવતાં શીખવે છે. અને એ જ તો

માનવ સંસાધનની પ્રથમ શરત છે. સંસ્કૃતિનું ઉત્કૃષ્ટ જતન કરતાં જો શિક્ષણ શીખવે તો તે પોતાની ભૂમિકામાં સંપૂર્ણ સરફળ નીવડે.

- ★ **બુનિયાદી શિક્ષણનો અમલ :** બાપુએ જ્યારે બુનિયાદી શિક્ષણની વિભાવના આપી તેનાથી પહેલા તેમજે વર્તમાન ભારતની પરિસ્થિતિનો તલસ્પર્શી અભ્યાસ કર્યો હતો અને તેના આધારે ભવિષ્યની જરૂરિયાત સમજી હતી. એ મુજબ ઉધોગ દ્વારા શિક્ષણ અને માતૃભાષા દ્વારા શિક્ષણની આખી પદ્ધતિ હજુ સુધી અમલમાં મૂકાઈ હોત તો માનવ સંસાધન માટે ચિંતા સેવવાની જરૂર પડી ન હોત.
- ★ **સર્વાંગી દાખિકોણનો વિકાસ :** વર્તમાન શિક્ષણ પદ્ધતિ માણસને એકાંગી દાખિકોણ અને આવકદતવાળો બનાવે છે. જેના કારણે તે પોતાના ક્ષેત્રનો કદાચ તજશ બનશે, પણ મુસીબત સમયે તેની દશા ઘમંડી પંડિત જેવી બને છે. તે એટલા સુધી કે જીવ બચાવવા માટે પણ તે સક્ષમ રહેતો નથી. પરંતુ જો શિક્ષણ તેનો સર્વાંગી વિકાસ કરે તેવું હોય તો વિષમાં વિષમ પરિસ્થિતિનો સામનો કરી સાંગ્ઘોપાંગ પાર ઉત્તરે છે. રાષ્ટ્રને આવી માનવસંપદાની જરૂર છે.
- ★ **માણસને જીવંત રાખે તેવું શિક્ષણ :** માણસ ચૈતન્ય યુક્ત છે. એની જીવંતતા શા માં છે? આ બાબતનો અહેસાસ અપાવે તેવું શિક્ષણ. વર્તમાન રફતારમાં ટકી રહેવા માટે તેને યંગવત દોડવું પડે છે, સમજે કે તે ખુદ યંગ જ જની ગયો છે. ઉર્ભિશીલ માણસની સંવેદનાઓ જડ થઈ ગઈ છે. પાડોશીના ધરમાં મરણ થઈ જાય તો પ્રાર્થના સભામાં પાંચ મિનિટ બેસી, વ્યવહાર નિભાવતો થયો છે. આને તો ચેતના ન કહેવાય! પાડોશીની ચિંતા ન કરનાર કે સંવેદના જડ માણસ રાષ્ટ્રની શું ચિંતા કરવાનો?
- **ઉપસંહાર :** જીવંત બનાવવામાં શિક્ષણ નિષ્ફળ જશે તો કુદરતી સંસાધનની જેમ માનવ સંસાધન પણ નાચ થશે અને માત્ર યંત્રો એટલે કે રોબોટ જેવા માણસો રહેશે.

માનવ સંસાધનના વિકાસમાં શિક્ષણની ભૂમિકા અહેમ છે, સહૃદાયારીએ છીએ. પણ જાણવા છતાં તેની પરિસ્થિતિનો વિચાર આપણે કરીએ છીએ? નહીને? એનું કારણ કદાચ આપણે લીધેલું શિક્ષણ પણ હોઈ શકે. પરંતુ હવે જાણ્યા પછી શિક્ષણપ્રેમી હોવાના નાતે આ વિકાસમાં શિક્ષણ પોતાની ભૂમિકા ભજ્ય જ એનું દ્યાન રાખીએ અને સૌથી જરૂરી કે તેની શરૂઆત આપણાથીજ કરીએ.

સંદર્ભો : (૧) [www.google.com](http://www.google.com), (૨) [www.entrepreneur.com](http://www.entrepreneur.com),  
(૩) સર્વોર્ડ - ગાંધીજી, (૪) કેળવણીની તાત્ત્વિક આધારશીલાઓ - યુધ્ઘરવંશ અને દોલતભાઈ દસાઈ.

## જલિયાંવાલા બાગ - નરસંહાર

(અનુસંધાન : પાના નં. - ૧૬ ઉપરથી ચાલુ)

**‘અસહ્યોગ આંદોલન’**ની શરૂઆત કરી હતી. જ્યારે જલિયાંવાલા હત્યાકંડ થઈ રહ્યો હતો ત્યારે તે સમયે સરદાર ઉધમસિંહ ત્યાં હાજર હતા અને તેમને પણ ગોળી વાગી હતી. તેણે નક્કી કર્યું હતું કે તેઓ જધન્ય હત્યાકંડનો બદલો લેશે. ૧૩ માર્ચ, ૧૯૪૦ના રોજ તેમણે લંડનના કેક્સટન હોલની ઘટનાના સમયે બ્રિટીશ લેઝટનન્ટ ગવર્નર માઈકલ ઓ ડાયરને ગોળી મારીને ઢાર કર્યો હતો. ઉધમસિંહને ૩૧ જુલાઈ, ૧૯૪૦ના રોજ ફાંસીએ ચડાવી દેવામાં આવ્યા હતા. ગાંધી અને નહેરુએ ઉધમસિંહ દ્વારા માઈકલ ઓ ડાયરની કરવામાં આવેલી હત્યાની ટીકા કરી હતી. **જલિયાંવાલા બાગના હત્યાકંડ** ત્યારે ૧૨ વર્ષની ઊમના ભગતસિંહના વિચાર પર ઘેરો પ્રભાવ પાડયો હતો. તેની માહિતી મળતા જ ભગતસિંહ પોતાની શાણાથેથી ૧૨ માછલ પગે ચાલીને જલિયાંવાલા બાગ પહોંચ્યા હતા અને અહીંની ભલિદાની માટીને પોતાની સાથે ઘરે લાં ગયા હતા. આ ભગતસિંહ પોતાના બે સાથીદારો સુખદેવ અને રાજગુરુ સાથે ૨૩ માર્ચ, ૧૯૩૧ના રોજ ફાંસીના માંચકે ચટ્યા હતા.

આમ, આ ઈતિહાસને કોમ્પ્યુટર ટેકનોલોજીના માધ્યમથી આ મુલ્યિમમાં નજીકથી જોયો, તો મને અંદરથી લાગ્યું આ લોકોનો વાંક શો હતો? તેની પાછળ શહીદ ઉધમસિંહ, ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ જેવા વીર અને શહીદોથી જ દેશને સાચી આજાદી મળી હતી. તેમનું ભલિદાન કદી પણ ભૂલી જવાયે તેવું નથી. આપણી યુવા પેઢી આ જ્ઞાનને હુંમેશાં યાદ રાખે એટલે જ આ લેખ મેં લખ્યો છે.

**‘જય હિંદ’, ‘વંદે માતરમ’ અને ‘શહીદો અમર રહો’ના નારાથી મારો આ લેખ પૂરો કરું છું. હજુ પણ બ્રિટીશના બુદ્ધિજીવીઓ ભારતમાં આવે ત્યારે આ હત્યાકંડને પોતાનો દોષ માને છે પણ માર્ગી માંગવા તૈયાર નથી. ખરેખર તો બ્રિટીશ સંસ્કૃત એક માફીનો પ્રસ્તાવ પાસ કરવો જોઈએ, તેને બદલે હજુ પણ રાખેતા મુજબ ભારતના આંતરિક મામલામાં પોતાનું માથું માર્યું કરે છે. પણ સરકારની મજબૂત વિદેશ નીતિથી તેઓ નબળા પડ્યા છે, એ પણ એક સારી બાબત છે.**

મિત્રો, અનેક અખબારો અને પુસ્તકોમાં નામી અને અનામી લેખકોએ આ બનાવની સાચી વાતો લોકો સમક્ષ પ્રસ્તુત કરી છે, તે સૌને મારા વંદન. નહિતર આ ઈતિહાસ આપણી સમક્ષ આવ્યો જ ન હોત તે પણ એક હકીકત છે.

સંદર્ભ : ભારતનો ઈતિહાસ, વિવિધ અખબારી લેખો અને જલિયાંવાલા બાગનો ઈતિહાસ....

## કારકિર્દી

## જીપીએસ્સી પરીક્ષા પાસ કર્યા બાદ ડેચ્યુટી કલેક્ટરે કેવી કામગીરી નિભાવવાની હોય છે?



હિરેન દવે

જીપીએસ્સીની સૌથી પ્રચલિત વર્ગ-૧ અને ૨ પરીક્ષા લાખો લોકો ડેચ્યુટી કલેક્ટર કે રીવાયએસ્પી બનવાના જ્વાબ સાચે આપતા હોય છે. ગુજરાતની બધાર પોસ્ટિંગ મળતું ન હોઈ પોતાના જ રાજ્યમાં માનભેર કારકિર્દી ઘડી શકાય છે! પણ બહુ ઓછા લોકો સાચે જાણતા હોય છે કે વર્ગ ૧ અધિકારીની શું કામગીરી કે ભૂમિકા હોય છે? મારા શૈક્ષણિક અનુભવ પરથી મેં જોયું છે કે મોટાભાગના વિદ્યાર્થીઓએ ક્યારેય કલેક્ટર કચેરી કે મામલતદાર કચેરી જોઈ સુધ્યાં હોતી નથી! કોઈ પણ પરીક્ષા આપતા પહેલા વિચારો કે તેમાં જે કેડર કે કામકાજ મળે છે તેના માટે તમે કેટલા સજજ છો?

### ● ડેચ્યુટી કલેક્ટર :

જીપીએસ્સી પરીક્ષા આપતા મોટાભાગના લોકો માટે તે ડ્રીમ કેડર છે. સીધા વર્ગ ૧ અધિકારી તરીકે પસંદગી થાય છે. સૌપ્રથમ તાલીમ લીધા બાદ તેમને જિલ્લા કલેક્ટર નીચે કામગીરી સોંપવામાં આવે છે. આ તબક્કે જિલ્લામાં ફિલ પ્રશાસનનો અનુભવ મળે છે. કેટલાક તાલુકાના ગ્રાંટ અધિકારી તરીકે કામગીરી સોંપવામાં આવે છે. મામલતદારોની કામગીરીની ચકાસણી કરે છે. જીમીન વિવાદના કેસોમાં મામલતદાર એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ હોય છે. તેમણે આપેલા ચુકાદાથી જો પ્રજાને અસંતોષ હોય તો અપીલ ડેચ્યુટી કલેક્ટર એટલે કે સબ ડિવિનલ મેજિસ્ટ્રેટ સમક્ષ થાય છે. આવા કેસોનો તેઓ ચુકાદો આપે છે. આ ઉપરાંત જીમીન સંપાદન (લેન્ડ એક્ઝિક્યુશન ઓફિસર) તરીકે પણ ફરજ બજાવે છે. જિલ્લા પોલીસ તંત્ર પર પણ તેમની સત્તા હોય છે. આ ઉપરાંત જિલ્લામાં ચૂટણી યોજવી, વસ્તી ગણતરી કરવી, જો પૂર, ભૂકૂપ કે અન્ય કુદરતી આપત્તિ આવે તો ડિઝસ્ટર મેનેજમેન્ટનું કાર્ય કરે છે. ડિસ્ક્રીક્ટ સપ્લાય ઓફિસર તરીકે જો કામગીરી મળે તો રાશનની દુકાનો, પેટ્રોલ પંપો વગેરેની ચકાસણીનું કાર્ય પણ કરે છે. જો મહાનગરપાલિકામાં પોસ્ટિંગ મળે તો ક્યારેક ડેચ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે પણ કામ મળી શકે છે.

આ ઉપરાંત રેવન્યુ વિભાગની આ કેડર અન્ય અનેક સ્થાનોએ પણ સેવા આપે છે. સચિવાલયમાં તથા ગુજરાત સરકારના મહત્વપૂર્ણ પ્રોજેક્ટ જેવા કે 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' વગેરેના આયોજન અને નિર્માણમાં અનેક અધિકારીઓ આ કેડરમાંથી આવે છે. કેટલાક નિષાવાન અને કાર્યક્રમ અધિકારીઓને વિદેશમાં સંયુક્ત રાખ્યોમાં પણ કાર્ય કરવાની તક મળે છે.

પ્રમોશન મળ્યા બાદ કલેક્ટર કચેરીમાં કલેક્ટરના જમણા

હાથ સમાન નિવાસી નાયબ કલેક્ટર (રેસિનેન્ટ એડિશનલ કલેક્ટર) તરીકે કાર્ય કરે છે. લાંબાગાળે બઢતી મેળવીને આઈ.એ.એસ. પણ બની શકાય છે.

આ કેડરમાં આટલા લાભ છે તો સામે પડકારો પણ છે. જેમ કે પસંદગી પાયા બાદ ગુજરાતનાં કોઈપણ ખૂશામાં જોબ કરવાની તૈયારી હોવી જોઈએ. સૌરાષ્ટ્ર કે કચ્છના ગ્રામીણ કે અંતરિયાળ વિસ્તારોમાં પણ જોબ કરવાની સજજતા હોવી જોઈએ. બીજો મહત્વનો પડકાર એ ગણી શકાય કે આ જોબ ૨૪ કલાકની હોય છે. ચૂટણી, ડિઝસ્ટર કે અન્ય ખાસ પરિસ્થિતિઓમાં મહિનાઓ સુધી દિવસ-રાત કામ કરવાની તૈયારી રાખવી પડે!

### ● મામલતદાર :

જીપીએસ્સી પરીક્ષામાં વર્ગ-૨ માં મામલતદાર બની શકાય છે. તે ડેચ્યુટી કલેક્ટર માટે ફિડરકેડર છે. તેમાં તાલુકાનું પ્રશાસન આપવામાં આવે છે. થોડા વર્ષોના અનુભવ બાદ પ્રમોશન દ્વારા ડેચ્યુટી કલેક્ટર પણ બની શકાય છે. જે કાર્ય ડેચ્યુટી કલેક્ટર ગ્રાંટ સ્તરે કરે છે તે મામલતદાર તાલુકા સ્તરે કરે છે.

આમ, આજકાલ જે ઘેટાચાલ જોવા મળે છે તેમાંથી બહાર નીકળો અને તમારી ચોઈસને આધારે કારકિર્દીની પસંદગી કરો. તો જીવનમાં સફળતા અને સંતોષ પામી શકશો! ■

### કારકિર્દી ઘડતર માટેની ૭ ટીપ્સ

(અનુસંધાન : પાણા નં. - ૨૮ ઉપરથી ચાલુ)

ટ્રિવટ્સને કોટેડ (સંદર્ભિત) કરીને પણ લોકોને ઉપયોગી માહિતી ટ્રિવટર પર મૂકીને હકારાત્મક પ્રતિસાદ મેળવી શકાય છે.

★ શી-ટ્રિવટ્સ : તમારા વિષય અને ક્ષેત્રને લગતી પ્રભાવશાળી વ્યક્તિઓનાં ટ્રિવટ્સને ટ્રિવટ કરવાથી પણ ટ્રિવટરનો ઉપયોગ વધુ અસરકારક બનાવી શકાય છે.

★ એક્સપિરીયન્સ પોસ્ટરસ : તમે જે વિષય અને બાંડ પર ટ્રિવટ્સ પ્રસ્તુત કરો છો તેના વિશેના તમારા અનુભવો વિશે ટ્રિવટ્સ કરવું પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

★ આઇડિયા પોસ્ટરસ : તમારા વિષય અને ક્ષેત્રને લગતા વિવિધ મુદ્દાઓ પર તમારા અભિપ્રાયો / ટીપ્પણીઓ શોર કરવા પણ ઉપયોગી સાબિત થઈ શકે છે. ■

## કારકિર્દી



શબ્દનીર અહેમદ ખગી

## કારકિર્દી ઘડતર માટેની ૭ ટીપ્સ

મોટાભાગના લોકો એવું માને છે કે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મનો ઉપયોગ ફક્ત સામાજિક પ્રસંગો વિશે પોસ્ટ કરવા માટે થાય છે. પણ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર યોગ્ય પ્રોફાઈલ બનાવીને તેમજ અસરકારક રીતે વિવિધ મુદ્દાઓ પર પોસ્ટ કરવાથી નોકરીદાતાઓને આકર્ષિત કરીને આકર્ષક નોકરી પણ ગ્રામ કરી શકાય છે.

નિષ્ણાત વ્યક્તિઓના મત અનુસાર ટ્રિવટર પર માહિતીપ્રદ મુદ્દાઓ વિશે પોસ્ટ કરવાથી એમલોયર અને અન્ય પક્ષોને પ્રભાવિત કરીને કારકિર્દી વિકાસને ઝડપથી આગળ વધારી શકાય છે.

સોશિયલ મીડિયા એ વૈશ્વિક સ્તરે લોકો સાથે જોડવા માટેનું એક શક્તિશાળી સાધન સાબિત થઈ શકે છે. સોશિયલ મીડિયાના અનેક પ્લેટફોર્મમાંથી ટ્રિવટર, એ સૌથી વધુ ઉપયોગી સાબિત થતું પ્લેટફોર્મ બની શકે છે.

ટ્રિવટર વિશ્વના તમામ દેશોમાં ઉપયોગમાં લેવાતું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હોવાને લિધે જો વ્યવસ્થિત રીતે ટ્રિવટર ઉપર પોસ્ટ કરવામાં આવે તો તમારા માટે અનેક પ્રકારની તકોના દરવાજાઓ ખૂલ્લી શકે છે.

જો તમે ટ્રિવટરના નવા વપરાશકર્તા છો કે વર્ષોથી ટ્રિવટરનો ઉપયોગ કરી રહ્યા છો તો અહીં દર્શાવીલી બાબતોનું ધ્યાન રાખવાથી ટ્રિવટર ઉપર ખૂબ જ સારા પ્રમાણમાં ફોલોઅર મેળવી શકાય છે અને લોકોને પ્રભાવિત પણ કરી શકાય છે, જે તમારા કારકિર્દિના વિકાસમાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.

## ● તમારી પાસે સોશિયલ એકાઉન્ટ શા માટે હોવું જોઈએ?

તમારા જ્ઞાન અને કુરુળતાનો લાભ લોકોને પ્રાપ્ત થાય તેના માટે સોશિયલ મીડિયા પર એકાઉન્ટ જરૂરી છે. સમયાંતરે લોકોને જરૂરી માર્ગદર્શન આપીને સોશિયલ મીડિયા પર એક અસરકારક છાપ ઊભી કરી શકાય છે.

## ● તમે કેવી રીતે અસરકારક ટ્રિવટ પોસ્ટ કરી શકો છો?

૧. પ્રોફાઈલ : તમારા પ્રોફાઈલ અનુસારના વિષયો પર સર્જનાત્મક પોસ્ટ્સ કરીને અનુયાયીઓની સંખ્યામાં વધારો કરી શકાય છે.

૨. મંતવ્યો : તમારા અભિપ્રાય યોગ્ય અને સ્પષ્ટ રીતે પોસ્ટ થવા જોઈએ. રી-ટ્રિવટ્સ કરતી વખતે પણ તમારા વ્યક્તિગત અભિપ્રાયને પોસ્ટ સાથે સામેલ કરવાનો પ્રયાસ કરો.

૩. યોગ્ય ટ્રિવટ્સ : સમય અનુસારના વિવિધ વિષયો અને મુદ્દાઓ પર ટ્રિવટ કરવાથી ટ્રિવટર પર વધુ સારા પ્રતિભાવ હંસલ કરી શકાય છે.

૪. યોગ્ય વિષય પર શેરિંગ : તમારા વિષય વિશે વધુ ચર્ચા કરો. તમારા વિષય પરના તમારા મંતવ્યો ટ્રિવટર પર શેર કરો.

૫. યોગ્ય ચર્ચા : તમારા ક્ષેત્રની અન્ય નિષ્ણાત વ્યક્તિઓને ટેગ કરીને તેમની સાથે ચર્ચા કરો.

૬. ગુણવત્તાયુક્ત માહિતી : હંમેશાં ઉપયોગી અને ગુણવત્તાયુક્ત માહિતી ટ્રિવટ કરો. જેથી લોકો પોતાનું જ્ઞાન વધારવા તમારા ટ્રિવટ પર ધ્યાન કેન્દ્રિત કરે.

૭. હેશટેગ્સ : તમારી પોસ્ટમાં હેશટેગ્સનો ઉપયોગ કરીને તમારા ટ્રિવટને વધુ પ્રમાણમાં લોકોને જોડવાની કોશિશ કરો.

## ● તમારે કોણે અનુસરવું જોઈએ?

તમારા ક્ષેત્રની નિષ્ણાત વ્યક્તિઓ અને અન્ય સંબંધિત ક્ષેત્રોના સોશિયલ મીડિયા પરના પ્રોફાઈલ્સનો ફોલો કરવાથી વિવિધ માહિતી પ્રાપ્ત થઈ શકે છે, જે માહિતી અન્ય લોકોને આકર્ષિત કરવામાં મદદરૂપ થઈ શકે છે.

## ● સોશિયલ મીડિયા પર નેટવર્કિંગ કઈ રીતે કરવું જોઈએ?

તાજેતરમાં જે સમસ્યાઓ અને પ્રશ્નોનો સામનો લોકો કરી રહ્યા છે તેના પર વિચાર અને જ્ઞાન શેર કરવાથી સોશિયલ મીડિયા પર હકારાત્મક પ્રતિસાદ મેળવી શકાય છે અને નેટવર્કિંગનું વિસ્તરણ કરી શકાય છે અને ફોલોઅરની સંખ્યામાં વધારો કરી શકાય છે.

## ● તમારી પાસે કયા પ્રકારની પોસ્ટ્સ હોવી જોઈએ?

★ કોટેડ ટ્રિવટ્સ : તમારા વિષય અને ક્ષેત્રને લગતા

(અનુસંધાન : જુઓ પાના નં. - ૨૭ ઉપર)

રહસ્ય

## મૃત્યુની પરિવર્તનશીલતા



પ્રા. સૂર્યકાંત ભટ્ટ

ઈરાનના મશાહૂર બાદશાહ નોશેરવાન આદેલે એક દિવસ દરબારમાં પ્રશ્ન પૂછ્યો કે, “હુનિયામાં સૌથી ભારે દુઃખ ક્યું?” કોઈએ કહ્યું કે અંધાપો અને ગરીબી; બીજાએ કહ્યું કે વૃદ્ધાવસ્થા અને એકના એક પુત્રનું મૃત્યુ, ત્રીજાએ જણાવ્યું કે અશક્તિ અને પરાધીનતા. પરંતુ નામીચા વર્જીર બુરુજ્ઝમહેરે કહ્યું, મોતની નજીદીકી અને પાપી અંતઃકરણનો ઉખ એ હુનિયામાં સૌથી મોહું દુઃખ છે. હડીકતમાં જેઓ પાપ, હુગુણોથી કે જુલમોથી દૂર રહ્યા છે તેઓ પોતાના દુઃખ કે ઉખથી ત્રાસ પામશે નહીં.

### ● માનવી મૃત્યુને મહાત કરી શકે?

મૃત્યુની સમસ્યાનું સચોટ સમાધાન આપણને મળ્યું નથી. આપણે જન્મ-મરણની અનેક યાત્રાઓ કરી છે પરંતુ મૃત્યુને મહાત્મ કરવાનું રહસ્ય આપણાથી વેગણું રહેવા પામ્યું છે. અચલ મૃત્યુને કેમ વિચારિત કરી શકાય? તેના અનુસંધાનમાં પરમ યોગીઓ, ઋષિ મુનિઓ અને સંતવર્યો અંગૂઠીનિર્દેશ કરે છે. શ્રી હદ્યરંજન ભણ્યાર્થજ પોતાના પુસ્તક “Death not an end of life” માં વર્ણવે છે તે મુજબ In fact, Death is nothing its Destination ascertained by the almighty God.

વાસ્તવમાં મૃત્યુ, એ પરિવર્તન સિવાય કંઈ જ નથી કે જેના વિના આત્મા, ઈશ્વરે નિધરિલા પરમ સ્થાનને પામી શકે નહીં.

**કોઈ આત્મા-પરમાત્મામાં ન માને પરંતુ તને મૃત્યુમાં માનવું જ રહ્યું.** મૃત્યુ પર મનુષ્યજીવન દ્વારા જ વિજય મેળવી શકાય. મૃત્યુને મહાત કરવાની તાકાત પણ કુદરતે મનુષ્યને આપી છે. પરંતુ પ્રત્યેક જીવ માટે તે આસાન નથી. કારણકે મૃત્યુનાં રહસ્યને પામવા અનુકૂળ જન્મો ભાગ્યે જ મળતા હોય છે. મનુષ્ય જીવનમાં જ આ વિચાર શક્ય છે. મનુષ્ય પાસે મન અને બુદ્ધિ છે. તેનો સર્વોત્તમ ઉપયોગ કર્યો છે. તેઓ હુંમેશાં કહેતા રહ્યા છે, “દુર્લભો માનુષો દેહો” મનુષ્ય દેહ મળવો તે જ દુર્લભ છે. દેવોને પણ મોક્ષભાગી થવા મનુષ્ય દેહ ધરવો પડે છે. સાનુકૂળ યોગ હોવા છતાં મનુષ્ય સંસારની આસક્તિઓમાં જ પોતાનું જીવન વેડફી નાખે છે. પાણીથી બચવા વરસાએ પહેલાથી માનવી તેયારી કરે તેવી રીતે મૃત્યુ જ્યાર મારે તે પહેલા તેને જ મહાત કરવાની તેયારી કરી શકાય. મોહની

મહાનિદ્રામાંથી આપણને જગાડનાર મૃત્યુ છે. દિન પ્રતિદિન કે ક્ષણે ક્ષણે આપણે મૃત્યુ તરફ ધકેલાતા જઈએ છીએ. મૃત્યુને મહાત્મ કરવા જીવનને ઉપલબ્ધ કરવું ઘટે.

### ● મનવી મૃત્યુ સામે મીટ માંડો :

મૃત્યુ કઠોર વાસ્તવિકતા છે જેની અવગાણના થઈ શકે તેમ નથી. મૃત્યુનો સ્વીકાર કરવા માટે મૃત્યુને સત્કારવા માટે આપણા મનને જ તેયાર કરવું પડે. મનને સમજણથી તેયાર કરી શકાય. જેમ કે મૃત્યુ, એ એક અનિવાર્ય ઘટના છે. જન્મ થયો તેનું મૃત્યુ થવાનું મોટા મોટા માંધાતાઓ કે અવતારી પુરુષોને પણ આ ફાની દુનિયાને છોડવી પડી છે.

માનવીએ મનને એ પણ સમજાવવાનું છે કે આ વિશ્વમાં જન્મનાર વ્યક્તિઓનાં બધા જ કાર્યો ક્યારે પણ પૂરા થયા નથી. કેટલાક કાર્યો પૂરા થાય, તો કેટલાક બાકી રહી જાય. તેથી અધૂરા કાર્યો કે એવા સ્વખનો પર બેધ્યાન રહેવાથી કે આસક્તિ નહીં સેવવાથી મૃત્યુ તરફ મીટ માંડી શકાય.

આત્માને પરમાત્માના માર્ગ વિહરવાની અને જીવને શિવ થવાની બાબત માત્ર એક જ જન્માંતા ભાગ્યે જ સિધ્ય થાય. રોગનું મૂળ જાયા વિના તેનો યોગ્યતમ ઉપયાર થઈ શકતો નથી તેમ મૃત્યુ શું છું છે? તેનો બ્રમ આપણને શા માટે પજવી રહ્યો છે? મૃત્યુ પછી મારી ગતિ શી હોઈ શકે? આ અભ્યાસ મૃત્યુમાંથી અમૃતપ્રાપ્તિનો માર્ગ અજવાણે. મૃત્યુને ઓળખી લેવાથી મૃત્યુની ભીતિ અદશ્ય થઈ જશે. મૃત્યુ મહાવિશ્વામ છે. તેમ મનને સમજાવતા જવાથી મન મજબૂત થતું જશે. મૃત્યુનું મૂલ્ય સ્વીકારતું જશે.


**જીવનની વાસનાઓની ઇન્જ્રાળ આત્મદર્શનથી જ તોડવી પડશે.** શેષ જીવનની ક્ષણો ક્ષણને સત્કાર્યોથી સુધારવાનો પ્રયત્ન કરનાર મૃત્યુ સામે મીટ માંડી શકશે.

### ● અંત સમયની સાધના :

જીવનની અંતિમ ક્ષણો પર જીવની ગતિનો આધાર હોય છે. માનવીનું મન માનવીના બંધન અને મોક્ષનું કારણ છે. તેથી મન દ્વારા જ અંત સમયની સાધના સફળ થઈ શકે.

સૂર્યી સંત ફરીદા કહે છે, “રબ દાકી પાવના, ઈતો ફડકે ઉતે લાવના.”

(અનુસંધાન : જુઓ પાના નં. - ૩૩ ઉપર)



વાસ્તવિકતા

## ‘બી પ્રેક્ટિકલ’ અપ્રોય એ કોઈ પાપ નથી!



પાર્થ દવે, જનાલિસ્ટ

દિક્શનરીમાં ‘પ્રેક્ટિકલ’ શબ્દનો અર્થ થાય છે – વ્યવહારનું, વ્યવહારને લગતું, વ્યવહારિક. આ ઉપરાંત પ્રેક્ટિકલનો એક અર્થ ‘આવતતવાળું’ પણ થાય અને વાસ્તવિક પણ થાય. ‘બી પ્રેક્ટિકલ’ એટલે શું? વધુમાં વધુ વાસ્તવિક અથવા તો વાસ્તવિકતાની નજીક, સચ્ચાઈની નજીક.

રોજભરોજની જિંદગીમાં અતિશય બોલાતો કેળ છે : બી પ્રેક્ટિકલ. એના કારણે નાના બાળકને પણ આ શબ્દનો ખ્યાલ છે, કદાચ તેનો અર્થ પણ તેના મનમાં કંઈક બની ચૂક્યો હશે! આપણે મોટાભાગે પ્રેક્ટિકલ ન થઈને પોતાની જિંદગી વધુ મૂંગવણભરી ને ગુંચવણભરી કરી નાખતા હોઈએ છીએ! ‘બીજાને કેવું લાગશે?’ એ વિચારીને આપણે પોતાના માટે ઘણું બધું જતું કરતા હોઈએ છીએ. સૌથી મોટું અને તમને તાદેશ દેખાય એવું ઉદાહરણ છે : સગા-સંબંધીઓનું. કોઈ સારો-નરસો પ્રસંગ હોય, કોઈકને ત્યાં જવાનું હોય કે ન જવાનું હોય, મદદ કરવાની હોય કે ના પાડવાની હોય, માંગવાની હોય કે અટકી જવાનું હોય, જમવા બોલાવવાના હોય કે નાસ્તો કરાવવાનો હોય વગેરે પરિસ્થિતિમાં ‘બી પ્રેક્ટિકલ’ થવું કે ન થવું તેની કશમકશ રહેતી હોય છે! એમ કરીએ તો તમને કેવું લાગશે – અગેઠન આ જ સવાલ રાક્ષસની જેમ સામે આવીને ઊભો રહેતો હોય છે.

વેલ, ‘જિંદગી બહુ જ સરળ છે, ધારી છે’ – આ વાત એકદમ ખોટી છે. જિંદગીને સરળ બનાવવી પડે છે. તેને ઈજી કરવી પડે છે અને તેના માટે પ્રેક્ટિકલ થવું પડે છે. પ્રેક્ટિકલ થવું એ કોઈ પાપ નથી, જિંદગી કોઈપણ જાતના ટેન્શન વગર જીવવાનો કીમિયો છે અને દરેક વખતે બી પ્રેક્ટિકલ થઈએ એટલે ‘બીજાનું બગાડીએ છીએ’ કે ‘બીજાને ખરાબ લાગશે’ (જે આપણે માનીએ છીએ) એવું નથી હોતું. આપણે નાની-મોટી બાબતો અવગણીને અને પોતાનો સ્વભાવ બદલાવીને પણ ઈજી ગો લાઈફ જીવી શકીએ છીએ.

૧૮થી ૨૫ની આજુબાજુના છોકરાંઓ, જેમની પાસે માહિતીના અધધધ સોસિસ છે, શીખવા માટે બધું જ છે, જોવા માટે ઇન્ટરનેટમાં જાતજાતના પ્લેટફોર્મ્સ છે, ભણવા માટે કેટલા બધા પ્રવાહો છે; આ છોકરાંઓ સૌથી વધારે કન્ફિડ્યુઝ પ્રાયોરિટી

કોને આપવી એમાં હોય છે! આમાં સૌથી વધારે મહત્વનું શું છે તે નક્કી કરો અને એ હિસાબે ગાડી આગળ ધપાવો. વેરી ઈજી, છતાંય અધરું! કેમકે, આ જ વાતનો બીજો તબક્કો એ આવે છે કે, જ્યારે જરૂર ન હોય ત્યારે કોમ્યુનિકેશનના જેટલા પણ સાધનો છે તે સ્વીચ ઓફ કરી નાખો. ટી.વી., કોમ્યુટર, મોબાઇલ, મેઇલ, મેસેજ્સ, ફોન, વગેરે વગેરે! ખાસ તો રાતના! તમને કદાચ સવાલ થઈ શકે કે આમાં બી પ્રેક્ટિકલ ક્યાં આવ્યું? પણ મોબાઇલ કે કોઈપણ માધ્યમથી કોઈને જવાબ ન આપવો એ પણ પ્રેક્ટિકલ જ છે ને! બીજું, આ ઉમરના કે એથી થોડા મોટા યુવાનો, જેમણે મિઅનેસ સ્ટાર્ટ કર્યો છે કે સ્ટાર્ટ કરવાનું વિચારે છે કે કંઈક નવું કરવું છે, તેમને ખાસ કહેવું છે કે એક સમયે એક ટાર્ગેટ નક્કી કરો, એક લક્ષ્ય પર ફોક્સ હશે તો તે જડપથી અને સ્પષ્ટ મળશે. એકસાથે બે ઘોડા કે દુનિયાના એકેય પ્રાણી પર સવારી ન થાય! પણ એક વખત એક પર હાથ બેસી જાય પછી તેને ઓટો મોડ પર રાખીને અન્ય વાહન ટ્રાય કરી શકાય! માટે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધો. મગજ બષુ હાલતું હોય તો પણ એકીસાથે કૂદી ન પડો! (આ બાબત મારા સહિત અનેક યુવાનોને લાગુ પડે છે!)

બી પ્રેક્ટિકલની સૌથી મોટી અને મહત્વની સલાહ છે, જે તમામ ઉમરની વ્યક્તિઓને લાગુ પડે છે અને જેના પર અલાયદો આર્ટિકલ લખી શકાય એમ છે, એ છે : ના કહેતા શીખો. લાર્ન ટુ સે નો અને નો મિન્સ નો! બીજું, એમ કહેતા (ના પાડતા) યાદ રાખો કે આ કોઈ સ્વાર્થી વૃત્તિ કે ગદારી નથી. આ તમારી અંગત સ્પેસનો મામલો છે. પ્રાથમિક જરૂરિયાત છે એકાંતની, એ માટે ના કહેતા શીખો.

સી/૮૪, ગાલા ગલોરી, ગાલા એરોન્યૂસ્પેલી સ્ટોર્સ સેન્ટરની પાસે,  
સાર્વય બોપાટ, અમદાવાદ-૩૮૦ ૦૪૮.  
મો. ૯૮૨૩૦ ૫૬૯૯૯

ન બોલે તેને બોલાવજો, ન આવે તેને ધેર જાઓ, રીસાય તેને રીઝવઝે અને આ બધું તેમના ભલા માટે નહીં પણ તમારા ભલાને સાદું કરજો. જગત લેણદાર છે, આપણે તેના કરજદાર છીએ.


— ગાંધીજી

## આરાધના

## મદ્દ



સુનિતા એ. શાહ



એક ખૂબ જ ધનિક કુટુંબ હતું. તેમાં રહેવાવાળા પણ ઘણા બધા જણા હતા. સંયુક્ત કુટુંબ હતું. ગ્રાન્ડ માર્ડ, તેમની પત્નીઓ, તેમના સંતાનો અને વડીલ તરીકે દાદા-દાદી પણ ખરા જ.... કોઈ જ ખોટ ન હતી ઘરમાં. લક્ષ્મીની રેલમછેલ હતી. સૌથી નાના ભાઈનો મોટો દીકરો પ્રકાશ... પ્રકાશ જાણે કે ઘરમાં પ્રકાશ રેલાવવા આવ્યો હોય એવા જ અના વિચાર, વાણી અને વર્તન હતા. હજ તો તે બાર વર્ષનો જ હતો પરંતુ 'પુત્રના લક્ષ્મણ પારણામાં' એ ઉક્તિ સાચી ઠેરવતો હતો. તે ખૂબ જ હોશિયાર હતો. ભણવા ગણવામાં કે પછી રમત-ગમતમાં, કોઈ પણ ક્ષેત્રમાં પ્રથમ આવવું એ એની જાણે કે આદત થઈ ગઈ હતી. તેની ઉપર મા લક્ષ્મીજી અને મા સરસ્વતીજીની ફૂપાદ્ધિનો સમન્વય હતો.

તેની શાળાના મોટાભાગના વિદ્યાર્થીઓ તેની સાથે મૈન્ઝી કરવા માટે ઉત્સુક હતા. તે પણ બધાની સાથે હળતો ભળતો. તેને દોસ્તો સાથે રમવાની ખૂબ મજા આવતી હતી. આ બધામાં તેનો ખાસ દોસ્ત હતો જીગર... જીગર તેના જેટલો ધનાઢ્ય તો ન હતો પરંતુ તેની પાસે પણ પૈસાની કોઈ કંઈ તો ન જ હતી. તેથી જ તેના પિતાએ તેને શહેરની સૌથી મોંઘી શાળામાં ભણવા મૂક્યો હતો. જીગર પણ નામ પ્રમાણે ગુણ ધરાવતો હતો. કંઈપણ ક્રી છુટવાની જીગર તેની પાસે હતી. પ્રકાશ અને જીગરને બહુ સારું બનતું હતું. બંને જણા સાથે ભણીને સાથે મોટા થવા લાગ્યા.

પ્રકાશનો તો તેના બાપ-દાદાનો ધંધો હતો. તેથી તેણે ભણીને તે ધંધો જ સંભાળવાનો હતો. જ્યારે જીગરના પિતાજી એક ઉચ્ચ સરકારી પદ ઉપર હતા. તેમની સરકારી નોકરી હતી. તેથી જીગરને આગળ જતા કાં તો નોકરી જ શોધવાની હતી. અથવા તો પોતાનો કોઈ બિઝનેસ નવેસરથી શરૂ કરવાનો હતો.

જ્યારે બંને જણા પોતાનું ભણતર પૂરું કરીને જિંદગીના આગળ અનુભવો લેવા તૈયાર થયા ત્યારે પ્રકાશે તો તેના પિતાજીના ભાગમાં આવેલ બિઝનેસની તોર પોતાના હાથમાં લઈ લીધી. જ્યારે જીગર હજ અવફવમાં હતો કે નોકરી કરવી કે પોતાનો બિઝનેસ? પ્રકાશે પોતાના પિતાની પરવાનગી લઇને જીગરને પણ પોતાની જ ફર્મમાં જોડાવાની ઓફર આપી. જીગરને આમાં કશું અજુગતું ના લાગ્યું. તેને થયું કે પ્રકાશ પોતાનો ખાસ મિત્ર છે, જેને તે બચપણથી ઓળખે છે. તેની સાથે કરવામાં કોઈ વાંધો હોઈ જ ના શકે. ઉલટાનું

એકબીજાને સમજતા હોવાને કારણે કામ કરવાની વધારે મજા આવશે.

જીગર પ્રકાશની કંપનીમાં ગોઠવાઈ ગયો. તે મહેનતું તો હતો જ. એટલે ખૂબ મહેનત અને લગનથી કામ કરતો હતો. પ્રકાશ ખૂબ જ હોશિયાર હતો. તેથી પ્રકાશની હોશિયારી અને જીગરની મહેનત રંગ લાગ્યા. એમની કંપની થોડા સમયમાં ક્યાંથી ક્યાં પહોંચી ગઈ. તેઓ સફળતાના એક પછી એક શિખરો સર કરવા લાગ્યા.

સમય જતા બંને જણાએ પોતપોતાની શાતિની, પોતાની પસંદની કન્યાઓ સાથે લગ્ન કરીને પોતાનો ગૃહસ્થ સંસાર પણ શરૂ કરી દીધો. થોડા વખતમાં બંનેના ઘેર પારણું પણ બંધાઈ ગયું. પ્રકાશને ત્યાં દીકરી અને જીગરને ત્યાં દીકરાનો જન્મ થયો. બંને જણા ખૂબ ખુશ હતા.

**પણ કહે છે ને કે સમયના ચકને ફરતા વાર નથી લાગતી. સુખ પછી દુઃખ અને ચડતી પછી પડતી, એ જીવનનો કમ છે.**

અચાનક જ ધમધોકાર ચાલતી કંપની અનાયાસે લીવેલા એક ખોટા નિર્ણયના કારણે ખોટમાં જવા લાગી. કંપનીના શેરો ગગડી ગયા. જેમણે પણ કંપનીમાં પૈસા રોક્યા હતા, તે બધાને તેમના પૈસાની ચિંતા થવા લાગી. બધા પોતાના પૈસા પાછા માંગવા લાગ્યા. પ્રકાશના મનમાં કોઈ ખોટ ન હતી. તેથી તે જેમણે પણ પૈસા પાછા માંગ્યા, તે બધાને પૈસા પાછા આપવા લાગ્યો. આમ કરતા કંપની વધારે ખોટમાં જવા લાગી. કર્મચારીનો પગાર પણ અટકી ગયો. જીગર પણ ચિંતામાં પડી ગયો. ઘર ચલાવવું પણ ભારે પડવા લાગ્યું.

એટલામાં જ બીજી એક મોટી કંપનીમાંથી જીગરને ઓફર આવી. એ કંપનીના માલિક જાણતા હતા કે જીગર ખૂબ જ હોશિયાર અને મહેનતું છે. પ્રકાશની કંપનીને આગળ લાવવામાં જીગરનો પણ બહુ મોટો હાથ છે. તેમને ખબર હતી કે જીગર જો તેમની કંપનીમાં આવી જાય તો તેમની કંપનીને ખૂબ ફાયદો થાય તેમ છે.

આટલી મોટી કંપનીની ઓફર જોઈને જીગર વિચારમાં પડી ગયો. એક બાજુ તેને તેના પરિવારનું ગુજરાન ચલાવવાનું હતું

અને બીજી બાજુ તેનો નાનપણનો મિત્ર હતો. તેને મુસીબતમાં તેનો સાથ છોડીને જતા રહેવાનું તેનું મન માનતું ન હતું. ખૂબ વિચાર કર્યા પછી તે એક નિર્ણય પર પહોંચ્યો.

જગર પ્રકાશની કંપની છોડીને નવી કંપનીમાં જોડાઈ ગયો. આ વાતથી તેમના બધા પરિચિતોમાં આશ્રય અને આધાતની લાગણી ફેલાઈ ગઈ. જગર આવું કરી શકે તે કોઈના માનવામાં આવતું ન હતું. જગરની પત્નીને પણ ખૂબ નવાઈ લાગી. પોતાનો પત્ર તેના ખાસ મિત્રના દુઃખમાં સાથ આપવાને બદલે પોતાનો સ્વાર્થ જોઈને બીજી કંપનીમાં જોડાઈ જાય, તે તેના માનવામાં આવતું ન હતું. તેણે જગરને ખૂબ ખરી ખોટી સંભળવાની આવું પગલું કેમ ભર્યું તે વિશે સવાલોની જરી વરસાવી. આવું પગલું કેમ ભર્યું તે વિશે સવાલોની જરી વરસાવી. પરંતુ જગરે તો જાણે કે મોહું સીવી દીધું હતું. તે કોઈ જ ઉત્તર આપતો ન હતો. પ્રકાશને જ્યારે ખબર પડી ત્યારે તેને પણ ખૂબ દુઃખ થયું હતું. પરંતુ તેણે એમ વિચારીને મનને મનાચ્ચું કે જગરને પણ તેનું ઘર ચલાવવાનું હોય, પરિવારની જવાબદારી સંભાળવાની હોય, તો એ ક્યાં સુધી તેની સાથે બેસી રહે? તેણે પોતાના હિતમાં આ પગલું ભર્યું છે. તેમાં એનો પણ શું વાંક કાઢવાનો?

થોડા જ દિવસોમાં પ્રકાશની કંપની વેચાઈ ગઈ. તેણે હવે પોતાનો આલીશાન બંગલો પણ વેચી નાખ્યો અને શહેરના છેડે નાનું મકાન લઈને રહેવા લાગ્યો અને એક કંપનીમાં નાની મોટી નોકરી સ્વિકારી લીધી અને જેમતેમ તેનું ગાડું ગબડાવવા લાગ્યો.

જિંદગી આમ જ તેની રફતારમાં ચાલી જતી હતી. વર્ષો પણ પાણીના રેલાની માફક વહી રહ્યા હતા.

એક રવિવારની સવાર... દસેક વાગવા આવ્યા હશે. ત્યારે પ્રકાશના ઘરનો ડોરબેલ રણક્યો. તે વિચારવા લાગ્યો કે અત્યારે કોણ આવ્યું હશે? આમ પણ લોકોએ તેના ઘેર આવવાનું બંધ જ કરી દીધું હતું. એક વખત હતો કે જ્યારે લોકોની અવરજનરથી તેનું ઘર ભરેલું રહેતું હતું અને હવે લોકો તેના ઘેર આવવાનું ટાળવા લાગ્યા હતા. એટલે જ કહે છે ને કે, ‘સુખ કે સબ સાથી, દુઃખમે ન કોય.’ તેણે બારણું ખોલ્યું તો સામે જગર ઉભો હતો. તેને પોતાની અંખ પર વિશ્વાસ ન આવ્યો. આટલા વરસોમાં એક પણ ઝોન ન કર્યો કે મળવા પણ ના આવ્યો. પોતાનો ભાઈબંધ કેવી દશામાં જીવી રહ્યો છે તેની ભાળ સુધ્યાં ન કાઢી, એ જગર આજે પોતાના દરવાજે આવીને ઉભો છે. તેના પહેરવેશ ઉપરથી અને મોઢાની ચમક ઉપરથી જાણી શકતું હતું કે જગર ખૂબ જ અમીર આદમી બની ગયો છે. ચાહવા છતાં પણ પ્રકાશ તેના ઉપર ગુસ્સે ના થઈ શક્યો. આટલા વખત પછી જગરને જોઈને તેના નાનપણના મિત્ર ઉપર તેને લાગણી જ ઉભરાતી હતી. તેણે કહ્યું, ‘અરે જગર, કેટલા વખત પછી તને જોયો. કેમ છે ભાઈ તું? આવ, આવ, ઘરમાં આવ...’

‘હું ઘરમાં આવવા માટે નથી આવ્યો, પરંતુ તને આ ઘરમાંથી લઈ જવા માટે આવ્યો છું. ચાલ મારી સાથે...’

‘તારી સાથે? પરંતુ ક્યાં... કેમ...?’

‘કોઈ જ સવાલ નહીં! ભાબી, તમે બધા મારી સાથે કારમાં બેસી જાઓ. તમારા બધા જ પ્રશ્નોના જવાબ મળી જશે.’

જગર પ્રકાશના પરિવારને લઈને ગાડીમાં નીકળી પડ્યો. પ્રકાશને તો સમજાતું જ ન હતું કે આ બધું શું થઈ રહ્યું છે! થોડીવારમાં જ ગાડી પ્રકાશના એ જ આલીશાન બંગલા આગળ આવીને થોભી, જ્યાં પ્રકાશ પહેલા રહેતો હતો. ચોકીદારે બંગલાનો જાંપો ખોટ્યો અને જગરે ગાડી પોર્ચમાં ઊભી રાખી અને પ્રકાશને કીધું કે ભાઈ ઉત્તર ગાડીમાંથી...’

પ્રકાશ ફાટી આંખે બધું જોઈ રહ્યો હતો. જગર એને અહીં કેમ લઈ આવ્યો તે વિશે આગળ વિચારે તે પહેલા જગરે બંગલાની ચાવીઓ પ્રકાશના હાથમાં મૂકી દીધી. અને કહ્યું કે, તમારા ઘરમાં પ્રવેશ કરો. બીજી વાતો અંદર જઈને કરીશું. પ્રકાશ તેની પત્ની અને પુત્રી સાથે ઘરમાં પ્રવેશ્યો. અને ઘરમાં પગ મૂકતા જ જૂની યાદો તાજી થઈ ગઈ અને તે ચોધાર અંસુએ રીતી પડ્યો. જગરે તેને શાંત પાડ્યો અને પછી કહ્યું કે હવે તમારે અહીં જ રહેવાનું છે. આ ઘર હવે તમારું જ છે. અને સાથે સાથે થોડાક પેપર્સ પણ પ્રકાશના હાથમાં આપ્યા અને કહ્યું, ‘જે તારી કંપની હતી, તે જ કંપનીનો હવે તું ફરીથી માલિક બની ગયો છે. ચાલ હવે નવેસરથી નવી સફરની શરૂઆત કર...’

પ્રકાશ પાસે કોઈ શબ્દો જ ન હતા. આ બધું તેને એક સ્વખ જેવું લાગતું હતું. તેણે જગરને પોતાની પાસે બેસાડ્યો અને પૂછ્યું કે, ‘આ બધું કેવી રીતે થયું? મને તો કંઈ જ સમજાતું નથી. તું કંઈક કહે તો મને ખબર પડે.’

ત્યારે જગરે કહ્યું કે, ‘જ્યારે થોડાક વરસો પહેલા આપણી કંપની ખોટમાં ગઈ હતી ત્યારે મને બીજી કંપનીમાંથી ઓફર આવી હતી. પહેલા તો મેં વિચાર્યુ કે હું મારા ભાઈબંધને મુસીબતમાં એકલો મૂકીને ક્યારે પણ નહીં જાઉં. પરંતુ પછી મેં નક્કી કર્યું કે હું ભાઈબંધને તેના મુકામે પાછો લાવીને જ રહીશ. અને તે સાથે મેં એક નિર્ણય લીધો અને જે કંપનીમાંથી ઓફર આવી હતી ત્યાં જોડાઈ ગયો. થોડા જ સમયમાં એ કંપનીની શાખા વિદેશમાં ખૂલ્લી રહી હતી અને મને ત્યાંનો ચાર્જ સોંપવામાં આવ્યો. હું વિદેશ જઈને વસી ગયો. ત્યાં ખૂબ મહેનત કરી. ખૂબ કામ કર્યું અને ખૂબ પૈસા કમાયો અને જ્યારે તારો બંગલો અને તારી કંપની ખરીદી શર્કું તેટલા ડોલર કમાયો ત્યારે ભારત પાછો આવ્યો અને મોં માંગી કિંમત આપીને મેં તેને પાછા ખરીદી લીધા. અત્યાર સુધી મેં જેના માટે આકરી મહેનત કરી હતી, તે કામ હવે પૂરું થયું. હવે હું ક્યાંય પાછો જવાનો નથી. તારી સાથે જ રહેવાનો છું. આપણે બંને સાથે મળીને કંપનીને પાછી

ઓંયાઈના શિખરો ઉપર લઇ જઇશું. પ્રકાશ ઉભો થઈને જીગરને બેટી પડ્યો. જીગરે ખરા અર્થમાં તેની દોસ્તી નિભાવી હતી.

આ તો બંને પાક્કા મિત્રો હતા અને મિત્રએ મિત્રની મદદ કરી હતી. આવા મિત્રો કોઈક નસીબદારના નસીબમાં જ હોય છે. પરંતુ મદદ, એ ખરેખર કરવા જેવું કર્મ છે અને નિભાવવા જેવો ધર્મ છે. માણસ જીજાની મદદ કરીને ખરેખર તો પોતાની જ મદદ કરતો હોય છે. કવિશ્રી કરશનદાસનું એક અદ્ભુત કાવ્ય છે, જેની રચના આ પ્રમાણે છે :

જીવન અંજલિ થાજો  
મારું જીવન અંજલિ થાજો.

ભૂખ્યા કાજે ભોજન બનાજો, તરસ્યાવું જળ થાજો  
દીન-હૃદિયાના આંસુ લૂધણાં, અંતર કદી ના ધરાજો,  
મારું જીવન અંજલિ થાજો!

કવિશ્રી આ પંક્તિ દ્વારા જીણવવા માંગે છે કે જીવનને અંજલિસ્પ બનાવવું હોય તો દુઃખીઓની મદદ એ જ એક ઉતામ માર્ગ છે.

માનવસેવા એ જ પ્રભુસેવા છે. ઘણા લોકો આખો દિવસ પ્રભુ સામે બેસીને માળા જપતા હોય છે પણ આંગણો આવેલા ભિખારીને બટકું રોટલી આપતા નથી. ભગવાન પાસે છિપ્પનભોગ ધરાવે છે પણ કોઈ અનાથને અનાજ આપતા નથી. ઈશ્વરની મૂર્તિની પૂજા કરે છે પણ કોઈ બીમાર કે વૃધ્ધની સારવાર કરવાનો જરાપણ ટાઈમ નથી. તો આવી પૂજાનો કોઈ અર્થ નથી. ઈશ્વર સમક્ષ બેસી રહેવા કરતાં કોઈ જરૂરિયાતમંદની મદદ કરવી એ વધારે મહિંયનું છે. માનવીની મદદ, એ જ ઈશ્વરની સાચી પૂજા છે. મદદ કરનારાના હાથ સૌથી પવિત્ર હાથ છે. તમે બીજાને મદદ કરશો તો ઈશ્વર તમને મદદ કરશો. મદદ કરવાથી માનસિક શાંતિ મળે છે. લાંબી જિંદગી કરતા મદદ માટે ખચિયેલી ટૂંકી જિંદગી વધારે સાર્થક છે. સાચા મદદગારને નામ અને કીર્તિ સાથે કોઈ જ નાતો નથી હોતો કે તેને તેનો મોહ પણ નથી હોતો. મદદની જરૂરિયાતવાળા માનવી માટે તો મદદગાર માનવી જ ઈશ્વર છે. તમે કોઈને મદદ કરો એટલે કાંઈ એના માલિક નથી બની જતા. મદદ કરીને પછી ભૂલી જવાની ચીજ છે. અભિમાન રાખવાથી મદદનું મૂલ્ય કોડીનું થઈ જાય છે. તમે બીજાને મદદ કરશો તો ઈશ્વર તમને મદદ કરશો. દૂર રહીને કોઈના ભલા માટે ગ્રાર્થના કરવી, એ પણ એક જાતની મદદ જ છે.

મદદ એ મહાનતાની નિશાની છે.

૪૦૨, મૌખ ગ્રેસ એપાર્ટમેન્ટ, કિનારીવાલા બિલ્ડિંગની બાજુમાં,  
ક.પી. વિદ્યાલયની સામે, ગુલબાઈ ટેકરા, આંકુ સી.જી. રોડ,  
અમદાવાદ-૩૮૦ ૦૦૬. મો. ૯૮૨૫૧ ૫૫૫૫૩

### મૃત્યુની પરિવર્તનશીલતા

(અનુસંધાન : પાના નં. - ૨૯ ઉપરથી ચાલુ)

પરમાત્માને પ્રાસ કરવાનો સીધો માર્ગ છે મનને અહીંથી ઉપાડીને ત્યાં રોપી દેવું. મનથી નિઃસંગ રહેવું અતિ ઉત્તમ મનાય છે. અજાગ્રત દશામાં આપણે એકવાર મનના સ્વરૂપમાં સહેજ પણ ભણ્યા પછી તો તે આપણને ભેળવી દીધા વિના રહેતું જ નથી. તેથી મનમાં ઉઠઠી દરેક વૃત્તિ તરફ જાગ્રત રહેવું.

“Eternal Vigilance is the price of Freedom” અવિરમ સજાગતા મુક્તિની કિમત છે.

આપણી યોગી કેનશિન કહે છે, “જે જીવને ચોંટી રહે છે તે જ મરે છે.” (Those who cling to life die) અને જે મૃત્યુની અવજા કરે છે તે જીવે છે (And those who defy death live). આ બધી જ મનની રમત છે. મનમાં ઊંડા ઉત્તરતાં જણાય છે કે આપણી પાસે કંઈક એવું છે જે જન્મ-મરણની પર છે. સમાધિની અંતદાસનું આ સત્ય છે.


ઇન્દ્રિય બોધની પેદે પાર જે ગૂઢ તત્ત્વ છે, તે મૃત્યુના હવાલામાં છે. જે કોઈ માનવી મૃત્યુ પાસેથી એ રહસ્યને ઝૂંટવી શકે છે તે મૃત્યુનો પડદો ચીરી હસતો હસતો પરમપદને પામે છે. જીવન આપણને જે દ્વાર પાસે દોરી જાય છે એ દ્વાર છે મૃત્યુ. ત્યાં જીવનની ફસલની લણણી થાય છે. જીવનના ભરતકામમાં મૃત્યુ એક અનિવાર્ય અને ઉપયોગી દોરો છે.

એમ કહેવાય છે કે, ‘મન હોય તો માળવે જવાય.’ પણ મન ન હોય તો મોક્ષ પમાય. મન એટલે બંધન, અ-મન એટલે મોક્ષ.

બુદ્ધે કહ્યું છે : “આકાશમાં વિહરો કે સમુક્રની મધ્યે ચાલ્યા જાવ, કોઈ પર્વતની ટેકરીના એકાંતમાં જાઓ, આખી દુનિયામાં કોઈ એવી જગ્યા નથી કે જ્યાં ડિલા રહેવાથી તમે મૃત્યુની જાળમાંથી ભચી શકો. મૃત્યુ અવશ્યંભવી અપરિહાર્ય છે.”

આવતીકાલમાં રહેનાર માટે મૃત્યુ છે જ. પ્રામિની તૃષ્ણા ધરાવનારને મૃત્યુ શી રીતે છોડો? જે માનવી આ જીવંત ક્ષણમાં જ પરિપૂર્ણ જીવનને જીવે છે તેને માટે મૃત્યુ નથી. જ્ઞાનીઓ આપણને મૃત્યુ સાથે જીવવાનો બોધ આપે છે. તેઓ જણાવે છે કે સ્મૃતિનું પરિમાર્જન કરવું એટલે મૃત્યુ સાથે જીવવું. વાસ્તવમાં મૃત્યુમાંથી અમૃત તરફ ગતિ કરવા માટે આપણા આંતરચક્ષુ ખોલવા રહ્યા. અંત સમયની સાધના માટે જીવનમાં સવેળા જાગૃત થવાથી મનુષ્ય જન્મ સફળ થઈ જાય. જે પ્રકાશ અનાદિકાળથી આપણી અંદર છે તેને અંતરચક્ષુ ખોલીને નિહાળવાનો છે. મિસરવાસી હેરોફિન્ટ લખે છે : “The Light is withing Thee; Let the Light Shine” પ્રકાશ તારી અંદર છે, પ્રકાશને પ્રકાશવા દો.


“સહજાંદ”, દ/અ, લીમડા લેન,  
શ્રી સ્વામિનારાયણ વિદ્યાલય રોડ, સંકાર નગર,  
મુજાફાની, કાશી-૩૭૦ ૦૦૧. મો. ૯૮૨૫૧ ૫૫૫૫૩



વાતાં

મરક મરક કથા

## કોરોનાના ફળ મીઠા — જરૂર



બલવીરસિંહ જાડેજા

(પોઝિટિવ થીન્કિંગ : “ડિસેમ્બર ૨૦૨૦ સુધીમાં ભારત દેશ કોરોના કે કોવિડ-૧૯ મહામારીનો સામનો કરીને દેશમાં કોરોના વાયરસને મહાત આપી, સંપૂર્ણ કોરોના મુક્ત બની, હુનિયાને આવી મહામારીને નાથવાની રાહ થીએ” — એ અભિયાન સાથે માણ્ણો સાથેની મરક મરક કથા.)

અમારો પરમ મિત્ર મનસુખ ઉછ્વેષ જરૂર (‘જરૂર’ એનું તકિયાકલામ છે) આશાવાદી ઘણો. ડોક્ટર બનવું એટલે બનવું. પણ અંગ્રેજી - ગણિત - વિજ્ઞાનમાં બહુ ચાંચ દૂબે નહીં. છેવટે ડોક્ટરને બદલે વેટરનરી ડોક્ટર પણ નહીં છેલ્લે લાઈસસ્ટોક આસિસ્ટન્ટ બન્યો. છતાં મેં અને ભરતે એને ડોક્ટર તરીકે પ્રાણ્યાત બનાવવા બીજું જરૂર્યું.

મારી, ભરત અને મનસુખની ત્રિપુટી. એકડા-બગડિયાથી લઈને મેટ્રિક સુધી એક પાટલીએ બેસી ભજ્યા. મનસુખ ખેડૂતનો દીકરો, હું મામાના ઘરે મોસાળમાં જન્મીને મોટો પણ થયો અને પરણીને સ્થાયી પણ અહીં જ થયો. એટલે જન્મથી જ જિલ્લા આબાનો “ભાણુભા.” એટલે ભાણુભા તરીકે જ ઓળખાઉં. કદાચ મારા ઘરના સત્યો સિવાય કોઈને મારું સાચું નામ પણ યાદ નહીં હોય એવો ભાણુભા નામનો પ્રતાપ. રહેવાનું શહેરમાં અને બાજુના ગામમાં મામાની જેતી સંભાળવાની. ભરત જિલ્લાની કો.ઓ. બેંકની, શહેરની બ્રાંચમાં જ નોકરી મળતાં, લાગી ગયો. એટલે અઠે દ્વારકા. મનસુખ રાજ્યમાં સરકારી નોકરીમાંથી લાઈફ સ્ટોક આસિ. તરીકે રીટાઇફ થયો એટલે આ તાલુકાના શહેરમાં જ પણ દવાખાનું ખોલવા મેં ને ભરતે સમજાવ્યો ત્યારે માન્યો ને કહે, ... “જરૂર” પણ દવાખાનું ખોલવું કઈ જગ્યાએ?” હું અને ભરત એને ડોક્ટર તરીકે પ્રસ્તાવિત કરવા દ્રઢ નિશ્ચયી હતા એટલે એનો ઉકેલ પણ શોધી લાવ્યા.

અમારા તાલુકાનું શહેર, રાજ્યશાહી વખતે, પંચરંગી જ્ઞાતિઓની વસ્તી ધરાવતું શહેર હતું. એક કંસારા જ્ઞાતિની વાડી તળાવ કાંઈ એક ઓરડી અને ઘોડા સૂરા-પૂરા, સૂરધન દાદાના પાળિયાઓ અને મોટું કમ્પાઉન્ડ. જેમાં ચાર પાંચ લીંબડા - પીપળાના જાડ. જ્ઞાતિના માંડ બે પાંચ ઘરો અહીં રહી ગયા. બાકી બધા ધંધાર્થી બધાર ગયેલા. આ જગ્યા અમને મનસુખના દવાખાના માટે આઈડિયલ લાગી, ને મળી પણ ગઈ સાવ મહિતમાં. ઓરડીમાં ઓફિસ રાખવાની ને સાફ્ફ-સફાઈ

રાખવાની, જેથી બહારગામથી નવા જન્મેલા જ્ઞાતિના બાળકોની બાબરી કે નવા પરણેલા વર-વધુ પગે લાગવા આવે ત્યારે સાફ્ફ-સફાઈ કરવાની ન પડે. એટલે સાફ્ફ-સફાઈ કરવાની એ જ ભાડું. વળી કમ્પાઉન્ડમાં જાડનો છાંયો એ મનસુખના દર્દીઓ (પશુઓ) નો વેઈટિંગ રૂમ. વાહ ભાઈ વાહ, અમે તો બોર્ડ લગાવી દીધું.

ડૉ. મનુભાઈ જરૂર (પશુરોગોના નિષ્ણાત)

(RLSA) Mob. No. 94984 74864

હવે ભૂતોભાઈ જાણો કે RLSA કઈ ડિચી છે. અમને ત્રણ ભાઈબંધને જ ખબર (રીટાઇફ લાઈફ સ્ટોક આસિસ્ટન્ટ). શહેર અને તાલુકાના પણ ધરાવનાર ખેડૂતો - માલધારીઓને લોકલ ચેનલ મારફત ઉદ્ઘાટનનું આંત્રેણ આપી ઉદ્ઘાટન વખતે સામેવાળા મેરાભાઈની અડધી ચા થી સ્વાગત કર્યું અને દરેકને ગામેગામમાં વહેંચવા નાના ચોપાનિયા રવાના કર્યા : “આનંદો... આનંદો... હવે તમને તમારા વહાલા પશુઓની સારવાર માટે કયાંય જવાની જરૂર નથી. અહીં જ હાજર છે ડૉ. મનુભાઈ જરૂર.”

ઉદ્ઘાટનમાં તો ચા પીવા પશુના માલીકો ઉપરાંત પશુઓ વિશે કક્કોય ન જાણનાર ઘણાય આવ્યા. પણ અઠવાડિયું વિસ્તુ તોય એકેય દર્દી (પણ) મનુભાઈના દવાખાને ડોકાયું નહીં. છેવટે મેં ને ભરતે, મિત્રભાવે મનસુખનો ઉત્સાહ ટકાવી રાખવા ઘોડાગાડીવાળા અબુલને ઘોડા માટે દસ રૂ. ૨૪કો - ગદબ ખવડાવવા આપીને ઘોડો લઈને મનસુખ પાસે પ્રથમ દર્દી તરીકે મોકલ્યો. દસ રૂપિયા વધારાના મનસુખની ફી માટે પણ આયા.

‘આવો, આવો અબુલભાઈ... શું થયું તમારા ઘોડાને?’ ‘આમ તો બધું બરાબર છે સાહેબ, પણ હમણાં હમણાં એના આચાર ઠીક નથી લાગતા.’ ‘કાં, શું કરે છે?’

‘આજકાલ સ્ટેશને લઈને જાઉ ત્યારે ટ્રેનમાં ઉત્તેલા પેસેન્જરોમાં બાઈયું હામે બહુ તાકે છે.’

(તારી ભલી થાય અબુલ! ઘોડો બરોબર ખાતો નથી કે એવું કાંઈક કહેવાને બદલે, અમને શું ખબર, તું આવું બોલીશ?)

‘કાંઈ વાંધો નહીં, હમણાં એની આંખ જોઈ લઉં.’

મનસુખે ઘોડાના ડાબલા ઉતારી એની આંખો પાણીથી ધોઈ - લૂછી, ઘોડા ઉપર હાથ ફેરવી હેત કર્યું ને બોલ્યો, ‘જરૂર.’ ‘શું જરૂર?’ અબુલને કાંઈ સમજાયું નહીં એટલે પૂછ્યું.

‘અરે એની આંખ થોડી નબળી પરી ગઈ છે. લ્યો, આ વિટામિનની ગોળીઓ. દસ દિવસ સુધી એક એક ખવડાવજો એટલે જરૂર સાજો થઈ જશે.’

‘પૈસા?’

‘અરે આના તે કાંઈ પૈસા હોય? કોઈક દિવસ મને સ્ટેશને જવાનું હોય તો બેસાડી જજો, બસ.’

અખુલે પડધો પાડ્યો, ‘જરૂર.’

અમે આપેલા ફી પેટેના પૈસાનો પણ અખુલે રજકો લઈ, ઘોડાને ખવડાવી દીધો.

હવે આવા શહેરમાં મનસુખની પ્રેક્ટિસ ક્યાંથી ચાલે? પણ... પણ... એમાં આવ્યો આ કોરોના.

અમારા શહેરના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર રાઠોડ સાહેબ શહેરમાં રાઉન્ડમાં નીકળ્યા ને એમને મનસુખના દવાખાનાની જગ્યા ગમી ગઈ. બોર્ડ ઉપર નંબર જોઈ ફોન લગાવ્યો. ‘ડૉ. મનુભાઈ, પોલીસ ઈન્સ્પેક્ટર રાઠોડ બોલું છું.’

‘બોલો, બોલો, સાહેબ, શું કામ પડ્યું મારું? આપના પાળીતા કોઈ કૂતરા-બિલાડી બીમાર છે કે આપના રાતે રોનમાં ફરી ચોકી કરતા ઘોડેસવારના ઘોડાને કાંઈ થયું છે?’ મનસુખે અતિ ઉત્સાહમાં ઘણું બધું પૂછી લીધું.

‘અરે ડૉક્ટર, કોઈ બીમાર નથી પણ તમે અહીં તમારા દવાખાને જલ્દી આવી જાવ, કામ છે.’

‘જરૂર’ કહીને મનસુખે એનું જૂનું લ્યુના ઉપર પલાણ કર્યું. લોકડાઉન કફ્ફયું હતો છતાં મોં પર માસ્ક લગાવી ભાગ્યો. ઘર અને દવાખાના વચ્ચેના દર ચાર રસ્તે પોલીસોએ રોક્યો. ‘ક્યાં જાઓ છો? કોણ છો? બબર નથી કફ્ફયું છે?’ ‘અરે, તમે મને ઓળખતા નથી. હું ડૉ. મનુભાઈ. તમારા રાઠોડ સાહેબે જ મને બોલાવ્યો છે. મારું ખાસ કામ છે, એમને. કેમ રોકો છો? કરું એમને ફોન?’

‘ના... ના... સાહેબ, જાઓ... જાઓ...’ ‘જરૂર’ કહીને ડૉ. મનસુખ દવાખાના પાસે ઉભેલી જીપ પાસે પહોંચ્યો.

‘સાહેબ, હું ડૉ. મનુભાઈ.’

‘ઓહો..હો... આવો, આવો...’ રાઠોડ સાહેબે વી.આઈ.પી.ની જેમ આવકાર આપ્યો. મનસુખને તો મનમાં ગલગલીયા થવા લાગ્યા. ‘ડૉક્ટર સાહેબ, તમારા જેવું એક કામ છે.’ ‘જરૂર. હુકમ કરો, સાહેબ.’

‘આ તમારા દવાખાનાની જગ્યા ખૂબ સરસ અને અનુકૂળ છે. આપણું પોલીસ સ્ટેશન શહેરની એક બાજુ છે એટલે આ કફ્ફયું - લોકડાઉનમાં પહેરો ભરતા સ્ટાફ માટે અહીં ટેન્ટ લગાવીએ. જેથી વારાફરતી ડ્યુટી કરનારને અહીં આરામ થઈ શકે અને અહીંથી બધે દેખરેખ પણ રાખી શકાય. બોલો, વ્યવસ્થા થઈ શકે?’

‘જરૂર સાહેબ, પણ...’

‘ચિંતા ના કરો. અમે સરકારશી તરફથી ભાડું મંજૂર કરાવીને રૂ. ૧૦૦૦/- મહિનાનું ભાડું પણ અપાવીશું.’

ડૉ. મનુભાઈને તો મોં ખોલતા પતાસું આવી પડ્યું. એને કહેવું હતું કે, ‘મને દરરોજ આવવાની છૂટ આપજો ને ઓફિસમાં બેસવા દેજો.’ એ તો પાછળથી રાઠોડ સાહેબે સામેથી કહ્યું, ‘ભલે ને તમે આવીને અહીં બેસો, અમને વાંધો પણ નથી. તમે તમારો કામ ધંધો ચાલુ રાખો. બસ, તમને છૂટ છે.’

ઈન્સ્પેક્ટરના શબ્દો ‘કામધંધો ચાલુ રાખો’ શબ્દોએ ડૉ. મનુભાઈના વિચારના દ્વાર ખોલી નાખ્યા. આમેય દવાખાનાનું બે મહિનાથી ચાલુ કર્યા પછી ક્યાં કોઈ દર્દી આવતા હતા ને હવે લોકડાઉનમાં દર્દી (પશુ) ક્યાંથી આવે?

એકાદ મહિનો સતત વિચાર્યા પછી, પ્રધાનમંત્રીશ્રીના શબ્દો ‘આકૃતને અવસરમાં ફેરવો’ માટે વિકલ્પો વિચાર્યા પછી એના મગજમાં ધીરે ધીરે થતી મરક્યુરી લાઈટ થઈ. બાબા રામદેવને આદર્શ માની પ્રેરણ લઈને ડૉ. મનુભાઈએ નવા ધંધામાં ઝુકાવ્યું.

આમેય બેદૂત હોવાથી બે-ચાર ગાયો, વાછરડા તો ઘરે હતા જ. સામે ચાની ડિટલી ચલાવતા મેરાભાઈ પાસે પણ આઈ-દસ ગાયો હતી. સગાસંબંધી બેદૂતો પાસે પણ ગાયોની સંખ્યા ઘણી હતી. સૌપ્રથમ શહેરમાં વસતા એકમાત્ર ભંગારના વેપારી બાબુલાલ મારવારીના ઘરે ડૉ. મનુભાઈએ વિઝીટ કરી.

‘ઓહોહો... આવો... આવો... મનુભાઈ. આવા ટાણે તમે? અમારા ઘરે ક્યાંથી?’ ‘જરૂર’ કહીને મનુભાઈએ લગભગ મફતના ભાવે કે પૈસા છ મહિના પછી આપવાની શરતે પ્લાસ્ટિકના જૂના કેરબા, ડોલો, કાચ અને પ્લાસ્ટિકની નાની-મોટી બાટલીઓ જે સારી કન્ડિશનમાં હોય એટલી બધી ભેગી કરી, ઘરે પહોંચાડી. સાથે ભડોલા એકમાત્ર હુકાન ધરાવતા કનુ કંસારાનું ઘરનું બારણું ખોલાવી હોલાવી, બે મોટા એલ્યુમિનિયમના તપેલા લીધા. ઘરે ગાયો - બળદ હોવાથી ઘરમાં ગોબર ગેસનો ખ્લાન્ટ તો પહેલેથી જ હતો. ચંપા ભાભીને ખાનગીમાં કહ્યું, ‘જો કોઈને કહેતી નહીં આપણે નવો ધંધો કરવાના છીએ. હું કહું તેમ તારે કરવાનું છે.’ કહીને આખો પ્લાન સમજાવ્યો. એક તપેલામાં પાણી ઉકાળી કેરબા - ડોલો - બાટલીઓ ગરમ પાણીથી ચોખા કર્યા પછી ડોલો અને કેરબા લઈને મનસુખ ઉપજ્યો ગાયોવાળાને ત્યાં. ‘આ કેરબા ડોલોમાં ગોમૂત્ર ભેગું કરી રાખજો. હું જાતે આવીને લઈ જઈશ.’ આમ ગોમૂત્ર ભેગું કરી ચોખા કરી, મનસુખે લાવેલા એક ભાગમાં જરૂર મુજબ લાઈફબોય સાબુ અને બીજા ભાગમાં લક્સ - હમામ જેવા મોંઘા સાબુ ઓગાળી ગોમૂત્રને સુગંધી બનાવ્યું. ‘જરૂર

રેઝયુલર' અને 'જરૂર સુપર' હેન્ડવોશની બાટલીઓ ભરી, તૈયાર કરી. જોકે ગોમૂત્ર આપનારને મનસુખ ભૂલ્યો નહોતો. સૌને ફી નિફિટ હેન્ડ વોશ જરૂર પહોંચાડતો અને ગોમૂત્ર લઈ આવતો.

હું અને ભરત કેટલાય સમયથી મિત્ર મનસુખને મળ્યા નહોતા. પણ જ્યારે પણ ફોન કરીએ, 'હું કામમાં છું. પછી મળીએ જરૂર' કહીને અમને મળતો પણ નહીં કે વાત પણ કરતો નહીં. રાઠોડ સાહેબ અને પોલીસોની મહેરબાની, ને સૌને, પોતાના તરફથી મેરાભાઈને પણ કિટલી ચલાવવાની ગોડવણ કરી આપી હોવાથી, અદ્ધી ચા પીવડાવીને મનસુખે છુપા રૂસ્તમ બની ધંધો શરૂ કરી દીધો. કોરોના કાળમાં હેન્ડ વોશની સાવચેતી રૂપે આવશ્યકતા ને જરૂરિયાત વધી જતાં "જરૂર"ની ખપત જોતજોતામાં વધી ગઈ.

હું ને ભરત મિત્ર મનસુખને મળવા વાકુળ હતા. ને જેવું લોકડાઉન ખૂલ્યું કે વાત કરી હું ભરતના ઘરે મારા ઠાડિયા મોટર સાઈકલ લઈને માસ્ક પહેલાને પહોંચ્યો ને અમે મનસુખના ઘરે જવાનું વિચાર્યુ. ઘરે ગયા ત્યારે ઘર બંધ હતું. કોઈ દેખાયું નહીં. એટલે બાજુવાળાને પૂછ્યું કે 'ક્યાં ગયા બધા?' 'ભાષુભા તમને ખબર નથી?' 'ના.' 'એ તો દવાખાને ચંપાભાબી ને મનુભાઈ સવારના, હાથ ધોવાના પ્રવાહી, આ કોરોના માટે બનાવે છે.' હું ને ભરત તો એકબીજાની સામે તાકીને જોઈ રહ્યા ને ઉપડ્યા ડૉ. મનસુખના દવાખાને.

રસ્તામાં પહેલા જેમ સિનેમાના શો ની જાહેરાત - હાથ લારી - ધોડાગાડીમાં નીકળતી, એમ અમને અખુલની ધોડાગાડી સામે મળી. ધોડાગાડીની બંને બાજુ બોર્ડ ચિત્રરાવેલા વાંચવા મળ્યા : "દોડો... દોડો... દોડો... અનુભવી ડૉ. મનુભાઈ 'જરૂર'ની અનમોલ શોધ. કોરોના મહામારીને નાથવાનો સંપૂર્ણ અને સચોટ ઉપાય એટલે 'જરૂર હેન્ડવોશ.'" બે જાતમાં ઉપલબ્ધ : જરૂર રેઝયુલર અને જરૂર સુપર. 'પહેલા ઈસ્ટેમાલ કરો, પછી વિશ્વાસ કરો.' મળવાનું ડેકાણું : ડૉ. મનુભાઈ જરૂરનું દવાખાનું, કંસારા જ્ઞાતિની જૂની વારી, તળાવ કાંઠે."

અમને તો માન્યામાં નહોતું આવતું કે આ દોઢ મહિનાના લોકડાઉનમાં આ બધું શું થઈ ગયું!

જેવા ડૉ. મનુભાઈના દવાખાને પહોંચ્યા ને લાંબી લાઈન સોશિયલ ડિસ્ટન્સને ઘ્યાલમાં રાખીને ૧-૧ મીટરને અંતરે બનાવેલા કુંડળામાં લોકો થેલીઓ લઈને ઉભા હતા. અમે દૂરથી જોયું તો મનસુખ અને ચંપાભાબી નાની મોટી કાચ અને પ્લાસ્ટિકની બોટલો લોકોને આપીને પૈસા લેતા હતા અને લાઈન આગળ વધતી હતી.

અમારી સામે પણ જોવાની નવરાશ ન હતી. એટલે અમે સૌથી પહેલાં મેરાભાઈ ભરવાડની કિટલીએ જઈને મનસુખના ખાતામાં લખાવીને ચા પીધી.

અડ્ધા એક કલાકમાં તો મનસુખનો આજનો સ્ટોક ખલાસ થઈ ગયો. રહી ગયેલા, નિરાશ થઈને પાછા જતાં પહેલા મનસુખને રહી ગયેલાઓને પુંઠાના બનાવેલા વેઈટિંગ ટોકન આપી બીજે દિવસે સવારે સૌથી પહેલા હેન્ડવોશ આપવાની બાંહેધરી આપી રવાના કર્યા. પૈસા ગણીને નવરા થયેલા ચંપાભાબીએ મારી અને ભરત સામે નજર કરી, મનસુખને અમારા આવ્યાની જાણ કરી.

અમે તો જોઈ જ રહેલા. શું બોલવું, શબ્દો જડતા નહોતા. ચંપાભાબીએ મૌન તોડ્યું. 'આવો ભાષુભા - ભરતભાઈ. લ્યો પહેલા હાથ ધોવો' કહીને અમને જરૂર હેન્ડવોશથી હાથ ધોવડાવ્યા.

'આ બધો શું ચમત્કાર છે મનસુખ? કાંઈ કહે તો ખબર પડે અમને!' 'જરૂર. પહેલા નિરાંતે બેસો અને ચા પીવો.' મનસુખની પ્રગતિની ખુશીમાં ફરીવાર ચા પીધી.

**કોરોનાના ફળ મીઠા...** કહીને એશે અમને અથથી ઈતિ સુધી વાત કરી અને બોલ્યો, 'આ તો શરૂઆત છે, જુઓ આગે આગે હોતા હે ક્યા!' અમે બંને એકસાથે બોલી ઉઠ્યા, 'જરૂર.'


એ પછી તો ડૉ. મનસુખના દવાખાનાના મોટા કમ્પાઉન્ડમાં રાઠોડ સાહેબ ઈન્સ્પેક્ટરની મદદ અને સ્થાનિક ધારાસભ્યના સહકારથી, કામચલાઉ પચાસ બેડની કોવિડ-૧૯ની હોસ્પિટલની સુવિધા શરૂ થઈ અને હોસ્પિટલના ભાડા સાથે 'જરૂર' હેન્ડવોશનો ધંધો એવો તો જાય્યો, કે કોરોના ગયો, છતાં મનસુખના જરૂર હેન્ડવોશનો ધંધો - સાવચેત થઈ ગયેલા લોકોની જરૂરિયાતથી ધમયોકાર ચાલુ છે અને હવે તો એના જૂના લ્યુનાની જગ્યાએ નવું લેટેસ્ટ મોટર બાઈકનું મોડેલ પાર્ક કરેલું છે અને ડૉ. મનુભાઈ જરૂરની પશુ ચિકિત્સક તરીકેની પ્રેક્ટિસ, હોમ વિઝિટ પણ ચાલુ થઈ ગઈ છે. જેનો સૌથી વધુ આનંદ મને અને ભરતને છે.

હવે તો અમે દરરોજ સાંજે, હું ને ભરત ડૉ. મનસુખના દવાખાને અચૂક પહોંચીને, તે પણ માસ્ક પહેલીને, ને પહેલા જતાં જ 'જરૂર હેન્ડવોશ'થી હાથ ધોઈને કહીએ છીએ, 'મનસુખ દોસ્ત, ચા મંગાવ.'

'જરૂર' કહીને રાજકારણીને શરમાવે એવું મુત્સદીભરેલું હાસ્ય મોં પર લાવીને, હહહ...હહહ... કહીને ચા મગાવી અમને પાય છે ને અમે કોરોનાના મીઠા ફળ ભોગવીએ છીએ.

"વાત સાચી કે નહીં?" - જરૂર.

૧૨, ઘરાંગણ ફ્લેટ્સ, પ્રોફેસર કોલોની સામ્ય, વિજય ચાર રસ્તા પાસે, નવરંગપુરા, અમદાવાદ-૬.  
મો. ૮૮૨૫૭ ૦૦૦૬૬



સેલ્વૂટ

લાખુ



ડૉ. સુધીર ચી. મોડી

આટલા બધા વર્ષોની ફેમિલી ફિલ્મિશિયન તરીકેની પ્રેક્ટિસમાં જતજાતના દર્દીઓ અથવા માનવો જોયા છે — ઉમરમાં, દેખાવમાં અને વર્તનમાં. પરંતુ કોઈ દર્દી કાયમ સ્મરણપટમાં અંકિત થઈ જાય છે. ક્યાં તો દેખાવને કારણે, ક્યાં તો તેના વર્તનના કારણે. ઘણીવાર બાળક તરીકે આવેલો દર્દી એટલો સરસ દેખાવડો, નિર્દ્દિષ અને વહાલો લાગે. પરંતુ તે બાળક દર્દી થોડા વર્ષો બાદ યુવાન થઈને આવ્યો હોય ત્યારે ખૂબ જ બદલાઈ ગયેલો લાગે. કદમાં તો ખરો, પણ સાથે સાથે તેના સ્વભાવ, વર્તન અને બોલવામાં! આવી વાત સી દર્દીઓમાં પણ જોવા મળી. જેની આંખોમાં નિર્દ્રિષ્ટતા રમતી હોય, હસતી કૂદતી બાળકી ૧૫ વર્ષ બાદ ઠરેલ, કોલેજિયન તરુણી થઈને આવે. અરે! થનગનાં યુવાન કે યુવતી થોડા વર્ષો બાદ જમાનાની થખ્પડો બાઈને ગંભીર, પ્રૌઢ થઈને આવે. આ જ પ્રમાણે સુંદર સુખી જોહું, પતિનું અવસાન થતાં બહેન જિંદગીમાં રસ ખોઈ બેઠેલા અને સાદા વખોમાં આવે. અહો! કેટકેટલું જોયું.

**શું ઉંમર માણસને બદલતી હશે, કે શું સંભેગો માણસને બદલતા હશે? જે હોય તે, પરિવર્તન તો સ્વીકારવું જ રહ્યું.**

આજે સ્મરણપટ પર એક બહેન દેખાયા. લગભગ ૨૦ વર્ષ પહેલાની વાત છે. તે અર્પિતા બહેનની લગભગ ૨૫ (પચ્ચીસ)ની ઉંમર હશે. સારી ઊંચાઈ, સહેજ ઘઉંવર્ષો રંગ, સફાઈબંધ સાડી પહેરેલા. આપણને પહેલી નજરે જ સૌજાન્યશીલ લાગે. અર્પિતાબહેનને તપાસતા તેમના ચહેરાની બીજી બાજુ નજર ગઈ. અરે, આ શું? ચહેરાની જમડી બાજુ કપાળથી ગાલ પૂરો થાય ત્યાં સુધી લાખુ અને તે પણ ધેરા રંગનું. તરત જ રાજ ક્રૂરનું જાણીતું પિકચર ‘સત્યમ શિવમ સુંદરમ’ ચાદ આવી ગયું. જેમાં મુખ્ય અભિનેત્રીનો એક બાજુનો ચહેરો ખરાબ હતો.

અર્પિતાબહેન બે મહિનાથી નવરંગપુરામાં રહેવા આવ્યા હતા. સ્કૂલમાં શિક્ષિકા તરીકે સર્વિસ કરતા હતા. આચું કંઈક જોવામાં આવે અથવા સાંભળવા - અનુભવવામાં આવે ત્યારે થોડો સારો પરિચય થયા બાદ તેમના જીવનમાં રસ લેવાનું મન થાય. અલબંત તેમને માનહાનિ કે ખરાબ ના લાગે તે ધ્યાન રાખવાનું. પેશાન્ટો પણ જ્યાં મન મળી જાય કે વિશ્વાસ પડી જાય ત્યાં હિલ ખોલીને વાતો કરતા હોય છે.

તે પછી તો અર્પિતાબહેન અવારનવાર સારવાર માટે આવે ત્યારે વાતચીત થયા કરે. તેમને શિક્ષણમાં ખૂબ રસ. વિદ્યાર્થીઓમાં પણ પ્રિય.

એક વખત તેમના ચહેરા પરના લાખાની વાત નીકળી. ત્યારે

તેમણે કછું, બાળપણમાં મારી ખૂબ મશકરી થતી કે ચીડવતા પણ ખરા. મને ઘણો ગુર્સો આવતો. પરંતુ સ્કૂલમાં અને કોલેજમાં મને સારી બહેનપણીઓ મળી. માણસ એકલવાયો હોય ત્યારે ઘણો મુંજાય. પરંતુ સારો સાથ હોય તો ઘણો ફેર પડે. મન પણ આનંદમાં રહે. બીજું, યુવાન થઈ ત્યારે એક સારી સમજણ આવી ગઈ. અપંગ કે દિવ્યાંગને જોઉં ત્યારે સમજાય કે મને તેમના જેવી તકલીફ તો નથી! આ સમજણે મને ઘણી હિંમત આપી અને લઘુતાંગ્રંથિ (Inferiority) દૂર થઈ.

તેમના અનુભવો કહ્યા ત્યારે સમાજને ઓળખવાની સમજ આવી. તે કહેતા, કોઈ પણ વ્યક્તિ પહેલી વખત મળે ત્યારે મોં પર કાંઈ ના બોલે, પણ પાછળથી કહે, આનો ચહેરો કેવો છે? અને દયા ખાય. આ બધું સહન કરવાનું ઘણું અધરું છે. પરંતુ એકવાર સમજ આવી ગઈ એટલે હવે તો ગૌરવથી જીવું છું અને બાળકોને ભણાવું છું.

**આપણા સમાજમાં મોટા પર દચા ભતાવનારા હોય ત્યારે તે સમજતા નથી હોતા. ઘણી વખત તો અવ્યવહારુ, લાગણી દુભાય તેવા સવાલો પૂછતા હોય છે.**

એકવાર વાતવાતમાં પૂછ્યું કે, ‘તમને કોઈ ખરાબ અનુભવ થયો છે?’ તો કહે, ‘હા. ગયા વર્ષે જ એક પગે ખોડવાળો યુવાન આવ્યો હતો. અમારા કુટુંબે પહેલાથી જ જણાવ્યું હતું કે મોટા પર મોટો ડાઘ છે, છતાં આવ્યો હતો. અમારી મુલાકાત થઈ ત્યારે એવું ખરાબ વર્તન કર્યું કે માફ ના કરી શકાય.’

મારા માનબાપ મારી ઘણી ચિંતા કરે છે. પરંતુ મેં જણાવી દીધું કે હું સ્વાવલંબી થઈને રહીશ અને જીવીશ.

માનવ જ્યારે મનથી મક્કમ બની જાય ત્યારે તે દુનિયાની પરવા કરતો નથી.

તેમના ગયા બાદ મને પણ થયું કે ધન્ય છે, તેમની સમજણભરી જીવન જીવવાની દસ્તિ અને શિક્ષિકા તરીકે તેમને ગમતું કામ કરવાની ધગશને.

આવી બહેનોને જોઈને સલામ કરવાનું મન થાય છે.

શૂન્ય પાલનપુરીનો શેર છે :

“દર્દની લાગણીનાં ઘણાં રૂપ છે, માત્ર આંસુ જ હોવા જરૂરી નથી; સ્વિત થઈને ફરકતા હશે હોઠ પર, વ્યક્ત થઈ ના શકે એવા ગમ કેટલા?”

૩, સમૃદ્ધ કેપિટલ, આર્થિક ફ્લેટ પાર્સ,  
પાણીની ટાંકીવાળો રોડ, સાયન્સ સિટી રોડ,  
સોલા, અમદાવાદ-૩૮૦ ૦૬૦. મો. ૯૮૮૮૮૯ ૧૨૬૮૫

## વિવિધ માહિતી

સંકલન : દિનેશયંક જગ્યાવન શાહ

### ભારતનો રાષ્ટ્રધ્વજ

- આજના તિરંગા પહેલા કે વિવિધ અંધો ડઝન ડિઝાઇનોવાળા રાષ્ટ્રધ્વજ બની ચૂક્યા હતા અને ક્યાંક ક્યાંક ફરકાવાયા પણ હતા. પરંતુ સર્વસ્વિકૃતિ પામેલો એકમાત્ર ધ્વજ તિરંગો જ હતો. આંધ્ર પ્રદેશના સ્વાતંત્ર્ય સેનાની પિંગલી વેંકેયાએ તેને ડિઝાઇન કર્યો હતો.
- દર વર્ષે ૧૫મી ઓગસ્ટ અને ૨૬મી જાન્યુઆરીએ ફરકાવાતો ભારતનો રાષ્ટ્રધ્વજ આખા ભારતમાં માત્ર એક જ સ્થળે તૈયાર થાય છે. કણ્ઠિકના હુબલી શહેરમાં આવેલું કણ્ઠિક ખાદી ગ્રામોદ્યોગ સંયુક્ત સંઘ (KKGSS) ભારતમાં રાષ્ટ્રધ્વજ તૈયાર કરવાનો એકાધિકાર ભોગવે છે. ત્યાં તૈયાર થતા રાષ્ટ્રધ્વજ આખા દેશમાં અને પરદેશમાં આવેલી એલચી કચેરીઓ તથા પરદેશી ભારતીયો દ્વારા વપરાય છે. કેન્દ્ર સરકારના ખાદી અને ગ્રામ્ય ઉદ્યોગ કમિશને આખા દેશમાં માત્ર કણ્ઠિક ખાદી મંડળને જ રાષ્ટ્રધ્વજ તૈયાર કરવાની સત્તા આપી છે. તિરંગાના સર્જનમાં ૬૦ કરતાં વધારે જાપાની બનાવટના સંચાઓ પણ વપરાય છે.
- બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા પ્રમાણિત થાય પછી જ રાષ્ટ્રધ્વજને વેચાણમાં મૂકી શકાય છે. રાષ્ટ્રધ્વજની લંબાઈ - પહોળાઈ, કલર, મજબૂતી, ખાદીના તાણાવાળા વગેરે અંગેના ચોક્કસ નિયમો છે અને તેનું પાલન કરવું અધ્યરૂપ છે. માટે ગમે તે જગ્યાએ રાષ્ટ્રધ્વજનું ઉત્પાદન થઈ શકતું નથી. રાષ્ટ્રધ્વજ તૈયાર કરવાના વિવિધ ૧૦૦ જેટલા નિયમો છે, એ બધાનું પાલન કરવાનું કામ અત્યંત મુશ્કેલ છે. ભારતે રાષ્ટ્રધ્વજ અંગેના ધારાધોરણો માટે ૧૯૯૮માં ‘નેશનલ ફ્લેગ કોડ’ નામે કાયદો તૈયાર કર્યો હતો. ૨૦૦૮માં એ કાયદામાં કેટલાક સુધારા પણ થયા હતા.
- પહેલો રાષ્ટ્રધ્વજ છેક ૧૯૦૬માં કલકત્તાના શ્રીનપાઈ ખાતે ઉમ્મી ઓગસ્ટે ફરકાવાયો હતો. તેની ડિઝાઇન આજના ધ્વજ કરતા અલગ હતી.
- સૌથી મોટો રાષ્ટ્રધ્વજ મહારાષ્ટ્ર સરકારના કાર્યાલય પર ફરકે છે. ૨૧ ફીટ બાય ૧૪ ફીટનો.
- ૨૦૦૧ પહેલા સામાન્ય નાગરિકને વ્યક્તિગત રીતે રાષ્ટ્રધ્વજ ફરકાવવાની છૂટ ન હતી. પરંતુ ઉદ્યોગપતિ



નવીન જિન્દાવે કોર્ટમાં લડત આપી દેશના દરેક નાગરિકને ધ્વજ ફરકાવવાનો અધિકાર અપાવ્યો છે.

- ૧૯૫૭ના એવરેસ્ટ આરોહણ વખતે બ્રિટિશ અને નેપાળી ધ્વજ ઉપરાંત પૃથ્વીના સૌથી ઊંચા સ્થળે તિરંગો પણ લહેરાવાયો હતો. ૨૦૦૮માં ચંદ્ર પર મોકલાયેલા ચંદ્ર યાનના પડ્યે તિરંગો વિતરાયેલો છે. એપ્રિલ ૧૯૮૪માં રાકેશ શર્મા અવકાશમાં ગયા ત્યારે પણ તેમની સાથે તિરંગો હતો.
- કણ્ઠિકમાં બનતા કપાસ માટે જો કે બી.ટી. નસલના કપાસનો ઉપયોગ થાય છે. એ બી.ટી. કપાસનું બિયારણ અમેરિકાએ બનાવ્યું છે. એટલે કે ભારતનો રાષ્ટ્રધ્વજ પરદેશી કપાસમાંથી બને છે.

### આપણું રાષ્ટ્રીય પ્રતીક : અશોક સ્તંભ

ચલણી નોટો, સિક્કા, રાષ્ટ્રીય દસ્તાવેજો અને રાષ્ટ્રીય સાહિત્યમાં અશોક સ્તંભનું ચિત્ર જાણીતું છે. અશોક સ્તંભ બૌધ્ધ શિલ્પ છે. તેમાં ચાર દિશા તરફ મોં રાખીને બઠેલા ચાર સિંહ છે. દરેક સિંહની નીચે ૨૪ આરાવાણું અશોક ચક છે. ચારે ચકની વચ્ચેની જગ્યાએ વૃષભ, અશ્વ, હાથી અને સિંહ એમ ચાર શિલ્પો છે. ભગવાન બુધનો જન્મ થયો ત્યારે તેમની માતાને સ્વખનમાં હાથી દેખાયેલો. એટલે હાથી, બુધનો જન્મ વૃષભ રાશિમાં થયેલો એટલે વૃષભ, બુધે ગૃહત્યાગ વખતે કંથક નામના ધોડા ઉપર સવારી કરેલી એટલે અશ્વ – આમ ત્રણ પ્રતીકો ભગવાન બુધના જીવન સાથે સંકળાયેલા છે. ચોંધું શિલ્પ સિંહ જ્ઞાન અને શક્તિનું પ્રતીક છે. જ્ઞાન અને શક્તિના પ્રતીક સમા આ પ્રાચીન શિલ્પને રાષ્ટ્રીય પ્રતીક બનાવાયું છે. તેનો ઈતિહાસ પણ જાણવા જેવો છે.



ભારતમાં થઈ ગયેલા મૌર્ય વંશના સમાટ અશોકે ઈસવીસન પૂર્વે ઉજ સદીમાં ભારતમાં ધણાં સ્થળોએ અશોક સ્તંભ બંધાવેલા. ૪૦થી ૫૦ ફૂટ ઊંચા અને લગભગ ૧૦ ટન વજનના આ સ્તંભો હતા. નવાઈની વાત એ છે કે ૧૦ ટન વજનના આ સ્તંભોને બનાવ્યા પછી સેંકડો કિ.મી. દૂર લઈ જઈ સ્થાપવામાં આવેલા. હાલમાં ભારતમાં ૧૮ અશોક સ્તંભ બંધ્યા છે. આ સ્તંભો વારાણસી નજીક ચુનાર ખાતે બન્યા હોવાનું મનાય છે. ઉત્તર પ્રદેશના સ્વરનાથમાં આવેલા અશોક સ્તંભ અકબંધ અને સારી સ્થિતિમાં છે. દરેક સ્તંભ ઉપર બ્રાહ્મી લિપિમાં લખાણ કોતરેલું છે. મોટાભાગના સ્તંભો બિહારના સાંચી, છપરા, ચંપારણ ખાતે છે.

## ભારતની ખ્યાતપ્રાપ્ત વ્યક્તિઓના નામો અને તેમના કાર્યો

- ★ લિલુ અખંડાનંદ : ગુજરાતમાં સસ્તુ સાહિત્યની સ્થાપના કરી.
- ★ આલેભાઈઓ : બિલાઝિત આંદોલન ચલાવ્યું.
- ★ અશોક મહેતા : પાર્ટી સત્યાગ્રહમાં નેતાગીરી સંભાળી.
- ★ એની બેસન્ટ : થિયોસોફીકલ સોસાયટીની સ્થાપના કરી અને હોમરૂલ આંદોલનનાં અગ્રેસર નેતા રહ્યાં.
- ★ એ.આ. હુમ : ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના કરી.
- ★ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર : વિધવા પુનર્વર્ગનની હિમાયત કરી.
- ★ કનેયાલાલ મુનથી : ભારતીય વિદ્યાભવનની સ્થાપના કરી.
- ★ ગોલ્વેલકર : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરી
- ★ ગોપાળકૃષ્ણ ગોખલે : સર્વન્દ્રસ ઓફ ઇન્ડિયા સોસાયટીની સ્થાપના કરી.
- ★ ગાંધીજી : અસહકારનું આંદોલન, દાંડીકૂચ, હિંદ છોડો વગેરે અહિસક આંદોલનનો દ્વારા ભારતને આજાઈ અપાવી.
- ★ જયપ્રકાશ નારાયણ : ભારતમાં સમાજવાદી વિચારસરણીનો ફેલાવો કર્યો.
- ★ જવાહરલાલ નેહારુ : બિનજોડાણવાદી નીતિ અમલમાં મૂકી.
- ★ જીવરાજ મહેતા : ગુજરાતમાં દ્વિલક્ષી વેચાણવેરો દાખલ કર્યો.
- ★ જી.બી. કૃપલાની : પ્રજાસમાજવાદી પક્ષની સ્થાપના કરી.
- ★ જાર્સ્ટેસ રાન્ડે : પ્રાર્થના સમાજની સ્થાપના કરી.
- ★ કક્કર બાપા : હરિજનો માટેનાં સેવાકાર્યો કર્યા.
- ★ ડૉ. આંબેડકર : ભારતનું બંધારણ ઘડવામાં મહત્વનું યોગદાન આપ્યું.
- ★ ડૉ. આર.ડી. તાતા : ભારતમાં પોલાદ ઉદ્ઘોગની સ્થાપના કરી.
- ★ ડૉ. હાર્ટિકર : કોંગ્રેસ સેવાદળની સ્થાપના કરી.
- ★ શેરપા તેનસિંગ : માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ ભારતીય.
- ★ દયાંદ સરસ્વતી : આર્સમાજની સ્થાપના કરી.
- ★ ધોંડો કેશવ કર્મ : ભારતમાં મહિલા યુનિવર્સિટીની સ્થાપના કરી.
- ★ ગુલજારીલાલ નંદા : સદાચાર સમિતિની સ્થાપના કરી.
- ★ પોઢી રામુલ્લુ : આંધ્ર પ્રદેશની રચના માટે પ્રથમ શહાદત વહોરનાર.
- ★ ફાર્બસ સાહેબ : ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરી.
- ★ ભુવાભાઈ દેસાઈ : લાલ કિલ્વાનો મુકદમ્મો લડનાર વડીલ.
- ★ મદનમોહન માલવિયા : હિન્દુ યુનિવર્સિટીની સ્થાપના કરી.
- ★ મોટેગ્યુ ચેમ્સફર્ડ : દ્વિગૂઢી ધારાસભા શરૂ કરાવનાર.
- ★ મોલ્દી મિન્ટો : લઘુમતીઓ માટે અલગ મતદાર મંડળની રચના કરી.
- ★ માસ્ટર તારાસિંગ : અકાલી દળની સ્થાપના કરી.
- ★ રવીન્દ્રનાથ ટાગોર : શાંતિ નિકેતનની સ્થાપના કરી.
- ★ રાજા રામમોહનરાય : બ્રહ્મો સમાજની સ્થાપના કરી.

★ રાધાનાથ સિકાર	: માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ માપી.
★ વિનોબા ભાવે	: ભૂદાન અને ગ્રામદાન પ્રવૃત્તિ ચલાવી.
★ લોર્ડ રિપન	: ભારતમાં સ્થાનિક સ્વરાજની શરૂઆત કરાવી.
★ લોર્ડ ડેલહાઉસી	: ભારતમાં રેલવેની શરૂઆત કરાવી.
★ લોર્ડ મેકોલ	: ભારતમાં અંગ્રેજ શિક્ષણની શરૂઆત કરાવી.
★ લોકમાન્ય ટિળક	: બંગાંગની ચળવળ કરાવી.
★ ચર સેયટ એહેમદ	: મુસ્લિમ યુનિવર્સિટીની સ્થાપના કરી.
★ સરદાર વલ્લભભાઈ પટેલ	: બારડોલી સત્યાગ્રહના પ્રમુખ નેતા, દેશી રાજ્યોનું ભારતમાં વિલિનીકરણ કરાવ્યું.
★ સાને ગુરુજી	: આંતરભારતીની સ્થાપના કરી.
★ વીર સાવરકર	: હિન્દુ મહાસભાની સ્થાપના કરી.
★ સુભાગ્યંત્ર બોઝ	: આજાદ હિંદ ફોજની સ્થાપના કરી.
★ સ્વામી વિદ્યાનંદજી	: અમદાવાદમાં ગીતામંદિરની સ્થાપના કરી.
★ સ્વામી વિવેકાનંદ	: રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી.
★ શામણાસ ગાંધી	: આરજી હકૂમતની સ્થાપના કરી.
★ શ્યામપ્રસાદ મુખરજી	: જનસંઘની સ્થાપના કરી.
★ ડૉ. હેડગેર	: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો સક્રિય પ્રચાર કર્યો.
★ અરવિંદ ધોષ	: પોંડિયેરી આશ્રમની સ્થાપના કરી.
★ એમ.એન. રોય	: રેડિકલ ટેમોકેટિક પાર્ટીની સ્થાપના કરી.
★ શ્યામજી કૃષ્ણ વર્મા	: દુંગલેન્ડમાં કાંતિકારીઓની સંસ્થાની સ્થાપના કરી.
★ ડૉ. જગદીશચંદ્ર બોઝ	: વનસ્પતિમાં સંવેદના છે તેમ સાબિત કર્યું.
★ રામમનોહર લોહિયા	: પ્રજાસમાજવાદી પક્ષની સ્થાપના કરી.
★ ઈન્કુલાલ યાણિક	: ગુજરાતમાં મહાગુજરાતની ચળવળ ચલાવી.
★ ડૉ. વિકમ સારાભાઈ	: ભારતનો અવકાશ યુગમાં પ્રવેશ કરાવ્યો, પીઆરએલની સ્થાપના કરી.
★ શંકરાચાર્ય	: હિંદુ ધર્મનો પુનરુદ્ધાર કર્યો.
★ ડૉ. રવીન્દ્ર દવે	: લાઇફ લોંગ એજિયુકેશનની હિમાયત કરી.

## રેડકોસ શું છે?

દવાખાના કે હોસ્પિટલના ચિક્નો માટે લાલ ચોકડીનું નિશાન જાણીતું છે. પરંતુ 'રેડકોસ' નામની એક સંસ્થા પણ છે તે તમે જાણો છો? રેડકોસ સંસ્થા આંતરરાષ્ટ્રીય છે અને દુનિયામાં કોઈ પણ સ્થળે યુધ્ય થતું હોય ત્યાં ધાયલ થયેલા સૈનિકોની સારવાર માટે પહોંચી જાય છે. રેડકોસના ડોક્ટરો, નર્સો અને અન્ય સ્ટાફ હોય છે. તેમના પર હુમલો કરવામાં આવતો નથી. ૧૮૮૮માં ઓસ્ટ્રેલિયામાં યુધ્ય ચાલતું હતું ત્યારે સ્વિટ્ઝરલેન્ડનો એક બેંકનો માલિક હૈન્રી દૂનાન ત્યાં હાજર હતો. દૂનાનને દુઃખ થયું અને દયા આવી. તેણે સૈનિકોની સારવાર માટે કંઈક વ્યવસ્થા કરવા વિનંતી કરી. આ વિનંતીને ધ્યાનમાં લઈ ૧૬ દેશો આવી સંસ્થા માટે તૈયાર થયા અને રેડકોસ સંસ્થાની સ્થાપના થઈ. **રેડકોસના ડોક્ટરોને ચુદ્ધ મેદાનમાં જવાની અને ચુદ્ધ કેદીઓની છાવણીમાં જવાની છૂટ હોય છે.** તેઓ જે પ્રશ્નો પૂછે તેના જવાબો પણ આપવા પડે છે. રેડકોસની સંસ્થાએ કેટલાક નિયમો પણ બનાવ્યા. ઈ.સ. ૧૮૬૩ જુનિવામાં તેની સ્થાપના થઈ હતી. રેડકોસની સ્થાપના કરનાર દૂનાનને ૧૯૦૧માં નોબેલ ઈનામ એનાયત થયું હતું.

## ગુજરાતના પ્રસિદ્ધ સામાયિકો

૧. અક્ષમ વિજ્ઞાન	૪૧. યુગાન્તર
૨. અખંડ આનંદ	૪૨. યુવદર્શન
૩. અભિયાન	૪૩. યોજના
૪. અમૃતા	૪૪. રમકું
૫. આરામ	૪૫. રંગતરંગ
૬. ઉન્મૂલન	૪૬. રંગભૂમિ
૭. એકાંકી	૪૭. લોકનાદ
૮. કવિતા	૪૮. વિજ્ઞાનબંધુ
૯. કવિલોક	૪૯. વિજ્ઞાન ભિત્ર
૧૦. કુમાર	૫૦. વિશ્વ હિંદુ સમાચાર
૧૧. કૌમુદી	૫૧. વ્યાયામ
૧૨. ક્ષિતિજ	૫૨. શ્રી
૧૩. ખેલાડી	૫૩. સત્યપ્રકાશ
૧૪. ગુજરાત	૫૪. સબરસ
૧૫. ગુજરાત ટાઈમ્સ	૫૫. સમર્પણ
૧૬. ગુજરાત દર્પણ	૫૬. સમાચાર દર્પણ
૧૭. ગોળી	૫૭. સર્વોદય
૧૮. ઘરશાળા	૫૮. સંસાર
૧૯. ચાંદની	૫૯. સંસ્કૃતિ
૨૦. ચિત્રલેખા	૬૦. સાધના
૨૧. ચિત્રલોક	૬૧. સિનેસ્ટરાર
૨૨. જનકલ્યાણ	૬૨. સુવિચાર
૨૩. ઝગમગ	૬૩. શ્રી
૨૪. ધર્મલોક	૬૪. શ્રીજીવન
૨૫. ધર્મસંદેશ	૬૫. સ્વાધ્યાય
૨૬. નવિકેતા	૬૬. સ્કોપ
૨૭. નવજીવન	૬૭. હરિજનબંધુ
૨૮. નવનીત સમર્પણ	૬૮. હિંદુસ્તાન
૨૯. પગલું	૬૯. જીવનયજ્ઞ
૩૦. પરબ	૭૦. તાદર્થ
૩૧. પ્રવાસી	૭૧. ભવિષ્ય નિદાન
૩૨. ફાર્બેસ ગુજરાતી	૭૨. શહેરી
સભાનું ટ્રેમાસિક	૭૩. અલવિઆ
૩૩. બાલજીવન	૭૪. સફારી
૩૪. બાલમિત્ર	૭૫. હિન્દિયા ટુટે
૩૫. બાલ સંદેશ	૭૬. ધર્મધારા
૩૬. બુદ્ધિ પ્રકાશ	૭૭. નિત્ય સંસ્કૃતિ
૩૭. મહિલા જગત	૭૮. કચ્છશુદ્ધિ
૩૮. મિલાપ	૭૯. મંગલ મંદિર
૩૯. મુક્તિ	૮૦. લોહાળા પ્રકાશ
૪૦. યુગર્ધમ	૮૧. જ્ઞાતિ સેતુ
	૮૨. પાટીદાર સંદેશ

## ગુજરાતના નામાંકિત સમાચાર પત્રો

૧. ગાંધીનગર સમાચાર	૧૬. સૌરાષ્ટ્ર સમાચાર
૨. ગુજરાત સમાચાર	૧૭. સાંજ સમાચાર
૩. સંદેશ	૧૮. કાઠિયાવાડ
૪. જનસત્તા	૧૯. કેસરેહિન્દ
૫. જ્યાહિન્દ	૨૦. નયા પડકાર
૬. કચ્છમિત્ર	૨૧. ખેડા વર્તમાન
૭. ફૂલધાબ	૨૨. જન્મભૂમિ
૮. અકીલા	૨૩. જ્ય ભારત
૯. મુંબઈ સમાચાર	૨૪. વંદે માતરમ્
૧૦. ગુજરાતમિત્ર	૨૫. સમકાલીન
૧૧. ગુજરાત ટુટે	૨૬. સચરાચર
૧૨. પ્રભાત	૨૭. રખેવાળ
૧૩. લોકસત્તા	૨૮. દિવ્ય ભાસ્કર
૧૪. મુંબઈ વર્તમાન	૨૯. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા
૧૫. સમભાવ	૩૦. નવગુજરાત ટાઈમ્સ

## લોકોને તમારું શ્રેષ્ઠ આપો

લોકો સ્વાર્થી, કૃતભ અને વિવેકહીન છે.

છતાં તેમને ચાહે.

તમે અકારણ તેમનું ભલું કરો તો તમારા ઈરાદા વિશે શંકાશીલ બને છે.

છતાં તેમનું ભલું કરો.

તમે સફળ થશો તો ખોટા મિત્રો અને સાચા શત્રુઓ તમને આવી મળશે.

છતાં સફળતા હાંસલ કરો.

તમારું કરેલું સત્કાર્ય આવતીકાલે કોઈ યાદ ન પણ રાખો

છતાં પણ સત્કાર્ય કરતા રહો.

પ્રામાણિકતા અને નિખાલસત્તા તમને હાનિકારક સાખિત થશે

છતાં પ્રામાણિક અને નિખાલસ બનો.

સત્યનો પક્ષ લેવા જતાં ઘણા તમારા વિરોધી બનશે

છતાં સત્યના પક્ષે રહો.

જે સર્જન કરતાં તમને વર્ષો લાગ્યા હોય, તે કદાચ ક્ષણોમાં જ વિસર્જિત

થઈ જાય

છતાં સર્જન કરતા રહો.

દુનિયાને તમારું શ્રેષ્ઠ આપો અને દુનિયા તમને લાત મારે

છતાં તમારું શ્રેષ્ઠ આપવા તત્પર રહો.

## YOUTH CLUB : SOME GOLDEN RAYS....

When you are wrong  
and we surrender,  
it means we are honest.

When you are in doubt  
and we surrender,  
it means you are wise...

But when we are right  
and we surrender,  
it means we value relations.

Peace of mind is a beautiful gift  
which only we can give to ourselves  
just by expecting nothing from anyone  
even after doing everything for them.

Nothing in this world is good or bad.  
Our thinking makes it so.  
A knife is good when a surgeon uses  
it to save a life and  
bad when a terrorist uses it to kill.

The purpose of religion is to control  
yourself, not to criticize others.  
How much am I doing about my  
anger, attachment, hatred pride and  
jealousy? These are the things which  
we must check in our daily live!

- Dalai Lama

Life and Time are  
the worlds best teachers.

**Life teaches us the use of Time and  
Time teaches us the value of Life.**

Before you speak,  
let your words pass through  
three gates :  
Is it true? Is it necessary? It is kind?

**The happiness of your life  
depends upon  
the quality of your thoughts.**

*Presentation : Dinesh R. Mehta*

### જીવનનો રાહ

સહજ સ્વાર્થભરી આ હુનિયામાં ઉચ્ચ આદર્શો, સિદ્ધાંતો  
અને મૂલ્યો જીવની રાખવા ખૂબ અધરા છે.

ચતુર અને વ્યવહારદક્ષ ગણાતા લોકો કહે છે કે આ બધાં  
કહેવાતાં સદ્ગુણો તો હવે ઈતિહાસ થઈ ગયા. વેદિયાવેડા છોડો,  
વ્યવહારુ બનો.

પણ સત્યના આધાર વિનાનું જીવન હોઈ જ ના શકે.  
જીવનનું અસ્તિત્વ જ સત્ય, પ્રેમ, વિશ્વાસ અને પ્રાર્થનાના ચાર  
પાયા ઉપર ટકેલું છે.

મૂલ્યો અને સિદ્ધાંતો આકાશમાં ચમકતા તારા જેવા છે.  
એક સાહસિક સાગરખેડુ તોફાની સાગરનાં ઊંચા અફળાતાં મોઝાં  
ઉપર આમથી તેમ ફંગોળાતો આકાશના તારા જોઈને પોતાનો  
માર્ગ શોધી લે છે. એ જ રીતે આપણો ઉચ્ચ આદર્શની મદદથી  
જીવનનો રાહ નક્કી કરી શકીએ. એમ કરીને આપણા જીવનને  
પણ તારલાઓની જેમ ચમકાવી શકીએ.

- હેલન સ્ટેઇનર રાઈસ

### સૂર્ય બહાર ના ડોકાયો હોય!

જીવનમાં સુખ-દુઃખની  
તકદી-દ્વારાંયડી તો આવ્યા જ કરે.  
સુખ-દુઃખ, આનંદ-આંસુ,  
ખુશી-દર્દની ઘરમાળ ચાલ્યા જ કરે.  
બધા દિવસ એક સરખા હોઈ જ ના શકે,  
પણ હજુ સુધી એક પણ વાદળ એવું નથી બની શક્યું,  
કે જેમાં હંકાયેલો સૂર્ય બહાર ના ડોકાયો હોય!

ગમે તેવી મુશ્કેલીમાં પણ સદા હસ્તા રહો!  
જીવનની દરેક પળે ભગવાન તમારી સાથે જ છે  
તેમ દર્શાયે માનો! તમારો બોજો હળવો લાગશે!  
તમારો હસ્તા ચહેરો  
તમારી આસપાસનાં સહુને આનંદ આપશો!  
હસ્તા ચહેરાની સુંદરતા અને હુંક જેવું મૂલ્યવાન  
આ પણી ઉપર બીજું કંઈ જ નથી!

- હેલન સ્ટેઇનર રાઈસ

## આંજો કાગર

### ‘મંગલ મંદિર’નો વિશેષાંક

#### સંગ્રહ કરવા લાયક એક ઉત્તમ દસ્તાવેજ

શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદ દ્વારા માસ એપ્રિલ-૨૦૨૦થી જુલાઈ-૨૦૨૦ (સંયુક્ત) અંક એટલે “કોરોના સંકમણ : કોવિડ-૧૯” વિશેષાંક તરીકે તાજેતરમાં પ્રકાશિત થયેલ છે. આ વિશેષાંકના સંદર્ભમાં એટલું ચોક્કસ કહી શકાય કે તે માત્ર અંક નહીં પરંતુ એક અગત્યનો અને દરેક સ્થળોએ સાચવી રાખવા જેવો દસ્તાવેજ છે. આ માટે તેના તંત્રી મંડળને ખૂબ ખૂબ અભિનંદન ઘટે છે.

પ્રસ્તુત અંકમાં ખૂબ જ પરિશ્રમ વેઠીને સંપૂર્ણ-૧ માં કોરોના સંબંધી વિગત, લેખો અને માહિતી કાળજીપૂર્વક અને વ્યવસ્થિત રીતે આપવામાં આવી છે. આ પ્રકારની માહિતી અન્ય કોઇ મેગેજિનમાં જોવા મળવી મુશ્કેલ છે. જ્યારે સંપૂર્ણ-૨ માં આપવામાં આવેલ લેખો, માહિતી વગેરે ખરેખર રસપ્રદ અને અજોડ છે. દરેક લેખો ખૂબ પરિપક્વ છે. દરેક રચનાઓના વાંચનમાં એક નિજાનંદ અનુભવાય છે. સૌ રસ્શ વાચકવર્ગને વિવિધ પ્રકારના તમામ લેખો અને

રચનાઓ ગમી જાય તેવા છે. વિશેષાંકનું ટાઈટલ પણ ‘થીમ’ને અનુરૂપ સુંદર છે. પ્રસ્તુત મેગેજિનના છેલ્લા બે વર્ષથી ખૂબ સરસ અંકો પ્રકાશિત થઈ રહ્યા છે. તે પેકી ઉપરોક્ત વિશેષાંક એક અજોડ છે. એ કોરોના સંકમણનો સંગ્રહ છે. જેની વિવિધ માહિતી અને પ્રસ્તુતિ શ્રેષ્ઠતમ છે. આ વિશેષાંકમાં વિષય વૈવિધ્ય ઉપરાંત અન્ય વિશેષ માહિતીઓ, કાબ્યો, મુક્તકો, શેર-શાયરી વગેરે પણ દસ્તિગોચર થાય છે. જે દરેક પ્રસ્તુતિ પાછળ તંત્રી મંડળના દિનેશ આર. મહેતાની મહેનત કાબિલેદાદ સમાન છે. દરેક લેખોના લેખકશ્રીઓને પણ અભિનંદન. ફરીને, આ પ્રકારના વિશેષ, શ્રેષ્ઠ વિશેષાંકની પ્રસ્તુતિ બદલ ધન્યવાદ.

**ચંદ્રકાંત દામજી શાણ (કે.ડી. શાણ) - અમદાવાદ  
મો. ૯૪૨૭૩ ૬૦૦૦૭**

### ‘મંગલ મંદિર’નો ગત વિશેષાંક એટલે એક ચિરસ્મરણીય અંક

ભારત વર્ષમાં વેદ, પુરાણ, રામાયણ, મહાભારત તથા કલ્યાણ જેવા શાશ્વત ગ્રંથો તેમજ મેધાણી, પ્રેમચંદ મુન્શી, રવિન્દ્રનાથ ટાગોર, સરોજની નાયદુ જેવા ઉત્તમ સર્જકોની અનેક ચિરસ્મરણીય કૃતિ આજે પણ લોકો વારંવાર વાંચે છે અને વાગોળે છે. આ રીતે ‘મંગલ મંદિર’નો ‘કોરોના સંકમણ : કોવિડ-૧૯’ વિશેષાંક લાંબા સમય સુધી લોકોપણોગી રહેશે અને ભવિષ્યમાં તેમાંની વિગતો લોકો ‘રેફરન્સ’ તરીકે લેશે.

### Thank You....! આંજો કાગર — પ્રતિભાવ!!

‘મંગલ મંદિર’માં આંજો કાગર વિભાગમાં મોકલાતા કોઈપણ પત્ર, પ્રતિભાવો ખૂબ આવકારપાત્ર હોય છે. ‘મંગલ મંદિર’ના ગત વિશેષાંક ‘કોરોના સંકમણ’ અંતર્ગત થોકબંધ પ્રતિભાવો મળ્યા છે. તે દરેક લેટરને એક અંકમાં સ્થાન આપવાનું શક્ય નથી. અનુકૂળતાએ અન્ય અંકમાં પ્રકાશિત કરવા પ્રયાસ કરીશું. સામયિકની તારીફની સાથે તેમાં વર્ત્તીની ઉણાપ તરફ પણ ધ્યાન દોરવામાં આવે તો વધારે ઉપયોગી થઈ શકે. વાસ્તવમાં લેખન સામગ્રીઓના સર્જકો અને વાચકવર્ગ જ કોઈપણ સામયિકોની અસલ તાકાત છે. આખી પ્રક્રિયામાં તેમનો રોલ વધારે અગત્યનો હોય છે. એટલે ‘મંગલ મંદિર’ની પ્રશંસાના ખરા અવિકારી તેઓ છે. પ્રતિભાવો માટે અમે દરેકના ખૂબ ખૂબ આભારી છીએ.

— તંત્રી મંડળ

- તે અન્વયે શરૂઆત કરીએ તો તંત્રીલેખમાં ગાગરમાં સાગર ભરી દીખેલ છે.
- ઇ.સ. ૧૮૧૭થી ૨૦૨૦ — એમ બે સૈકા સુધી ફેલાયેલી વિશ્વની મહામારી અને તેમાં સપદાયેલા કરોડો લોકોના મૃત્યુની તવારીખ, ખેગ જેવા રોગોનો બાયોલોજીકલ વેપન્સ તરીકે થયેલો ઉપયોગ અને આ મહામારીમાંથી દુનિયા કેવી રીતે ઉગારી તેની વિગત અને જાણકારી ખૂબ ઉપયોગી છે.
- કોરોનાના કારણે દેશવ્યાપી લોકડાઉનની અસર અને આ આફિતને સોનેરી અવસરમાં કેવી રીતે પલટી શકાય તેની વિસ્તૃત જાણકારી.

- લોકડાઉને લોકોને કેવી રીતે નશામુક્ત કર્યા તે અંગે સમજ.
- આ કપરા સમયના સદૃષ્યોગથી પોતાના આંતરિક અને બાહ્ય વ્યક્તિત્વને નવો ઓપ આપતો શ્રી દિનેશ મહેતાનો રસબસતો લેખ મોરની કલગી સમાન છે.
- આ સમયે લોકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી રંગારંગ અનુભવ કર્યા તેની હાસ્યરસિક શ્રેષ્ઠીમાં માહિતી.
- અંતે કોરોના વિશે ડરામણી નહીં પણ જ્ઞાનવર્ધક દુનિયા - દેશ - રાજ્ય અને શહેર વિશેની તુલનાત્મક માહિતી કાન્ફિલેદાદ છે.
- લોકડાઉનથી ધ્યાન રોજગાર જેવા કે હોટલ, ટુરિઝમ ઇન્ડસ્ટ્રીઝ વગેરેને થયેલા નુકસાન અને તેમાંથી ઉભરી આવવા માટેની વાત અદ્ભુત છે.

અંતમાં, આ અવિસ્મરણીય અંક 'મંગલ મંદિર'ના અંકોની શ્રેષ્ઠીમાં ચાર ચાંદ લગાવે છે, તે માટે ફરીને અભિનંદન.

જ્ઞાનીકાંત પારેખ - અમદાવાદ  
મો. ૯૮૯૮૦ ૫૩૫૨૧



### 'મંગલ મંદિર' વિશેષાંકની વિગત ભવિષ્ય માટે ખૂબ જ ઉપયોગી સાભિત થશે

ત્રણ મહિનાના અંતરકાળના વિયોગ બાદ આખરે 'મંગલ મંદિર' સાથે મિલન આનંદમાં અવતર્યો. 'મંગલ મંદિર'નો એપ્રિલ-૨૦૨૦થી જુલાઈ-૨૦૨૦ના સંયુક્ત અંકમાં, દુનિયા એક મહામારીના સંકટમાંથી પસાર થઈ રહી છે તે વિશેની 'કોરોના' અંગોની સંપૂર્ણ મહત્વની તવારીખનું સંકળન ભાઈશ્રી દિનેશ મહેતાએ કરીને આ વિશેષાંકને ભાવિ પેઢી માટે એક દસ્તાવેજુ અંક તરીકે પ્રસ્થાપિત કરેલ છે. જેમાં દુનિયા, દેશ, ગુજરાત તથા અમદાવાદમાં બનતા રોજબોરોજના કોરોના સંકમણના સમાચારો અને તેની સંપૂર્ણ વિગત તથા સરકારશ્રીએ આ મહામારીથી બચવા અંગે લીધેલ પગલાની વિગત વગેરે ખૂબ પરિશ્રમ માંગી લે છે. તે માટે અભિનંદન. તદ્વારાંત આ મહામારીના જંગ સામે પોતાના જીવનની પરવા કર્યા વગર સેવાભાવી ડોક્ટર્સ, નર્સિસ, સફાઈ કામદારો, પોલીસ કર્માંઓની કાબેલિયતભરી સેવાની વિગત તેમને સલામ દ્વારા અભિભૂત કરેલ છે અને તેના સંબંધી જે નોંધ પ્રકાશિત થઈ છે તે ઉચિત છે અને પ્રશંસનિય છે.

આ મહામારીના સમય દરમિયાન સરકારશ્રી તરફથી લેવાયેલ પગલાં અને તેની વિગત તથા વિશ્વ, દેશ અને ગુજરાતમાં કોરોના સંકમિત વ્યક્તિઓના આંકડા સહિતની માહિતી ખરેખર ખૂબ મહેનત અને દાદ માંગી લે તેમ છે.

આ મગદુર કાર્ય બદલ શ્રી દિનેશ મહેતા ધન્યવાદને પાત્ર છે. ઉપરાંત સરકારશ્રી દ્વારા જાહેર થયેલ લોકડાઉન પીરિયડમાં લોકોને પડતી હાલાકી, જીવન જરૂરિયાતની વસ્તુઓ નહીં મળવાથી થતી હાડમારી તેમજ ધાર્મિક, સામાજિક, માંગલિક, અમાંગલિક કાર્યક્રમો ઉપર અંકુશ કરવાથી થતી તકલીફની સંવેદનાનું વર્ણન, જીણે જીવન ઘરમાં કેદ થઈ ગયું. વાહન વ્યવહાર બંધ થવાથી રસ્તાઓ સૂમસામ ભાસવા લાગ્યા. આ બધી મનોવેદનાનો ચિતાર અને જીવન નિવાહિમાં પડતી તકલીફ અંગેની માહિતી પણ કોરોના મહામારી કેવી રીતે ભયંકર છે તેનો ખ્યાલ આપે છે. જે અંગે દિનેશભાઈએ પોતાની સંવેદના બતાવી છે.

સને ૧૮૧૭થી ૨૦૨૦ સુધીમાં પૂછ્યી પર આવેલ ભયંકર રોગચાળાની વિગત પણ આજની પેઢીને અચરજમાં મૂકી દે તેવી છે. કોરોના - કોવિડ-૧૯ની આંકડાકીય (મહામારી સંદર્ભે) દસ્તાવેજ માહિતી એકઠી કરવામાં દિનેશ મહેતાએ જે મહેનત કરી છે, તે કાબિલે દાદ છે. જેમાં તા. ૨૨-૦૪-૨૦૨૦થી તા. ૨૩-૦૬-૨૦૨૦ સુધીની વિગતનો સમાવેશ કરેલ છે. આ વિગત ભવિષ્યમાં રેફરન્સ તરીકે ઉપયોગમાં આવી શકે તેમ છે.

બીજુ તરફ, કોરોના બીમારીના હાઉના સમયે સરકારે જાહેર કરેલ લોકડાઉને, વિખરાતા કુટુંબને એકજૂટ કરવામાં અગત્યનો ભાગ ભજવ્યો છે તેનો અછડતો ખ્યાલ રમૂજ દ્વારા ભાઈશ્રી દિનેશ મહેતાએ આપેલ છે. જેનાથી બે ધી અંક વાંચવાનો આનંદ મમળાવાય છે.

કોરોના મહામારી અંગે શાબ્દિક, આંકડાકીય માહિતી બદલ દિનેશ મહેતાને તેમની અથાગ મહેનત બદલ ખૂબ ખૂબ અભિનંદન. આમ, લોકડાઉન સમયનો તેમણે સદૃષ્યોગ કરી સમાજની સેવા કરી છે.

દિનેશયંદ્ર જગ્નાનું શાંદ - અમદાવાદ  
મો. ૯૮૨૬૫ ૭૭૬૭૮



### 'મંગલ મંદિર' વિશેષાંક એટલે એન્સાયકલોપીડિયા

'મંગલ મંદિર' માસ એપ્રિલથી જુલાઈ-૨૦૨૦નો સંયુક્ત અંક હાથમાં આવતા જ જીણે અત્યાર સુધીના કોરોના - કોવિડ-૧૯નો એન્સાયકલોપીડિયા મળી ગયો. એટલું જ નહીં, પરંતુ સંપૂર્ણ-૧ અને સંપૂર્ણ-૨ માં પ્રકાશિત માહિતી વાંચીએ ત્યારે થાય, આ મહામારીએ ધાણી બધી પોઝિટિવ બાબતોનો આવિભાવ કર્યો છે. જેમકે, કુટુંબ અને અંગત સ્વજનોની આત્મિયતા કે લાગણી અને કોઈપણ વસ્તુ વિના ચલાવી શકાય એવી આવડત વગેરે.

કોરોનાના પગલે લોકડાઉનમાં ઉદ્ભવેલા ટ્રૂયકાઓની મજા સાથે આત્મવિશ્વાસમાં વધારો થાય છે અને માનવ જીવનને આનંદથી - હસતાં હસતાં જીવવાની ગાઈડલાઇન તેમાંથી મળી રહે છે.

શ્રી પ્રતાપભાઈ અને શ્રી દિનેશભાઈ મહેતા સાથે સહયોગી કાર્યકરોને અભિનંદન. તે સાથે આપણે સૌ કોરોના-૧૮ને મહાત

આપીને જલ્દીથી હેમબેમ રીતે બહાર આવીએ અને પહેલાથી પણ વધુ સારી રીતે આનંદથી જીવન માણિએ એવી શુભેચ્છા.

**બલવીરસિંહ જાડેજા (સુપરસિલ લેખક) - અમદાવાદ  
મો. ૯૮૨૫૯ ૦૦૦૮૬**



### ‘મંગલ મંદિર’માં પ્રકાશિત થતી લેખન સામગ્રીઓ વિવિધ પ્રકારના પુષ્પોની જેમ ખુશ્બૂ સર્વત્ર પ્રસરાવે છે

ચાર મહિનાના અંતરાય પછી ‘મંગલ મંદિર’નો સંયુક્ત અંક હાથમાં આવતાની સાથે જ ખૂબ આનંદ થયો. ‘મંગલ મંદિર’ એક એવું મુખ્યપત્ર છે કે જે બધા વિષયોનો રસારવાદ એક સાથે કરાવે છે.

‘મંગલ મંદિર’ એક એવો બગીચો છે જેમાં મૌલિક કૃતિઓ અનેક જુદા જુદા રંગના ફૂલો સ્વરૂપે પોતાનું સૌંદર્ય, ખુબસુરતી અને ખુશ્બૂ રેલાવતા હોય છે. જેમ ફૂલથી ભરેલો ભાગ જોઈને મન આનંદિત થઈ જાય તેમ ‘મંગલ મંદિર’ જોઈને હૃદય પણ ફૂલની જેમ ખીલી ઊંઠે છે.

‘મંગલ મંદિર’ જીવનના દરેક પાસાઓને આવરી લેતા લેખોનો સમાવેશ કરીને સમાજના બધા જ વર્ગના લોકોને સ્પર્શી જાય એવી રજૂઆત કરે છે. ‘મંગલ મંદિર’ સમાજમાં ચાલતા સાંપ્રત વિષય ઉપર હંમેશાં પ્રકાશ પાડતું આવ્યું છે. અત્યારે સમગ્ર વિશ્વ માટે ખૂબ જ ચિંતાનો વિષય બની ગયેલા કોરોના નામના અષટેબ્યા વાયરસ વિશે જે પ્રકારે વિવિધ માહિતી આ વિશેખાંકમાં આપી છે, તે અદ્વિતીય છે. શ્રી દિનેશભાઈ આર. મહેતા દ્વારા ‘કોરોના વાયરસ મહત્વની તવારીખ – વિશ્વ, ભારત, ગુજરાત, અમદાવાદ’ને ચાર વિભાગોમાં વહેંચીને નાનામાં નાની માહિતીને ચૂક્યા વગર સમાવવામાં આવી છે. આ પ્રકારની સઘણી માહિતી એકસાથે અત્યાર સુધી કોઈ સામયિક કે અખભારમાં જોવા મળી નથી, તે ખૂબ જ પ્રશંસાને પાત્ર છે. એક જ અંકમાં દેશ-દુનિયાની કોરોના અંગેની માહિતી ચોક્કસ આંકડાઓ સહિત તથા મહત્વની જાણકારી વાચકોને ઉપલબ્ધ કરાવવા બદલ શ્રી દિનેશભાઈ મહેતાને ધ્યનવાદ આપવા ધટે છે. તે રીતે ‘કોરોના વાયરસને પગલે એક અનોખો અનુભવ’, ઉપરાંત બીજા અન્ય મૌલિક લેખન જેવા કે લોકોના રંગારંગ અનુભવો, લોકડાઉન એક સોનેરી અવસર - વ્યસનોને કાયમી અલવિદા આપવાની સુવર્ણ તક વગેરે સકારાત્મક લેખો આપીને લોકોના મનમાં હળવાશ લાવવાનો પ્રયત્ન ખૂબ પ્રશંસનીય છે. કોવિડ-૧૯ વિશે આટલો બધો માહિતીપૂર્ણ લેખ આપીને ‘મંગલ મંદિર’ની લોકપ્રિયતામાં ચશમદિયાનું એક છોગુ વધું ઉમેરાયું છે. આ સંયુક્ત અંક અવિસ્મરણીય સામયિક તરીકે ઊભરી આવેલો વિશેષાંક છે. જેમાં વિવિધ પ્રકારની લેખન સામગ્રીઓ પ્રદાન કરનારાઓનો પણ અશ્રીમ રોલ છે.

‘મંગલ મંદિર’ના નિયમિત બધા અંકોમાં આવતી લેખન સામગ્રી પણ એટલી જ રસપ્રચુર હોય છે. બધા જ લેખકશ્રીઓ તથા કવિશ્રીઓ તેમની મૌલિક લેખન સામગ્રી દ્વારા ઉચ્ચ કોટિનું જ્ઞાન પૂરું પાડે છે અને તેમાંથી મળતા વિવિધ રસ જેવા કે હાસ્ય રસ, કરુણ રસ, જ્ઞાન રસ, ધર્મ રસ, આરોગ્ય અંગેના લેખો, માહિતીપ્રધાન લેખો - વિગત, વાર્તાઓ, કાચ્યો સધણું ખૂબ જ સરાહનીય છે. મને પણ બધાનો એક હિસ્સો બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે, તે બદલ હું ખૂબ ગૌરવ અનુભવું છું.

શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદના કાર્યકર્તાઓ તથા કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ ઉત્તમ સેવા અને જરૂરિયાતમંદોને સહાય કરવા બદલ તેઓને ખૂબ ખૂબ અભિનંદન અને ધ્યાનવાદ...

‘મંગલ મંદિર’ આ જ રીતે ખૂબ પ્રગતિ કરે અને લોકોના હૃદયથી જોડાયેલું રહે અને તેનો વાચકવર્ગ વિશાળ થતો જાય એવી હાર્દિક શુભેચ્છાઓ....

સુનિતા એ. શાહ - અમદાવાદ  
મો. ૯૮૨૫૯ ૫૫૫૫૩

### 'મંગલ મંદિર' - માસ એપ્રિલ-જુલાઈ ૨૦૨૦ના કોરોના વિશેષાંક અંગે

'પુત્રના લક્ષ્ણ પારણામાંથી...' - એવું ચોક્કસ કહી શકાય.

કોરોના વિશેષાંકનું મુખપૃષ્ઠ જોઈને જ નથી લાગતું, કે અંદરની લેખન સામગ્રીઓમાં કેટલો બધો દમ હશે?! આખી દુનિયાને માસ્ક પહેરાવીને ડિઝાઇનરે કમાલ દેખાડી છે!

આવા સર્વાંગ સુંદર અંક બદલ તેમજ સમયોચિત તંત્રીલેખ બદલ મુખ્યતંત્રી શ્રી પ્રતાપભાઈ દંડ તેમજ સહતંત્રી શ્રી દિનેશભાઈ મહેતા અભિનંદનના અધિકારી છે.

આમ તો અંકમાં સમાવાયેલી તમામ વિગતો તેમજ તમામ કૃતિઓના લેખક / લેખિકાઓની કૃતિઓ સુંદર જ છે પરંતુ સર્વેનો અહીં ઉલ્લેખ કરવો શક્ય નથી. તેથી તેમાંની કેટલીક કૃતિઓ અંગે જ અહીં ઉલ્લેખ કર્યો છે. અને તેમને સર્વેને અભિનંદનથી નવાજ્ઞાએ.

★ સર્વપ્રથમ, આવો આપણે બધા મળીને આભાર વ્યક્ત કરીએ.... 'THANK YOU....!' એમાં દરશાવેલા સર્વ તો વંદનને યોગ્ય છે જ પરંતુ તે વિસ્તરમાં આ લખનારને એક વધારે વર્ગને સામેલ કરવાની ઈચ્છા થાય છે અને તે છે - પાવર સ્ટેશન તેમજ પાવર સપ્લાય સિસ્ટમમાં કામ કરતાં એન્જિનિયર્સ તેમજ અન્ય કર્મચારીઓ કે જેઓ પણ લોકડાઉન દરમિયાન તેમજ તે સિવાય પણ સતત જ્યુટી પર હાજર રહી અતિ આવશ્યક વિદ્યુત પુરવઠો ચાલુ રાખવા ખૂબ પ્રયત્ન કર્યા છે. પાંચ મિનિટ માટે પણ જો વિદ્યુત પુરવઠો ખોરવાઈ જાય તો શું પોકિશન થાય?! કલ્પના પણ થઈ શકે તેમ નથી કારણકે બધી જગ્યાએ ઓફ્ટરનેટ અરેન્જમેન્ટ હોય પણ નહીં અને હોય તો પણ અપૂર્તી હોય.

★ શ્રી સૂર્યકાંત ભણ લિખિત પ્રાર્થનાને પમાડતું પ્રાણ તત્ત્વ. વારંવાર વાંચવી ગમે તેવી 'ભૂલી હ્યુ ચાદો મુઝે હતના ના સતાઓ...'

#### ★ વાયબ્રંટ હાસ્યરંગ!

(આ લખનારને આમેય 'હાસ્ય - હળવાશ' સાથે પ્રથમ પ્રેમ છે!)

★ શ્રી દિનેશ આર. મહેતા લિખિત 'કોરોના વાયરસના પગલે લોકડાઉન : એક અનોખો અનુભવ.'

★ શ્રી દિનેશ પાંચાલ લિખિત 'વૃધ્યોએ વૃધ્યહઠ છોડી વૃધ્ય ગટ્ટસ અપનાવવી જોઈએ'. હળવાશની શૈલીમાં લખાયેલો સરસ લેખ. આમેય શ્રી દિનેશ પાંચાલના લેખો વાંચવા

ગમે તેવા જ હોય છે એટલે એમાં કાંઈ કહેવાનું હોય જ નહીં. ખૂબ સરસ રીતે લખતા હોય છે.

★ શ્રી ભોલાભાઈ ગોલીભાર લિખિત લેખ - 'જિંદગી ક્યારેય સરળ નથી બનવાની, તમારે જ મજબૂત બનવાનું છે.'

★ શ્રી જેરાવરસિંહ જાદવ લિખિત લેખ - 'કચ્છની સંસ્કૃતિના છીદીદાર : શ્રી રામસિંહજ રાઠોડ.'

(યોગાનુયોગ આ લખનારને પણ શ્રી રામસિંહજ રાઠોડને એક વખત મળવાનું અને તે સમયે તેમના ઘરમાં જ બનાવાયેલા સંગ્રહ સ્થાનને જોવાનો સુખદ સંયોગ સાંપડ્યો હતો.)

★ 'કચ્છી કસબને વૈશ્વિક ઊંચાઈ પ્રાપ્ત થઈ...' દ્વારા એક કચ્છી મહિલા પાલીબેન રબારી અંગે સારી જાણકારી મળી.

★ 'દુનિયાની અજ્ઞયબીઓ'માં 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'ને પણ સ્થાન આપવાની જરૂર હતી.

★ 'શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદના સામાજિક કાર્યમાં ઉમેરાયેલું એક સુવર્ણ પીછું!'માં દર્શાવાયેલી અગત્યની વિગતો વાંચીને આનંદ અને સંતોષ થાય તેમ છે.

હવે કોરોનાથી જલ્દી છૂટકારો થાય એવી આશા સાથે વીરમીએ!

**યાત્રાના શાહ (નાયન નિવૃત્ત કાર્યપાલક ક્રજનર : જીરણી) - ગ્રાંદીનગર માટે ૧૪૦૮૪ ૪૧૫૫૧**



#### 'મંગલ મંદિર'નો ખૂબ જ સરસ અને ઉપયોગી વિશેષાંક

શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદના મુખ્યત્વ 'મંગલ મંદિર'નું માસ એપ્રિલ-જુલાઈ ૨૦૨૦ વિશેષાંક કોરોના સંકમણ વિષયક તથા સંપૂર્ણ-૨ ની અન્ય લેખન સામગ્રીઓ ખૂબ જ ઉત્તમ અને ઉપયોગી છે.

કોરોના સંકમણના સમયે જ્યારે માનવી અનેક ભય, ચિંતા અને દુઃખથી ઘેરાયેલો રહે છે ત્યારે આ વિશેષાંકની લેખન સામગ્રીઓ દ્વારા વ્યક્તિને શાંતિથી જીવવાની એક નવી અને અદ્ભુત પ્રેરણ મળી શકે છે. આ વિશેષાંક તૈયાર કરવામાં અથાગ પરિશ્રમ જોઈએ, એ તેમાં પીરસાયેલી વિવિધ સામગ્રીઓથી ફલિત થાય છે અને તે માટે તંત્રીમંડળ અને ખાસ કરીને દિનેશ આર. મહેતાને અભિનંદન સાથે ધ્યાવાદ. અત્યારના સમયે આપણે ફલુ, પ્લેગ જેવી ગંભીર મહામારીની વિગત વાંચીએ છીએ ત્યારે તેમાંથી ઘણું બધું જાણવા મળે છે. તે રીતે થોડા વર્ષો બાદ ઉપરોક્ત વિશેષાંકમાંથી કોરોના સંબંધી વિગતો નવી પ્રજાને ખૂબ જ ઉપયોગી થશે. સર્વ કોઈ વાંચીને સમજ શકે અને દરેકને રસ

પડે એવી સરળ રીતે તેમાં વિગતો આપી છે. લોકડાઉનના સમયમાં લોકોએ અપનાવેલી વિવિધ કાર્યશૈલી અને તેનાં પરિણામે ઉપજેલા જેકસ - વિગતથી માણસનું મન હળવું થાય છે. આ પ્રકારની રજૂઆત પણ એક કઠિન કામગીરી છે. તે માટે તેના પ્રસ્તુતકર્તાને ખાસ અભિનંદન.

વિશેષાંકનું મુખપૃષ્ઠ સરસ છે અને તંત્રીલેખ ખૂબ પ્રેરણાદાયી છે. તંત્રીલેખ ખૂબ વિગતવાર અને સચોટ માહિતી સાથે લખાયેલું છે. હાલના સમયે દરેકને અસરકર્તા બને તેવું છે. તે સિવાય, અન્ય લેખો, કાચ્યો વગેરે પણ ઉત્તમ પ્રકારના છે. તે માટે તેના લેખકો, કવિઓને અભિનંદન.

ટૂંકમાં ઉપરોક્ત વિશેષાંક પ્રેરક, માર્ગદર્શનરૂપ છે.

**સામાજિકલાલ કુંવરજી ગોસર - અમદાવાદ**



### હેતુલક્ષી અને ઉપયોગી

**'મંગલ મંદિર' માસ એપ્રિલ-જુલાઈ ૨૦૨૦ વિશેષાંક**

'મંગલ મંદિર' માસ એપ્રિલ-જુલાઈ ૨૦૨૦નો 'કોરોના સંક્રમણ વિશેષાંક' વાંચ્યો. એના વિશે ખાસ પ્રતિભાવ અતે પ્રસ્તુત છે.

સમગ્ર વિશેખમાં હાલે કોરોના પ્રકોપ પ્રવર્તમાન છે. એના વિશે બેણસેળયુક્ત માહિતીનો અતિરેક છે. આ સંયોગોમાં, એક સામાજિક સામયિકના સુનિશ્ચિત વાચક વર્ગની રસ અધ્યિને અનુકૂળ માહિતીનું ચીવટપૂર્વક ચચન કરી, પ્રસ્તુત કરવાનું કઠિન કાર્ય બખૂબીપૂર્વક આ અંકમાં થયું હોવાનું સ્પષ્ટ વર્તાય છે.

આ અંકમાં કોરોનાની વૈશ્વિક, રાષ્ટ્રીય, રાજ્ય, જિલ્લા અને સ્થાનિક દસ્તિએ જાણવાજોગ માહિતીનું સંક્ષિમ અંકડાકીય અને વર્ણનાત્મક વિહંગાવલોકન છે. વધુમાં વિષયની ગંભીરતાને હળવી કરવા 'લોકડાઉન'ના લોક અનુભવોનું રસપ્રદ માણવાજોગ વર્ણન છે. સહતંત્રીના શબ્દોમાં 'લોકડાઉન દરમિયાન માણસ માણસની રીતે જીવતા શીખી ગયો.' તહુપરાંત, આ અંકના હાઈ સમાન, કોરોના સંક્રમણે સર્જેલી હતાશાને ખંખેરતા, આમંત્રિત લેખકોના પ્રોત્સાહક લેખો છે.

આ અંકની ખાસ નોંધપાત્ર વિશેષતા એ છે કે, જૈન સમાજના મુખપત્ર તરીકે, સામયિકની સમાજ પ્રત્યેની પ્રતિબધ્યતાને અનુરૂપ, સમાજલક્ષી વિગતો પણ સુપેરે વણી લીધી છે. જેમકે ડૉ. પારેખનો 'સાધાર્મિક વાત્સલ્ય'નો મર્મસભર લેખ. આરોગ્ય વિભાગમાં સ્ટ્રેસ વિશે સમજ, સંશોધન ક્ષેત્રે 'એમટી પ્લેનેટ' પુસ્તકની વિશ્વ વસતિ ઘટવાની અવધારણા, ગોલીનારે ટાકેલા, નિર્મલ વર્મની નવલક્થા 'વે દિન'નું વિધાન 'આપણે જીવતા

છીએ એ જાણવું' તેમજ ડૉ. યાસીન દલાલના લેખમાં આલ્બર્ટ કામુની વિશ્વપ્રસિધ્ય નવલક્થા 'પ્લેગ'નું વર્ણન અને ડૉ. નેલા સંઘવીની શીખ, 'ચાલ મનવા, જીવી લઈએ!' – આ બધામાં, કોરોના સંદર્ભે ઉજાગર થતો આશાવાદ પ્રેરક અને રસપ્રદ છે.

આ અંકમાં કોરોના લોકડાઉન પરિણામે પ્રભાવિત લોકો પ્રત્યે સંવેદના અને સાધાર્મિક વાત્સલ્યની વિભાવના કૃતાર્થ કરતી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદની સેવા પ્રવૃત્તિ તેમજ સેવાભાવી કાર્યકરોની સમર્પિત ભાવના દર્શાવતી વિગતોનો પણ સમુચ્ચિત સમાવેશ છે.

અમદાવાદના ઝુંપડપણી વિસ્તારોની લોકડાઉન દરમિયાન વંચિત વસતિ માટે 'ફૂડ પેકેટ વિતરણ'. નાતજાતના ભેદભાવ વિના, અમદાવાદથી કચ્છ જવા આતુર ૨૨૦ વિધાર્થીઓ અને અન્ય લોકો માટેની બસ વ્યવસ્થા તેમજ સમાજના સંકટપ્રસ્ત 'સ્વજનો' માટે સન્માન પૂર્વકની આર્થિક સહાયતા તેમજ લોનની વ્યવસ્થા જેવી પ્રવૃત્તિઓ ઉલ્લેખનીય તેમજ ઉદાહરણ સ્વરૂપ છે.

ટૂંકમાં 'મંગલ મંદિર'નો આ અંક એક વિશેષ સમાજના મુખપત્રમાં માહિતી તેમજ આમ સમાજ ઉપયોગી સાહિત્ય, પ્રસ્તુત કરતો આદર્શ વિશેષાંક તેથાર કર્યો છે, જે ભવિષ માટે પણ ઉપયોગી નીવડશે. તંત્રી મંડળને આવે હેતુલક્ષી અંકઆપવા બદલ હાઈક અભિનંદન.

**હંસરાજ કંસરા - ડિલો**

(વિવિધ સામયિકોના તંતી તથા મુખ્ય સલાહકાર)  
મો. ૯૫૪૮૩ ૭૬૩૬૬



**એવોર્ડ પ્રાપ્ત કરવા લાયક 'મંગલ મંદિર'ના અંકોની શૃંખલા પ્રકાશિત કરવા માટે અભિનંદન**

'મંગલ મંદિર'નો કોરોના સંક્રમણ વિશેષાંક અંગે એટલું ચોક્કસ કહી શકાય કે આ વિશેષાંક એટલે કોરોના સંબંધી વિગતો અને માહિતીનો એક અમૂલ્ય ખજાનો!

ભારતમાં કોરોના વાયરસની શરૂઆત થઈ ત્યારથી વિગતવાર માહિતી તંત્રીલેખમાં આપવામાં આવી છે. તે ઉપરાંત તેમાં ઘણા બધા મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે, જે પ્રશંસાને પાત્ર છે. કોરોના વાયરસ સામે લડવા લોકજાગૃતિ જ એક ઉત્તમ અને મહત્વનો ઈલાજ છે તે પરત્યે જે ભાર મૂકવામાં આવ્યો છે તે ખરેખર ઉચ્ચિત છે.

કોરોના વિશેષાંકના પ્રથમ ભાગમાં મહામારી સંબંધી જે લેખો અને વિગત આપવામાં આવ્યા છે, તે કાબિલેદાદ સમાન છે. કોરોના - કોવિડ-૧૯ની અંકડાકીય માહિતી તથા તેની મહત્વની તવારીખમાં વિશ્વ, ભારત, ગુજરાત અને અમદાવાદની

જે વિગતો આપવામાં આવી છે તે એકત્ર કરીને તેની વ્યવસ્થિત રજૂઆત એક અદ્ભુત કામગીરી છે.

કોરોના... કોરોના... કોરોના... આ વિષય સંબંધી લોકો એકદમ પરેશાન ન થાય, ચિંતાગ્રસ્ત ન થાય તે માટે લોકડાઉનના સમય દરમિયાન લોકોએ ઘરે રહીને કેવી રીતે સમય પસાર કર્યો, કેવા કેવા અનુભવો કર્યા અને તેને અનુલક્ષીને કેવા જોકસ તથા જોડકાંની રચના કરી તેની વિગત ‘ભૂલી હુઈ યાદો મુશ્ખે ધતના ન સત્તાઓ’ મથાળા હેઠળ આપવામાં આવી છે, તે કોરોનાના ગંભીર માહોલને હળવો કરવા સફળ થઈ છે. આવું જ મનોરંજન વાયબ્રન્ટ હાસ્યરંગ વિભાગમાં કરવામાં આવ્યું છે. આ બધી રજૂઆત માટે શ્રી દિનેશ મહેતાને અભિનંદન ધારે છે.

તે સિવાય, કોરોના સંકમણ સંબંધી અન્ય લેખો તથા સંપૂર્ણ માં જે કૃતિઓ પ્રકાશિત થઈ છે – તે દરેક તારીફ કરવા લાયક છે. તેના દરેક લેખકશ્રીઓ, કવિશ્રીઓને ખાસ ધ્યાનવાદ.

કોરોના સંકમણના પ્રકોપના પગલે સરકાર દ્વારા લોકડાઉન, કફ્યુન્ટ તથા કલમ-૧૪૪ની જાહેરાત થઈ ત્યારે આમ જનતાની સ્થિતિ વિચિત્ર થઈ ગઈ. તેઓ માનસિક તાણ, તંગદિલીનો અનુભવ કરવા લાગ્યા. ઘરની બહાર નીકળવાની મનાઈ! દિવસ-રાત ઘરમાં જ રહીને ઘરનાં દૈનિક કામકાજ કરવા. આ પ્રકારના તણાવભર્યા વાતાવરણ વચ્ચે કોઈ એક ખાસ વિષયની વિગતો એકત્રિત કરવી, તેનું સંકળન કરવું, ત્યારબાદ તેની વિવિધ રૂપોદ્ધ રજૂઆત કરવી, આ ખરેખર અધ્યંતું કામ છે. આ પ્રકારના માહોલમાં સાહિત્ય સર્જનની કામગીરી કરવી, એ આસાન નથી. માત્ર દિનેશ આર. મહેતા જેવા મર્યાદિત સર્જક જ આવું સર્જન પ્રદાન કરી શકે, તે સત્ય વાત સૌંદર્ય સમજવી પડે. આ માટે અભિનંદનની વર્ષા જેટલી કરીએ તે ઓછી થશે. શ્રી પ્રતાપભાઈ દંડ તથા દિનેશ મહેતાને સલામ!

આ પ્રકારની પ્રશંસા માટે એક અન્ય કારણ પણ છે. આપણે સૌ જાણીએ છીએ કે ગત અખાડી બીજના અવસરે મુખ્ય સ્થિત એક કચ્છી સાર્વજનિક સંસ્થા દ્વારા શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદના પ્રમુખશ્રી તથા ‘મંગલ મંદિર’ના મુખ્યતંત્રી શ્રી પ્રતાપભાઈ દંડને ‘મંગલ મંદિર’નો ૫૦૦મો દળદાર અંક માસ જાન્યુઆરી ૨૦૨૦માં પ્રકાશિત કરવા માટે ‘કચ્છ શક્તિ’ એવોર્ડ અર્પણ થયો હતો. શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદ માટે આ ગૌરવપ્રદ ભાબત છે. તે સાથે શ્રી પ્રતાપભાઈ દંડને અભિનંદન. અતે નોંધનીય બાબત એ છે કે છેલ્લા થોડા સમયમાં સમાજના મુખ્યપત્ર ‘મંગલ મંદિર’ની પ્રતિષ્ઠા અને તેના શ્રેષ્ઠ પ્રકાશનનો મુદ્રા કેટલા ઉંચા સ્તરે જઈને સમાજને ચાર ચાંદ લગાવી રહ્યો છે. આવી જ ક્ષમતા - ગુણવત્તા ઉપરોક્ત કોરોના સંકમણ વિશેષાંક

ધરાવે છે. તે માટે ઉચ્ચિત કાર્યવાહી કરવી ધટે.

‘મંગલ મંદિર’ના આ પ્રકારના શ્રેષ્ઠતમ અંકોની શુંખલા છેલ્લા થોડા સમયથી પ્રકાશિત થઈ રહી છે, તે માટે હાલના તંત્રી મંડળને ફરીથી અભિનંદન!

દસ્તુખ બાબુભાઈ ખાંડવાલા - અમદાવાદ  
મો. ૯૮૨૫૦ ૪૦૬૬૬



**‘મંગલ મંદિર’ વિશેષાંક :** સમાજમાં નોંધાયેલા સભ્યોને મળતા લાભોની વિગત અંગે....

‘મંગલ મંદિર’ માસ એપ્રિલ-જુલાઈ ૨૦૨૦નો સુંદર, માહિતીસભર વિશેષાંક હાથમાં આવતા ખૂબ જ આનંદ થયો.

આ અંકમાં “સમાજના નોંધાયેલા સભ્યોને મળતા લાભો” અંગે ખૂબ જ સરસ માહિતી આપવામાં આવી છે. તેમાં નીચેની બાબત અંગે વિશેષ પ્રકાશ પાડવા વિનંતી.

#### ૧. મેડિકલ સેન્ટર :

તેમાં જણાવેલ છે કે “સીટી સ્કેન / એમ.આર.આઈ. માટે બહારના તબીબી સેન્ટર સાથે ટાઈ-અપ કરેલ હોવાથી જરૂરિયાત હોય તેવા સભ્યોને સીટી સ્કેન / એમ.આર.આઈ.માં ડિસ્કાઉન્ટ મળે છે.”

ક્યા તબીબી સેન્ટર સાથે ‘ટાઈ-અપ’ કરેલ છે તેની માહિતી, એટ્રેસ તથા ત્યાં ડિસ્કાઉન્ટ કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદના મેડિકલ કાર્ડથી આપવામાં આવશે? આ અંગે ‘મંગલ મંદિર’માં તથા મેડિકલ સેન્ટરમાં જરૂરી માહિતી પ્રગટ કરવાથી સમાજના સભ્યો તેનો લાભ લઈ શકે.

#### ૨. સામાજિક સુરક્ષા :

તેમાં જણાવેલ છે કે, “સમાજની ૭૦ વર્ષથી નીચેની વ્યક્તિઓની રૂ. ૫,૦૦,૦૦૦/- સુધીની પર્સનલ એક્સિસેન્ટ પોલિસી પણ લેવામાં આવેલ છે.”

આ પોલિસી હોલ્ડરના નામ તથા પોલિસીમાં ક્યા લાભ મળે છે તેની માહિતી ‘મંગલ મંદિર’માં આપવાથી સભ્ય તે પોતાની ફાઈલમાં રાખી શકે. આ એક્સિસેન્ટ પોલિસી કેટલા વર્ષથી લેવામાં આવે છે? તેનો લાભ કોઈએ લીધો છે?

પર્સનલ એક્સિસેન્ટ પોલિસી સમાજ પાસે છે તેવું ધાણાને શાયદ યાદ પણ ના હોય. આ માટે વિચારવું જોઈએ.

#### ૩. સમાજના ધણા સભ્યો અવારનવાર - પ્રસંગે ડોનેશન આપે છે.

જેમ કે જલારામ અનુભૂતિ, શૈક્ષણિક સહાય, મેડિકલ વગરે... જે તે સમિતિએ ડોનેશન આપનારને ‘આભાર પત્ર’ લખવો જોઈએ. અલબત્ત, ડોનેશન આપનારના નામ

‘મંગલ મંદિર’માં આપવામાં આવે જ છે પરંતુ એક આભાર-પત્ર સમિતિ દ્વારા પાઠવવામાં આવે તો ડોનેશન આપનારને તે માટે ભવિષ્યમાં પણ પ્રોસ્સાહન રહે.

‘મંગલ મંદિર’ દ્વારા સમાજના સભ્યોને ધંધી ઉપયોગી માહિતી મળતી રહે છે. આજે જ્યારે વાંચન ઓછું થઈ ગયું છે તે સમયમાં પણ ‘મંગલ મંદિર’નો હિતેજાર રહે છે, તે તેની તથા તંત્રીમંડળની કેરિટ છે.

નવીનયંક વાડીલાલ મહેતા - સમાજાદા  
મો. ૨૦૦૩ ૫૦૪૮

### નવીનયંક વાડીલાલ મહેતા

#### (૧) મેડિકલ સેન્ટર

સીટી સ્કેન / એમ.આર.આઈ. માટે નીચે જણાવેલ લેબ - સેન્ટર સાથે ટાઇ-અપ થયેલ છે. જ્યાં કુલ બીલમાં નક્કી થયેલ રકમ બાદ મેળવી શકાય છે. ★ સદ્ગ્રાવ ઇમેજિંગ સેન્ટર - ગુજરાત કોલેજ પાસે. ★ શાલીમાર ઇમેજિંગ સેન્ટર - મહાલક્ષ્મી પાંચ રસ્તા પાસે.

વ્યક્તિઓ દ્વારા મુજબના ટેસ્ટ - ચકાસણી માટે સૌપ્રથમ સમાજના મેડિકલ સેન્ટરના અધિકૃત અધિકારીનો સંપર્ક કરવાથી આ બાબતે સંબંધિત સેન્ટર પર જરૂરી પત્ર લખી આપશો.

#### (૨) સામાજિક સુરક્ષા

આ પ્રકારની પોલિસી હેઠળ સમાજમાં નોંધાયેલા જે સભ્યોને આવરી લેવામાં આવ્યા છે, તેની વિગત તાજેતરમાં સમાજના સભ્યશ્રીઓને વોટસાંપેના માધ્યમથી આપવામાં આવી હતી. છેલ્લા લગ્ભગ પાંચ વર્ષથી આ પોલિસી નિયમિત રીતે લેવામાં આવે છે અને અત્યાર સુધી તે યોજના હેઠળ ૩/૪ સભ્યોએ લાભ લીધેલ છે. આ એક ચુપ પોલિસી હોય છે. તેથી તેની પોલિસી - વીમાનું કરારનામું સમાજના કાર્યાલયમાં જ રાખવામાં આવે છે. અગર કોઈ વ્યક્તિ અક્સમાતે મૃત્યુ પામે અથવા તો કાયમી અક્ષમ (ડિસેબલ)ની સ્થિતિમાં બંને અંખ ગુમાવે અથવા બંને હાથ/પગ ગુમાવે તે ડિસ્સામાં પોલિસીનો લાભ મળે છે. આ સંબંધી બધી કાર્યવાહી સમાજ દ્વારા કરવામાં આવે છે.

#### (૩) ડોનેશન અંગે

સૂચન સારું છે. આ અંગે સંબંધિત સમિતિમાં અગાઉ ચર્ચાથી હતી. તે અન્વયે જે નિષ્ણય થયો હતો, તે મુજબ હાલે કાર્યવાહી થઈ રહી છે. વહીવટી કામગીરીને ધ્યાનમાં લેતાં હાલે જે પ્રથા અમલમાં છે, તેમાં અન્ય કોઈ બાબતને અવકાશ નથી.

આપે લખેલ પત્ર આવકારપાત્ર છે. તે માટે આભાર.]

## અન્ય સંસ્થાઓના સમાચાર

### લાયોનેસ કલબ ઓફ ભુજના ઉપકરે નિ-દિવસીય યોગ શિબિરનું નિઃશુલ્ક આયોજન

લાયોનેસ કલબ ઓફ ભુજના પ્રમુખ વનિતાબેન શાહના નેજા હેઠળ તાજેતરમાં “સ્વાસ્થ્યની ગુરુચાવી – આપણા શાસમાં” આ ટોપિક પર ભુજ ખાતે નિ-દિવસીય નિઃશુલ્ક યોગ શિબિરનું આયોજન થયું હતું. આ પ્રોજેક્ટના ચેર પર્સન ભાવના એ. જવેરી હતા. દીપ પ્રાગટ્ય કરી આ શિબિરનો પ્રારંભ થયો હતો. તે સાથે કલબના હોદેદારોનું ઉચિત સંભાન કરવામાં આવ્યું હતું.

હાલના સંજોગોમાં કોવિડ-૧૯ બીમારી તથા કોરોના વાયરસ સામે ઝસુમવું છે, તેને મહાત કરવું છે, એટલું જ નહીં પરંતુ તેની સામે સ્વાસ્થ્યમય રીતે જીવન જીવવું છે. આ માટે પ્રાણાયામ ખૂબ જ જરૂરી છે. યોગ એ વિશ્વને ભારતની અમૂલ્ય દેન છે. યોગની વાત નવી નથી. એ પ્રાચીન પદ્ધતિ છે. યોગ એટલે માત્ર શારીરિક વ્યાયામ નથી. શરીર અને મનની સ્વસ્થતા માટે યોગ આવશ્યક કિયા છે.

ઉપરોક્ત નિ-દિવસીય શિબિરમાં યોગના ફાયદા, કયા રોગમાં કયા પ્રાણાયામ કરવા, સૂર્ય નમસ્કારના ફાયદા, જીવનને સ્વસ્થ રાખવા માટે પ્રાણાયામ, ધ્યાનની અસરો... વગેરે ટોપિકની વિસ્તૃત સમજ યોગગુરુ કમલકાંતભાઈએ આપેલ હતી. શારીરિક રીતે તંદુરસ્ત રહેવા જરૂરી કસરતો યોગ ટીચર ભાવનાબેન જવેરી દ્વારા કરાવવામાં આવી હતી. જ્યારે પ્રાણાયામ, મેડિટેશન મહેશભાઈ છાયાએ કરાવેલ. શિબિરના કાર્યક્રમનું સંચાલન ભાવના જવેરી દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું, એમ સંસ્થાની એક યાદીમાં જણાવાયું હતું.

### ઉમા યોગ કેન્દ્ર - ભુજ

ઉમા યોગ કેન્દ્ર - ભુજ ખાતે ગુરુપૂર્ણિમા નિમિત્ત ગુરુ વંદનાનો એક ખાસ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં યોગગુરુ કમલકાંતભાઈનું ઉચિત સંભાન કરવામાં આવ્યું હતું. આ અવસરે રમિલાબેન મહેતા, ભાવના જવેરી તથા દિમ્બીબેન તરફથી રોકડ અનુદાન તથા જરૂરી ચીજાવસ્તુઓ બેટ સ્વરૂપે સંસ્થાને આપવામાં આવ્યા હતા. કમળાબેને ગુરુ પૂર્ણિમાનું મહત્વ તથા ગુરુવંદના વિશેની વિગત જણાવીને ઉપસ્થિત સભ્યોને પ્રભાવિત કર્યા હતા. તેવી રીતે સિનિયર સિટીઝન દિન નિમિત્ત પણ એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વયસ્ક વ્યક્તિઓને અનુરૂપ ચેર-યોગ તથા તેઓ માટે રમતગમતનું સંચાલન ભાવના જવેરીએ કર્યું હતું. ઉપસ્થિત પ્રેક્ષકગણો આ બંને કાર્યક્રમોની પ્રશંસા કરી હતી, એમ સંસ્થાની એક યાદીમાં જણાવાયું હતું.

## દેલવાડા મંદિર (Delwara Mandir) – એક નજર...

અમદાવાદથી ૧૮૬ કિ.મી. અને હિલ્ડી – અમદાવાદ રસ્તા પર પશ્ચિમ રેલવે લાઈનનું આબુ રોડ સ્ટેશન છે. ત્યાંથી માઉન્ટ આબુ જવાય છે. સમુદ્રની સપાટીથી ૬૦૦ મીટર ઊંચાઈએ ૨૮ કિ.મીટરે આબુ પર્વત છે. અમદાવાદ, જોધપુર, અજમેર, ઉદ્દેપુર વગેરે સ્થળોએથી આબુ રોડ જવા બસ સેવા પણ ઉપલબ્ધ હોય છે.

માઉન્ટ આબુ પર્વત ઉપર જનરલ પોસ્ટ ઓફિસથી ઉત્તર તરફ જતાં રસ્તા પર લગભગ ૩ કિ.મી. દૂર દેલવાડા ગામ સ્થિત ખૂબ જ અલોકિક અને ભવ્ય દેલવાડા જૈન મંદિર આવેલું છે. આબુ પર્વતની ઉપર આવેલું રાજ્યસ્થાન રાજ્યનું એકમાત્ર દેલવાડા જૈન મંદિર વિશ્વ વિષ્યાત છે. એટલું જ નહીં પરંતુ સરકાર દ્વારા પર્યાટક કેન્દ્રના રૂપે તેનો ઉમદા વિકાસ કરવામાં આવ્યો છે.

દેલવાડા ગામમાં દિગંબર જૈન ધર્મશાળા તથા ભગવાન કુંથુનાથ દિગંબર જૈન મંદિર છે. ધર્મશાળામાં પ્રાથમિક દરેક સગવડો છે.

દેલવાડાના મુખ્ય મંદિરના પરિસરમાં પાંચ મંદિરોનો સમૂહ ખૂબ જ સૂક્ષ્મ કલાકારીગરીથી સજ્જ છે. આ પ્રકારની અતિ ભારીક અને સાષ્ટ કલાકારીગરી અન્ય કોઈ મંદિરમાં જોવા મળતી નથી. આ પ્રકારની કલાકારીગરી જોઈને દેશ-વિદેશના લોકો નવાઈ પામે છે, આશ્રમચક્રિત થઈ જાય છે. જે દરેક કારીગરી સફેદ માર્બલ પર કરવામાં આવી છે. આ શિલ્પ કારીગરીમાં ઘુમ્મર, થાંબલા, દેવ-દેવીઓ અને દેવતાઓના ચિત્ર, નૃત્ય કરતી દેવાંગનાઓ, પશુ-પક્ષીના આબેહૂબ ચિત્રો, ફૂલ-પત્રી-પાંખડીઓ વગેરે કારીગરી સજ્જવતા સ્વરૂપે જોઈ શકાય છે. સફેદ પથરો પર આવી શિલ્પકળા બીજે કંયાંય ભાગ્યે જ જોવા મળે. આ બધી હસ્ત કલાકારીગરી છે. જેનો એક ધાતીસા છે. સફેદ સંગેમરમરથી બનેલા મંદિરોની શોભા અન્યોન્ય અને અવર્ણનીય છે. આ કારણો દેલવાડા મંદિર અદ્વિતીય છે. એટલું જ નહીં પરંતુ તેની ભવ્ય સુંદરતાના પરિણામે તેનું વિશેષ આકર્ષણ છે. દેશ-વિદેશના હજારોની સંખ્યામાં દરરોજ મુલાકાતીઓ અહીં આવીને અનહંદ આનંદ અનુભવે છે. દરેક મંદિરો અને તેની સજાવટ બેમિસાલ અને અદ્ભુત સ્વરૂપના છે. ત્યાં મૂળનાયક આદિનાથજીની પ્રતિમા સંગેમરમર છે. મંદિરમાં કોઈપણ સ્થાનેથી મૂળ નાયકની પ્રતિમાના દર્શન ખૂબ જ સુંદર રીતે થઈ શકે છે. આ મંદિર સને ૧૦૩૧માં ૧૮ કરોડના અને ૫૩ લાખ રૂપિયાના ખર્ચ બીમલ શાહ દ્વારા બનાવવામાં આવ્યું હતું. ત્યાં કુલ પર દેરીઓ છે. દરેક સ્થાનોમાં અલગ અલગ જૈન ભગવાનના દર્શન કરી

શકાય છે. અન્ય એક મંદિરમાં ૪૮ દેરીઓ છે. જે વસ્તુપાળ, તેજપાળ નામના ભાઈઓએ સને ૧૨૩૦માં ૧૨ કરોડ, ૫૩ લાખ રૂપિયાના ખર્ચે તૈયાર કરાવેલ. જ્યાં મૂળનાયક તરીકે ૨૨માં તીર્થકર નેમિનાથજીની મનોગમ્ય પ્રતિમા બિરાજમાન છે. આ સિવાય, ઋષભદેવ પાર્વતીનાથ તથા મહાવીર સ્વામીની પ્રતિમાઓ મંદિરોમાં દર્શનીય અને અજોડ છે. દેલવાડા મંદિરની કલાકારીગરી જોઈને વિદેશના પ્રવાસીઓ ખૂબ જ પ્રભાવિત થાય છે અને આશ્રમ સાથે કલાકોના કલાક સુધી મંદિરોની ભવ્યતા નિહાળતા હોય છે.

દેલવાડાથી ૬ કિ.મી. દૂર એક નાના પર્વત પર શ્વેતાંબર મંદિર અચલગઠ આવેલું છે. તેના પછી ચાર મંદિરોના એક સમૂહવાળું સ્થળ ચૌમુખજીનું મંદિર પણ પ્રખ્યાત છે. ત્યાં ભગવાન આદિનાથજીની આષધાતુ મિશ્રિત સુંદર અને ભવ્ય પ્રતિમા છે. લગભગ ૧૪૪૪ મણ જેટલી વજનવાળી ૧૪ પ્રતિમાઓ છે, જે અંદાજે ૫૦૦ વર્ષ પહેલાની હોવાનું અનુમાન છે.

આબુ પર્વત પર દેલવાડા મંદિર સિવાય અચ્યેત્ન મહાદેવ મંદિર, નખ્ખી લેક, ટોડ રોક, રધુનાથજીનું મંદિર, ગૌમુખ, સૂર્યસ્ત દર્શન, બ્રહ્માકુમારીનું આશ્રમ વગેરે જોવાલાયક છે. આ એક ખૂબ પ્રાચીન હિંદુ તીર્થ તરીકે પણ અજોડ છે.

**ચંકાંત દમજી શાહ (ક.ડી. શાહ) - અમદાવાદ  
મા. ૧૪૨૩ ૯૦૦૭**

## રંગસૂત્ર અને જનીન : રહસ્યમય માહિતીનો ખજાનો

કેટલાક વૈજ્ઞાનિકો માને છે કે બ્રહ્માંડના પ્રારંભિક એકમ તરીકે માત્ર પદાર્થ અને ઉર્જા જ નહીં પરંતુ ઈન્ફર્મેશન એટલે કે માહિતીનો પણ સમાવેશ કરવો પડશે. બ્રહ્માંડમાં કોઈપણ એવો પદાર્થ નથી જેને માહિતી વડે દર્શાવી ન શકાય. સમીકરણ હોય, શાષ્ટ હોય, ચિત્ર હોય, અવાજ હોય કે હાલતા ચાલતા દશ્ય હોય – દરેકને એક અને શૂચની સિકવન્સ તરીકે દર્શાવી શકાય છે. જીવનનું રહસ્ય સમજવા માટે, જીવની ઉત્પત્તિ કેવી રીતે થઈ? તે સમજવા માટે જીવવિજ્ઞાનીઓ હવે ઈન્ફર્મેશન થિયરીનો ઉપયોગ કરી રહ્યા છે. જિનેટિક્સથી માંદીને તબીબી જગત સુધી આ થિયરીનો ઉપયોગ થઈ શકે છે. કોઈપણ એક સાલુને બનાવવો હોય તો પુષ્ટ પ્રમાણમાં અંગોને લગતી માહિતીની જરૂર પડે છે. તે સમયે વાસ્તવા લક્ષણો અને અંગોના વિકાસ માટે જરૂરી જૈવિક ચીજને વૈજ્ઞાનિકો રંગસૂત્ર અને જનીન તરીકે ઓળખતા હતા. રંગસૂત્ર અને જનીન જૈવિક માહિતી ધરાવતું હતું. આમ છતાં રહસ્ય અકબંધ હતું. કેટલાક વૈજ્ઞાનિકો માનતા હતા કે આ માહિતી પ્રોટીનમાં સચ્યવાયેલી છે.

૧૯૪૪માં અમેરિકન બાયોકેમિસ્ટ ઓસવાલ એવરીએ જ્ઞાયું કે કોષમાં આવેલ ખૂબ જ સાદા રેણુ, જિનેટીક ધન્ફર્મેશન ઘરાવે છે. તેને ડીએનએ કહે છે. ત્યારબાદ બીજા વીસ વર્ષ વીતી ગયા. અંતે ખબર પડી કે ડીએનએ, માહિતીને ચાર બેઝપેરમાં જગતી રાખે છે. જિનેટીક માહિતીના આધારે જ સજીવ બદલાવ અથવા ઉત્કાંતિ પામે છે. મનુષ્ય જેવા જટિલ પ્રાણીની બનાવટમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં ડીએનએ માહિતીનો સંગ્રહ કરે છે. હુમન જેનોમ પ્રોજેક્ટ વડે વૈજ્ઞાનિકો જાણી ચૂક્યા છે કે એક મનુષ્યના શરીરમાં ઉપયોગી અને

ક્રિયાશીલ જનીનોની સંખ્યા ૨૫ હજાર જેટલી છે. હુમન જેનોમમાં રહેલ બાકીનો ૮૦ ટકા હિસ્સો જંક ડીએનએ એટલે કે જિનઉપયોગી કચરો છે. ૧૯૮૨માં બોસ્ટન યુનિવર્સિટીના હુજુન સ્ટેનલીએ થિયરી ઓફ ઇન્ફર્મેશન આધારે બતાયું કે જંક ડી.એન.એ. એટલે કે બિન ઉપયોગી જિનેટીક ક્ષેત્રોમાં પણ માહિતી રહેલી છે. મોટી સંખ્યામાં સંશોધકો માને છે કે જેનોમિક્સ દવાની સફળતા સમજવી હોય તો જંક ડી.એન.એ.માં રહેલ માહિતીને પણ લક્ષમાં લેવી પડશે.

## સંબંધ

### દીકરી એટલે શું?

- – દીદાર સાથે જોડાયેલો એક અતૂટ શાસ.
- – કસ્તુરીની જેમ સદાય મહેકતી અને મહેકાવતી.
- – રિષ્ણ સિષ્ણ આપનારી અને પરિવારને ઉજણો કરતી એવી એક પરી.
- ★ કોઈપણ પરિવારમાં એક પિતાને ખખડાવવાનો અધિકાર માત્ર દીકરી પાસે જ હોય છે...
- ★ દરેક દીકરી પોતાના પિતાને કેમ સૌથી વધુ પ્રેમ કરે છે? કેમકે તેને ખબર છે કે આખી દુનિયામાં આ એક જ પુરુષ છે, જે તેને ક્યારેય દુઃખી નહીં કરે...
- ★ દીકરી દાંપત્યનો દીવડો.  
ચર્ચા દરમિયાન મિત્રએ કહ્યું, ‘હું પણી કરતાય મારી દીકરીને વધારે પ્રેમ કરું છું. આજે પણ હું બીમાર હોઉં અને એ સાસરેથી મળવા આવે છે ત્યારે એને જોઈને હું મારા બધા દુઃખો ભૂલી જાઉં છું.’
- ★ મને લાગે છે કે કદાય એ જ કારણે તેની વિદાયવેળાએ મા કરતા બાપને વધુ વેદના થાય છે.  
કેમકે મા રડી શકે છે, પુરુષો આસાનીથી રડી શકતા નથી. દીકરી વીસ-બાવીસની થાય ત્યાં સુધીમાં બાપને તેના વાતસ્ય પ્રેમની આદત પડી જાય છે.
- ★ દીકરી ક્યારેક મા બની રહે છે, ક્યારેક દાઈ બની જાય છે તો ક્યારેક મિત્ર બની રહે છે.
- ★ સુખ હોય ત્યારે દીકરી બાપના હોઠનું સ્થિત બની રહે છે અને દુઃખમાં બાપના આંસુ લૂછતી હૃથેળી બની જાય છે. જોતજોતામાં દીકરી મોટી થઈ જાય છે અને એક દિવસ પાનેતર ઓઢી વિદાય થાય છે.

જતી વેળા પિતાની છાતીએ વળજીને સજળ નેત્રો એ કહે છે : ‘પણા, હું જાઉં છું... મારી ચિંતા કરશો નહીં. તમારી દવા બરાબર લેજો....’ અને ત્યારે પોતાની આંખમાં ઉમટી આવતાં આંસુઓને તે રોકી શકતો નથી.

- ★ કવિ કાલીદાસના અભિજ્ઞાન શરૂતલમાં શરૂતલાને વિદાય કરતાં કણવ ઋષિ કહે છે : ‘સંસાર છોડીને સંન્યાસી બનેલા અમારા જેવા વનવાસીને પુરી વિદાયનું આટલું દુઃખ થતું હોય, તો સંસારીઓને કેટલું થતું હશે?’
- ★ એકવાર મારે એક લગ્નમાં જવાનું બન્યું હતું. મિત્રની દીકરીના લગ્ન હતા. દીકરીને સાસરે વળાવ્યા બાદ ઘરમાં ઢીલા થઈને બેઠેલા અમારા મિત્રએ કહ્યું હતું : ‘આજપર્યત મેં કદી ભગવાનને પ્રાર્થના કરી નથી પણ આજે સમજાય છે કે દરેક દીકરીના બાપે ભગવાનને એક જ પ્રાર્થના કરવી જોઈએ : “પ્રભુ, તું સંસારના સધળા પુરુષોને ખૂબ સમજુ અને શાણા બનાવજો...”
- સંસારની બધી સ્ત્રીઓને તું ખૂબ પ્રેમાળ બનાવજે કેમકે એમાંથી કોક મારી દીકરીની સાસુ કે નાંદ બનવાની છે. ભગવાન, તારે આખી દુનિયાનું પુનઃનિર્માણ કરવું પડે તો કરજે પણ મારી દીકરીને કોઈ વાતે દુઃખ પડવા દઈશ નહીં!
- ★ હમણાં જ નિવૃત્ત થયેલા એક આચાર્યમિત્રે એક વાત કહીઃ “અગર તમારા ઘરમાં દીકરી ના હોય તો પિતા-પુરીના પ્રેમની ઘનિષ્ઠતા તમે કદી જાણી શકવાના નથી. બસ એટલું કરજો, ગમે તેવા મનદુઃખો જન્મે તોય પુત્રવધૂને તેના પિતા વિશે કટુ વચ્ચેનો કદી સંભળાવશો નહીં. દીકરી ભગવાન વિરુદ્ધ સાંભળી લે છે પણ પોતાના પિતા વિરુદ્ધ તે સાંભળી શકતી નથી.

## ધર્મ અને અદ્યાત્મનું પ્રતીક : હઠિસિંહના દેરાસર

ક્ષેમવર્ધન નામના અમદાવાદમાં જન્મેલા જૈન સાધુએ ૧૮૧૪માં રચેલો રાસ નગરશેઠ હીમાભાઈ વખતયંદ ઉપરાંત તે સમયના અમદાવાદનાં જૈન અને જૈનેતર વેપારીઓની દેશ વિદેશની પ્રવૃત્તિઓનો ઘોટક છે.


“આદરતી દોકાનો દેશાવર રે,  
દ્વારા બંગાળ દેશ,  
કાપડ મંગાવે બહુ ભાતાના રે,  
ભારે અલ્પ મૂલ વિશેષ.  
દિલ્હી, આગ્રા, મેડિના રે,  
ચિત્રોડ, કોટા, બુંધી ઓર,  
દક્ષિણ સોરઠ મેવાડ રે,  
જવ ખંડ પ્રસિદ્ધ.  
વહાણવટી વેપારમાં રે,  
કરિયાણું બહુ કોડ,  
જલવટ, સ્થલવટ, ભેદથી રે,  
વાળોતેર બહુ ઓર.”

ચીન સાથે ગુજરાતી જૈનોનો વ્યાપારી સંપર્ક છેક ૧૮૮ સદીથી ભરુચ મારફત હતો. ૧૪૧૧માં અમદાવાદની સ્થાપના પહેલાં પણ ખંખાત, ધોધા અને ભરુચમાં વસેલા જૈનો જાત્રા, સુમાત્રા, બાલી, કંબોડિયા, સીયામ મસાલાનાં ટાપુઓ અને છેક ચીન સુધી વેપાર કરતા હતા. જૈન અષ્ટરાનાં સ્વરૂપમાં ચિન્તિત કરેલા વખ્તોનો ઉપયોગ ઠન્ડોનેશિયા અને ચીનમાં “વોલ હેંગીંસ” તરીકે કેવી રીતે થતો હતો તે “ગુજરાતી અને દરિયો” નામના ગ્રંથમાં બતાવ્યું છે. આ પ્રકારનાં પરંપરાગત વેપારમાં ૧૮માં સૈકામાં અફીણનો કેવી રીતે ઉમેરો થયો, અને હઠાસિંહ કેસરીસિંહ અને તેમનાં વડીલ કુટુંબીજન મહોકમભાઈએ આ તકનો કેવી રીતે લાભ લીધો તેની વાત સૌપ્રથમ વખત કરીને જૈનોનાં રીલિજિયસ નેટવર્ક અને બિઝનેસ સક્સેસનાં તાણાવાળાં સાંધ્વા છે. આ વાત તહન નવી હોવા ઉપરાંત આજની જનરેશનને રસ પડે તેવી છે.

હઠીસિંહનું દેરાસર ચીન સાથેનાં એમનાં અફીણ અને કાપડનાં ધીકતા વેપારમાંથી નિષ્પત્ત થયું હતું. અફીણનો ઉપયોગ છેક પ્રાચીનકાળથી પીડાશામક રૂગ તરીકે થતો આવ્યો છે. પણ હિંદના રાજ મહારાજાઓ તેમજ ચીન જેવા વિદેશોમાં તેનો ઉપયોગ નશા તરીકે કરતા હતા. અફીણનો નશો ઓર હોય છે! તેનું સેવન કરનારને તે સદેહે વૈકુંઠના દર્શન કરાવે છે! ચીનને તેનો ચસ્કો લગાડનાર હુંગલીશ ઈસ્ટ ઈન્ડિયા કંપની હતી. અફીણનું વાવેતર હુંગલેન્ડ અને યુરોપમાં થતું નહીં હોવાથી કંપની સરકારે ૧૭૭૦ બાદ બંગાળ, મધ્ય પ્રદેશનાં માળવા અને રાજસ્થાન ઉપરાંત સૌરાષ્ટ્રમાં તેનાં વાવેતરને ઉત્તેજન આપ્યું. ચીનનાં બંદરો કેન્ટોન (હવે ગુવાનઝો) અને મકાઉમાં ઈસ્ટ ઈન્ડિયા કંપની અફીણની

પેટીઓ મોકલતી અને તેમાંથી અઢળક નફો પ્રામ કરતી. કંપની સરકારને આવો બહોળો નફો પ્રામ કરતી જોઈને સર જમશેરદજી જુઝભાઈ, હોરમરજી દોરાબજી, દીનશા માણેકજી પીટિટ, ફરમજી કાવસજી અને પેસ્તનજી વાડિયા જેવા મુંબઈના પારસી વેપારીઓની જેમ અમરચંદ ખીમચંદ, તારાચંદ મોતીચંદ અને મોતીશા અમીચંદ પણ અફીણના વેપારમાં રૂકાયું. તેઓ કરોડપતિ થયા. મુંબઈના જૈનો જ્યારે પાલીતાણ તથા રાણકપુરનાં સંઘ કાઢતા ત્યારે સુરત અને વડોદરા ઉપરાંત અમદાવાદનાં જૈનો તેમાં જોડાતા હતા. અમદાવાદના નગરશેર વખતચંદ ખુશાલચંદ અને તેમનાં પુત્ર હીમાભાઈ, કરમચંદ પ્રેમચંદ (હઠીસિંહના દાદા) તેમાં જોડાતા. આવા સંજોગોમાં હઠીસિંહ અને તેમનાં કાકા રચયંદના પુત્ર મહોકમભાઈએ ૧૮૨૨માં શરુંજયનો સંઘ કાઢ્યો અને તેનો તમામ જશ મુંબઈનાં અફીણના વેપારનાં બેતાજ બાદશાહ મોતીશા અમીચંદને (૧૭૮૨-૧૮૩૭) આપ્યો. તેથી મોતીશાહે ખુશ થઈને ૨૬ વર્ષના હઠીસિંહને અફીણનાં વેપારની ‘લાઈન’ બતાવી. હઠીસિંહે ઘોઘાની કન્યા હરકુંવર સાથે ૧૮૩૮માં લગ્ન કર્યા. તે પહેલા પણ દમણ અને મુંબઈ ઉપરાંત ઘોઘા બંદરનો ઉપયોગ કરીને ચીનનાં કેન્ટોન બંદરમાં અફીણની પેટીઓની પેટીઓ નિકાસ કરતા હતા. તે વખતે ઘોઘા બંદર ભાવનગર રાજ્યના તાબામાં હતું. ઘોઘા કોઈ ધાર્મિક સ્થળ નહીં પણ સૌરાષ્ટ્રનું ધીકતું બંદર હતું અને હઠીસિંહ ધંધાર્થી તેની અવારનવાર મુલાકાત લેતા હતા. ચીન સાથેનાં અફીણનાં વેપારમાંથી હઠીસિંહ થોડા જ વર્ષોમાં એટલું બધું કમાયા કે તેમની ગણના અમદાવાદના સૌથી ધનિક આસામી તરીકે થતી. મૃત્યુ સમયે તેમની મિલકત ૮૦ લાખ રૂપિયાની (તે સમયના!) હતી. આમ ચીન સાથેનાં અફીણનાં વેપારમાંથી પ્રામ થયેલા દ્રવ્યનો ઉપયોગ તેમની સ્મૃતિ જાળવવા “હઠીસિંહના દેરાસર”નાં સર્જનમાં થયો હતો.

તારાયંદ મોતીયંદે (૧૭૭૬-૧૮૫૨) ચાઈનીઝ બંદર  
કેન્ટોનમાં ૧૨૦૦ વર્ષ જૂના હોનાન બુથિસ્ટ મંદિરની સમીપમાં  
૧૮૧૨માં પાર્શ્વનાથનું મંદિર બંધાવીને ભગવાન પાર્શ્વનાથની  
પિતળની વિશાળ મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરી. ૧૮માં સૈકાના અંત  
સુધી આ મંદિર હયાત હતું. તેની તપાસ કરવી ખૂબ જરૂરી છે.  
તારાયંદ મોતીયંદ વર્ષો સુધી ચીનમાં રહ્યા હતા. આ વસ્તુસ્થિતિ  
બતાવે છે કે કેન્ટોન બંદરમાં જૈનોની નાનકડી વસાહત હશે. મુદ્રો  
એ છે કે ધર્મ અને વિદેશ વેપાર પેરેલલ ચાલ્યા હતા! “હઠિસિંહ  
દેરાસર ફીનોમીના”ને માત્ર ધર્મ, અધ્યાત્મ અને કલાના ઢાંચામાં  
ગાળી ના નાખતાં તેને ગ્લોબલ આર્થિક ફીનોમીનાનાં વ્યાપક  
સ્વરૂપમાં જોવા વધારે ઉચિત છે. આ દાણિએ જો જોઈએ તો  
હઠિસિંહનું દેરાસર “લોકલ” તેમજ “ગ્લોબલ” ફીનોમીના છે!  
તે અમદાવાદના વર્લ્ડ હેરિટેજને વધારે વ્યાપક સ્વરૂપમાં જોવામાં  
મદદરૂપ છે.



## ગેમ્સ ગેલેરી

## આઈ લવ માય છન્ડિયા



ભાવના એ. પટેલી

૧૫મી ઓગસ્ટ નજીક આવી રહી છે. તેની ઉજવણી કરવા માટે થઈ જાવ તૈયાર. આ ગેમ તમે ગીત-સંગીતની સાથે સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓને, સિનિયર સિટીઝન, ડિટી પાર્ટીમાં ધ્વજવંદનના સેલિબ્રેશનમાં રમાડી શકશો. તમને તો ખ્યાલ જ હશે કે ગેમ રમીએ એટલે ટ્રિવસ્ટ - સરપ્રાઇઝ તો આવે જ... બધું ને....?

આપેલાં બોક્સમાં દેશની આજાઈને લગતાં ગીતોની કરીઓ આપેલી છે. તે રમનારાની સંખ્યા પ્રમાણે કલર પ્રિન્ટ કરાવી, બધાને પેન-પેડ સાથે આપો. રમનારે તે બધામાં આપેલા રાઉન્ડમાં ૧ થી ૮૦માંથી મનપસંદ અંક લખીને તૈયાર કરો.

હોસ્ટે હાઉસીનું બોર્ડ અને ટોકન નંબર લઈ આ ગેમ રમાડવાની રહેશે. ગિફ્ટની તૈયારી પહેલેથી જ કરી રાખો. ફ્લેગ, બ્રોજ બધાને આપવા માટે રાખો.

## ● ગેમના નિયમો ●

## જવાબ કેમ આપવા?

રમનારને નિયમ પ્રમાણે જે ગીતની કરીના નંબર કર થાય તે ગીત સૂર-સ્વર સાથે ગાવાનું રહેશે. એકાદ કરી જ. બાદમાં નંબર વેરિફિય કરવાના રહેશે.

- ★ ક્રિક્ષક પાંચ નંબર : ચાર કોર્નર અને વચ્ચેનો એક નંબર.
- ★ કેમ પ્રમાણે પહેલી બે લાઈનો-૧,

૧.
સારે જહાં સે અચા
વંદે માતરમું સુજલામું
મેરે દેશ કી ધરતી સોના
યે દુનિયા એક દુલ્હન
જહાં ડાલ પર સોને કી
ભારત હમકો જાસે...

૨.
દે દી હુમેં આજાઈ બિના
દેશ મેરા રંગીલા રંગીલા
હર કરમ અપના કરેંગે
યે દેશ હે વીર જવાનોં કા
હે પ્રીત જહાં કી રીત
હોઠોં પે સર્વાઈ રહતી

૩.
નશા મુશ્શા રાહી હું
એ મેરે વતન કે લોગોં
સરફરોશી કી તમજા
કર યલે હમ ફિદા જાન
આઓ બચ્ચોં તુછે દિયાયે
અય મેરે ઘારે વતન

બીજી લાઈનના બે, ત્રીજી લાઈનના ત્રણ નંબર કરવાના.

- ★ પહેલી લાઈનના બધા જ નંબર.
- ★ બીજી લાઈનના બધા જ નંબર.
- ★ ત્રીજી લાઈનના બધા જ નંબર.
- ★ બધા જ નંબર થાય તે વિનર. તેને આ બધામાંથી મનગમતું ગીત ગાવાનું.

**ટ્રિવસ્ટ :** ગેમ રમાડતા વચ્ચે આવા પ્રશ્નો પૂછો. જવાબ આપનારને ગિફ્ટ આપો.

(૧) રાષ્ટ્રીય ચિક્કો, (૨) આજાઈના ઘડવેયાના નામ-પ, (૩) દેશભક્તિને લગતી મૂવિના નામ-પ, (૪) રાષ્ટ્રીય પ્રાણી-પક્ષી, (૫) સ્લોગન બોલો-૩

## સરપ્રાઇઝ :

૧. જેણે ફ્લેગ વડે દિનિયાનું ટેટુ કરાવેલું હોય.
૨. ડ્રેસમાં દિનિયાનું બ્રોજ નાખેલું હોય.
૩. સફેદ કલરનો, કેસરી-લીલા કલરનો ડ્રેસ પહેરેલો હોય.
૪. માથામાં કેસરી-સફેદ-લીલા પાનની વેણી નાખેલી હોય.
૫. ધ્વજવંદનમાં શિસ્તબદ્ધ રીતે ઊભીને કરેલું ધ્વજવંદન.


આમ હોસ્ટને યોગ્ય લાગે એ રીતે સરપ્રાઇઝ આપીને બધાને ખુશ કરો.

દુઃખ અને દર્દ પામો ત્યારે એમ માનો કે વિધાતાએ તેના માટે તમને ખાસ પસંદ કર્યા છે.

પાનખરની વિદાય પછી વસ્તં આવવાની જ છે. તમારાં સ્વખાની માવજત કરો, તેમને મરવા ના દો.

‘આવું શા માટે? હું જ શા માટે? કયા પાપે?’ – આવું બધું વિચારીને સંતાપ ના કરો.

બધા સવાલોના જવાબ મળી જ રહેશે.



**ગોમસ ગેલેરી**


## ગોમસ ગેલેરી : પર્વત



સંકલન : કિરણબેન પી. ૮૫૫૨

### પર્વત-૧ : આંકડાઓની આંટીઘૂંઠી

આપેલ કલુ સાથે મગજમારી કરી સંખ્યા શોધો



૧. પહેલા અને બીજા આંકડાનો સરવાળો કરીએ તો જવાબ ‘૧૫’ મળે છે.
૨. બીજા આંકડામાંથી ત્રીજો આંકડો બાદ કરીએ તો જવાબ ‘પહેલો’ આંકડો મળે છે.
૩. ત્રીજા અને પાંચમા આંકડાનો સરવાળો કરીએ તો જવાબ ‘પહેલો’ આંકડો મળે છે.
૪. પહેલા અને ચોથા આંકડાનો સરવાળો કરીએ તો જવાબ ‘૧૦’થી વધુ મળે છે.
૫. ચોથા અને પાંચમા આંકડાનો ગુણાકાર કરીએ તો જવાબ બીજા આંકડાથી ‘૩’ ગણો મળે છે.
૬. પહેલા અને બીજા આંકડાનો ગુણાકાર કરીએ તો જે જવાબ મળે છે તેને ચોથા આંકડા વડે નિઃશેષ ભાગી શકાય છે.
૭. છેલ્લા ત્રણ આંકડાનો ગુણાકાર કરીએ તો જવાબ ‘૨૪’ મળે છે.
૮. ચોથા આંકડામાંથી ત્રીજો આંકડો બાદ કરીએ તો જવાબ પાંચમા આંકડાથી ‘અડ્ધો’ મળે છે.
૯. પહેલા અને પાંચમા આંકડાનો સરવાળો કરીએ તો જવાબ બીજા, ત્રીજા અને ચોથા આંકડાનો સરવાળો મળે છે.
૧૦. જો બધા આંકડાઓનો સરવાળો કરીએ તો જવાબ ‘૨૬’ મળે છે.

### પર્વત-૨ : જો.... અને તો....

આ પર્વતમાં ત્રણ કલુ આપેલા છે. તેની મદદ વડે યોગ્ય શબ્દ શોધો.

<b>A</b>	<input type="radio"/>	<input type="radio"/>	<input type="radio"/>	<input type="radio"/>	<b>B</b>	<input type="radio"/>	<input type="radio"/>	<input type="radio"/>	<input type="radio"/>	<b>C</b>	<input type="radio"/>	<input type="radio"/>	<input type="radio"/>	<input type="radio"/>
----------	-----------------------	-----------------------	-----------------------	-----------------------	----------	-----------------------	-----------------------	-----------------------	-----------------------	----------	-----------------------	-----------------------	-----------------------	-----------------------

૧. જો બીજો અને ત્રીજો અક્ષર કાઢી, પહેલા અક્ષરને દીર્ઘ ઈ લગાવીએ તો ‘મદારીનું વાદ’ મળે.
૨. જો ત્રીજો અને ચોથો અક્ષર કાઢી, પહેલા અક્ષરને કાનો લગાવીએ તો ‘લોખંડનો મેલ’ મળે.
૩. જો પહેલો અને ચોથો અક્ષર કાઢી, બીજા અક્ષરને દીર્ઘ ‘ઈ’ લગાવીએ તો ‘પદ્ધતિ’ મળે.

૧. જો પહેલો અને ત્રીજો અક્ષર કાઢી, પહેલા અક્ષરની જગ્યાએ ‘સ’ મૂકીએ તો ‘આફંત’ મળે.
૨. જો બીજો અને ત્રીજો અક્ષર કાઢી, પહેલા અક્ષરને કાનો લગાવીએ તો ‘લોખંડનો મેલ’ મળે.
૩. જો બીજો અને ચોથો અક્ષર કાઢી, ત્રીજા અક્ષરનો કાનો પણ કાઢીએ તો ‘યુક્તિ’ મળે.

**જવાબ  
આપો  
ફટાફટ!**

- (૧) લોકમાન્ય તિલકે ગીતા વિશે લખેલા પુસ્તકનું નામ શું છે? (૨) ફિલ્મ કલાકાર અરબાજ ખાનની પત્નીનું નામ શું છે? (૩) રાવશના મૃત્યુ પછી લંકાના રાજ કોને બનાવવામાં આવેલ? (૪) સો઱િયમ કલોરાઇડને સામાન્ય ભાષામાં શું કહેવાય? (૫) કયો રાગ ગાવાથી વરસાદ વરસે એવી માન્યતા છે? (૬) પૃથ્વી કોનું બીજું નામ હતું? (૭) ડાયપરની દાઢ કેટલી હોય છે?

### પણલ-૩ : આંકડાઓની આંટીઘૂંઠી

૧. ૬ ની ઉપર ૨૬ ને નીચે ૩૦ છે.
૨. ૧૮ ની નીચે ૨૮ ને ડાબી બાજુ ૮ છે.
૩. ૧ ની ઉપર ૨૦ ને નીચે ૭ છે.
૪. ૨૦ ની ઉપર ૧૦ ને નીચે ૧ છે.
૫. ૧૨ ની ડાબી બાજુ ૨૧ ને નીચે ૨ છે.
૬. ૮ ની ડાબી બાજુ ૧૮ ને ઉપર ૨૨ છે.
૭. ૪ ની ઉપર ૮ ને ડાબી બાજુ ૨૩ છે.
૮. ૧૬ ની નીચે ૯ ને ડાબી બાજુ ૫ છે.
૯. ૨૪ ની ડાબી બાજુ ૭ ને જમણી બાજુ ૧૪ છે.
૧૦. ૧૭ ની નીચે ૧૦ ને જમણી બાજુ ૩ છે.
૧૧. ૧૧ ની નીચે ૨૪ ને જમણી બાજુ ૩૦ છે.
૧૨. ૨૭ ની ડાબી બાજુ ૨૦ ને ઉપર ૧૫ છે.
૧૩. ૨૨ ની ઉપર ૨૮ ને જમણી બાજુ ૧૩ છે.
૧૪. ૧૮ ની નીચે ૨૩ ને ઉપર ૨૫ છે.

જવાબો  
આ જ  
અંકમાં  
અન્યત્ર  
આપેલા  
છે.

### આપેલ કલુ પ્રમાણે પણલ ભરો.

નીચે આપેલા કોષ્ટકમાં કટુની મદદ વડે

૧ થી ૩૦ સુધીના અંકો ગોઠવો

			૧૨	૫	
	૧૫				
			૨૫		
					૧૬
			૧૪		

## ભારતના ખ્યાતનામ વૈજ્ઞાનિકો

૧. ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ : ભારતને પ્રક્ષેપાદ્ર ક્ષેત્રે મહાસત્તા બનાવનાર દેશના આ મહાન વૈજ્ઞાનિકને દેશના સર્વોચ્ચ સંન્માન 'ભારત રત્ન'થી નવાજી ભારતે પોતાનો પ્રતિભાવ વ્યક્ત કર્યો છે. ગાઈડર મિસાઈલ્સ (પ્રક્ષેપાદ્ર) નો યશ ડૉ. અબ્દુલ કલામને ફાળે જાય છે.
૨. ડૉ. ચંદ્રશેખર વેંકટ (સી.વી.) રામન : 'રામન અસર' ની શોધ માટે તેમને ઈ.સ. ૧૯૩૦ માં નોબેલ પારિતોષિક મળ્યું હતું. વિજ્ઞાનના ક્ષેત્રે નોબેલ પારિતોષિક મેળવનાર તે પ્રથમ એશિયન વ્યક્તિ હતા. તેમણે 'ઈન્ડિયન એકેડમી ઓફ સાયન્સ' અને 'રામન રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ' ની સ્થાપના કરી હતી.
૩. ડૉ. જગદીશચંદ્ર બોગ : ડેસ્કોગ્રાફ, રેઝોનાસ, રેકોર્ડર વગેરે સાધનોની શોધ કરી વનસ્પતિમાં માણસની માફક સંવેદના છે તે સાબિત કરી આખા જગતને આંજી નાખનાર વૈજ્ઞાનિક. તેમની બીજી શોધ ઈલેક્ટ્રિક વેલ (વાયરલેસ) ની છે.
૪. ડૉ. હોમી ભાબા : ભારતીય આણુશક્તિ કાર્યકર્મના સર્જક, એટભિક એનર્જી કમિશનના પ્રથમ અધ્યક્ષ.
૫. ડૉ. કે.એ.સ. કિશનન : સી.વી. રામનના શિષ્ય, પ્રકાશના સંશોધનમાં તેમના સહભાગી, તેમને 'નશનલ પ્રોફેસર પદ' અને 'પદ્મભૂષણ' ના પુરસ્કારો મળેલ છે.
૬. ડૉ. પ્રકૃત્લલ ચંદ્ર રોય : મહાન રસાયણશાસ્ત્રી. મકર્યુરેસ નાઈટ્રેસને લગતી તેમની શોધ નોંધપાત્ર છે.
૭. ડૉ. મેધનાથ સહા : મહાન ભૌતિકશાસ્ત્રી, ભૌતિકશાસ્ત્રને લગતાં તેમનાં લખાણો અને સંશોધન નિબંધો નોંધપાત્ર છે.
૮. શ્રીનિવાસ રામાનુજમ્મ : વિશ્વવિદ્યાત ગણિતશાસ્ત્રી, જેમણે નંબર થીઅરી આપી.
૯. ડૉ. વિજમ સારાભાઈ : અવકાશી સંશોધન માટે ભારતને આંતરરાષ્ટ્રીય ઘ્યાતિ અપાવી. તેઓ ગુજરાત રાજ્યના અમદાવાદ ખાતેની ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી અને અટિરા જેવી આંતરરાષ્ટ્રીય સંશોધન સંસ્થાઓના પ્રણેતા છે.
૧૦. ડૉ. જયંત લાર્ટીકર : ઇંગ્લેન્ડના પ્રાધ્યાપક મિ. ઓર્ટિલ સાથે તેમણે આઈન્સ્ટાઇનના સાપેક્ષવાદમાં સુધારા સૂચ્યા છે.
૧૧. ડૉ. હરગોવિંગ ખુરાના : જનીન વિજ્ઞાનમાં સંશોધન કરી નોબેલ પારિતોષિક મેળવનાર વૈજ્ઞાનિક, જેઓ અમેરિકામાં સ્થાપી થયા છે.

આ ઉપરાંત ડૉ. રામનાથન, ડૉ. શાંતિ સ્વરૂપ ભટનાગર, ડૉ. આત્મારામ ઉપેન્દ્ર ટેસાઈ, ડૉ. ચંદ્રશેખર, ડૉ. રાજી રામના, શ્રી રાવ, ડૉ. યશપાલ ક્રૂર, ડૉ. સતીષ ધવન, ડૉ. એમ.જી.કે. મેનન, ડૉ. વરદરાજન, પ્રો. અર્થના શર્મા વગેરે પણ નોંધપાત્ર વૈજ્ઞાનિકો છે.

## ખુમારી

ધિલેંમે વસેતી, ખુમારી અસાંજુ,  
કલીજું ખુલેતી, ખુમારી અસાંજુ.

મિડે ભા ઉભા રૈં, વતનજે જતન લા,  
છિલોછિલ છિલેતી, ખુમારી અસાંજુ.

લરી પોં ડિસી હુખ, નં સુખમેં છિકોંતા,  
રગારગ કુછેતી, ખુમારી અસાંજુ.

ફનાગીર થિઈને લુટાયું સિરેંકે,  
બિવણજું બિવેતી, ખુમારી અસાંજુ.

નમે કોય જિત કુઠ, નમોં વેંત પૂરી,  
નમેસેં ચેતી, ખુમારી અસાંજુ.

ધિલેંમેં મહોભત, ખુસીજા છિલોરા,  
ખુસીમેં બિરેતી, ખુમારી અસાંજુ.

અહિસા અમનજા અયું ભેખધારી,  
ભલી થિઈ ભલેતી, ખુમારી અસાંજુ.

અલગ નાય કો હિત, સજો જગ જ હિકડો,  
ખલકતે રમેતી, ખુમારી અસાંજુ.

વજેં સાજ ભેરા, 'કુમર', લય રખીને,  
સુરીલો કુછેતી, ખુમારી અસાંજુ.

ખગી હુલેન શસ્ત્રમાયલ (કમર કચ્છી) - મુજ, કર્ણ  
મો. ૯૯૨૭૫૮૮૨૩૮૮

## જોવા આવ્યો છું

સર્જન કરેલું કુદરતે આ જગત જોવા આવ્યો છું,  
તારા-ચંદ્ર ને સૂર્યથી શાંતગારેલું જગ જોવા આવ્યો છું.

આકાશ મહીં સમરંગે મહેલું આભ જોવા આવ્યો છું,  
બટ્યુ-ભૂરા ગગન મહીં રંગ નિહારવા હું આવ્યો છું.

વસુંધરા-પર્વતની લીલી ચાદર જોવા આવ્યો છું,  
સાગર, સરિતાને સમીરથી સરેલું જગ જોવા આવ્યો છું.

કુદરતે સર્જલા રંગબેરંગી વૃક્ષ - પુષ્પ જોવા આવ્યો છું  
ને કુદરતે વિવિધ રીતે સરેલી ધરા જોવા આવ્યો છું.

આ ધરા 'દિલકશ' જોવાનો આનંદ લેવા આવ્યો છું,  
ને ભરચોમાસે માટી સોડમ પ્રસરે તે લેવા આવ્યો છું.

દિલીપ આચાર્ય 'દિલકશ' - મુજ  
મો. ૯૯૨૪૪ ૨૬૬૮૮

## પિતાની વાત - બાળકની સંગાથ

જાણી મારા આગમનની વાત,  
મળી તેમને મીઠી સૌગાત.  
અનુભવી રહ્યું મન અનોખી અમીરાત,  
આ છે, મારા પ્રત્યેના પ્રેમની શરૂઆત.  
પિતા છે, સ્નેહ સાથેની મુલાકાત.

રાહ જોતા એ અનિમેષ નયનો  
ક્યારે છૂટશે મારા બંધનો  
ઉમટી રહ્યો હૃદયમાં બાલનો દરિયો,  
મને ભીજવવા આતુર એ રુદ્ધિયો  
પિતાએ વાત્સલ્યનો અણમોલ ખજાનો ધરીયો.

મારા આગમનની સાથે રહી પડી આંખો  
નિરખી મને, જોઈ મને,  
ફિક્કા પડ્યા દુનિયાના સુખ લાખો  
છાતીએ વળગાડી મળી ગઈ સ્વર્ગ સુખની પાંખો,  
પિતાનો પ્રેમ છે અનોખો.

મોટો થતો હું હાથ પકડતો ક્યારેક  
નિરાશ થતો, હું હતાશ થતો  
આદિંગનથી પિતાના ત્યારે,  
નીડર ફરી હું બનતો જતો,  
સ્વરૂપ પિતાનું એ, કદી ન વિસરતો.

સ્નેહથી તરબોળ કર્યો તો,  
કડોર બની સાવધાન કર્યો  
પાઈ શીખવી હિંમત અને સાહસના,  
મુશ્કેલીમાં, આગળ વધવા સજજ કર્યો  
પિતા છે, અનોખું વક્તિત્વ, એવો મેં તરજુમો કર્યો.

રોશની ગૌતમ શાહ - માધાપર, કર્ણ

## હવે શક્યતા નથી

રસ્તે ફરી મળાય હવે શક્યતા નથી,  
પાછું અહીં અવાય હવે શક્યતા નથી.

મિલનની જંખનાને ડાળ પણ ઉગે,  
સાકાર સ્વખ થાય હવે શક્યતા નથી.

જો તર્જ એ હતી - ઉઘડશે સૂરો, ખરા,  
ગીતો એ જ ગવાય હવે શક્યતા નથી.

જન્મો યુગાવતારોના ફરી ભલે થતા,  
ગીતાઓ ફરી લખાય હવે શક્યતા નથી.

બની ગયા છે ભક્ત કૃષ્ણના દુઃશાસનો,  
ચીર દ્રૌપદીના પુરાય તે હવે શક્યતા નથી.

રમેશચંદ્ર જ. વૈદ - મુજ, કર્ણ  
મો. ૯૫૫૮૭૨૭૭૧૭૬

૧	૨			૩	૪		૫	૬		૭
૮				૯			૧૦			૧૧
							૧૪			
૧૫	૧૬				૧૭				૧૮	
	૧૯			૨૦				૨૧		
૨૨		૨૩					૨૪	૨૫	૨૬	
૨૭	૨૮			૨૯		૩૦		૩૧		
૩૨							૩૩		૩૪	૩૫
	૩૬	૩૭	૩૮	૩૯		૪૦				
૪૧		૪૨		૪૩			૪૪			૪૫
૪૬	૪૭			૪૮					૪૯	
	૫૦									

શબ્દ રમત ભરનારનું નામ : \_\_\_\_\_

સરનામું : \_\_\_\_\_

ફોન/મો. \_\_\_\_\_

આપણીના જવાબો તા. ૩૧-૦૮-૨૦૨૦ સુધીમાં શ્રી કથી જૈન ભવન - પાલડીના સરનામે મોકલાવવા વિનંતી.

**આડી ચાવીઓ**

૧. દેવોના ઋષિ, નારદ (૩)  
 ૩. કામ ચલાવવા પૂર્તું, હંગામી (૫)  
 ૮. ધારણા, અભિપ્રાય, મત (૨)  
 ૯. પવન ઝૂંકવાનું એક સાધન,  
કોરોનાના દર્દી માટેના  
વેન્ટિલેટરનું નામ (૩)  
 ૧૦. હોટલમાં નોકરને આપવામાં આવતી  
બખીસ (૨)  
 ૧૧. હોરી, વહાણ (૨)  
 ૧૪. પરાજ્ય, પંક્તિ, ગળાનું ઘરેણું (૨)  
 ૧૫. ગામ કે જેતરની ચોકી કરનાર (૪)  
 ૧૭. ભોમિયો, રાહ બતાવનાર (૪)  
 ૧૮. આશા, ઉમેદ, \_\_\_\_\_ નિરાશ, ભય (૨)  
 ૧૯. ગાઢી તકિયાનો ગલેઝ (૨)  
 ૨૦. અંધારિયાનો છેલ્લો ટિવસ (૩)
૨૩. મંદિર, દેવસ્થાન (૪)  
 ૨૪. પગે ચાલીને પ્રવાસ કરનાર, પાદચારી (૪)  
 ૨૭. સાઠીનો લટકતો છોડો (૩)  
 ૨૮. રામનો એક પુત્ર (૨)  
 ૨૯. માણ ખાડાવી કથા કહેનાર, વ્યાસ (૪)  
 ૩૧. બુદ્ધિ, મતિ, નહિં, અભિપ્રાય (૨)  
 ૩૨. વેશ ભજવનાર, દોડા પર ચાલનાર (૨)  
 ૩૪. શાસ લેવાનું એક અંગ (૨)  
 ૩૬. પ્રયત્ન, મહેનત (૩)  
 ૩૮. પડોશમાં રહેતી સ્ત્રી (૪)  
 ૪૨. રાત્રે સુગંધ આપતું ફૂલ (૪)  
 ૪૩. રાજાની સ્ત્રી (૨)  
 ૪૪. બાખર, શરીરનું રક્ષણ કરનાર મંત્ર (૩)  
 ૪૬. ઢોંસા સાથે ખાવાનું દાળ જેવું પીણું (૩)  
 ૪૮. સ્નેહાળ, હેતાળ, માયા રાખનાર (૩)  
 ૪૯. આય, આવક, આયાત (૨)

૫૦. રંગોની ખેંચ, તંગી, અછત (૨)  
 ૫૧. \_\_\_\_\_ મોટા ને દર્શન ખોટા (૨)

**જાની ચાવીઓ**

૧. જૈનોનું દેવસ્થાન, જિનાલય (૪)  
 ૨. ઊમર, વાયુ (૨)  
 ૩. વશીકરણ, જંતર મંતર,  
મોહિની લગાડવી તે (૩)  
 ૪. ૪૦ શેરનું તોલે (૨)  
 ૫. લાકડાનું પીઠું (૨)  
 ૬. ભેટ, બખીસ (૪)  
 ૭. ખાલી જગ્યા, સ્પેસ, કુરસદ (૪)  
 ૧૨. કિકેટના વર્લ્ડ કપ જીતનાર  
પ્રથમ ભારતીય કેપ્ટન (૪)  
 ૧૩. જોખમ ભરેલું કામ (૩)  
 ૧૬. એક રમત, ખો (૨)  
 ૧૭. રામની જીવન કથાનો ગ્રંથ (૪)  
 ૨૦. લોન્ડાનું કબાટ, તિજોરી (૪)  
 ૨૧. સૃષ્ટિનો સૌથી પ્રથમ જન્મેલ પુરુષ,  
\_\_\_\_ અને ઈવ (૩)  
 ૨૨. ઊગતા સૂર્યનો દેશ (૩)  
 ૨૩. દેવતા (૨)  
 ૨૬. દુઃખ, કષ્ટ, પીડા (૩)  
 ૨૮. શરીરનો મોહક હાવભાવ, નખરું (૩)  
 ૩૦. નકામી ફજેતી (૩)  
 ૩૩. લગ્ન તિથિ વખતે કન્યા કે વર  
સાથે રહેનાર મિત્ર (૪)  
 ૩૪. પક્ષીઓનો મધુર ધ્વનિ, કલાબલાટ (૪)  
 ૩૭. સવારનો નાસ્તો (૪)  
 ૩૮. સો (૨)  
 ૩૯. ધરમાં પાણી રાખવાની જગ્યા (૪)  
 ૪૦. વહેમ, શંકા, સંવત (૨)  
 ૪૧. મનુષ્ય, પુરુષ (૨)  
 ૪૩. સ્ત્રી, સુંદર સ્ત્રી (૨)  
 ૪૫. અવાજ, ધ્વનિ, નાદ (૨)  
 ૪૭. સતે પે \_\_\_\_\_, અમિતાભની ફિલ્મ (૨)  
 ૪૮. કેરી, મરડો, કાચો મળ (૨)

**'શબ્દ રમત' તથા 'સુડોકુ' બાબત**

કોરોના વાયરસના કારણે હાલે પોસ્ટ  
ખાતાની કેટલીક કામગીરીને અસર થઈ છે.  
આ સ્થિતિ અગાઉની જેમ જ્યારે નિયમિત  
થશે ત્યારે શબ્દરમત તથા સુડોકુ વિભાગના  
જવાબ મોકલનારના નામો જીહેર કરવા  
તથા ઈનામ વિતરણ સંબંધી કાર્યવાહી  
કરવામાં આવશે, જેની નોંધ લેશો.

## ૭ NanoNine® શાદ રમત-૧૬રનો ઉકેલ

ક	મ	લા	ક	ર		કુ	પા		દા		પા
બ	રો		પા	વ	ન		ય	મ	સ	દ	ન
ર	ડ	મ	સ		સ	વ	લ	ત		લ	
		હે		ચ	કો	ર		લ	ખ	પ	તિ
અ	ચ	ર	જ		રી		શ	બ		તિ	થિ
		બા	જ	રી		શા	હુ		અ		
ર	જ	ની		ત	સ	ર		તી	ર્થ	ધા	મ
જ	ગ			ભા	ગી	દા	ર				હે
	ત	ર	બ	ત	ર		મ	ન	મો	હુ	ન
શ		ત	લ			સ	ખા		ભા	ર	ત
રા	વ		વા	તા	વ	ર	એ		દા	એ	
ફ	ર	મા	ન		દ	લ		હા	ર		હા

## શ્રીપત્રી રંજન

### કયા હીરો-હીરોઈનોના સંતાનો ફિલ્મમાં આવ્યા?

પૃથ્વીરાજ કપૂર પછી રાજકપૂર, શમ્મી કપૂર. રાજ કપૂરના પુત્રો રણધીર કપૂર, રિશી અને રાજીવ કપૂર. રણધીર બબીતાની પુત્રીઓ કરિશ્મા અને કરીના. શશી કપૂરના પુત્રો કરણ અને કુણાલ. ધર્મન્દ્રના પુત્ર સની અને બોબી ટેઓલ. દેવ આનંદનો પુત્ર સુનિલ આનંદ. મનોજકુમારનો પુત્ર કુણાલ ગોસ્વામી. અરુણ આહુજાનો પુત્ર ગોવિંદા. રાજ કુમારનો પુત્ર પુરુ, પાનીની. રાજેન્દ્ર કુમારનો પુત્ર કુમાર ગૌરવ. સુનિલ દત્તનો પુત્ર સંજ્ય દત્ત. વિનોદ ખનાનાં પુત્ર અક્ષય અને રાહુલ ખના. વિશ્વાતનો પુત્ર પ્રસત્થાત. જિતેન્દ્રનો પુત્ર તુખાર. નાસીર ખાનનો પુત્ર અચ્યુત ખાન. અમિતાભનો પુત્ર અભિષેક. રાકેશ રોશનનો પુત્ર હવિક. ફિરોઝ ખાનનો પુત્ર ફરદીન. જગદીપનો પુત્ર જાવેદ જાફરી વગેરે.

**હીરોઈનની પુગીઓ :** ફાતિમા શેખ - જુબેદા, જદનબાઈ

- નરગીસ, નસીમ - સાઈરાબાનુ, શરીફા - હુસનબાનુ, હુસનબાનુ - નારીમા, જયશ્રી - રાજશ્રી, શોભના સમર્થ - નૂતન - તનુજી - કાજોલ, ઉષા કિરણ - તન્વી આજમી, ઈકબાલ - ખુરશીદ, મીનાકુમારી, મધુ પુષ્પવલ્લી - રેખા, સુચિત્રા સેન - મુનમુન સેન - રાઈમા સેન, રિયા સેન. બબીતા - કરિશ્મા, કરીના. ડિમ્પલ - ટ્રૈવકલ અને રિકી. નાજ - મુમતાજ. વસુંધરા

દેવી - વૈજયંતિ માલા. માલાસિંહા - પ્રતિભા. નસરીન - સલમા આગા. નિગાર સુલતાના - હીના ક્રોસર, અમિતા - સબિરા વગેરે.

### પ્રશંસકોને ઓટોગ્રાફ્સ ને ફોટોગ્રાફ્સ મોકલવાની પ્રથા કયારથી શરૂ થઈ?

મૂક ફિલ્મોના દોરમાં ડી. બિલીમોરિયા, ઈ. બિલીમોરિયા, સુલોચના (રૂબી માયર્સ) આ બધા એ જમાનાના સુપર સ્ટાર્સ ગણાતા અને પ્રથા એમણે જ શરૂ કરેલી. રૂબી માયર્સે તો આ કામ માટે ખાસ સેકેટરી રાખ્યો હતો.

### લતા મંગેશકર અને આશા ભોંસલે - એ બંને ગાયિકાઓમાંથી વધુ એવોર્ડ્સ કોને મળ્યા છે?

અલબત્ત, આશા ભોંસલેને. લતા મંગેશકરને બીસ સાલ બાદ (૧૯૬૨)ના ગીત કહી દીપ જલે કહી દિલ; ખાનદાન (૧૯૬૪)ના આપ મુજે અચ્છે લગને લગે માટે ત્રાણ ફિલ્મફેર એવોર્ડ્સ મળ્યા પછી એમણે જ ધોખણા કરેલી કે એ વધુ ફિલ્મફેર એવોર્ડ નહીં સ્થિકારે. તેથી એમને પછી ક્યારેય નોમિનેશન નહોંતું મળ્યું. આશા ભોંસલેને દસ લાખ (૧૯૬૭)ના ગીત ‘ગરીબો કી સૂનો’, શિકાર (૧૯૬૮)ના ‘પરદે મેં રહને દો’; કરવા (૧૯૭૧)ના ‘પિયા તૂ અબ તો આજા’, હરે રામ હરે કૃષ્ણા (૧૯૭૨)ના ‘દમ મારો દમ’, નયના (૧૯૭૩) ‘હોને લગી હે રાત જવાં’, પ્રાણ જાયે પર વચન ન જાયે (૧૯૭૪)ના ‘ચૈન સેહમ કો કભી આપને જીને ના દિયા’ અને ડોન (૧૯૭૮)ના ‘યે મેરા દિલ ઘાર કા દિવાના’ માટે સાત વાર ફિલ્મફેર એવોર્ડ્સ મળ્યા છે. ૧૯૭૨થી ૧૯૭૪ સુધી લગાતાર ચાર વર્ષના ફિલ્મફેર એવોર્ડ્સ જીત્યાનો વિકિમ એમણે નોંધાવ્યો છે. લતા મંગેશકરને પરિચય, કોરા કાગજ, લેક્ન માટે ત્રાણ રાષ્ટ્રીય પુરસ્કારો મળ્યા છે અને આશાને ઉમરાવ જન અને ઈજાત માટે બે વાર રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા છે.

### સજ્જનની વ્યાખ્યા

એક એવો માણસ જે મન, વચન, કાયાથી શુદ્ધ હોય.

જે તવંગરોની ખુશામત અને ગરીબોની અવમાનના ન કરતો હોય.

જે ફરિયાદ કર્યા વિના હારી શકતો હોય અને આત્મશ્વાદા કર્યા વિના જીતી શકતો હોય.

જે લીલા, બાળકો અને વૃદ્ધોની દરકાર કરતો હોય.

જે સત્યાનિષ અને મૂલ્યાનિષ હોય

જે સારી રીતે જીવતો હોય અને અન્યોને સારી રીતે જીવવા દેતો હોય.

એને સંપૂર્ણ સજ્જન કહેવાય...

 NanoNine® **Sudoku**

જાળીકાંત પાઠેન (૧૯૯૦૦ પૃષ્ઠા)

સુડોકુ ક્રમાંક-૧૧૨૧ અને રૂપું કરવામાં આવે છે. તેના ચારે ભાગ ભરીને 'મંગલ મંદિર' કાર્યાલય પર તા. ૩૧-૦૮-૨૦૨૦ સુધીમાં મોકલી આપવા વિનંતી. તથન ખરા જવાબો મોકલનારનાં નામ સપ્ટેમ્બર-૨૦૨૦ના અંકમાં પ્રસારિત કરવામાં આવશે.

સુડોકુ ભરનારનું નામ : \_\_\_\_\_

સરનામું : \_\_\_\_\_

ફોન/મોબાઈલ : \_\_\_\_\_

**A****ક્રમાંક - ૧૧૨૧****B**

7			3	2	4		9
6		1			2		
	1					7	
	7	5	6			2	
5	8			9			
1	8	9	4		3		
7						4	
6	9		8				
			5	7	6		

7			2				5
1	6				8	2	7
	8		3	5			6
		8			9	6	4
4	5	9	6	8			2
					2		8
	6		9		3	3	1
5	4				3	9	
7		8	1		4		

**C****D**

4	2			1	5	7	
1		7	2		4	6	
	7		6			1	
5		1	7				
7				3	1	8	
6	1		4		9	7	
2			8		1	3	
1	4		3		7		
	3	6	5			2	

4				7		5	
7	2	8		4	3	9	
	3	1	8				2
		1		7		8	
3				1		2	4
6	7		3		5	1	
	9	2					2
	3				4	8	7

ક્રેન્ટ :  
ક્રમાંક - ૧૧૨૦

**A**

4	9	2	8	3	7	6	5	1
3	6	1	4	5	2	8	7	9
8	7	5	1	9	6	4	2	3
6	5	9	3	2	8	7	1	4
1	3	8	5	7	4	9	6	2
7	2	4	6	1	9	5	3	8
9	4	7	2	6	1	3	8	5
2	8	3	7	4	5	1	9	6
5	1	6	9	8	3	2	4	7

**B**

9	1	8	2	7	3	6	4	5
3	6	4	9	5	1	2	7	8
7	2	5	8	4	6	1	9	3
8	9	6	1	3	2	4	5	7
4	3	7	5	6	8	9	2	1
1	5	2	7	9	4	3	8	6
5	7	1	6	2	9	8	3	4
6	4	9	3	8	7	5	1	2
2	8	3	4	1	5	7	6	9

**C**

2	4	1	8	9	7	6	3	5
9	7	6	5	4	3	1	2	8
8	5	3	6	2	1	7	9	4
1	2	9	4	3	5	8	7	6
5	6	7	1	8	9	3	4	2
4	3	8	2	7	6	5	1	9
7	8	5	9	1	4	2	6	3
3	9	2	7	6	8	4	5	1
6	1	4	3	5	2	9	8	7

**D**

1	6	3	8	4	2	5	9	7
8	7	9	1	5	6	4	3	2
5	2	4	3	7	9	1	8	6
6	3	8	2	9	4	7	5	1
2	5	7	6	3	1	9	4	8
4	9	1	7	8	5	6	2	3
7	1	5	4	2	3	8	6	9
3	4	6	9	1	8	2	7	5
9	8	2	5	6	7	3	1	4



## બાલુકેં જ્યું ગાલીયું

સંકલન : ગુલાબચંદ ધારશી રંભિયા

### બચુડો

અધા : પુતર બચુડા?

બચુડો : કો અધા કુરો કમ આય?

અધા : નીચે રોડ તે ટ્રાફિક પોલીસવાળો હક્કે ટ્રક કે રોકેને ડ્રાઇવર કે નીચે ઉતારે ને કોઈ પૂછાણા ગેનેતો સે હઈયા નીચે વેનેને સોણે અચ ક ટ્રાફિકવાળો કુરો પૂછેતો અને ડ્રાઇવર કુરો જવાબ દે તો? (બચુડો નીચે અચે ને સાવ નજીક ઊભો રે તો ને ગાલીયું સુણો તો....)

પોલીસ : મોં ખોલ...

ડ્રાઇવર : મોં ખોલે ને વતાયતો.

મોં મેં કી નાય

પોલીસ : દેશી દારુજી વાસ અચેતી.

ડ્રાઇવર : હા સાહેબ, આંટિ તા પાંજે વડાપ્રધાનજી આજાજો અમલ કર્યાતો — સ્વદેશી ચીજ અપનાવો... અતારે આંટિ કોરોના કે ભગાયેલા કરે દેશી દારુ પીને સજે શરીરકે મંજથી સેનેટાઈઝ કરે શકે તેલા દેશી દારુ પીયાંતો....!!

### ખિલજી મ ભલા

સોહન : અત્યારના વખતમાં આપણે ક્યો સંકલ્પ કરવો જોઈએ?

મોહન : આજથી આપણે સંકલ્પ કરીએ કે એકનો એક ફોટો, એકનો એક જોક, એકનો એક વીરિયો અને એકનો એક ઓર્ડિયો કોઈ ચીજ આપણા ચુપમાં ફોરવર્ડ કરીશું નહીં. તોજ આપણું ચુપ આગળ આવશે, આપણો દેશ આગળ આવશે અને આપણે બધા આગળ આવશું. બાકી ડાઉનલોડ કર્યા કરીશું તો વોડાફોનવાળા જ આગળ આવશે.

☺ ☺ ☺ ☺ ☺

ડોક્ટર : તમે બીલ ચૂકવતી વખતે ૨૦ રૂપિયા ઓછા કેમ આખ્યા?

સી દર્દી : તમે ચેકઅપ કરતી વખતે મારો મેક-અપ સાફ કરી નાખ્યો હતો એટલે મેક-અપનો ખર્ચો કાપી લીધો!

☺ ☺ ☺ ☺ ☺

અબુ : ‘આઈ એમ ગોઈંગ’નો અર્થ શું થાય છે?

બબુ : હું જઈ રહ્યો છું...

અબુ : અરે જાય છે ક્યાં? પહેલા અર્થ બતાવ, પછી જ જવા દઈશ.

☺ ☺ ☺ ☺ ☺

જગુ : આપણી કાર બગરી છે. માટે આપણે ચારેય જણાએ નીચે ઉતરીને કારને ધક્કા મારવા પડશે.

મંગુ : સાંસું. બબે જણાએ નીચે ઉતરી ધક્કા માર્યા. પણ ગાડી આગળ પાછળ ના થઈ.

જગુ : અમે ધક્કા તો મારીએ છીએ. અમે બે આગળથી અને તમે બે પાછળથી ધક્કા મારો છો એટલે કાર ત્યાં જ છે.

☺ ☺ ☺ ☺ ☺

આદિત્ય : હે ભગવાન, આ ગરમીથી તો તોબા.

પર્વ : તો પ્રાર્થના કર, જેનાથી રાહત થાય.

આદિત્ય : હે ભગવાન, જે કોઈ બહાર હોય તેમને સૂર્યના તાપથી અને ઘેર હોય તેમને ઘરવાળીના તાપથી બચાવજો.

☺ ☺ ☺ ☺ ☺

ચીન્ટુ : સાંસું થયું, વાવાજોડામાં તારા હાથમાં જાડ આવી ગયું એટલે તું બચી ગયો. નહિ તો ક્યાંય ફંગોળાઈ જાત....

મોન્ટ્ટુ : એવા વહેમમાં ન રહેતો. આ તો હું હતો એટલે જાડને પકડી રાખ્યું ને જાડ બચી ગયું. નહિ તો ઉખડીને ક્યાંય ફંગોળાઈ જાત!

☺ ☺ ☺ ☺ ☺

જાનુ : વોટ્સએપ આવ્યું તો SMS ખતમ. યુ-ટ્યુબ આવ્યું તો DVD ખતમ. સ્કાઈપ આવ્યું તો STD કોલ ખતમ. એમેજોન આવ્યું તો દુકાનમાં શોપિંગ ખતમ!

માનુ : રાહુલ અને કેજરીવાલ આવ્યા તો બીજા હાસ્ય કલાકારોના જોક્સ ખતમ!!

☺ ☺ ☺ ☺ ☺

રમેશ : ડાયાબિટીસ થઈ ગયા પછી ડોક્ટરે મને ખાંડ વગરની ચા પીવાનું કહ્યું છે.

રમીલા : અલગ અલગ ચા નહીં બને... લાડવો ખાઈને. પછી ચા પી લેજો એટલે મોળી લાગશે.

☺ ☺ ☺ ☺ ☺

પ્રિયતમ : પ્રિયા, ઉદાસ છે?

પ્રિયતમા : ના, આ તો તોબરો ચઢવવાની પ્રેક્ટિસ કરું છું.

☺ ☺ ☺ ☺ ☺

પર્વ : મમ્મી, તે મને બોલાયો?

પૂર્વી : ના. આ તો ઘરમાં રહેલાની હાજરી પૂરું છું!

☺ ☺ ☺ ☺ ☺

શિક્ષિકા : નાડાને અંગેજમાં શું કહેવાય?

પર્વ : મેડમ, પી.એચ.ડી.

શિક્ષિકા : કાંઈ સમજ ના પડી....

પર્વ : પી.એચ.ડી. એટલે પાયજામા હોલ્ડિંગ રીવાઈસ.

૮/૨૬, ગંગામણિ ફ્લેટ્સ, વસ્ત્રાંગ સોસાગટી, ગોપાલગઢ,  
માણસનગર, અમદાવાદ-૩૮૦ ૦૦૮. ફોન : ૨૪૪૬૮૯૬૦

## સમાજ દર્પણ

### સરનામા ફેરફાર

- પીયુષ વશનજી સાવલા  
સી-૭૦૧, સંસ્કાર ટાવર, ગ્રાન્ડ કેમ્પિં હોટલ સામે,  
એક્લિબ્યુ સ્પોર્ટ્સ એક્ટેન્સી સામે, થલતેજ,  
અમદાવાદ-૩૮૦ ૦૫૪. મો. ૮૮૭૮૫ ૬૮૦૨૭
- કૃષાલ ડાહ્યાભાઈ મહેતા  
૫૭, ધમદિવ નગર, સાંનાટનગરની સામે,  
ઈસનપુર, અમદાવાદ. મો. ૮૮૭૮૫ ૫૫૬૮૮
- આશિષ કેશવલાલ દોશી  
ઈ/૩૧, ત્રીજે માળે, વિશાળ રેસિડેન્ચી,  
દેવપ્રિયા બંગલોઝ-૨ ની સામે,  
આનંદનગર - રામદેવનગર રોડ, સેટેલાઈટ,  
અમદાવાદ-૩૮૦ ૦૧૫. મો. ૮૮૨૫૭ ૫૩૫૮૮

### અવસાન નોંધ - પુષ્પાંજલિ

- શનિવાર, તા. ૨૧-૩-૨૦૨૦  
પલવીલેન દુંગરશી રાયશી રાંભિયા (ઉ.વ. ૫૬) (સમાધોધા - અમદાવાદ)
- મંગાળવાર, તા. ૨૪-૩-૨૦૨૦  
માતુશ્રી રમીલાબેન જ્યોન્દ્રભાઈ ફોફણિયા (ભુજપુર - અમદાવાદ)
- બુધવાર, તા. ૨૫-૩-૨૦૨૦  
દલાલ સુધીરકુમાર ચીમનલાલ શાહ (ઉ.વ. ૫૭) (માંડવી - અમદાવાદ)
- રવિવાર, તા. ૫-૪-૨૦૨૦  
રોહિત ચુનીલાલ સંઘવી (ઉ.વ. ૫૮) (મુંદ્રા - અમદાવાદ)
- સોમવાર, તા. ૧૩-૪-૨૦૨૦  
માતુશ્રી લક્ષ્મીબેન માવજી ધારશી કુર્ખિયા (ઉ.વ. ૮૨)  
(લાચાલ - અમદાવાદ/મુંબઈ)
- મંગાળવાર, તા. ૧૪-૪-૨૦૨૦  
શેલેષ મોહનલાલ શાહ (અંજર - અમદાવાદ)
- રવિવાર, તા. ૨૪-૪-૨૦૨૦  
વર્ધમાન દેવજી છેડા (ઉ.વ.-૮૨) (સુજપુર - અમદાવાદ)
- ગુરુવાર, તા. ૨૮-૦૫-૨૦૨૦  
મિતાબેન લહેરચંદ જૈન (શિયાડ) (ઉ.વ. ૭૩) (જાહો - અમદાવાદ)
- સોમવાર, તા. ૦૧-૦૬-૨૦૨૦  
શાંતિલાલ રવજી દેવરાજ રાંભિયા (ઉ.વ. ૭૨) (રામાણિયા - અમદાવાદ)

- શનિવાર, તા. ૬-૬-૨૦૨૦  
માતુશ્રી પુરભાઈ કાનજુભાઈ ધરમશી (ઉ.વ. ૮૨) (જાહો - અમદાવાદ)
- ગુરુવાર, તા. ૧૮-૦૬-૨૦૨૦  
વલભજી ખીમજી દેટિયા (ઉ.વ. ૮૨) (મેરાઉ - અમદાવાદ)
- ગુરુવાર, તા. ૧૮-૦૬-૨૦૨૦  
ખીમજી નાનજી પ્રેમજી ગાલા (ઉ.વ. ૭૨) (દેવપુર - અમદાવાદ)
- બુધવાર, તા. ૨૨-૦૭-૨૦૨૦  
પ્રેમજુભાઈ શામજી હરિયા (ઉ.વ. ૮૪)  
(સાંભરાઈ - કચ્છ) હાલે અમદાવાદ (આદિનાથ પેટ્રોલ પંપવાળા - અમદાવાદ)  
સદ્ગતશ્રીઓના આત્માના શ્રેયાં પ્રાર્થના.

## અભિનંદન

મૈત્રી મનિષ સાવલા

B.Tech. I.T. - 92%




મૂળ વતન વાંકી - કચ્છ અને હાલે અમદાવાદ સ્થિત શ્રીમતી ઊર્વશીબેન સાવલા તથા મનિષ રમેશભાઈ સાવલાની પુત્રી ચિ. મૈત્રી મનિષ સાવલાએ તાજેતરમાં લેવાયેલ B.Tech. I.T.ની પરીક્ષામાં ૯૨% માર્ક્સ સાથે જણહળતી સર્કારી હાંસલ કરી છે.

આ સિદ્ધિ બદલ ખૂબ ખૂબ અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભ કામના.

ધુવિન મનિષ સાવલા

ધોરણ-૧૦ (ICSE) - 91%



મૂળ વતન વાંકી - કચ્છ અને હાલે અમદાવાદ સ્થિત શ્રીમતી ઊર્વશીબેન સાવલા તથા મનિષ રમેશભાઈ સાવલાના સુપુત્ર ચિ. ધુવિન મનિષ સાવલાએ તાજેતરમાં લેવાયેલ ધોરણ-૧૦ (ICSE Board)માં ૯૧% માર્ક્સ સાથે જણહળતી સર્કારી હાંસલ કરી છે.

આ સિદ્ધિ બદલ ખૂબ ખૂબ અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભ કામના.

**શ્રીમતી ઊર્વશીબેન મનિષ રમેશભાઈ સાવલા** તરફથી તેમના સુપુત્રી ચિ. મૈત્રીએ તથા સુપુત્ર ચિ. ધુવિને અભ્યાસમાં જણહળતી સર્કારી મેળવ્યાની ખૂશાલીમાં જલારામ અનુક્રમ ખાતે રૂ. ૧૫૦૦/- તથા વૈયાવરચ્ચ ખાતે રૂ. ૧૫૦૦/- ભેટ મળેલ છે. જેનો સંસ્થાએ સાભાર સ્વીકાર કરેલ છે.

## ાનિનંદન

અદિતિ નીરવ વસા  
ધોરણ-૧૨ (સાયન્સ) CBSE : ૯૬.૪%



મૂળ વતન ભુજ કચ્છ અને હાલે અમદાવાદ ખાતે સ્થિત શ્રીમતી ઊર્મિલાબેન તથા મહેન્દ્ર મોતીલાલ વસાની પૌત્રી તથા શ્રીમતી સુરભિ તથા નીરવ મહેન્દ્ર વસાની સુપુત્રી અને મહારાજા અગ્રસેન વિદ્યાલયમાં અભ્યાસ કરતી ચિ. અદિતિએ તાજેતરમાં લેવાયેલ ધોરણ-૧૨ સાયન્સ (CBSE Board) વર્ષ ૨૦૧૮-૨૦ની પરીક્ષામાં ૯૬.૪% ગુણાંક સાથે જગ્ઘળતી સર્કણતા પ્રાપ્ત કરી છે. અને ઉલ્લેખનીય છે કે વિદ્યાલયના ચ્રૂપ-Aનાં સમગ્ર છાત્રોમાં ચિ. અદિતિએ પ્રથમ ક્રમાંક હાંસલ કરીને પોતાના અભ્યાસ ક્ષેત્રે શ્રેષ્ઠતમ દેખાવ કરેલ છે. જે તેની અત્યાર સુધીની શૈક્ષણિક કામગીરીમાં સતત પુરુષાર્થ અને પરિશ્રમના અજોડ પ્રતીક સમાન છે. જેની પ્રતીતિ તેણે શૈક્ષણિક ક્ષેત્રે પ્રતિવર્ષ પ્રાપ્ત કરેલી ઉત્કૃષ્ટ સર્કણતા દ્વારા થાય છે. હાલે ધોરણ-૧૨ (સાયન્સ પ્રવાહ)માં જે સિદ્ધિ મેળવી છે તે અનન્ય છે. તેની આ સિદ્ધિ પરિવારજનો માટે ગૌરવપૂર્ણ છે.

ચિ. અદિતિએ CBSE બોર્ડની ધોરણ-૧૦ની પરીક્ષા પણ ૮૫.૨% સાથે ઉત્તીર્ણ કરીને અમદાવાદ - ગાંધીનગર વિસ્તારના સમગ્ર કચ્છી સમાજોમાં પ્રથમ ક્રમાંક મેળવેલ હતો. આ રીતે તેની શૈક્ષણિક કારકિર્દી હંમેશાં તેજસ્વી રહી છે. તેણી કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ ક્ષેત્રે વધુ અભ્યાસ કરીને સિદ્ધિના હજુ ઉંચા શિખરો સર કરવાની તમના ધરાવે છે.

અતે એ પણ ઉલ્લેખનીય છે કે ચિ. અદિતિ ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજી કાય્યોની રચના પણ ખૂબ જ ભાવાત્મક રીતે કરે છે. એટલું જ નહીં પરંતુ શીંગ્ર કાબ્ય રચના કરવાની કાબેલિયત ધરાવે છે. તેની અનેક કાબ્ય રચનાઓ સ્થાનિક સામયિકોમાં પણ સ્થાન પામી છે અને આ પ્રકારની કૌશલ્યપૂર્ણ રજૂઆતથી વાયકવર્ગ ખૂબ પ્રભાવિત થતો હોય છે.

આ અપૂર્વ સિદ્ધિ મેળવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને આ રીતે નિરંતર પ્રગતિ સાધતા રહીને અભ્યાસ ક્ષેત્રે હજુ ઉચ્ચતમ શિખરો સર કરતા રહો તેવી શુભેચ્છા.

## લાઈબ્રેરી સમિતિ

શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદની લાઈબ્રેરી સમિતિ દ્વારા સંસ્થાના સભ્યો અને તેમના પરિવારજનોમાં વાંચનવૃત્તિ કેળવાય તેવા હેતુથી પુસ્તક લાઈબ્રેરી ચલાવવામાં આવે છે. જેમાં સમાજના સભ્યો રૂ. ૧૦૦/- લાઈબ્રેરીની આજીવન મેમ્બરશિપ ફી ભરી, સભ્ય બની શકે છે.

કન્વીનર - લાઈબ્રેરી સમિતિ

## શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદ

### “સરસ્વતી સંન્માન”

શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદ તથા ગાંધીનગર વિસ્તારો સ્થિત સમાજ પરિવારજનોના ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓને નિયમાનુસાર પુરસ્કાર આપી પુરસ્કૃત કરે છે અને તેજસ્વી વિદ્યાર્થીઓને વિશેષ પુરસ્કારથી પુરસ્કૃત કરે છે. આ પ્રકારના સરસ્વતી સંન્માન માટે સંબંધિત વિદ્યાર્થીઓએ નિયત કરેલું ફોર્મ, તેમાંની સંપૂર્ણ વિગત સાથે ભરીને સમાજના કાર્યાલયમાં મોકલવાવા વિનંતી. જરૂરી ફોર્મ ‘મંગલ મંદિર’ના આ અંકમાં અન્યત્ર ધાપવામાં આવેલ છે. યોગ્ય હોય ત્યાં તેના બિડાણ ફોર્મ સાથે મોકલવાના રહેશે.

**ફોર્મ - A :** ધોરણ-૮ સુધી ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓ માટે છે.

**ફોર્મ - B :** ધોરણ-૧૦ અને તેનાથી ઉપરના ધોરણમાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ માટે છે.

આ ફોર્મ ભરીને તા. ૩૦-૦૮-૨૦૨૦ સુધીમાં સમાજના કાર્યાલયમાં પહોંચતા કરશો. પ્રવર્તમાન પરિસ્થિતિને આધીન રહીને આ સંબંધી આગળની જાણકારી ‘મંગલ મંદિર’ દ્વારા કરીશું.

ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ સિવાયના ધોરણો માટે વર્ગમાં લેવાયેલ જે-તે વર્ષની છેલ્લી માર્કશીટ મોકલશો.

પંકજ મેધાજી ગોગરી, કન્વીનર - સરસ્વતી સંન્માન સમિતિ

## શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદ સંચાલિત

### NAVNEET નવનીત મેડિકલ સેન્ટર તથા

કંચનબેન નવીનચંદ્ર નાનજી શાહ O.P.D. સેન્ટર

દીપ ફાઉન્ડેશન મેડિકલ ચેક-અપ સેન્ટર

બીજો અને ત્રીજો માળ, ગાલા ડબ એનેક્ષ, ગાલા જીમબાનાની બાજુમાં, લોપલ, અમદાવાદ-૩૮૦ ૦૪૮. ફોન : ૮૮૨૪ ૮૮૦ ૩૦૩, ૮૮૨૪ ૮૮૦ ૪૦૪

### મેડિકલ સેન્ટરમાં પ્રિલબ્ય તબીબી સેવાઓ

- OPD સ્પેશિયાલિસ્ટ કન્સલ્ટેશન : રૂ. ૮૦/-
- ફોલોઅપ (લીજું) કન્સલ્ટેશન : રૂ. ૫૦/-
- OPD સુપર સ્પેશિયાલિસ્ટ કન્સલ્ટેશન : રૂ. ૧૬૦/-
- ફોલોઅપ (લીજું) કન્સલ્ટેશન : રૂ. ૮૦/-
- બોડી ચેક-અપની વિવિધ સ્કીમ (રૂ. ૫૫૦/- થી રૂ. ૨૩૦૦/-)
- અધ્યતન પેથોલોજી લેલોરેટરી (સામાન્ય લેલ કરતા આશરે ૫૦% રાહિત દરે)
- ડેન્ટલ (દાંતનો વિભાગ) / ફિઝીયોયોરેપી વિભાગ : રાહિત દરે
- એક્સસ-રે (Digital) : રૂ. ૨૦૦/-
- સોનોગ્રાફી (અધ્યતન Logic P9 મશીન) : રૂ. ૫૦૦/-
- ECG : રૂ. ૧૦૦/-
- TMT / 2D ECHO : રૂ. ૭૦૦/-
- Colour Doppler : રૂ. ૮૦૦/-
- Minor Surgery, Cosmetic Procedure, મોતિયાના ઓપરેશન

**શ્રી કચ્છી કેન્ડેન સેવા સમાજ - અમદાવાદ સંચાલિત**

**NAVNEET નવનીત મેડિકલ સેન્ટર અને**

**કંચનબેન નવીનયંદ્ર નાનજી શાહ O.P.D. સેન્ટર તથા દીપ ફાઉન્ડેશન મેડિકલ ચેક-અપ સેન્ટર**

રજો અને ઉજો માળ, ગાલા હખ એનેશ, ગાલા જમખાના રોડ, બસંત બાધાર બંગલોની બાજુમાં બાજુમાં, સાઉથ બોપલ, અમદાવાદ.  
ફોન : ૯૮૨૪ ૮૮૦ ૩૦૩, ૯૮૨૪ ૮૮૦ ૪૦૪

**સ્પેશિયાલિસ્ટનાં પ્રથમ કન્સલ્ટેશનના : રૂ. ૮૦/- ● ત્યારબાદ ૩ મહિના સુધી : રૂ. ૫૦/-**

(પ્રણ મહિના બાદ ફરી ન્યુ કન્સલ્ટેશન ચાર્જના રૂ. ૮૦/- ભરવાના રહેશે.)

**બીજા ડોક્ટર કે બીજા વિભાગમાં નવો કેસ કટાવવાનો રહેશે.**

ઓ.પી.ડી.	માટ / રૂમ નં.	દિવસ	સમય	ડોક્ટર
(૧) મેડિસિન	બીજા માળે ૫ બીજા માળે ૫	સોમથી શનિ સોમથી શનિ	સવારે ૧૧.૦૦ થી ૧૨.૩૦ સાંજે ૪.૩૦ થી ૬.૦૦	ડૉ. ધીરેન સોલંકી, MD (Medicine) ડૉ. ધીરેન સોલંકી, MD (Medicine)
(૨) આંખનો વિભાગ	બીજા માળે ૧૫ બીજા માળે ૧૫	સોમ-મંગળ-ગુરુ-શનિ સોમથી શનિ	સવારે ૬.૩૦ થી ૧૧.૩૦ સાંજે ૫.૦૦ થી ૬.૩૦	ડૉ. મિત પટેલ, MS (Ophth.) ડૉ. મિત પટેલ, MS (Ophth.)
(૩) જનરલ સર્જન	બીજા માળે ૧૩ બીજા માળે ૧૩	સોમથી શનિ સોમથી શનિ	સવારે ૮.૦૦ થી ૧૦.૩૦ સાંજે ૪.૦૦ થી ૫.૩૦	ડૉ. કમલેશ રામ, MS (Gen. Surgeon.) ડૉ. અપૂર્વ પટેલ, MS (Gen. Surgeon.)
(૪) બાળરોગ વિભાગ (પીડિયાટ્રીશિયન)	બીજા માળે ૩ બીજા માળે ૩ બીજા માળે ૩	સોમ-બુધ-શુક મંગળ-ગુરુ-શનિ સોમથી શનિ	સવારે ૮.૦૦ થી ૧૦.૩૦ સવારે ૮.૦૦ થી ૧૦.૩૦ સાંજે ૫.૦૦ થી ૬.૩૦	ડૉ. ધવલ અખાણી, MBBS, DCH ડૉ. મેહુલ શાહ, MD (Pedia) ડૉ. ફાલ્ગુની મહેતા, MD (Pedia)
(૫) સ્ત્રી રોગ વિભાગ	બીજા માળે ૬ બીજા માળે ૬ બીજા માળે ૬	મંગળ-ગુરુ-શનિ સોમ-બુધ-શુક મંગળ-ગુરુ-શનિ	સવારે ૮.૦૦ થી ૧૦.૩૦ સાંજે ૫.૦૦ થી ૬.૩૦ સાંજે ૫.૦૦ થી ૬.૩૦	ડૉ. એશા શાહ, MD (Gyn) ડૉ. કરીશ્મા પરાશર, MD (Gyn) ડૉ. પૂર્વી શાહ, MD, DGO
(૬) ઓર્થોપિડિક	બીજા માળે ૧૨ બીજા માળે ૧૨ બીજા માળે ૧૨	સોમ-બુધ-શુક મંગળ-ગુરુ-શનિ સોમથી શનિ	સવારે ૮.૦૦ થી ૧૦.૩૦ સવારે ૮.૦૦ થી ૧૦.૩૦ સાંજે ૫.૦૦ થી ૬.૩૦	ડૉ. દૈવેશ શાહ, MS (Ortho) ડૉ. અધિ શાહ, MS (Ortho) ડૉ. નીલ રોહરા, MS (Ortho)
(૭) ચામડીના રોગો	બીજા માળે ૪ બીજા માળે ૪ બીજા માળે ૪ બીજા માળે ૪	મંગળ-ગુરુ શનિ મંગળ-ગુરુ-શનિ બુધ	સવારે ૮.૦૦ થી ૧૦.૩૦ સવારે ૮.૦૦ થી ૧૦.૩૦ સાંજે ૫.૦૦ થી ૬.૩૦ સાંજે ૫.૦૦ થી ૬.૩૦	ડૉ. મધૂરી ચંદાના, DVD (Skin) ડૉ. ભૂમિ પટેલ, MBBS, DVD ડૉ. મધૂરી ચંદાના, DVD (Skin) ડૉ. ભૂમિ પટેલ, MBBS, DVD
(૮) કાન, નાક, ગાળાનો વિભાગ	બીજા માળે ૧૪ બીજા માળે ૧૪ બીજા માળે ૧૪	સોમ-બુધ-શુક સોમ-બુધ-શનિ મંગળ-ગુરુ-શુક	સવારે ૮.૦૦ થી ૧૦.૩૦ સાંજે ૫.૦૦ થી ૬.૩૦ સાંજે ૫.૦૦ થી ૬.૩૦	ડૉ. નેહા શાહ, MS (ENT) ડૉ. સૌરીન શાહ, MS (ENT) ડૉ. રોમા ગાંધી, MS (ENT)
(૯) દાંતનો વિભાગ	ત્રીજા માળે ૨૧ ત્રીજા માળે ૨૧ ત્રીજા માળે ૨૧ ત્રીજા માળે ૨૧	સોમથી શનિ સોમથી શનિ સોમથી શનિ Appointment	સવારે ૮.૦૦ થી ૧૨.૦૦ સવારે ૮.૦૦ થી ૧૨.૦૦ સાંજે ૪.૦૦ થી ૭.૦૦	ડૉ. અર્યના શાહ, BDS ડૉ. શૈલી જ્વરી, BDS ડૉ. કાજલભા જેઝા, MDS

**CONTACT NUMBER FOR 2ND FLOOR : 9824 880 404**

ઓ.પી.ડી.	માટ / રૂમ નં.	દિવસ	સમય	ડોક્ટર
(૧૦) ફિલ્ઝિયોથેરાપી	ગ્રીજા માણે ૨૫	સોમધી શનિ	સવારે ૮.૦૦ થી ૧.૦૦	ડૉ. દેણિ શેઠ, MPT
	ગ્રીજા માણે ૨૫	સોમધી શનિ	સાંજે ૫.૦૦ થી ૭.૦૦	ડૉ. દેણિ શેઠ, MPT
	ગ્રીજા માણે ૨૫	સોમધી શનિ	સવારે ૮.૦૦ થી ૧.૦૦	ડૉ. ભૂમિ વખારવાલા, BPT
	ગ્રીજા માણે ૨૫	સોમધી શનિ	સાંજે ૩.૦૦ થી ૭.૦૦	ડૉ. ભૂમિ વખારવાલા, BPT
	ગ્રીજા માણે ૨૫	સોમધી શનિ	સવારે ૮.૦૦ થી ૧૨.૦૦	ડૉ. માધ્વી કાસુંદ્રા, BPT

**સુપર સ્પેશિયાલિસ્ટનાં પ્રથમ કન્સલ્ટેશનના : રૂ. ૧૬૦/- ● ત્યારબાદ ૩ મહિના સુધી : રૂ. ૮૦/-**

(ગ્રણ મહિના બાદ ફરી ન્યુ કન્સલ્ટેશન ચાર્જના રૂ. ૧૬૦/- ભરવાના રહેશે.)

બીજા ડોક્ટર કે બીજા વિભાગમાં નવો કેસ કટાવવાનો રહેશે.

ઓ.પી.ડી.	માટ / રૂમ નં.	દિવસ	સમય	ડોક્ટર
(૧) કાર્ડિયોલોજી	ગ્રીજા માણે	સોમવાર	સવારે ૮.૦૦ થી ૧૦.૦૦	ડૉ. ચિરાયુ વાસ, MDDM (Cardio)
	ગ્રીજા માણે	શુક્વાર	સવારે ૮.૦૦ થી ૧૦.૦૦	ડૉ. સુનિલ ગુરુમુખાની, DM (Cardio)
(૨) યુરોલોજી	ગ્રીજા માણે	સોમવાર	સાંજે ૫.૦૦ થી ૬.૦૦	ડૉ. વિવેક કોણારી, MS, DNB (Uro)
	ગ્રીજા માણે	ગુરુવાર	સાંજે ૫.૦૦ થી ૬.૦૦	ડૉ. પ્રિયાંક શાહ, MS, DNB
(૩) ન્યુરોલોજી	ગ્રીજા માણે	મંગળવાર	સવારે ૧૦.૦૦ થી ૧૧.૦૦	ડૉ. સૂચિત પાંડે, MDDM (Neuro)
(૪) નેફ્રોલોજી	ગ્રીજા માણે	મંગળવાર	સવારે ૮.૦૦ થી ૧૦.૦૦	ડૉ. રૂપેન પંચાલ, MD, DNB (Nephro)
(૫) ગેસ્ટ્રોલોજી	ગ્રીજા માણે	મંગળવાર	બપોરે ૧.૦૦ થી ૨.૦૦	ડૉ. હાર્દિક પરમાર, MDDM, DNB (Gastro)
(૬) સ્પાઇન સ્પેશિ.	ગ્રીજા માણે	મંગળવાર	સાંજે ૫.૦૦ થી ૬.૦૦	ડૉ. સૌમિલ માંડલિયા, DNB, MNAMS (Ortho.)
(૭) પલ્મોનોલોજીસ્ટ	ગ્રીજા માણે	શુક્વાર	સવારે ૧૧.૦૦ થી ૧૨.૦૦	ડૉ. વૈશલ શેઠ, DTCD, DNB (Pulmo.)
(૮) ઓન્કો સર્જરી	ગ્રીજા માણે	ગુરુવાર	સવારે ૮.૦૦ થી ૧૦.૦૦	ડૉ. અતુલ પટેલ, MS, M.CH.
(૯) સાયકિયાટ્રીસ્ટ	ગ્રીજા માણે	બુધ - શનિ	સવારે ૮.૦૦ થી ૧૦.૩૦	ડૉ. પ્રશાંત ગોહિલ, MBBS, DPM (Psy.)
(૧૦) રેટીના સર્જન	બીજા માણે ૧૫	બુધવાર	સાંજે ૪.૦૦ થી ૫.૦૦	ડૉ. અતુલ પટેલ, MS (Retina Surgeon)

**CONTACT NUMBER FOR 3RD FLOOR : 9824 880 303**

## સાભાર સ્વીકાર

શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદની વિવિધ સેવાકીય યોજનાઓ માટે નીચે મુજબ દાખાશીઓ તરફથી દાન / ભેટ પ્રાપ્ત થયેલ છે. દાખાશીઓનો ખૂબ ખૂબ આભાર...

## તનીની સહાય ખાતે

રૂ. ૨૧,૦૦૦/- સ્વ. સીતાબેન ડાયાભાઈ ફિડિઆ ચેરિટેબલ ટ્રસ્ટ - અમદાવાદ

## વયર્ક સમિતિ ખાતે

રૂ. ૫૦૦/- શ્રીમતી કોડીલાબેન ભોગીલાલ શાહ - અમદાવાદ  
(શ્રી રજનીભાઈ પારેખના જન્મદિન નિમિત્ત ભેટ)

## મેરેજ ન્યુરો સમિતિ

શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદની મેરેજ ન્યુરો સમિતિ શ્રી કચ્છી જૈન ભવન - પાલડી ખાતે સમસ્ત જૈન પરિવારોના લગ્નોત્સુક ઉમેદવારો માટે કાર્યરત છે. સમાજના તેમજ બહાર વસતા કચ્છી જૈન પરિવારો તેમજ અન્ય સમસ્ત જૈન પરિવારોના લગ્ન લાયક યુવક-યુવતીઓની સંપૂર્ણ વિગત - ડેટા બેંક - આ સમિતિ દ્વારા રાખવામાં આવે છે. જેનો ઉપયોગ સમાજના સભ્યો તેમજ સમસ્ત જૈન પરિવારજનો કરી શકે છે. લગ્નોત્સુક ઉમેદવારો પોતાના નામનું રજિસ્ટ્રેશન કરાવી દર શનિવારે બપોરે ૦૩.૩૦થી ૦૫.૩૦ દરમિયાન આ સમિતિના સભ્યોની રૂબરૂ મુલાકાત કરીને ડેટા બેંકનો લાભ લઈ શકે છે.

ખૂબ વિગત માટે સંપર્ક : ૮૮૭૭૯૯ ૫૧૯૮૮, ૮૩૨૦૩ ૧૬૮૬૮



CUT FROM HERE



## શ્રી કષ્ટી વૈન સેવા સમાજ - અમદાવાદ

વર્ષ ૨૦૨૦માં ભાગવગ્યથી ધોરણ-૮ સુધીના પરીક્ષામાં ઉતીર્ણ થયેલાઓનું માહિતી પત્રક

(નોંધ : ફોર્મ ભરતાં પહેલાં પાછળની સૂચનાઓ અવશ્ય વાંચી જવી)

નોંધણી ક્રમાંક

A -

dL. :

વાલીનું પૂરું નામ અને અટક \_\_\_\_\_  
 (વાલીનું નામ) \_\_\_\_\_ (દાદાનું નામ) \_\_\_\_\_ (અટક)

૨૦૧૨ના વસતિ પત્રક મુજબ પરિવાર ક્રમાંક : \_\_\_\_\_ ફોન : \_\_\_\_\_ મોબાઈલ : \_\_\_\_\_

કષ્ટમાં ગામ \_\_\_\_\_ તાલુકો \_\_\_\_\_ જાતિ/પેટા જાતિ \_\_\_\_\_

પત્રવ્યવહારનું પૂરું સરનામું \_\_\_\_\_  
 \_\_\_\_\_ પીન \_\_\_\_\_ ફોન \_\_\_\_\_

તા. - - ૨૦૨૦

વાલીની સહી \_\_\_\_\_

ક્રમ	વિધાર્થીનું નામ - પિતા - દાદા - અટક	વય	ઉતીર્ણ કરેલું ધોરણ	કથા ધોરણમાં આવ્યા	મેળવેલ માર્ક	કુલ માર્ક	કુલ ટકા	પરીક્ષા પાસ કરી હોય તે શાળાનું નામ અને સ્થળ
૧	૨	૩	૪	૫	૬	૭	૮	૯

★ ઉપરોક્ત ફોર્મમાં દરેક વિગત સારી અને સંપૂર્ણ રીતે લખીને મોકલવી.

(નામ વધુ હોય તો બીજું પાતું જોડવું)

ફોર્મ ભરીને મોકલવાની છેલ્લી તારીખ : 30-06-2020

અનુભૂતિ અનુભૂતિ અનુભૂતિ અનુભૂતિ અનુભૂતિ

મંગ માટે ● એપ્રિલ - ૨૦૨૦

અનુભૂતિ અનુભૂતિ અનુભૂતિ અનુભૂતિ અનુભૂતિ

૩૫

## સૂચનાઓ

- (૧) આ પુરસ્કાર યોજના આ સમાજ હેઠળ આવરાયેલા અમદાવાદ - ગાંધીનગર અને તેની આજુબાજુના વિસ્તારોમાં વસવાટ કરનાર કચ્છી જૈન પરિવારોના અભ્યાસ કરતા બાળકો માટે છે.
- (૨) ફોર્મમાં માટ્યા પ્રમાણેની પૂરી વિગતો સ્પષ્ટ વંચાય તે રીતે ગુજરાતી ભાષામાં સારા અક્ષરે ભરવી. નામો ટૂંકાક્ષરી ન લખતાં પૂરેપૂરાં લખવાં. ભરેલું ફોર્મ તા. ૩૦-૦૯-૨૦૨૦ સુધીમાં મળી જાય તે રીતે આ સરનામે મોકલવું. **પુરસ્કાર સમિતિ, શ્રી કચ્છી જૈન સેવા સમાજ, શ્રી કચ્છી જૈન ભવન, નવયેતના હાઇસ્કૂલ સામે, પાલડી - એલિસાંબ્રિજ, અમદાવાદ - ૩૮૦૦૦૬.** અન્યત્ર મોકલાયેલાં ફોર્મની કે ટપાલમાં મોડાં કે ટપાલમાં ગેરવલે ગયેલાં ફોર્મની જવાબદારી સ્વીકારારો નહીં. પરબીઉયા પર યોગ્ય મૂલ્યની ટિકિટો (ટપાલના નવા દર પ્રમાણે) લગાડવી. દંડ થયેલી ટપાલ સ્વીકારાતી નથી.
- (૩) ધોરણ ૫ થી ધોરણ ૮ માં પાસ થનાર દરેક વિદ્યાર્થીઓએ પોતાની માર્કશીટની અધિકૃત નકલ મોકલવાની રહેશે.
- (૪) પોતાનું ફોર્મ સમાજને મળી ગયું છે કે કેમ તે નિશ્ચિત કરવા ઈરણનારે પોતાના સરનામાવાળું પોસ્ટકાર્ડ (પૂરતી સ્ટેમ્પવાળું) સાથે બીડું, જેના પર ફોર્મ મળી ગયાની પહોંચ અગ્રેથી મોકલી આપવામાં આવશે. સંસ્થાની ઓફિસે ઇબર ફોર્મ આપી જનારે પોતાના ફોર્મનો નોંધણી કમાંક મેળવી લેવો.
- (૫) ફોર્મ તા. ૩૦-૦૯-૨૦૨૦ સુધી જ સ્વીકારવામાં આવશે.

પંકજ મેધાજી ગોગરી, કંદીનગર - પુરસ્કાર સમિતિ



CUT FROM HERE



# શ્રી કચ્છી વૈન સેવા સમાજ - અમદાવાદ

વર્ષ ૨૦૨૦માં ધોરણ-૧૦ અને તેનાથી ઉપરના વગની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલાઓનું માહિતી પત્રક

(નોંધ : ફોર્મ ભરતાં પહેલાં પાછળની સુયાનાઓ અવશ્ય વાંચી જવી)

નોંધણી કમાંક

B -

cl.

વાલીનું પૂરું નામ અને અટક —  
(વાલીનું નામ) \_\_\_\_\_ (દાદાનું નામ) \_\_\_\_\_ (અટક) \_\_\_\_\_

૨૦૧૨ના વસતિ પત્રક મુજબ પરિવાર ક્રમાંક : \_\_\_\_\_ ફોન : \_\_\_\_\_ મોબાઇલ : \_\_\_\_\_

કચ્છમાં ગામ \_\_\_\_\_ તાલુકો \_\_\_\_\_ જાતિ/પેટા જાતિ \_\_\_\_\_

પત્રવ્યવહારનું પૂરું સરનામું \_\_\_\_\_

ਪੀਨ \_\_\_\_\_ ਫੋਨ \_\_\_\_\_

દા. — — ૨૦૨૦ વાલીની સહી \_\_\_\_\_

★ પુરસ્કારપાત્ર વિદ્યાર્થીના વાલીઓને વિનંતી કે તેઓના પુરસ્કાર સરસ્વતી સંભાળના દિવસે જ મેળવી લેવા. પછીથી ક્ષમા. ★ ઉપરોક્ત ફોર્મમાં દરેક વિગત સારી અને સંપૂર્ણ રીતે લખીને - જરૂરી માર્કશીટની ફોટો નકલ સાથે મોકલાવશો. અન્યથા તે ફોર્મ રદ્દભાબાલ થશે.

(ਨਾਮ ਵਖੂ ਛੋਧ ਤੇ ਬਿਚੁੰ ਪਾਤ੍ਰ ਜ਼ੋਦੁ)

ફોર્મ ભરીને મોકલવાની છેલ્લી તારીખ : 30-06-2020

## સૂચનાઓ

- (૧) આ પુરસ્કાર યોજના આ સમાજ દેઠળ આવરાયેલા અમદાવાદ - ગાંધીનગર અને તેની આજુબાજુના વિસ્તારોમાં વસવાટ કરનાર કચ્છી જૈન પરિવારોના અભ્યાસ કરતા બાળકો માટે છે.
- (૨) ફોર્મમાં માટ્યા પ્રમાણેની પૂરી વિગતો સ્પષ્ટ વંચાય તે રીતે ગુજરાતી ભાષામાં સારા અક્ષરે ભરવી. નામો ટૂંકાકશરી ન લખતાં પૂરેપૂરાં લખવાં. ભરેલું ફોર્મ તા. ૩૦-૦૬-૨૦૨૦ સુધીમાં મળી જાય તે રીતે આ સરનામે મોકલવું. **પુરસ્કાર સમિતિ, શ્રી કચ્છી જૈન સેવા સમાજ, શ્રી કચ્છી જૈન ભવન, નવયોતન હાઇસ્ક્યુલ સામે, પાલડી - એલિસબ્રિજ, અમદાવાદ - ૩૮૦૦૦૬.** અન્યત્ર મોકલાયેલાં ફોર્મની કે ટપાલમાં મોડાં કે ટપાલમાં ગેરવલે ગયેલાં ફોર્મની જવાબદારી સ્વીકારાશે નહીં. પરબિદ્યા પર યોગ્ય મૂલ્યની ટિકિટો (ટપાલના નવા દર પ્રમાણે) લગાડવી. દંડ થયેલી ટપાલ સ્વીકારાતી નથી.
- (૩) ધોરણ-૧૦થી ઉપરના વર્ગના દરેક વિદ્યાર્થીએ ફોર્મની સાથે ગુણ પત્રકની અધિકૃત નકલ જોડવી ફરજિયાત છે. **જ વિદ્યાર્થીઓના ગુણપત્રક પણીયી આવવાના હોય તેમણે તેની નોંધ ફોર્મમાં જરૂરી લખવી.**
- (૪) ફોર્મ તા. ૩૦-૦૬-૨૦૨૦ સુધી જ સ્વીકારવામાં આવશે.
- (૫) શૈક્ષણિક ક્ષેત્રે કોઈપણ વિશિષ્ટતા મેળવનાર વિદ્યાર્થીઓના ફોર્મ સાથે આવી વિશિષ્ટતાના અધિકૃત પુરાવા (વર્તમાન પત્રમાંના ઉલ્લેખો વગેરે)ની અધિકૃત નકલો સાથે અલગ કાગળ પર ઉલ્લેખ કરવો.
- (૬) નીચેની વિગતો અનુસાર ચાલુ વર્ષે ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ પુરસ્કારને પાત્ર છે.
  - (ક) ધોરણ-૧૦ અને તેથી ઉપરના વર્ગના દરેક વિદ્યાર્થીએ ફોર્મની સાથે ગુણપત્રકની અધિકૃત નકલ જોડવી ફરજિયાત છે.
  - (ખ) (i) ધો. ૧૦થી પૂર્વસ્નાતક (**Under graduate**) સુધીના તેમજ સાર્ટિફિકેટ, ડિપ્લોમા કે તેમના સમકક્ષ વર્ગની પરીક્ષામાં **૫૦.૦ ટકા ગુણ** કે તેથી વધુ ગુણ મેળવી ઉત્તીર્ણ થનાર દરેક વિદ્યાર્થી પુરસ્કારને પાત્ર છે. ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીના GUJCET નું પરિણામ જરૂરથી બીડવું.  
 (ii) સ્નાતક (**Graduate**) વર્ગની પરીક્ષામાં **૫૦.૦ ટકા** કે તેથી વધુ ગુણ મેળવી ઉત્તીર્ણ થનાર દરેક વિદ્યાર્થી પુરસ્કારને પાત્ર છે.  
 (iii) અનુસ્નાતક (**Post Graduate**) વર્ગની પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર **દરેક વિદ્યાર્થી** પુરસ્કાર પાત્ર છે. આવા વિદ્યાર્થીઓનાં ગુણપત્રકની અધિકૃત નકલો ફોર્મ સાથે બીડવી જરૂરી છે.
- (૭) પોતાનું ફોર્મ સમાજને મળી ગયું છે કે કેમ તે નિશ્ચિત કરવા ઈચ્છનારે પોતાના સરનામાવાળું પોસ્ટકાર્ડ (પૂર્તી સ્ટેમ્પવાળું) સાથે બીડવું, જેના પર ફોર્મ મળી ગયાની પહોંચ અગેથી મોકલી આપવામાં આવશે. સંસ્થાની ઓફિસે રિઝિસ્ટ્રેશન ફોર્મ આપી જનારે પોતાના ફોર્મનો નોંધણી કમાંક મેળવી લેવો.

**પંકજ મેધાજી ગોગરી, કન્વીનર - પુરસ્કાર સમિતિ**

## પર્વાધિરાજ પર્યુષણ : તપ, ત્યાગ અને તિતિક્ષાનો તહેવાર



ખામેમિ સવ્ય જુવે સવ્યે જુવા ખમંતુ મે,  
મિતિ મે સવ્યભુઅંસુ, વેરં મજા ન કેણાથ.

એટલે કે આજથી હવે આ જગતના સર્વ જુવો સાથે મારે મિત્રતા છે.  
કોઈની પણ સાથે દુશ્મનાવટ નથી. સહુ મારા મિત્ર છે, હું સહુનો મિત્ર છું.  
મારાથી થઈ ગયેલા અપરાધોની સહુ મને માફી આપો. હું પણ સહુને મારા તરફથી માફી આપું છું.  
એકબીજાને ખમાવવાની પ્રથા જૈન ધર્મમાં છે. એટલે જ પર્યંશને મેત્રીનું પર્વ પણ ગણવામાં આવે છે.



॥ મિચ્છામિ દુક્કડમ् ॥



## વૃદ્ધ કાઢપણી આજા વારતાં બોલ્યાટીક સોલ્યુશન આપવી કંપની




### આગારી વિશેષતાઓ - સિંગારા વિન્ડો ખોટકોમ્બ

- V/VX ની ૫૫૦+ સાથારાની
- ISO 9001:2015 પ્રમાણિત કંપની
- Robust Systems & Processes પર ભાર્યાની
- Trace & Track Facility સાથે સંપૂર્ણ કોમ્પ્યુટરાઇઝ લેટર્ચરી
- બુકીંગ બી ડિલ્લીપરી સુપી સામાજિક Complete Insurance Cover
- 10 ટિલોટી કુલ ૩૫ સ્ટોર સુવીલા પાર્સિસ સ્વીકારીએ છીએ
- 100000+ સ્ટોર શાહેરો
- Hard Freight Surface Transportation નું ૬ હાયકાની અનુભવ
- ડોર, એર અને રેલીન ડ્રાઈ પ્રોટોકોલ્સ
- પિસ્કુત એટ્ચ રાન્ડરી Supply Chain & Inventory Management



Our other Divisions




## ચાતુર્માસ દરમ્યાન પ્રવાસ, અધ્યાત્મ અને જીવનચરિત્ર વિષયક તદ્દન નવાં આ પ્રણ પુસ્તકો વાંચો / વસાવો / વહેંચો

નર્મદા પરિકમા બેટલે  
પ્રાકૃતિક રમણીયતા  
અને આધ્યાત્મિક  
આદ્ભુતાની પરિકમા




અમારી અધ્યુત્ત્તી નર્મદા-પરિકમા  
સ્વામી તચ્છિદાનંદ  
રૂ. 100

ફેન ધર્માં કર્મવાદનું વિરોધ મહાત્વ છે.  
એક ખ્રિયને તેના વર્તમાનભવનાનું કે  
અગ્રાઉન્ડા કોઈપણ ભવનાનું કર્મનું છે  
અવસ્થા મળે છે તે સમજાવતી કથા



મધ્યાત્રા-શ્રીપાણ  
આ. વિ. રાજશોભરસૂરી  
રૂ. 80

પોતાના ચાસ કરતો ફેન શાસનને  
વિરોધ મહાત્વ આપત્તા ફેન મુનિ  
વજસ્ત્વામીની આ ચરિત્રકથા આપકા  
ચરિત્રને પજ સુંધરમય બનાવશે



વજસ્ત્વામી  
આ. વિ. રાજશોભરસૂરી  
રૂ. 80

ચાતુર્માસને આધ્યાત્મિક  
સેવધનુષ્ઠાન સંજવતો

### જીન ધર્મનાં આણમોલ પુસ્તકો

#### પંડિત સુખલાલજી

સમાજ, ધર્મ અને સંસ્કૃતિ	130
જીન ધર્મ અને દર્શાન	200
પરિશીળન	150
ધર્માન્તર ચિત્તન	155
અધ્યર્થ	100
અનેકાંત ચિત્તન	180
રતિલાલ દી. દેસાઈ	
અમૃત સમીપે	360
જિનમાર્ગનું જતન	280
જિનમાર્ગનું અનુશીલન	300
શ્રી ભદ્રેશ્વર દર્શાઈ મહાતીર્થ	30
રોહિત શાહ	
મારા મહાવીર, તારા મહાવીર	60
આવક ધર્મનું શિખર : રેણુવચ્ચ	40
મિશા મિ દુક્કડમ્	50

#### આચાર્ય વાત્સાલ્યાદીપસ્કૃતિ

ફેન સંજાય અને ધર્મ	70
સુખ તમારી પ્રતીક્ષા કરે છે	30
અધ્યર અને અસ્તિત્વ	100
ભગવાન મહાવીરની	
આગમવાતી	40
દોગનિષ્ઠ આચાર્યશ્રીની	
આત્મવાતી	50
પ્રભાવના	12
Jain Dharma	100
જીનોપનિષદ	65
શ્રી ફેન મહાવીર જીતા :	
એક દર્શાન	350
અધ્યપ્રકારી પૂજા	60
દોલતભાઈ દેસાઈ	
જીનધર્મ જાઓ :	
અવનમર્મ પાણો	
	25

### જીનિગમનાં અન્ય જાજરમાન પુસ્તકો

#### સંગીતી

પ. બેચરદાસ દોશી

#### માયુરી

પ. દ્વારુભાઈ માલવલિયા

#### અવધૂત આનંદયન પઢલહરી

માયશ કે. સાવલા

#### ફેન રામાયણ

મુનિ તરુણવિજ્ય

#### જીનત્વને ચરણે

દિમાંશુ શાહ

#### ભદ્રકર પ્રસંગમાળા

- 100

#### Science Discovers Eternal Wisdom

Muni Amarendravijay 40

#### મધ્યકાલીન પદ્ધતિ વિર્મશી (શાગુ, બારમારી, ચોવીસી)

અભય દોશી 500

#### જીન રાસવિર્મશી

અભય દોશી 600

#### જીન સાહિત્યના અશ્વર-આરાધકો (19મી અને 20મી સદીના)

માલતી શાહ 700

#### શ્રી પાર્વતી પ્રભુનાં પ્રાચીન તીર્થો

વિમલકુમાર મો. ધામી 130

#### પાંડિત્યાનાં જીન મંહિરો (ઉર્દુ)

ઠિકબાલ કેસર, અનુ. ગુજરાતી બરવાળિયા 300

## ગુજરાત સાહિત્યભવન

રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ - 380 001

ફોન : 079-22144663.

e-mail : goorjar@yahoo.com

## ગુજરાત સાહિત્ય પ્રકાશન

102, લેન્ડમાર્ક લિલિંગ, વાણીસેન્ટર પાસે, સીમા લોકની સામે,

100 ફૂટ રોડ, પ્રદ્વાનગર, અમદાવાદ-15 ફોન : 26934340, મો. 9825268759

ઈમેલ : gurjarprakashan@gmail.com



ગુજરાત  
સાહિત્ય  
કાર્યાલય

"Mangal Mandir" - Regd. under Postal Registration No. GAMC-315/2018-2020 Valid upto 31st December, 2020  
Issued by the SSPO's Ahmedabad City Division, permitted to post at Ahmedabad PSO on 5th of Every Month.  
R.N.I. No. of RNP is 33266/1978 • Published on 1st of Every Month

## શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદ સંચાલિત

### નવનીત મેડિકલ સેન્ટર

કંયનબેન નવીનયંદ્ર નાનજી શાહ O.P.D. સેન્ટર અને દીપ ફાઉન્ડેશન મેડિકલ ચેક-અપ સેન્ટર

બોજે અને ત્રીજે માણ, ગાલા ઢબ અનેકા, ગાલા જીમખાના રોડ, બસંત બાહાર બંગલોની બાજુમાં, સાઉથ બોપલ, અમદાવાદ-૩૮૦ ૦૫૮.

ફોન: ૯૮૨૪ ૬૬૦ ૩૦૩, ૯૮૨૪ ૬૬૦ ૪૦૪



If undelivered please return to :

શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદ

શ્રી કચ્છી જૈન ભવન,

૪૩-૪૪, ભાબલાં મિન્નમંડળ સોસાપટી,

નવચેતન હાઈસ્કૂલની સામે, પાલડી - એલિસબ્રિઝ,

અમદાવાદ-૩૮૦ ૦૦૬.

ફોન : (૦૭૯) ૨૬૪૯ ૮૮૭૨, ૨૬૪૮ ૧૫૦૧

To,

\_\_\_\_\_  
\_\_\_\_\_  
\_\_\_\_\_  
\_\_\_\_\_